

ભક્ત કવિશ્રી દ્વારામ રમારક સમિતિ અંથમાળા

## પ્રકાશન ચોજના.

આ ચોજના અગે ડોધપણ ભાવિક સંગ્રહન શ. ૧૨૫૦  
એકમેં પચીસ અસ્ત્રાથી મુલ્યાદુત્ત્વ સ્થૂલે પૂર્ણાંકે હેઠાં સભ્ય થયા  
આ બદાર પડનાર તમામ પ્રકાશનો તેમને વીજાં મન્દ્ય આપવામાં  
આવે છે.

વધુમાં આ ચોજના અગે ને પ્રકાશનો બદાર પડું તે  
તમામ પ્રકાશનો પડતર કીંમને જ આપવામાં આવશે; ભક્ત કવિશ્રી  
દ્વારામ રમારક સમિતિનો ઉદેશ સદર પ્રકાશનોનાં વેચાણુમાંથી  
સંરથાના નિભાવ અગે અન્ય કાંઈ પણ પ્રાપ્તિ કરવાનો નથી; પરંતુ  
ભાવિક ભક્તોમાં સદર પ્રકાશનોનો દેવાવેલું થાય તે જોવાનીજ સમિતિની  
આતુરતા છે.

ભાવિકાને વિજ્ઞપ્તિ કે આ ચોજનાનો લાભ કાઢ સમિતિના  
ઉત્સાહને ઉદ્ઘિંગત કરે.

અત્યાર સુધી નોંધાયકા આજુવન સભ્યોફી નામાવિઃ-

૧૨૫૦ શેડ જમનાદાસ ચુનીલાલ અત્યાળા.

૧૨૫૦ સૌ. કારીશેન જમનાદાસ ચુનીલાલ

૧૨૫૦ શેડ ગેરિંદ્રાલ માણેદાલ વસાધવાળા.

૧૨૫૦ શેડ સુદુનદાલ હીનાલાલની પેટી.

૧૨૫૦ અરોડા ઈન્ડાટીજ લીમીટેડ (અરોડા ફેક્ટરી)

- ००५४ पा अगानान अतु-भाव (गरोडा डेक्कन ट्रेडिंग डा.)  
 १०५५ मोरी भगवन्दान जगद्गुरुदास  
 ११५६ अटेता राक्षसान प्रदादश  
 १०५७ वर्णन जमनादास दीभतवान  
 १०५८ अ दामनगन्दान शा भावेनाथ दग्गोपनासना अम-लाये  
     तेमना सत्पुन रा जमनादास भावेकनान दामनगन्दाना  
 १०५९ शेइ-ही भतवाक द-गोपनदास शीर्गनावागा  
 १०६० ज्ञेश्वा अवलुनान अमननान.  
 ११५६ चीमननान हेनार्ट उभोधनागा  
 १०५७ खुदानदास भाष्युभाव  
 १०५८ उभोधनागा नारायण्युदास परमानदहास  
 १०५९ शा ओरवनान जमनादास भीआवागा  


---

 २००७) ए उन्हें

—४४४—

આ સુ ખ.

ફૂલ ફૂલ

ભક્ત કવિર્ય થો દ્વાગમ સમાન અથમાળાનું આ પ્રથમ  
પુરુતક ભાવિદું વાચકદના કરેનુંમનમા ધરતા અત્યત આનંદ થાય છે.  
સપ્ત ૨૦૦૦ ના બાદન્વા શુદ્ધ ૧૧-૧૨ ના દિવમોએ ભક્ત કવિર્યની  
દ્વાગમભાઈની ૧૬૭ મી જ્યતિ પ્રસાગે બીજી દિવસના સમારભમા  
ઉંબોઘ વાસીયોની વિગાટ સભામા ભક્ત કવિર્ય થો દ્વાગમભાઈના  
ડાંધેના પ્રકાશનની યોજના પસાર થઈ, અને તદ્દાનુસાર એકજ  
થયેલી રહેના આવયે આ પ્રકારન જન્મ પામે છ.

ભક્ત કવિર્યની દ્વાગમભાઈના અપ્રસિદ્ધ સાહિત્ય બદામના  
મયારદો તેમના નશેજ દિલ્લો સહૃગત પ-મ ભગવીય નોરીઓ  
શ્રીનાથદાર્ઢ ઉર્દે છોટાનાન તથા સહૃગત પરમ ભગવદીય નોરીઓ  
દુગનનાયભાઈ છે, સહૃગત નોરીઓ શ્રીનાથદાર્ઢ ઉર્દે છોટાનાનનો  
સાહિત્ય બદાર ઉંબોઘમા સાડોદાનાગામા ભક્ત કવિદી દ્વાગમ  
ન્માર્દ મદિનમા સુરક્ષિત છે, જ્યા ભક્ત કવિદીના હૃતાદર, તેમનુ  
વીય તથા તેઓશીના ચરભા અનિત્વમા છે, અને આ પ્રકારન  
તેમના સઅદમાથી પ્રકટ થાય છે તેમની ભક્ત કવિદીનું દન  
લિખિત સાહિત્ય તથા તણુંગે તેમના વશેજ નિષ્ય ભરુત નોરીઓ  
દુગનનાયભાઈના ચિંદુની કુવણુલાનભાઈ પાગે એનિ ધનવે નું આ  
તણુંના તારના મજુબ સાગેનો નભાળ ભાવિદું સાતારનો ન્માપ  
મૂર્તી રૂપે ધન્તા હમાર હૃદય દર્શાનુંમત થાય તે નાનારીનું છે

આપણું જુતા શુર્દે - સાહિત્યના કંદુ કંદુતારી નયેતિંધરા  
થી નરસિંદ, થી પ્રેમાનંદ અને થી વ્યાનાન નનનિને શુર્દે

સાહિત્યનું રીતગૈરણ્ય કર્યું પ્રેમાનદે સાહિત્ય રાડીને શાલુંગારી શ્રી યાગમે ગુર્જર સાહિત્યોવાતનો બાળ સમું હા। તુ નરસિંહનો યુગ તે પ્રભાતીયાનો પગ ભક્તિ રસનો યુગ પ્રેમાન નો યુગ તે મહુર માગ ઉપર ગાજતા આખરાનોના રણ રણનો યુગ શ્રી યાગમનો યુગ ન હું રા અમિતા રસભીના રસાલા રસગાજની ગરમીઓ અને ગગ રાતેની ગુજરાતણાનો યુગ પ્રેમરસનર્થી પગાગનો યુગ મહુર એગરસભારી આનદૃસ જગતી સંગ્રહાનો યુગ ભાગભાઈ ભક્તિરસનો યુગ આના ભક્તિરસનર્થી યુગનું આનેખન કયા ભધતાના હું પતેતું ન હેઠાવે ?

આના ભક્તિરસભાઈ આનેખનમા કર્તિર્ણ શ્રી દ્વારગમનાઈ પોતાના પ્રાણુંનિય શ્રી કૃષ્ણચના સુખ કરુનમાથી ઉત્થવેન જાન કર્મ, ભક્તિરોગપૂર્ણ શ્રીમહ ભાગનદ્વારીનાને રથત ન આપે એ કદાપિ ન અને આ પ્રકાશનમા સુખ્યત્વે રહીને શ્રી દ્વારગમભાઈનું શ્રીમહ ભાગનદ્વારીનાનું પણ નાદ ભાગાન્તર ધ્યાન એચે તેચું તે ભાગ પણી સંગ્રહ છે કોઈ કોઈ રથગે સમજતોક જેચું છે, ભાગાર્થ પિત્તાર્થી સમજનામા કોઈ રથગે લભાયું રહ્યના કરેની છે, તેમ ભાગાન્તર કરવામા શ્રીમહ ભાગનદ્વારી ઉપરની "શ્રાધરી" ટીકાનો આશ્રય લીધો એપ તેચું જાણ્યાય છ ગુર્જર ભાગ પણ સર્કૃત ભાષા જેવીજ બની છે છતા નિર્બદ્ધ બોગ ન મનતા આખ્યું ભાગાન્તર સરળ બન્યું છે જેથી કરીને સાવારણ જન સમાજ પણ સહેનાઈથી સમજ આત્મક યાણું અનુભાવી શકે

આ પ્રકાશનનું ૧૫, સુદ્ધા વગેરે મારે ડેટનીં મુસ્કેનીઓના કારણે હીનમા પડ્યું હતું અને સર્જેમનશાત્ર છાપકામ મારે છે છુતાગઢ શુંખી નહું પડ્યું છે ઉનીધનાસી શ્રી દ્વારગમભાઈનું પ્રકાશન

શ્રી નગસિહન। જુનાગઢમા મૂર્તિમત થાય તે પણ એક ઉચ્ચરી પ્રે એથા  
 અને સ ડેટનજ પરિષ્કાર છ જુનાગઢ સુધી પોચવા મારે ત્યાના  
 ભાઈઓ હરિઝંદ સ તોકનામને યન ઘરે ? તેમ ર તેમનાજ પ્રયાસથી  
 મોના સાથે સુગધ મળો તેવો સુયોગ શ્રીયુત પ્રમોદ મહેતાનો થયો તે  
 તેઓઓ જુનાગઢની ગડાઉદીન કોનેજમા અંગેછ બ નાના પ્રાણીય ?  
 સ નૃત ભાવાના પ્રખ્ય નિદ્રાન તે તેમ રૈટલીક જીતન પ્રાતિન  
 સ ગ્યાઓના લેખન અને સ ચારન છે તેઓઓઓને આ પ્રમાનને ઉચ્ચી  
 મ્લાયે મૂલ્યવા મારે ને જીતન હાવી છે તે મારે તેઓઓઓના તથા  
 ભાઈ રન્દુંના હુમેં કંઈણી છીએ

તેમજ અથ પ્રડાતાનના ગાર્ફમા સમિતિના પ્રયાસને વેગ  
 આપ્યા મારે અમલાદ ચિથન શુદ્ધિત ભાલિય સ સહે આ પ્રમાનનત્તી  
 છસો નેગલી પ્રત ખરીની લેના મારે ને દુગન મ્યા ? તે મારે  
 સ સહના અને તેના પ્રણેતા શ્રીયુત પ્રેસર ને નાનાન ગો રાદ  
 એમ એ ના હમેં કંઈણી છીએ

આ પ્રમાન સમિતિમા ખાસ ડ્રીન કોર્ટ આરા પા-ગત  
 સાક્ષર નથી તેમ શુર્ય ભાવાના પ્રખ્ય અભ્યાસી નથી, પરતુ ભર્મિત  
 અને સેગાભાગ્યી પ્રેનાયા સાદા સ ણ મેન્ડો ઠે એટલે ચાચન  
 દુદ્દે નભાવે વિશુદ્ધિ કર્યાની ને શુદ્ધિ અનુદ્ધિ કે ભાગાદોપને ન  
 ગણ્યતા ઈદ્યના ભાવને પીધાની આ અદ્ભુતાના પ્રથમ પ્રકાશનને  
 વધાવી કેને

દસોધ	લીં
દ્યારામ જ્યતિ ઉત્ત્વ	દાસાનદામ
સ ૨૦૦૨ પામનદાંતી }      જીતનાદાસ ચુનીલાલ જનવાલા	પ્રખ્ય
ભુધવાર }	
તા ૧૮-૬-૪૫ ]      મ ક શી દ્યા મ મારા સમિતિ-દસોધ	

## પુસ્તકો ભરતવાનાં ફેકાણું:-

અભોગ - શ્રી એચ. રવાન જમના અ મરીઓ,  
" " દ્વારા, અભોગ

અડોફરા - જેલ્લા અધ્યનાન છગનાન એફોડેર,  
નાડી, દનુમાન દ્વારા, અડોફરા.

અમનવાદ - શ્રી જોનાન જો, શાહ અમ, એ.  
જાર્ખન નિરાસ,  
મદાવદભી મોસાયરી, અમનવાદ

ઝુંબણ - ડૉ. રામાંગા નાગાયણુદાસ પરમાનદાસ નાદ,  
C/o ઝુગાડી કીસનનાસ પુરુષોત્તમનાસ,  
અધીયાન, રામમેડ ગ્રૂપ, ઝુંબણ ૨

વાડીયાં - ગોવિદવાન છોકાનાન પારેખ વડીન

વાડીયાં  
(રેનાક્ટા એન્નસા)

(આ કિનાય દરેક નાણીતા ઝુડમેનરો પાસેદી મનથી )

બન્ધાકવિશ્વી દ્યારામભાઈની અપ્રસિદ્ધ કાવ્ય કૃતિઓનું  
પ્રકાશન અસ્થળિત ગતિઓ ચાલે તે હેતુથી, અને શુદ્ધાદ્રેત  
આલુવન સભ્યોને લેટ આપી રાકાય તે હેતુથી આ  
“ દ્યારામ રસ્થાળ ”ની ૧૦૦ નકલો સંસદને મળેલી  
સાહિત્ય પ્રકાશનની નીચેની રકમોનો ઉપયોગ કર્યો છે.

---

૫. લ. શેડ શ્રી નાનાલાલ દામોદરદાસ અમદાવાદ રૂ. ૪૦૦	
” ” ચુંઘવાસી	રૂ. ૧૦૦
” ” રતિલાલ નાનાલાલ પટેલ અમદાવાદ રૂ. ૫૨	
રૂ. ૫. ગીરધરલાલ ઉત્તમરાય રૂસ્ટ રૂણ રૂ. ૧૦૦૦૩ ના	
વ્યાજની રકમ	

૫. લ. ગીરધરલાલ હરિલાલ રૂસ્ટ રૂણ રૂ. ૧૦૦૦૩ ના  
વ્યાજની રકમ ( તેમના ચિ. ૫. લ. સંસદના પ્રમુખ શેડ  
ભાલાલાઈ ગીરધરલાલ તથા ૫. લ. શેડ પ્રીફમદાસ  
ગીરધરલાઈ થકી મળેલ. )

૫. લ. શેડ રતિલાલ મનસુખલાલ તરફથી તેમના કાઢાના  
સમારકમાં મળેલી રૂ. ૫૦૦૩ ની રૂસ્ટ રૂણની રકમના  
વ્યાજમાંથી.

દીપાત્રની	મોહનલાલ વીહુલદાસ ગાંધી બી. એ. એલ. એલ. બી.
	બળાદેવભાઈ કેરાબળ પટ્ટવારી
અમદાવાદ	જેહાલાલ ગોવર્ધનદાસ શાહ એમ. એ.
	મંત્રીઓ શુદ્ધાદ્રેત સંસદ-અમદાવાદ.

३७	આરો અગન સત્ય જગત કરનવે	૩૨૦
૩૮	મેરેનાથ ગિનિધારી-દ્યામા સ્વામ્યની ધ્યારી	૩૨૧
૩૯	નહી દદ દરિ વિશ્વાસ, તાકુ ઉજ્જ્વલ ન કણીએ	૩૨૨
૪૦	ઓક વર્ષો ગોપીજન વલ્લભ, નહી રમામી ભીજો	૩૨૩
૪૧	સદા શીરૂપણુને સેવો રે, સમજ કો ચુરો સિદ્ધાત	૩૨૪
૪૨	તેના દરિ સન્સુખના દોષ, સાધન રિમુખ તથા	૩૨૫
૪૩	ઓહવા ભી હળિને ગો નવ ગાય	૩૨૬
૪૪	તે ભગવાનીના દર્શન હુલ્લાલ	૩૨૭
૪૫	સદગુણ સિદ્ધુ શીનાયજ રે.	૩૨૮
૪૬	શ્રેમરસ તે પિયરે જેમા અતિ અતુજ્જ પણુ	૩૨૯
૪૭	નથી નિષે ડોઈને નાથ, કણુ પડી કુ કંગો	૩૩૦
૪૮.	નોક-અલા ભ્યાસ રિંગો.	૩૩૧
૪૯	આરીવાંદ-ચિંજ જીયો, સુખી રોટો, હુમ સકન દિઝાન	૩૩૨



# દ્યારામ રસથાળ



ગસ્તિ - અક્ષતકવિસભાઈ

શ્રી દ્યારામસાહુ

જન્મ — સપ્ત ૧૮ ૩

ગોલોડાસ - સપ્ત ૧૯૦૬

પૃ શુદ્ધેવ

શ્રીમહુ ગોસ્વામી ૧૦૮

શ્રી છાયાલ મહારાજ.

(અમદાવાદ)

શ્રી વદ્વલભાધીશા જ્યતિ.



પ્રમ અગન્ધીય બોર્ડિલ નાથજીભાઈ ગિરિજિંશાંકરના  
સંભળમાંદી

## ઉ પોદ ધાત

જ્ઞાન પ્રકૃતણુ.

( શ્રી ભક્તરાજ દ્વારાભસાઇ વિરચિત. )

શરીર અનિત્ય છે; વળી તે દમેશાં એકજ સ્થિતિમાં રહેવા-  
વાળું નથી. તેમાં નિરંતર દેશાર થવાવાળું છે. એટકુંજ નહિ, આર્થિક  
સ્પર્શિએ પણ દમેશાં ( નિત્ય સ્થિર ) રહેવાવાળી નથી. મૃત્યુ દરરોજને  
હાતે ડગસે એટસે ક્ષણે ક્ષણે પામે આવતું જાય છે. તેટલા માટે સર્વ  
પ્રકારના પ્રાત્ને. કરીને ધર્મનો સાથું અવરથ કરવો જોઈએ. અને એ  
કારણથી સર્વમાં પહેલી એપણ આગા પણ છે કે—

“ધર્મ ચર્ચ” ( ધર્મનું આચરણ કર. )

દીપ—ધર્મનિપૂનત જનો—(અ) = જાણો—

(१) દુરિશ્વા (२) બતિ (३) દરશય (४) ચૂંઘય (૫) ચુંઘના  
(૬) રમનાય) અને ખીળ—

(૧) ધૂમિ કાર્તિ, (૨) ભોગ પિતા, વગેરેની કથા ભક્તાણું  
નિધિ અથે તથા ભાગરતે અને મહાભારતે પ્રસિદ્ધ છે

॥ અનિત્યાનિ શરીરગण વિમબ્રો નૈવ શાશ્વતઃ ॥  
॥ નિત્ય સનિહિતો મૃત્યુઃ કર્તવ્યો ધર્મ મંગ્રહ ॥  
॥ તદ્વાં સંપ્રત્રદ્વયામિ લોકાના હિતકામ્યયા ॥  
॥ યેન વિજ્ઞાનમાનેણ સર્વજ્ઞતર્ય પ્રપદ્યતે ॥

સર્વ લોકના હિતને ભારત ને નીનિના અમૃત્ય ગ્રાત વચ્ચો  
કરું છુટું, તેણે કરી મૂર્ખાંતા (અજ્ઞાનતા) નાચ પામી અને સર્વ ગતપણ  
સર્વને પ્રાપ્ત થને એવી ભારી પ્રભુ યાંદે વિનિ છે

ઉપર્દેશો હિ સૂર્ખાણાં પ્રકોપાય ન શાંતયે ॥  
પદ. પાત્ર મુજંગાનાં કેવળ વિષવર્ધનમ ॥

મૂર્ખ માણુસને ઉપર્દેશ કર્યો, એ પણ તેને ગુર્જે થવાનું કાગળ  
થઈ પડે છે, સર્વને નેમ મધુર દૂધ પાણું, તો પણ તેથી વિષની  
દુર્દીજ થશે ભાટે શિખામણ પણ રાણું માણુસનેજ અસર કરે છે

સ સારમા સર્વ કોઈ ધનાદિ સ્વાર્થને ભાટેજ સ્નેહ કરે છે.  
નિસ્વાર્થી તો માત્ર સત્ત્વુદ્દો ને શ્રી ભગવાનજ છે. તે ભાટે ભાઈક  
પદાર્થી જિપરની આસક્તિ છોડી, સાચા નિત્યના એકી પરમ હિતકારક  
પ્રભુ, ને પ્રભુના સાચા જનો ઉપરજ પ્રોત્સિ જોડવી

પ્રાકૃત જનો સર્વ પોત પોતાના ભનનને ભાટે (અ સ્વાર્થ  
સાધનાને ભાટે) પ્રોત્સિ ગણે છે, તે સમજના ચાટે—

“ ત્વજંતિ મિત્રાણિ ધનૈર્બિંહીન ”

“ દારાશ્ચ ભૃત્યાશ્ચ સુહૃજજનાશ્ચ ॥

“ તંચાર્થવંત પુનરાશ્રયંતે અથોહિ લોકે પુરુપસ્ય વૈધુ: ॥ ”

સર્વ સ્વાર્થ સાધવા ઉપ ને ધન તેથી હીણ નરને ભિત્ર, બંધુ, કામિની, સુત, સેવકો, આ સંભારમાં સર્વ ડાઈ તેનો ત્યાગ કરે છે, તેજ નર ને પાછો ધનવંત થાય તો ભિત્રાદિ, એ સર્વે પનિકર તેને વળગતા આવે છે, માટે સર્વ ધનાદિક પોતપોતાના સ્વાર્થ માટે જ રેનેદ નોકે છે. ડાઈ નિષ્કામે સાચો રેનેદ સગા સુદ્ધાંત પણ જોડતા નથી.

કર્મ, રાન અને ભક્તિ એ વણે ધોગ જાણુવાનું સાધન મુખ્ય વેદ, અને તેનાં અગ ઉપ અંગ એટને વેદ શાખ (સ્વુતિ) પુરાણ અને પંચરાત્ર તથા ઘૃતિદાસાહિક ધર્માચાર્યોના સ્વિદ્ધાંત છે, અને તેણે કરીને પ્રથમ જ્યારે ધર્મ (આવસ્યક કર્તાંય કર્મો દ્વરાનુઝપના ધર્મ, અને સદાચાર નીતિ ધર્મ) ને જણે, ત્યારે તે કર્મ, રાન, અને ભક્તિનાં તરવેને સમજે છે. તેટલા સાડ તે જાણુવાનાં સાધનો ઉપના કિયા સદગ્ર થે. પ્રમાણ ભૂતના શિષ્ટ મુર્ગોએ હગવેલા છે, તેનું દિગુર્ધીન કરવું છું.

એ ધર્મના અંથોનો શ્રી સતગુર દ્વારાએ રહસ્ય સંહિત અથોનુસંધાન જાણીને સદાચાર ધર્મ પાળવો. અને અધર્માદિ અસત આચરણનો સદ્ધ સર્વદા ત્યાગ કરવો.

“ આચારો પ્રથમો ધર્મ: ધર્મસ્ય પ્રમુદ્ધચ્યતે. ”

સર્વની પહેનાં સદાચાર ઇંપીનો ધર્મ પાળવો. કેમકે તે પ્રથમ પાયા ઉપનો મુખ્ય ધર્મ છે. અને તે પાળવાથી પ્રભુ પ્રસન થાય છે.

આ સત્તાચાર ધર્મનું સત્તા વર્તન કરવાનું છે, અને અનાચાર તથા અળીતિને સદ્ગુરી, એ સામાન્ય ધર્મ સર્વતો છે ગોધુ પણ કાળે તેનો ત્યાગ કરવાનો નથી. જ્ઞાને ધર્મ અને અધર્મના લક્ષણું તથા તેનો ભર્મ સમજાય, ત્યારે, કર્તાબ્ય, અકર્તાબ્ય, ની જ્ઞાનતો લક્ષમા આને તેટલા માટે તે ધર્મભૂપતા સહૃદયે જાણી ને પ્રમાણે વર્તન કરાય ને માટે ધર્મને અધર્મના સર્વ ભાતનીય અથે સહીત ધર્માધર્મના ચિનદ સૂચક લક્ષણું પ્રથમ દર્શાવ્યા છે.

## ॥ સત્તસંગ વિષે ॥

સત્તપુરોણી સંગતિશ્વપી કર્મ કરવાથીજ ધર્માધર્મ ને કર્તાબ્યના કંઈતુ જ્ઞાન ઉદ્ભવે છે તથા સત્તસંગતિ થકીજ ખલાનું જ્ઞાન થાય છે. અને સત્તસંગતિ વડેજ ભગવાન ઉપર રેલાતમક પ્રીતિની બંદિન ઉત્પન્ન થાય છે. સત્તસંગે કરીને મનની જરૂરતા (મુર્ખતા અજ્ઞાનતા) નાથ પામીને શુદ્ધ-શુદ્ધભૂદ્ધિની રૂતિ પ્રાપ્ત થાય છે. સત્તય ભાવણ્યાની શુદ્ધતિ કરવાની ટેવ પડે છે, ને પાપ કર્મથી દૂર રહેવાય છે અને જાગ્યી પદ્ધતિ પામી, માન, પ્રતિઠા, પ્રાપ્ત થાય છે સર્વ ચિત્તા નાથ પામી અહંકાર અજ્ઞાનદમા પ્રસન્ન ચિંતાઘૃતિ રહે છે અને તેથી સર્વત્ર યથ દેવાય છે તાત્પર્ય એકે મહાત્મા પુરોણી સત્તસંગતિ ઊપી કર્મ દરગેજ કરવુ જોઈએ સત્તપુરોણી સંગતિ તેજ સત્તસંગ કહેવાય છે, ને તે સત્તપુરોણ ને કાઈ હિતોપદેશ હે છે તે સર્વનું મૂળ વેદાદિ સત્તવિધાના અથે છે માટે સત્તસંગતિ કર્ણી એ પ્રથમત કર્તાબ્ય કર્મ છે.

॥ જાડ્યે ધિષો દ્વરતિ સિદ્ધતિ યાચિ સત્ય ॥

॥ માનોગ્રતિ દિશતિ પાપમપાકરોતિ ॥

॥ ચિત્ત પ્રસાદદ્વારતિ દિશ્યુ તનોતિ કિર્તિ ॥

॥ સત્તસંગતિ: કથ્ય કિ ન કરોતિ પુંનામ્ ॥

“ અતાં પુરણે ”

॥ નાયુનાં ભમયશ્વચાપિ પ્રમાણ વૈદવત् ભવેત् ॥

પ્રમગાનુસાર સત્પુરુષની વાણી કે ઇની ધત્યાદિ વેદ પુરુષ પ્રમાણ  
ભૂત થઈ પડે છે

પ્રથત મદત્ત પુરુષના અસાધારણના વયનામૃત પરી તેનો અર્થ  
—જીકા-ભાવાથ—જ્યાખ્યાને રૂપદ્ધ સિદ્ધાત દર્શય સમજાય, એમ અસાધા-  
રણુ તત્ત્વતના આદ્દો સાંપુરુષની પ્રસાની વાણી ઉપરા મુજબ  
આપાર ગણે હો.

॥ નાયુનામર્થ વાગનુ ધારતિ ॥

॥ જરૂરીણાં પુનરાદીનાં વાચમર્થનુધારતિ ॥

નેહી રીતે દ્વાર ધત્યારી રૂપદ્ધ પદાર્થીમા સુનનાર ભાવુર્પતા  
મિદ્ધા (મિદાથ) અને પુરુષિ આદિ ગુણો રદ્દવા છે તેમ નિયારમા  
જેવ વગુની પ્રથમ પ્રાપ્તિ અને પરી તે ખણુંમે દરીતે ખાનામા આનં  
દિદ્ય થાય છે તે રીતે સત્પુરુષોની વાણીમા સત્યામૃતિદ્ય અપાગનન  
દ્વારા છે, એમ તત્ત્વને અણુનાર તત્ત્વપિત પુરાં કહે છે

॥ વિચારોડવ્યાત્મ વિદ્યાનાં જ્ઞાનેતત્ત્વવિદ્યો કિદુ. ॥

॥ દ્વારે તસ્યાંતરે ચાલિન માયુરી પયસો યથા ॥

॥ દૃષ્ટાંત— ॥

અલ (અદરી) ને ગળે સનનારુનિદ્ય આયળો દ્વારા છે, તથાપિ  
તે કથન માત્ર (જોના પુત્તી) ન છે ખળોના વન્નતી રાખ (ભરમ)  
જોમ તે વન્નતી સમાન દેખાય પણ તે વન્ને તરીકે પરંના કે એવામા  
કામ ન લાગે, તેમ, ઉપ, ૨ગ, આરૂપી કદી સમાન ભરે પણ નાદે,  
શુણે, મૂલ્યે, પ્રમાણે, અથવત ભેત દ્વારા છે.

ઉદ્ધરની લીડી અને લીડી પીપર, જને દેખાવમા કાઈ અંગે  
સરખા છે પણ સ્વાત્મા, અને શુણુંમા, અત્યત, તકાત હોય છે એજ  
રીતે, સાકર અને શુદ્ધ, અથવા ઇટકડી, પણ સમજવી પીણું લુણ  
અને ખાડ, ડેરી અને આકાડોડી, ચણાનુ બેશણ (લોટ) અને નાડાનુ  
સરણુ, અથવા વડોર, દીરેા અને ટાય સરખા દેખાય, પણ ભૂયમા  
ખુલ્લ હેર હોય છે

ગ્રહિભણુ અને કાગો પત્થર સમાન દેખાય પણ તેનું ઉપર  
પ્રમાણેજ સમજવું ચાક (ખડી) અને સેમન સરખા ભાસે, પણ  
અનેના શુણુંમા ભેટ

કૌતયક (કૌતુક) ગનાની અથે એનેક પદ્ધિઓની ચાતુર્યતા  
અને તેમની દુલ્લર ચાતુરાધ સુધકતાની કારીગરી વળ્ણવી છે કે—

(૧) રેખામના ક્રાંત (ક્રાંત) ડેશેટામાથી એવી અદ્ભુત કૃતિની  
રૂપના કરી રેખામના તાતણું ખાડાર કાઢે છ કે ને પડે દ્રવ્યવતના  
સહન શોને એવા વસ્ત્રો બતે છે વળા ડેશીકું કરીને એનું ઘર બાધે  
છે કે તેમા અન્ય કોઈ પેસી ન શકે પરતુ પોતાને નીળાનાનુ પણ  
દ્વારા રાખવાનું સમજતો ન હોવાથી તેમા ગુગળાધ (અકળાઈ) જઈને  
મરણ પામે છે

(૨) સુધરી જતની એક પ્રકારની ચકલી (ચટની) એવો માળો  
ગુણે છે કે તે, ધી, ઇત્યાદિ, પ્રવાહી પદાર્થો ભાગખામા અતિ ઉપયોગી  
થાય છે

(૩) ભધમાખાઓ એવો ભધપુડો રૂપે છે કે જેમા વિનિર  
પ્રકારની અનત પનસપતિઓનો અને તેના રમોને, જણી, તેને સ અણી  
આણી પોતાના રથાનમા જગતાની ગક્ષણુ કરે છે કે એનું ભધ કે જે

ઉત્તમ પ્રકાની મિથ્યતાવાળું બનાવે છે, અને આક્રોણ ભાગમાથી મીણ ( મેલુ-લગાવ ) બને છે

(૪) કેટનાક પદી જેમકે ડેપન કટિનાહિના કહોનો અનુ અત્યત મધુર હોનાથી મોદક મનગ જરૂર હોય છે

(૫) ચોરમા કળા કળવાની રૂપ બડુ સુદૂર હોય છે

(૬) કેટનાક પક્ષીઓના માળા ભખમન કરતા પણ વિશેર ગૈમળ હોય છે

॥ પંચ વિપયમાં આસક્તિ થવાથી થતાં બધનનાં દ્વારાંત- ॥

(૧) અર્થા વિપ્ય-અજ્ઞાન મોડે ( હાથી ) અર્થા સડિન હાથીને પદ્ધતાને ભાડે કાગળની દાથથી કરીને એક ડેકાણે તે ચીનરેલી દસ્તિથી રાખી, તેના ઇન્ટો ચોનરક્ષ ખાડો ખાદી ગર્ભીને ઉપર ધાસ તૃણુદ્વિની આચચાદન કરે છે કે તે તરફ ત હાથી ધસતાજ એ ખાડામા પડી બધન તાને વરા થઈ જાય છે

(૨) કણુતર જાયુ ચડેતુ હોય, તેને નીચે ઉતાન્યા, તે કણુતરને, તેની માદા રેખાડ છે, એટલે તરત તે ત્યાથી સુનાટ ખાદને તરફડતુ તરફડતુ નીચે તે માદાની પાસે આવી પડે છે

(૩) થાન ( કુતર ) નિપન કરતા કેટના બધા કણિત થાન છે.

(૪) ગર્ભવ ગર્ભવીની પાઠુંબતા મ્લાં સર્વન કરે છે

(૫) મૂગ ગર્ગમા આસક્ત થાય છે

(૬) ઉપમા પતરગીસા મળું પામે છે

(૭) રસમા ભાજના મન્દુ પામે છે

(૮) ગધમા (કમગમા) ભરમર લુંઘાઈ પ્રાણ ઉધનતુ  
કષ્ટ સડે છે

શ્રીમહુ ભાગવત જ સ્પેદમ રૂપે—જ્યારે દિનએક કસ્યપે પોતાના  
પુત્રને પોતાને સર્વ સત્તાધીર અજ્ઞત બળિયાપણુંનો ગર્વ લાવીને કલ્યા  
હે—મે તો ૧૪ ચૌદ કોણ જીત્યા છે, માટે હું સર્વ ભરતા બનીજી છુ  
લ્યારે પ્રદાદજીએ કલ્યા છે કે—

ને તમારું એક મનજ નમે છતો, તોજ ખરા બળિયા ગણુંએ  
અને જે ભન ન જતાય, તો તમે અતિ ડાયર અને સર્વેએ તમને  
દગ્વેલા (પગભર પામેના) છો માટે અન્ય શાશ્વતે શુ જતના મથો છો? પ્રયમતો દેહમા રૂપણુંએ  
અને પડુંગિનુ, ને, તેનો અધિષ્ઠાતા મન, તેને  
જતશો, તો સર્વ જાત્યુ એમ સમજબુ તાત્પર્ય કે અતિ શુરવીજ જન,  
મહાગણુમા કુદ્ધમા શાશ્વતે જુને પણ ખ્રી આદિના કટાક્ષણપી બાણ  
દર્શિયી મોદ પામીને, તે ગાંધસંસ્કૃતી છેતરાઈ, કામાદિ બાણથી કે  
વિહન થઈ રિધાઈ જાય, તો તેને શુરાતન વત ડેમ કહેવાય? માટે  
ધીરીર અને ગાભીજ તો તેજ કે કામાદિ હોયોથી પરાબવ ન પામે તેજ



श्री कृष्णाय नमः

श्री गुर—(श्री) गोपीजनवल्लभाय नमः

श्रीभद्राचार्यस्त्रेणुकमलेक्ष्मे। नमः

श्री गुरुसाध्वा परमदयालवे नमः

श्री वल्लभः

श्री कृष्णः

श्री भक्तराज द्यारामलाई विरचित अंथमाणा-मणुको—१.

“मंगलाचरणु。”

राग-कल्पाशुः ताल ३५६.

महा मंगलरूप श्री गुरदेव, श्री महा ग्रन्थ;

जाके पद पद्मो, प्रथम, शिर, नांधेऽ—महा मंगल.—१

नाम लेत उटे होत, परम आनन्द कंद;

सकल पाप ताप टरत, छम ध्याधेऽ—महा मंगल.—२

अहो शिव विष्णु पर अल, सो श्री गुरुराय;

सकल तीरथ आदि, अंधीरज नांधेऽ—महा मंगल.—३

द्यो उडे आर्यार्जन, अधिक हो दुन्ते नांडि;

शुरु सेवा चितामणि, धूपित इल पाधेऽ—महा मंगल.—४

## ૧૧ સતતસંગ વિષે ॥

ગરખી-(૧)

આવા નહાગે કુતી અનમેતી તેના જોડાની તરેકની  
 સુસગે સુખુદ્વિનો ભડાર, સુસગે જ્ઞાન મળે છે અપાર-૧  
 સુસગે સત્ય વરુણો બોધ, માટે કર્તૃ સતતસગતની ગોધ ૨  
 સુસગમા સહા રહે છે ક્ષેમ, સુસગે થાગે હરિ શુ પ્રેમ ૩  
 સુસગે પ્રત્યક્ષુ મળે અગ્રવાન, સુસગે મૂદને પણ થાયે જાન ૪  
 સુસગે સમજે હરિનુ ભાન, સુસગે હરિસુ લાગે તાન ૫  
 સુસગે નિર્મણ થાયે ચિત્ત, સુસગે લહે ભક્તિ તરણી રીત. ૬  
 સુસગે હરિશુ હેઠાં વિશ્વાસ, સુસગે સત્તન નિત્ય સુખતી ગાંઠ ૭  
 સુસગે સમજે સૌ સિદ્ધાત, સુસગે ભાગે સૌ ભાત ૮  
 સુસગે રણ દુર્ભુદ્વિ વિચાર, સુસગે થાયે નિર્દિંકાર ૯  
 સુસગે લાઘ્ય શાલે ભડાર, સુસગે પ્રભુ પણ મળતાર ૧૦  
 સુસગે લાભો છે અપાર, સુસગે સમજે સારતણો ને સાર. ૧૧  
 સુસગ ભડાર પવિત્ર અમૃત્ય, દ્વ્યો કહે નહિ ડો એની તુલ્ય ૧૨

## સતતસંગ વિષે

ગરખી (૨)

સાચુ સુખ રહ્યુ પ્રભુ પાસે, તેનો મર્મ સુસગે ભાસે,

સાચુ સુખ રહ્યુ પ્રભુ પાસે ૧

સુસગે હરિ રસને અહે, સત્યામૃત અપણુ દ્વારા લડે

સુસગે હરિસને દે અહે ૨

સુસગે સાર ઉરે ભરાશે, સુસગી સતપદે હગશે,

સુસગે સાર ઉરે ભરાગે ૩

ભાયા કાગથી પણ ઉગાગે, સસાર સાગર તરાશી  
 ભાયા કાગથી પણ ઉગાશી ૪  
 જે સાચુ સુખ મેળવા ચહે, દર્ઢીત અથો સૌ તે અહે  
 ને સાચુ સુખ મેળવા ચહે ૫  
 સુખ ગ તે સુખનુ છે આગાર, જાહી જયે હળજિનકેરે દાર,  
 સુસ ગ તે સુખનુ છે આગાર ૬  
 સુસ ગે સતપુરો ભાસે, સુસ ગે અવિદ્યા નામે  
 સુસ ગે સતપુરો ભાસે ૭  
 સુસ ગે ભાસે સાર અસાર, છોડે હોય જેમા અ પ સાર,  
 સુસ ગે ભાસે સાર અમાર ૮  
 સદી અહે સાર તથો ને સાર, સુષુદ્ધિએ કરે તે નિગવાર  
 સદી અહે સાર તથો ને સાર ૯  
 સુસ ગે નિયે ને ધાશે, કુતરો તેના સડ જગે  
 સુસ ગે નિયે ને ધાગે ૧૦  
 પરમાનંદ પ્રભાઈ દરસાગે, સદાનંદી ને થાશે,  
 પરમાનંદ પ્રભાઈ દરસાશે ૧૧  
 સુસ ગે સત્પથ સમજાશે, સુસ ગે લાભ ધથેા થારે,  
 સુસ ગે સત્પથ સમજાશે ૧૨  
 સુસ ગે પ્રભુભય સડુ ભાસે, સુસ ગે હાથ હળ સહાશે  
 સુસ ગે પ્રભુભય સડુ ભામે ૧૩  
 સુસ ગે બાકી ન રહે કો આશ,  
 સુસ ગનો સાર મટે દ્યો દાસ  
 સુસ ગે જાગ્ર ન રહે કો આશ ૧૪

## गरणी (३) सत्संग विषे.

नेणे करवा धार्यो हेय सत्संग,  
तेणे कर्ती करवा नहि हुःसंग;  
नेणे करवा धार्यो हेय सत्संग १

कहुं कांઈ दृष्टांतथी मुँछ,  
भीसरी तथा डाणु अहे लूँछ;  
कहुं कांઈ दृष्टांतथी मुँछ २

प्रथम थवुं श्रवणुतणु अधिकारी,  
ग्रही रीत हैवी पणुनी सारी;  
प्रथम थवुं श्रवणु तणु अधिकारी. ३

न्यां आगण सौ अधिकारी समान,  
चेणा थध चरचे श्री भगवान;  
न्यां आगण सहु अधिकारी समान. ४

थल ज्ञान विस्तारवा काळ,  
महाराय हेवा भणे समाळ;  
थल ज्ञान विस्तारवा काळ. ५

सायमांथी एकने वक्ता करे,  
अन्य श्रोता थध श्रवणे धरे;  
सायमांथी एकने वक्ता करे. ६

श्रवणु भननथी करे विचार,  
थल सञ्जो एड प्रकार;  
श्रवणु भननथी करे विचार. ७

દરિ વિમુખ નાસ્તિક પ્રસંગ,  
 તે નિય જ્વાળા જેમ લુજાગ,  
 દરિ વિમુખ નાસ્તિક પ્રસંગ ૮  
 ભારણ પર શુનામ નર થાયે,  
 જે જાયે તે કરકથી પોડાયે,  
 ભારણ પર શુનામ નર થાયે ૯  
 ઉષણુતા ક્યા રહે અગ્રદી માલ્ય,  
 કહિ ના દીહુ ડોઘણે ક્યાલ્ય,  
 ઉષણુતા ક્યા રહે અગ્રદી માલ્ય ૧૦  
 કરીયાતામા રાની હેઠ મીઠાશ,  
 રહાળા ધૂએ શ્વેત નલિ પ્રકાશ,  
 કરીયાતામા રાની હેઠ મીઠાશ ૧૧  
 ખાટા લીલુમા મિષ્ટતા ક્યાથી,  
 અથી વાસ એરડો ત્યાથી,  
 ખાટા લીલુમા મિષ્ટતા ક્યાથી ૧૨  
 જેના જે અધિકારી હેયે,  
 તેની ભતિ ત્યાજ તેહને રહોયે,  
 જેના જે અધિકારી હેયે ૧૩  
 પરા પૂર્વેથી જે હરિના દાસ,  
 તેહને ન લાગે હુસગતી પાથ,  
 પરા પૂર્વેથી જે હરિના દાસ ૧૪  
 દ્યો કરે સુસગે સુખની આશ,  
 હુસગે યાર સુસગનો નાશ,  
 દ્યો કરે સુસગે સુખની આશ ૧૫

## આચય સેવા ધત્યાદિ વિષે-ધ્વનિ. (૪)

શ્રી વદ્વાર શ્રી વિહુન માળુ-શ્રી યમુના શ્રી નવરીત-પ્રિયલ,  
સેવા કરો આનંદમા ભીજુ, તો રીજરો શ્રી ગોડુન પતિજી ૧  
દાદ્રાય શ્રી મહાપ્રભુજીનો રાંધો, અદ્યાક્ષર નિરાદ્વિન-સુખે ભાખો;  
અણુ જીમંબિ વસ્તુ રંગે આખો, ને રાખો શ્રી ગુરુ અરણું રતિજી. ૨  
અગ્રનથીધાનો સત્તસ-ગજ કર જોવો, દ્વા સર્વ પ્રાણી પર ધરેન્યો;  
વૈષ્ણુનાની રીતે અનુસરન્યો, ને ધરન્યો ટેક ધણી એકતો રે. ૩  
હરિ ગુરુ વૈષ્ણવ સરખા કેખો, ભિન ભાવ હુટે નવ્ય હેખો;  
૧ ૨ ૩ દાસપણું નહેણ્યો,, તે તન મન ધન વિવેકશુંધ. ૪  
પ્રકુદ્વિલ મને હરિના ગુણું ગાંયો, કપટ દંબ અકી અળગા થાંયો;  
હુષ્ટ સંગ અકી દૂર પણાયો, તો નાલયો પદરજ હરિ ભક્તની રે. ૫  
દીનતા ભાવ અંતરનો સ્નેહ, અસુ પ્રસંગતાતું કરણું છે એહ;  
નિષ્ઠે ભાંતન્યો નહિ રે સંદેહ, તો હેઠ દમો શા ડાંયે રે. ૬  
મનુષ્યજ-મમદા દુર્લભ જાણ્યો, તેથી દુર્લભ હરિના અરણું પ્રમાણે;  
એ એહ પાંચી સેવા રસ માણ્યો, તો જાણ્યો અર્પા આ જક્તમા રે. ૭  
શ્રી વદ્વાર પ્રભુ અદારા રે સ્વામી, પ્રાણુદ્વન ધન અંતર્યોમી;  
અદ્યાર અદ્ય તણ્ણા એ સ્વામી, તો દાસ દ્યો જાપ વારણે રે. ૮

---

### ગ્રણોધ વિષે.

#### રાગ ધવન ધન્યાશી (૫)

આચ નિરાચ જન-મતે મૃત્યુ, જગ વ્યાધિને સુખ્ય;  
દસ્તું રક્ષું લાભાલાભ, દુર્વન પ્રારંધે દુઃખ,  
જાણ્યું જ-મ જાણ્યા. ૧

આખી છુદગી લગી પ્રભુ નીરખુ, અન ઇતિને અનુસારણ,  
માટે નિર્ણયુ કર્મ શુ કરવા, લેણે સત્રતિ દ્વારે અપાર,  
અજો વન્નાથજી ૨

અન બુદ્ધ સાહિત્ય ઉપરકુ પ્રભુ મે જનતે આપ્યાણ,  
સર્વ ઉપરોગે વિદ્ધિત વર્તનથી, કરવા શાંતે રથાપ્યા,  
કર્મ એ જાણોણ ૩

રિદ્ધિત ગ્રહી નિયિદ્ધને છોડી, ભજવા પુર્વ પુર્ગાણીજ,  
નિર્મણ વૃત્તિ સદ્ગા ગખીએ, કરણુંબત ધી શાણી,  
શાખ મન આણોણ ૪

કેવન બાળી પર અવનથી, સાહસ કરા ન કરુ છ.,  
નિમિત્ત માત્ર ઉદ્ઘમ સૌ કરવા, ઇન હરિ ધર્ચિછા પર ધરુ  
ગર્વ ન ધરવોણ ૫

દાથ પગ જોડી મેસી ન ગહેરુ, અડો શિષ્ટ પુર્વપની રીતણ,  
જગપતિ વાણી થી ગીતામા, તે પર દુ ચિત્ત  
પ્રયત્ન કરવોણ ૬

ભાણી પ્રમાણે સંયોગ સાપડે, તેવી મરો સહાયણ,  
કર્મ અનુસારે બુદ્ધ થાએ, મહાબ્રત ભાપે ન્યાય  
જાણવો પર્મણ ૭

કર્ત્તવ્ય પરાણુ નિમિત્ત માત્ર ચર્ચ, ઇનાશા ના રાખેણ,  
હરિ ધર્ચિછા અદાટ પ્રમાણે, સતોય સુખાનંદ થાપે,  
નિષ્ઠનો પર્મણ ૮

કુઞ્ચ, મૃત્યુ, અખામાદિ જરમ, વણ માગે સૌ આવેણ,  
સંદુને સમય સૌ આંદી મરો છે, તરમ સુખાદિ પણ ઉપરાવે,  
ઓછ નિવેદણ ૯

શુપતિ સમ પ્રભુને ઉર ર ખી, પવિત્ર વૃત્તિથી સારણ,  
ધર્મ ન્યાય નીતિથી વતીએ, ને લાગે પ્રભુને ખાડ.

ધરીએ દ્વદ્દ ટેકળ. ૧૦

ને તે રીતે હરિ ગજ ગડે, તેવી ઇતિ આચરણીઅ,  
કણુ ભંઘું તન જાણી સદાએ, હરિશું પ્રીતિ કંઈ

પ્રભુ પણ મન વાળોઅ ૧૧

ચતુર્દ્દશ શુરૂન લગીના સુખ સઢુ, જાણી અસારણ;

સત્ય નિત્ય નિષ્ઠુ ઇષી ના મહોવાલું હ્યા ભજપથી ન હ કુમાર

ન થાય ક્ષેત્રી ખાળોઅ ૧૨

### શ્રી હરિ ભક્તિ વિષે.

ગરખી (૬)

આવ્યા બ્લાલો કુલી અસ્પેલી તેના જોટાની તરેકની,  
ભરતખંડે હરિ ભક્તિ મહોદી,

ખાણ સૌ ઇતિ જાણો છોટી;

ભરત ખડે હરિ ભક્તિ મહોદી. ૧

વિવિધ ધર્મ પણ મત જુઝુઅ પણ,

સૌમ્યા ખર જજવા રીતી;

ભરતખંડે હરિ ભક્તિ મહોદી. ૨

હો આત્મા પરમાત્મા નામે, હો કર્મ શાને પ્રીતિ,

ભરતખંડે હરિ ભક્તિ મહોદી. ૩

શાનેતરની પરાભક્તિ તે, કર્ત્વી રાખી આસક્તિ;

ભરત ખડે હરિ ભક્તિ મહોદી. ૪

ખોના કતો, સૌના સ્વામી, ને પૂર્ણીનંદ મદા જાની;  
ભરત ખડે હરિ ભક્તિ મહોદી. ૫

સર્વ શક્તિ પતિ સર્વજ સત્ય નિત્ય, તેજ મહાદાની,  
ભરત ખડે હરિ ભક્તિ મહોદી. ૬

કતો દાતા ભરતા હરતા, એક પુરુષોત્તમ જાણી;  
ભરત ખડે હરિ ભક્તિ મહોદી. ૭

નિરોપ અનત કુગુણુથી ભરિયા, તે પરબ્રહ્મ પ્રમાણી;  
ભરત ખડે હરિ ભક્તિ મહોદી. ૮

અન માને અશાને ભજવા, એવી વેદની છે વાણી;  
ભરત ખડે હરિ ભક્તિ મહોદી. ૯

“યો યદંશઃ સત ભજેત्” (ઇતિશુને)

“દાસ ભૂતાઃ સ્વતઃ સર્વૈ હ્યાત્માનઃ પરમાત્મનઃ” ||  
(પાગશર અભૂતિ વચન)

અ શ કદી અંશી સમ નહિ થાયે, અસંખ્ય અ રા પ્રાણી  
યસ્યા યુતા યુતાંશાંશો વિશ્વ શક્તિરિં સ્થિતાં (ઇતિ વચનાત)  
અંશો નાના મેદવ્યપદેશાત् (વ્યાસ સૂત્રે)  
અધિકં હુ મેદનિર્દેશાત् (વેદાત સૂત્રે વચનમ्)  
યદ્પિ જ્ઞાત્મા હરિને અંશ છે, તદ્પિ તે સમ નહિ—  
એ જાણી,  
ભરત ખડે હરિ ભક્તિ મહોદી. ૧૧  
ન તસ્ય પ્રતિમા અસ્તિ (ઇતિ શુને)

मेकाशीन जगत्सर्वे (धाभरभगपद्गीताया)  
 न तत्समश्चास्यधिकश्च द्रश्यते (धर्ति शुने)  
 सत्तादि तात्त्वम् विचारे, तेनी धी गायी  
 भरत अडे हरि भक्ति भेणी १२  
 परम ग्रेही परम ह्यायु, हरि सदा भद्रा जानी,  
 भरत अडे हरि भक्ति भेणी १३  
 रहे सौभां वगी सौथी न्यारो, सौने सदा सुखदानी,  
 भरत अडे हरि भक्ति भेणी १४  
 सी हारे भद्रा सत्ता तेषेती, स्वतन्त्र करे ते रहाय  
 भरत अडे हरि भक्ति भेणी १५  
 सीना साक्षी सदा रहे सुखन, सौने सदा ते रहाय,  
 भरत अडे हरि भक्ति भेणी १६  
 धाटे न भेष्यु, जेवा धनारा, भन्त्वा ते देवाधि देना,  
 भरत अडे हरि भक्ति भेणी १७  
 आत्माश्च तर सदा शुचि रही, करवी तन भन धनयी सेना,  
 भरत अडे हरि भक्ति भेणी १८  
 ४६ विद्यास ते धर्थुनो धारी, सौभा तेनो अरा जायी,  
 भरत अडे हरि भक्ति भेणी १९  
 ज्यम सति नार्म सतपति ने भजे, तम भजना सारगपायि  
 भरत अडे हरि भक्ति भेणी २०  
 एकज्ञ अहलनी सी छे व्यक्ति, पणु कर्वी परनी भक्ति,  
 भरत अडे हरि भक्ति भेणी २१

अन्य अंश क्षादि नियारी, पर सम नहीं क्यों आसक्ति;  
भरत खड़े हरि भक्ति भेदारी. २२

स्वधर्म शाने द्या युत हरि रति, नेहेती सदा रहे भति,  
भरत खड़े हरि भक्ति भेदारी. २३

द्या प्रीतम तेने निजनो करी, देशे श्रेम भक्ति रती.  
भरत खड़े हरि भक्ति भेदारी. २४



## २१६ धूनण-धून्याथी-(७)

श्री रिष्ट पुराणे—

अशुभानि निराचारे तनोति शुभमंततिम् ॥  
स्मृति मादेण यत् पुमा अहम् तन्मगल यिदु ॥  
(६८ वयनात्) मगलाचरणम्

(अ) (भगवद् अथ निष्पत्ति)

परमानन्द, भद्र मगल रस, उपगशि लग्नतल,  
शीघ्र सह, श्री वसनम् रिष्ट, कुपर खात सौ सत्तु १  
अकातम् इप लही वदन छरीने, खान धउ उँ मादेल,  
दिन सर्व गुणु इप रियारी, निष्पत्ति कह आदेल २  
सत्य सभा श्री दृष्टु प्रसादे, भानी तेनी अहाप्तु,  
पारमार्थिक परम भित्र, सुहंडनी रहे नित्य रहाप्तु ३  
पर अहम् रसमय सर्वेषु, सहण गुणु विभद्र शील्पु,  
तेता जस रसमा भति लोलो, ऐ वणु आश न झील्पु ४  
सभय वेद जहेने प्रतिपादे, गुणु गाढने नामेल,  
अनादि अनल अप्रतिम प्रभासी, रतनि, 'नेति'यो विरामेल ५

तम्ह अह वेद भूतिने, शशातित कडे निगमण,  
निगुण कान अग्न अक्षर पृ, सर्वातीत पुण्योत्तमण ५  
तत्त्वमस्यादि श्रुतिये करीने, पर अह निगुण थायण,  
थारे वेदनी च्यान श्रुतियो, पर स्वरूप हेतायण ७  
सामवेद छादोऽप उपनिषदे, एध कर्यो नन वारण  
उदानके श्वेत देहुने भदा वाक्ये जणयें। सारण ८

सयपपोऽणिमा पतदात्म्यदिदं सर्वं तत्सत्य  
म आत्मा तन्नमसि श्वेत वेतो ॥

(साम वेदोऽत छादोऽप उपनिषदे ८ आटम घडे

॥ अहं ब्रह्मा स्मि ॥ (युजुर्वेदोक्त श्रुते)

॥ प्रज्ञानमानन्दं ब्रह्म (ऋग्वेदोक्त श्रुते)

॥ अयमात्मा ब्रह्म ॥ (अथर्वणवेदोक्त श्रुते)

अद्वावीश अक्षर प्रमध्यी पुनरे कर्यो उपनिषद्,  
सत्य अल्पात्मक काण्डु सर्वे, सत्य उप आदेशण ९

सदैव सोम्येदमग्र आसीत ॥ (धति श्रुते)

मशुन मूर्खम काण्डु देहयी न्याइ, देवानित आत्मउपृष्ठण,  
अभिवात्मा परमह वरात्पर, सौनु भूण ते उपण १०

बगनदुप सकण जगत् छे आत्म इपथी सत्यण,  
अरात्पे जगत् सर्व छ, दृष्ट्ये क्लिं अर्जुन प्रत्यण ११

॥ मेङ्गाशेन जगत् सर्वे ॥ मेङ्गाशेन स्थितो  
जगत् ॥ (व्यास श्रूते) ॥ अंशो नाना व्यपदेशात् ॥

ममै धांशो जीव लोके जीव भूत सनातनः  
( भगवद् गीताया )

तत्त्वमुत्तमां शुभं भावने अव्यनोऽभास्यो। अंशल्,  
केवी केयी दृत्पति ते भूणने। सर्वे वंशशु. १२

ज्ञानादान-पृथक् उपनिषद्मा, वर्णत सर्वा एम भास्युऽहं;  
सत्य नित्य एम विष्णु पुराणे, एष मुनिश्चाने कृष्णाभ्यु शु. १३

भी विष्णु पुराणे

॥ मदेतद्वक्षयं नित्यं जगत् मुनिद्वयायिलम् ॥

॥ आविर्भाव तिर्णभाव जन्मनाश विकल्पयेत् ॥

॥ ब्रह्मा मृतं जगत् मत्यं ॥ धूददात्यैषोपनिषदे

ते परम्पराथी द्वाध न न्याइ, अत्र वसु आकी न हीभल्;  
सत्रे भण्डिभाणा प्राप्यावत्, सत्त्वन् सत्रधे विरामशु. १४

॥ सर्वे सत्त्विष्ट ब्रह्म. ॥ ( इतिश्रुते )

॥ नेह नानाऽस्ति किञ्चन ॥ (,,)

॥ सत्रे मणिगणाईव ( श्रीभद्र भगवद् गीतायां )

वसुतः तत्रे भेद न देहां, वासुदेव सर्व सर्वशु;  
अहस्थी भिन्न वसु न कांध, जागृ रहेतुं अभर्वशु. १५

सर्व प्राणीने सर्व सोऽभां, सर्व हिंसा सौ रथानशु;  
एकत्र अव तत्त्वपतु, सौभां सदा अष्टिभानशु. १६

॥ वासुदेव सर्वमिति सम्भातमा सुदुर्लभः ॥

( भगवद् गीतायां भगवद् वचनं )

तत्त्वे करीने सौनी औपना, तारतम्ये थाए विवेकः;  
अजिने तेना तथुभाये, वक्ति दाढ़कता अेकः १७  
नाम इपादि विविध ऐभीने, द्वेषपदुं नदि क्षेत्रः;  
नागर नदुवो चतुर शिरोभिषु, धरे अनेक ते वेशः १८  
अनंत लीला विअद्ध पुड्होत्तम, नाम इप लीला अनेकः.  
त्रिगुण्य अहने सर्वं शक्तिभां व्यापक श्रीः अेकः १९

अेकः देवाधि देव दरि ते, श्रुत अभिलभां राजेः;  
सर्वं स्थव्र व्यापक सौना अंतरमां, कर्माध्यक्ष विराजेः २०

॥ अन्योन्य मनुरकताः तेष्यन्योन्यः मुपजीविनः ॥

॥ अन्योन्यं प्रणता शैव लीलया परमेश्वराः ॥

(झर्म पुण्ये वाऽप्य)

॥ पको देवः सर्वं भृतेषु गूढः सर्वं व्यापी सर्वं भृतांतरात्मा

॥ कर्माध्यक्षः सर्वभृताधिवासः साक्षीचेता केवलो-  
निर्गुणश्च. ॥ धतिश्रुते.

साक्षीन्द्रत् निर्वप सदा छे, करे सौ प्राणीभां निवासः;  
त्रिगुणातीत सौने यैतन्य दाना, सौ धट करे प्रकाशः २१

अभिल कर्माध्यक्ष इल दाता सदा हरि निर्दीपः;

सकल और्ध्वं परिपूर्णुं लदाये, दिव्य अनंत गुणु डेपः २२

॥ निर्देषिपूर्णगुणविग्रहमात्मतंत्रेति निश्चयः ॥

स्वयं अह व्यापान रवयसु त्रिगुणु अक्षरातिनः.

अलङ्काल सर्वेना स्वाभी, परम्बह ते सर्वातीतः. २३

धाटे न झेतां धडनासे जेवो, जगन् अगीया इपः;

बाग रथना करनार अहतु अंतर इप अतुपः. २४

॥ आराममयस्य पश्यति न त पश्यति इच्छन् ॥  
(धति कुते)

ऐ वाडीमा अलि निमे, जगे रुगि होना भाग्य  
भाला ब्यतर भयु फेरे प्रक्षु, अनत छोरी अला अ २५  
जोध सालणी भानी अनुभवी, जानी भन र जन थायज्ञ,  
भनन फरी अतर आनह २६ रस खीता न हान्य २७

॥ आत्मा घारे द्रष्टव्य श्रोतव्य भत्यः (धति कुते)

प्राकृतिप गुणु दोना, अद्यमा, अनेहमय सर्वांगज्ञ,  
महान दिन २८ रस ३५ अभाईक द्वारा सागोपागज्ञ २९

॥ आनंदमानमरणादमुखोदरादि (श्रुते )

॥ अपाणिपादो यवनोग्रहीता, पश्यन्यचक्षुस-  
शृणोत्यकर्ण. ॥

(व) ॥ श्री सदगुडनी शरण्यागति अने  
सर्वांतम निवेदन विषे ॥

ऐ विज्ञान थाने काने, सदगुडने श-घु ज्ञयल,  
स-पति अनुसारे लेट लेई जर्धि, भूमी पञ्चु भायज्ञ ३८

॥ तद्विज्ञानार्थं सगुरमेवाभिगच्छेत् ॥  
॥ समित्पाणि श्रोत्रियं व्रद्धनिष्ठम् ॥

भाली दाये कही जतु नहि, देवगुड उगि पासज्ञ,  
तन भन धन नोऽनावर करीने, अपौ थध ३९ दासज्ञ. ३९

वेद वेता तत्त्वज्ञानी वेदार्थ रद्दस्यने ज्ञायेत्;  
 आचार्य सद्गुरु राःषे जातां, अत्म भूति उर आणेत्; ३०  
 हरित् पर्म प्रेम भक्तिथी गुरु पर निष्ठा हेत्  
 सेवा करीने रित्रवाथी, इपाये हरिने ज्ञेयत्. ३१

॥ यस्य देवे परामकितः यथा देवे तथा गुरो ॥  
 ॥ तस्यैते कथिताहि अर्थः प्रकाशंते महात्मनः ॥

उच्चय सत्कर्मना योगे करीने हरिने। अनुग्रह लेपत्;  
 माटे सत्कर्मी साधनन्तर, हरिनन त्वां चित्त प्रेष्यत्. ३२  
 अदा पूर्वक हरि अर्थे कर्मी, ज्ञान भक्तियुत यायत्;  
 तेषु सदा विशुद्ध वृत्ति रहे, अर्थं अश्च गायत्. ३३  
 त्रिवेच्छाथी अनेक जन्मे, भगे भनुधने। हेत्  
 पूरुष इप सुकर्म योगथी, स्वर्ग इव पामे तेदत्. ३४  
 पाप इप असत् कर्मथी, नीय योनीने पामेत्;  
 कर्मातुसारे इव भोगे ते, कर्मे न- संअति वामेत्. ३५  
 देवण कर्मे मुक्ति न सांपडे, वैराग्य ज्ञान सद भक्तित्;  
 ग्रहृति कर्मे श्रेष्ठ सधाय न, तत् हे इव संभासकित्. ३६  
 पुरुष पाप भिन्नप्रथाथी, हेत् भनुज अवतारत्;  
 निष्ठति धर्म कर्म आयदे, मोक्ष थाप निर्धारत्. ३७  
 स्वधर्म ज्ञान भक्ति युक्त थए, पर अहने अर्थत्;  
 निज सुखार्थ न गोर्ध अपेक्षा, थाप दरि प्रीत्यर्थत्. ३८  
 सुख भेणववा हुःअ हूर करवा, करे भनुध उपायत्;  
 सांसु सुख अस्यक्ष अभिडित, निष्ठति धर्मे थायत्. ३९

પ્રકૃત ને ગણિતાનં સુખમા, નિરાધિ નહિ આનંદ,  
ગિરુષુણિત હરિ પુરોત્તમ, રસ નિધિ પૃથુણિત ૪૦  
નિરૂપિત માર્ગ, નિરૂપણુપણાના, થા હરિ અર્થે યાયશ,  
પ્રભુ પ્રસન્નતા મેળવાયી, સર્વ અર્થી સધાયશ ૪૧  
સત્ય પૂર્ણ સુખ તેમા ન્યુ છે, એવુ ને જન જાણુશ,  
હરિ મીતર્થ વણુ ન કરે કાઢ, તે હરિ નસને માણુશ. ૪૨

॥ યો ચે ભસા તત્સુધે નાલેસુખમસ્તિ ॥  
॥ ભર્મૈચ સ્વેચ વિજિઝાનિતબ્યમ ॥

અરિતાણિ સુખ છોડી ને જન, માધિક વિધે હોણશ,  
ભાગ ડિન અજીને ડરાને, ઉત્તમને તન્દુણે. ૪૩  
અહુ જનમાતે જાની થવાએ, હરિ શરણુ પગયણુ યાયશ,  
અનેક - જન્મને સસિદ્ધિ, ભગવન્દગીતા ગાયશ. ૪૪

॥ વહુ જનમતામંતે જ્ઞાનવાન ર્મ પ્રપદતે ॥  
॥ અનેક જનમ મંસિદ્રસ્તતો ર્યાતિ પરાંગતિ ॥  
“શ્રી..દ ભગવન્દ ગીતા”

પાત્રાધિકાર પ્રમાણે સર્વ ધર્મા ગણી જાણેશ,  
મનથી માન્ય તે સુખ લફીને, તે મેળવના રાયેશ ૪૫  
આથારત સકામી જનને સદ્ગ રહે છે હુખશ,  
આદે, મધ્યે, અતે, તેણે સ્વપ્ને હોય ન સુખશ ૪૬  
ઘરિણત લાભની ગ્રાપ્તી થયે પણ, સદ્ગ તે કલેશશ,  
સર્વ અનથો રહે લોભમા, નહિ સુખ શાન્તિ સેશશ. ૪૭

कामनावाणी छश्चित् वर्तु, भोगे पथ नदि हग्यत्,  
हुण्डुर कामना तृप्त न याये, अधिकाधिक उभग्यत् ४८

॥ न जातु कामः कामानासुपभोगेन शास्यति ॥  
॥ हविर्यां कृष्णयन्मेव मृय पश्याभिवर्धते ॥  
इति वचनात् ( श्रीमद भगवद गीता )

ज्ञेनी भाष्यक पिप्पे कामना, अस तोपी हु भी ते द्वेष्यत्;  
अधीकाधिक भेणकवा चाहे, दन्त्री भिखारी सोयत् ४६

॥ महेऽद्रोपि दरिद्रायते ॥ भद्राभान्ते भिष्म वयन् ॥

ज्ञेने ने पश्चुनी कामना, तेद्देनो ते जाणुवो दासत्,  
“अर्थस्य पुरुषो दामो” भिष्म वयन सुखगत् ५०

॥ अर्थस्य पुरुषो दामो दास त्वर्थो न कस्यचित् ॥

॥ इति सन्ये महाराज वद्वोसम्यर्थे न कोरवे ॥

भद्राऽ भद्राऽ कषीने भृत्य, वृथा गरे छे दोडील,  
व्यर्थं विद्युत्यात् ते सहे छे, सर्व न आवे दोडील ५१

गृहदाग धनानि सर्वे, निजनु भाने वधनत्,  
कुणे सर्व दण्डाई जाशे नदि थवाय निर्वधनत् ५२

॥ द्रविण मे च दारा मे दंधुवर्गश्च मे धनं ॥

इति मे मे प्रदुर्वर्णं वालो हंति च पुरुषं ॥

इति वचनात्

वैभव छाडी वैभवीने जवुं, वैभव तथ जगेत्,  
असत् पदार्थं भोक्त प्रितयी, गोथा खाई खाई अथडाशेत्, ५३

त्रिताप छोणी तेने उर धिक्षेन न सुख शाति, गडे परितापशः  
अर्थं सिद्धि थवाने भाव, थाये चेविभी पापशः ५४  
॥ श्री विष्णु पुराणे त्रिविधि ताप वर्णनः ॥  
(जैवेय प्रति वर्णन)

स तोपामृत धन प्राप्तीथि, पूर्णं सुख शांति थापशः  
नन्य धन लुभ्यक अस तोपीते, सत्य सुख शाति न रहापशः ५५

॥ संतोषामृतवृणनार्न गत्सुखं शांतचेतसाम् ॥  
॥ कुतस्तद्वनलुधानामित प्रचेतश्च धावताम् ॥

अभंगणि क्षेत्र अभद्र ते डोरे, विधो। कष्ट अहु पेरशः  
तद्वितीया ना तले मुरभज्जन, वृद्धि ३५ करे डेशः ५६  
त्रिविधि नरकनां द्वार गायाव्या, लोभ, डामने डोपशः;  
भाटे त्रेणे त्याग करवाने गीतामां कर्ये प्रभेष्यशः ५७  
काम ब्रोदः तथा लोभस्तस्मादेतत्, ब्रयं त्यजेत् ॥

( भगवद् गीता अ० १६ श्लोक २१ )

धनातुर धनवंत जनोनी, क्षेत्र भनि, जानी जायुशः;  
निरादिन भन लाभ्यु रहे धनमां, न लोगवाय सुख माण्यशः ५८  
अति लोके भनने वरा रहे छे, रहे अपातुर तेहशः;  
निदा पर्यु सुख ३५ न अले, हुःभ मृण तृष्णा छे अदशः ५९  
पुत्रादि आपद सगा सुहृदमां, शंकाने नदि विश्वासशः;  
राज चोर शानु यायक लिघ्न, वाय पाभी याप उदासशः ६०

तु शाश्वे निरन्तर गोक मोहने, व्यापे भय ने कोधन,  
रोरा, वै, ने ऊर, भवाहि, हैने जे को करे रोधन ६१  
अमत् जनोयी प्रीति वापे, पनिथम दीनताति थाधन,  
पगधीनपथुं नित्य वेड, अपे नदि कलाम ६२  
काम तामाति चिप्य अर्थातु, सार्थ साधना काम ६३  
वज्जन अऽनु दितडागी जनकु, तोडे प्रीत समाज ६४  
॥ अर्थातुराणां स्वजनो न वधुः ॥

मेषता हु अ, हु अ गक्षणमा व्यये हानि अति हु अ,  
अनर्थं पद्म गडे छे धनमा, यित गडे हन्थी चिमुख ६५  
श्रीभद्र आगचते ११ अहं धे अध्याय २३ श्लोक १७  
लीकु गीतायां भगवद् पवनं —

॥ धनानामर्जने हु ख व्यये हु ख तथैव परिपालने ॥  
॥ नाशे हु खं व्यये हु ख चिगर्थान् क्षेत्र कारिण ॥  
॥ अर्थानामर्जने क्षेत्रस्तथैव परिपालने ॥  
॥ नाशे हु खं व्यये हु खं चिगर्थान् क्षेत्र कारिण ॥  
(इति धन विषयो विवेक ॥ जीवन्मुक्तिं विवेके )  
॥ वासना क्षये प्रकरणे वास्तव ॥

पिपीलिकाजितं धान्य, मक्षिका मचितं महु ॥  
लुधेन मचति द्रव्य, समूलं च विनश्यति ॥  
॥ उम्ततं च ॥

श्रीभद्र आगचते—

॥ अर्थस्य माधने निडे उन्द्रेष्टे रक्षणे व्यये ॥  
॥ नाशोपभोगआयास नास चिताव्रमो नृणाम् ॥

चोर्णि तिना असत्य न भने, नम हीध म ५८<sup>१</sup>,  
 १ २ ३ ४ ५ ६ ७ ८  
 ने नै अग्निश्वास ने अपर्याप्ति, चौकी द्वारा, मध्य अम सप्त ९, १५  
 ९ १० ११ १२ १३ १४ १५

॥ स्तेय हिंमा गुत द्रुम काम कोष समयो मद ॥  
 ॥ भेदों पेर अविश्वास सम्पद्धां, व्यसनानि च ॥  
 ॥ एने पचदशातर्था लार्यसलामता तृणाम ॥  
 ॥ तस्माद्वार्त्यमर्थात्य ओरोर्थी दूरतस्त्यजेत् ॥

सुकृष्ण अनर्थनी उत्पत्तिनु मृण इनमा आख्युः  
 मुकुट्कु सम्यक लगे सर्वते, श्रीमह भागवतमा वाख्युः ११  
 ४४ लोकाना ऐडी पारा सभ, ४६ अधनना अपल,  
 औ धनादिमा आसक्ति, तेद पडे भर इपल १७  
 ॥ लोहदारमयै पाईर्द्धं वन्दो निमुच्यते ॥  
 ॥ धनादिपु ससम्भो मुच्यते न कदाचन ॥

अहता भमतानी वृधिदाग्नि, धन दाग्नि,  
 ५६ कृतो अने आ छे भाव, अयोज्य अने द्वत्तु १८  
 तेष्ये ५७ अधनना पामे, मुकुट थाय नहि ५८  
 सर्व ५९ सत्ता इन्ही लाखी, अपै तन भन धन ५९  
 श्री हरिए प्रगटा यु सर्वे, कृती दाता तेहर,  
 जोक्ता हर्ता सर्वेश्वर छे, लाखी अर्पे सी अहर ७०  
 सर्वात्म निवेदन पञ्चलने भाता, अधन इटेह,  
 जेती छे ते तेनी भनाना, अविद्या भोदाहि ७१  
 ५८ कृतो अने आ छे भाव, अग्नाने भनाय  
 परसत्तानी निकली भाने, आधक ७५ ते ७६

લક્ષ્મીપતિની લક્ષ્મી મનાતાં, અહંતા મમતા જાપજુ;  
હરિની માની તેને અર્થે યોજતાં ભક્તિ થાપજુ. ૭૩

### ઉદ્ગતચ કૃલસીદાસ કૃત સાહી (વૃહો)

તુલ્બસી નાર ગરીશકી, અપતી કહે ન ડોષ;  
પ્રશ્નુ પત્તી અપતી કહે, (તો) કથોં ન ઇજેતી હોષ.

શ્રીમદ્ ભગવતે ૧૧ ૨૫ ધી

॥ એવં ધર્મૈः સતુલ્યાણાં ઉદ્ગતાત્મનિવેદિનાં ॥

॥ મયિ સંજાયતે ભક્તિ કાડન્યોર્થેડસ્યાવશિષ્યતે ॥

સર્વે વરતુ પ્રભુએ સરજુ છે, કર્તૌ, દાતા બોક્તા ઓહજુ;  
જેણે પ્રગાઢાણી આપી સીને, તે સ્વામી એવો વિવેકજુ. ૭૪

અલાર્ખે કરવાની વર્તુ, અલાર્ખે કરનારજુ;  
જે દારે અર્પાયે તે અલાર્ખે વિવ્યારજુ. ૭૫

બોધુ પરાર્થ અને બોક્તાદિસી, ઓક્કજ તત્ત્વ સિદ્ધાંતજુ;  
અલમય સૌ જે જાણે તે, અખું ન ગણે ભાંતજુ. ૭૬ -

વિશ્વભર સૌ વિશ્વને આપે, અન ધન નિર્ધારજુ;  
ધનપરાર્થ પણુ અલાર્ખેથી ભાડરિ કરે સ્વીકારજુ. ૭૭

॥ વ્રક્તાર્પણ વ્રક્ત હવિ: વ્રક્તાણો વ્રક્તણાહૃતં ॥

॥ વ્રક્તે ધ તેન ગંતવ્યં, વ્રક્તકર્મસમાધિના ॥

શ્રીમદ્ ભગવદ્ ગીતા-અધ્યાત્મ-૪ ધોંક ૨૪

આતિમાં વસુ એ નામે કરીને, ધનને ગણ્યું હરિ ઉપજુ;  
તત્ત્વે હરી અમિતતા રોકા, ધને હતું રદ્દજુ ૭૮

अन धनर्दि इता विभुभृ, वसुद श्रुति विच्यांशु,  
जेतु तेने अर्थे भोजता, निर्दीप अल सम सारल ७६

वसुद = (धन आपनारे)

॥ अन्नपो वसुदानः (ध्रुति शुने)  
॥ वसुरन्तरिक्षसन् (;;)

सायु उत्तम धन ते कहावे, धर्म युक्त ले होएशु  
धर्मथी विमुण पड़ाये जेणे, ते धन आधड सोयशु ८०  
सद्वित सर्व समर्पणे थाये, मृण्युर्पैषु भति अर्थशु  
अभिष्ठ निर्गीध थाये तहेने, कही न थाय अनर्थशु ८१  
सर्व रपुदाथी रहीत यहने, आथय इड इरिना धारेशु  
अंतग्राम तहेने न रहे को, रवान्दु रहीत न क्षारेशु ८२

श्रीमद्भागवते ११ २५ वे अध्याय २८ श्लोक ४४  
उद्देश प्रति श्रीरूपशु वरन -

॥ योग चर्यामिमां योगी विचरन् मदूचपाश्रयः ॥  
॥ नांतरायैविहन्येत् निस्पृहः सम सुखानुभः ॥

काया वाणी मन धर्दिने, खुदि आत्मादि सर्वशु;  
जेणे जे के थाप तेह सौ, अर्थे रही अगर्वांशु ८३  
भगवद जोग्य अर्थे उपयोगे, अर्थे तन मन धनशु;  
अलापणे निर्दीप थाप सौ, रहे न को अधनशु. ८४  
(श्रीमद भगवद गीतापां भगवद पर्यन्त)

श्रामद्-पुण्डितं-

सार शिक्षा मन छोध थवाने दास द्ये उर राखी;

तेमांधि मुख्य मुख्य संक्षेपे—ग्रसंग नीडणतां भाखी.

॥ श्री हृषिनुं तथा लक्ष्मानुं सर्वं साचुं ॥

५६-८- राग डेहारे।

साची वस्तु शक्ति लेमां ते तो सहज इये  
प्रार्थनानी अपेक्षा न राखे;  
वहाल विश्वासादि काम त्यां कथुं नहीं,  
व्यर्थ डेमे न गुणु आत्म हेये ।

साधु उपहेश अद्वितिना तान वण,  
भंत्र वा औपधि निज गुणु हेखाडे;  
तो पठी सहज उरि संबंधी वस्तु सहु,  
डेम अभिवाख पुरा न पाडे. २

चणी प्रतीति कुंती, भंत्र रविनो ज्ञयो, -  
उनि पधारी वस्तु शक्ति भारी;  
तो भरेंसा विना वस्तु उरि संबंधती,  
सहण याशे डेम जे वियारी. ३

तेम विभीषणुनो पण्य चल्यो। विश्वासमन,  
तर्दधि इण ना चल्युं राम राचा;  
सत्य संकल्प वयन आप्युं पाषुं न ले,  
अब ७२३ स्वभाविक होय काचा. ४

દાખિશે મોદા ગુની જીને કંચુ,  
વાગી તારી જગો વડ ફુ થાર  
તદ્ધિ છાની પ્રેરી ગણી વિશાસ વળુ  
વચન પાણુ પ્રણ દોં ના । ૫

કશ્યરતી અદ્દગમતિ જાણી મેદેતો કર્યા,  
સાસરે જાયો ખુની નુ જોત્યા,  
તદ્ધિ આપો દર્દિ, હાર, અગ્રે પર્યા,  
ચુ થયુ આદતે દાસ તોત્યા ૬

ચિપ વા અમૃત અનણે ઉદ્દે ગયુ,  
તદ્ધિ ગુણુ નિજ જાણ્યા કેવો આપે,  
તો પછી દર્દિ નામાહિક ગમે તેમ અંચુ,  
તેથા ફુખ ટ્યો, સુખ તેમ ન વાપે ૭

સમજે એ રીત વિશાસ સદજે ભગે  
મન હણીનુ અવળાયડી કેનુ,  
અવળુ કલીએ તારે સવળુ માને મુરભ  
ચુંઠિથી કામ માણિ લેણુ ૮

દાસ ચિતા ફં ચળ્યુ, તદ્ધિ તે ઇનમહાયુ,  
પ્રભુ વચન ના ચળ્યુ, નિશે આ કુ,  
સર્વ સાચુ દ્વા પ્રીતમનુ શુંતિ કણે,  
અહિત નિજ જમતનુ કદી ન ભા કુ ૯



## કર્મના ચર્મનું પદ (૬)

### રાગ ધ્વલ ધત્યાક્રી

આત<sup>૧</sup> અજ્ઞાનું અથો અથો, અને મુસુમું એ વ્યારણ;  
 પર<sup>૨</sup> અજ્ઞાસાવંત સરવને, શી હરિના આધારણ. ૧  
 કોષ્ટકર છે અજ્ઞપદ પ્રાપ્તિ, તે કરમ સાધણ;  
 વેદાદિમાં પદ ત્રિ દાખ્યા, તે મારગની લે રહાયણ. ૨  
 કર્મ - જ્ઞાન - ઉપાસન ત્રણે, મોક્ષ સાધનના ઉપાયણ;  
 જ્ઞાન ભક્તિની ઉભાગે જરૂર છે, માટે તેને ચાયણ. ૩  
 પ્રથમારંભે કર્મ વિદિતનાં, નિત્ય નૈમિત્તિક કરવાંણ;  
 નિપ્રામ ભતિએ અદ્વાયુતથી, અલ્પાર્થણ ચિત્ત પરવાંણ. ૪  
 કાભ્ય કરમ બાધક જાણીને, ઉત્તમ જને તે તરવાંણ;  
 નિપદ કરો પદર્થ કરીને, વિદિત હોય તે સરવાંણ. ૫  
 ચિત્ત શુદ્ધ થાવને માટે, બાખ્યા કર્મ સંરક્ષારણ.  
 અવિદ્યા અજ્ઞાન કાઢવા, ભવનિધિ તરવા પારણ. ૬  
 પદ નિપમાદિ સાધન સર્વે, હરિ ગ્રીતથો કરીયેણ;  
 પંચ વિષયને પરદરને, વૃત્તિ હરિ ચરણે ધરીયેણ. ૭  
 જ્ઞાન ધૂક્તનાં કર્મોગ ભી, અદતા ભમતા ત્યાગીણ;  
 લક્ષ નિયાન શી હરિમાં લેડી, થવું પ્રભુ પદ અનુરાગીણ. ૮

સર્વ વષ્ણુને, સર્વાશ્રમાંએ, સત્તાચાર વિચારણ,  
 તે કયારે કદી લ્યાગ ન કરા, કર્મ ભર્મ અહી મારણ ન  
 કર્મ જાને જડ સદ્ગ છે, કદ્વ ગતા પ્રશ્ન જાણોછ,  
 વષ્ણુશ્રમને ઉચ્ચીત કરતા, થાય અતર શુદ્ધ પ્રમાણોછ. ૧૦  
 કર્મ કરીને અવિદ્યા ટળતાં, ઉદ્દ્ય થગે સુનાનાછ,  
 પડે લેખુ અગે ધોનાએ, જે હોમ ભક્તિ નિજાનાછ ૧૧  
 કર્મથી કર્મ ધોરાય નહિ એ, ચિદ્ધ પૃથ્વે નિયારણ,  
 પથાકુમ અધિકાર મગેથી, પ્રગતે દ્વા દીનતા મારણ ૧૨  
 અવષ્ણાદિ સાધન ઉપયોગી, નહિ નિયોક ડોપણ,  
 કર્દમ કેખુ અગ શુદ્ધ હોયે, જે નિર્મણ ભક્તિ હોપણ ૧૩  
 અજ્ઞથી નિયોગ થયો ગુરતે રે, ત્યાંથી શુભાશુભ કર્મણ;  
 ચોભાણુ, ચોરાશી લક્ષે, નિવિષ ધર્મ ધર્મણ. ૧૪  
 મનુષ્ય દેહ દુર્બલ અતિલયો, જેમા જાનાદિ સાધનાણ,  
 તેવે ચોગ નહિ અન્ય ચેતીમા, શ્રી ભાગવતમા વચનાણ. ૧૫  
 એ કર્મ કર્મ વિકર્મ ભર્મને, શ્રી ગીતાથી જાણીણ,  
 પડે પ્રકારના ધર્મો લસીને, ભજવા ધર્મો શ્રી મુર્દુપ પુરાણીણ. ૧૬  
 કર્મ જડાદીના થાવું, ન થતુ શુદ્ધ વેદાતિ કયારેણ,  
 દ્વો કહે કર્મ કરતારા તે, આ ભર્મ વિચારણ ૧૭



## જ્ઞાનના ભર્તું પદ. ૧૦

રાગ ધવસ ધન્યાશી

સાધન જ્ઞાન ઉભયમાં વળ્યો, ખરરપર સંખધણ;  
અજિન કાષ જેમ અન્યાઅન્યને, ત્યમન લડેતે અંધણ. ૧

પાક સામથી સિદ્ધ કરવાને, સરપણ અભિ બનેણ,  
ત્યમ હરિ ગ્રામી થાવા ઉલ્યે, સદા સજ ગણે મનેણ. ૨

કાષમાં પણ અતિ જરૂરનો, અજિન સંખધ જેમ હોયણ;  
ત્યમ શ્રેષ્ઠે સાધવા સાધન જ્ઞાનનો, સંખધ વળ્યો ન હોયણ. ૩

આચાર ઇપી ધર્મ પ્રથમ છે; ને તેણ પ્રભુને ઘારોણ;  
આચારો પ્રથમ ધર્મ: ધર્મસ્ય પ્રભુરુ ચ્યતે “ઇતિ વચનાત्”  
॥ અથાતો ધર્મ જીજ્ઞાસા” એહ વચન વિચારોણ. ૪

સદાચાર વિચાર રહ્યાથી, ધર્મ અગ્નાસા થાયણ;  
કર્મ ધર્મનો લક્ષ રહ્યાથી, વિકાર માત્ર ટળી જાયણ. ૫

નિર્મણ વૃત્તિ બાદાભ્યંતર, શુભ કર્મને થાયણ;  
॥ અથાતો વ્રદ્ધ જીજ્ઞાસા ॥ એ સુત્રને જ્ઞાયણ. ૬

પાત્રકની પ્રમણના જેણેની, તેણી શીઘ્ર ગ્રોહણ;  
આત્મ વિરકે જ્ઞાનાતુર ભક્તિ, પરા પ્રાભયિત ગ્રોહણ. ૭

કર્માચારમા પણ અદિલુન રહ્યાંતા, ઇથી પ્રશાસાની જાણોછ,  
કર્મે જરૂર આસુગી નાબી, ભતિ ન સ્વપને આણોછ ૮

અજાન તિમિને દ્વારા માટે, અદ્ભુતાની જરૂરો,  
“ એક વિજ્ઞાને સર્વ વિદિતં ભગતિ ” શુણ લડો ઉંઘુ ૯

એક શુદ્ધ અનુદ્દિતિય અજ્ઞને, સરો સરા ભરપુરુષ,  
એક અને કરી સૌ જરો વ્યાખ્યા, સૌમા તે રક્ષણ નરુ ૧૦

॥ શ્રીમહ ભગવત્ ગીતાયા ॥

॥ વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુરુદ્દ્દભઃ ॥  
મેકાંશોન જગત् સર્વ વલિયદે બ્રહ્મ ॥ ધ્યાનિશ્ચુદે  
નામ ૩૫ ણંડુ તેદુ • પુરાણા, ધ્યાન ભાગનો બેદાન,  
॥ નામરૂપ પિભેદેન જગત् ફિલ્ડતિ યો યત् ॥

॥ તત્ત્વાર્થ દીપનિવંધ ॥

॥ એંદ્રાં બહુસ્થામ् ॥ પોકારી કહે વેદાન. ૧૧

આધિક્ષેપિક ભૂળ અભિના, અંતર્થ તથા ગણ્યાપુણી;  
તે રીતે વિશુદ્ધિ અશાદિ રહેતા, સર્વત્ર અહુ નાણ્યાપુણી ૧૨

॥ અંદ્રાં નાના વ્યપદેશાત् ॥ ઇતિ વ્યામ સુન્દરે ॥

હેવળ કરો અશાન હોરો, કહિયે ન કરે નાશાન,  
જરૂર ભૂળ સહીત દૂર થવાને, જોઈએ શાન પ્રકાશાન. ૧૩

શાન વિશોનતુ તારતમ્ય જાણો, શર્ણી અધ્યક્ષાર નિવારેણ,  
તદ્ધિ સુર્ય સમ કાતિ ન તેમા, એ તારતમ્ય નિધોરણ. ૧૪

શુદ્ધ શુને અહુ એક ભાસે, પરા અક્ષિત હોય જરૂનેણ,  
શર્દી અદ્ર વિશુ જરી અમગ યાય, એહ લક્ષ રહેતેનેણ ૧૫

પ્રથકું પ્રથકું સો દેખધારીમાં, આત્મા રૂપે રહે એકજ, સર્વાત્મા વર્તી રહ્યા અભિલભાં, અનેક તે એક વિવેઃજ. ૧૧

૨૬ નિશ્ચય છે ભાવ સત્યનો, તેને સત્ય સમજાયજ. રતંબે ગ્રહાદે રૂપું પ્રગટાયા, આવિભીષ રૂપદુઃ દરસાયજ. ૧૭

જ્યાં લગી અભ આચ્છાદાન હોયે, ત્યાં લગી સુદૂરનાં ભાસેજ, વાદળ વિખરાયે સોમ રવિ જ્યોતો, આપે શુદ્ધ પ્રકારોજ. ૧૮

ત્યમ અજ્ઞાને વિઅમ ભતિ જ્યોતો, વિજ્ઞાને ભ્રમ સો જાયજ, સત્ય નિત્ય અનંત અજ્ઞનો, એક ભર્મ દરસાયજ. ૧૯

એક અલ સર્વત્ર પ્રકારો, શુદ્ધ દૈત હરિ જાણેજ. તેને અન્ય કંધ ભાસે ન કહાએ, વિજ્ઞાની સર્વું પ્રમાણેજ. ૨૦

વરસુતઃ તર્ત્વજ્ઞાન યથારથ, એક અહનું જ્ઞાનેજ; તેની ભતિ કથી દૈત ન થાયે, વિજ્ઞાની કથીયે તેઙેજ. ૨૧

શર્વ વારી રજકણું સંયોગો, અર્વાચે જળ કરે શુદ્ધજ; મૈત્રતી સાથે ભૂતળાયે કરી, પેણે નિર્મળ વિશુદ્ધજ. ૨૨

‘અલ’કાર ખણું જુદા આકારના, પણ એક ધાતુનાંજ રૂપજ: આઘમધ્ય ને અંત તે ધાતુ, એમ નામને રવરૂપજ. ૨૩

જ્યમ ધાતુથી પ્રથક નહિ તે, એમ હરિ છે એકજ; એક છતાં અનેક તે થાયે, તદ્ધિ એકજ અનેકજ; ૨૪

જ્યમ જળ સ્વાભાવિક સ્વરૂપ મિષ્ટ છે, પણ સ્થાન પાત્રને બેદેજ; ક્ષાર કંડુ મોળુ દાત્યાદિ ભાસે, પ્રમ વેદ છેદેજ. ૨૫

સર્વ શુદ્ધ નિર્દેખ અલ ને, નિઃદ્વિષે સહાયણ;  
પૂર્ણ ગુણ વિગતાદિ પુકતાણે, વિપમ કે કુર ન કદાયણ. ૨૬

પચ ભૌતિક હેઠ ગદિ આત્મા, અનિત્ય લંડો શરીરણ;  
સતત નિત્ય અલ ડ્રેપ જાણો, અજર અમરાત્મા રહે સ્થીરણ. ૨૭

સર્વ વિગ્રહ ધર્માશ્રય પ્રશ્ન છે, સંબંધે દરિમાં સર્વણ;  
કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ, લંડી પ્રશ્ન તનને ગર્વણ. ૨૮

કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ, સદા સ્વતાંત્ર જ્ઞાયાનણ;  
પરાત્પર પુરુષોત્તમ ભક્તિમા, નિગમાગમે વ્યાખ્યાનણ. ૨૯

અહંતા ભમતા બાધક જાણ્ણી, નહિ કો રાખે જીણેણ;  
અતન્ય રાખુણ પર અહનું ત્રૈલેખું, સમપરી શ્રી કૃપશુણ. ૩૦

વિજ્ઞાન વિષ્ણુ સુક્રિત ના ચાપે, માટેય, કિંચિત ઉથ્યું ગુનણ.  
શુરુ દારાંએ દ્યે કેળવીયું, તેનું કથ્યું નિતાનણ. ૩૧

### ઉપાસનાના મર્મનું પદ (૧૧)

— રાગ ધ્વલ ધન્યાશ્રી —

પરાત્પર પ્રશ્ન રાણ ચાપે, તે માટે કરો તેનું ખ્યાનણ;  
ઉપાસ્ય ઉપાસક ભાવ હૃદ્યમાં, ન રાખે કઢી અભિમાનણ. ૧

સદા સ્વામી પ્રશ્ન, દાસ હું તેલેનો, એ મતિ દ્વદ્વાર રાખેણ;  
ઉપાસન ત્યારે ભાવિત રહે બદુ, માટે હું તહારો એમ ભાગેણ. ૨

પરમાત્માનું ગ્રાન ધ્યો વિષ્ણુ, ખલોપાસન નાં ચાપણ;  
શાશ્વત શીદી છોડીને ચડતાં, ભૂમી પર પડી જાયણ. ૩

સત્યના તપ અલયર્થ જાને કરી, પ્રથમ અલને જાણેલ;  
કરિ સેવન હરિ રૂપને ચેખો, પ્રગટ અલ તે માણેલ. ૪

પરાયન પ્રત્યક્ષ થવાને, શુદ્ધ જ્ઞાન ભક્તિની જરૂરાએ;  
જાનોત્તરની પરા ભક્તિં તે સેહેને ન પ્રગટે ઉરાએ. ૫

ખાડુ જન્મે કરી જાતી જન તે, પુરુષોત્તમ શરણે જાયાએ;  
શુદ્ધ રૂપ વિજાને અનુભવે, તૈને હરિ પ્રાપ્તજ થાયાએ. ૬

યોગ જ્ઞાન વૈગણ્ય તપ ભક્તિ, એ વિદ્યા પંચ આ વર્ણાએ;  
તદ્વિપ્રે વિદ્યા બળ ના ધરખું, રાખવું બળ ગિરિધર રાખ્યાએ. ૭

વિભ્રમણ્ણા અગ્નાન નિર્બંધો, સહૃપદેશને સંગેલ;  
શુદ્ધ ચિત્ત નિર્મણ કરીને, મતિ પ્રભુમાં રંગેલ. ૮

સ્વરૂપ સમાગમ મહાતુભૂતીનો, અને કંદિ ન જાયાએ;  
કુતક્ક કુવાસનાતું મૂળ છેદી, મેળવે થી અજરાયાએ. ૯

તત મત ધનથી મત કર્મ વચ્ચને, અતન્ય ઉપાસન દાખેલ;  
દ્રદ ભાવે શુદ્ધ રૂપે સેવતાં, માનસીને મુખ્ય બાખેલ. ૧૦

એકામ વૃત્તિ દ્વા થપા વિના, સાધન સેવા ન થાયાએ;  
સ્વરૂપ દિત વાતસથ રૂતિ કરતાં, ઇલ રૂપા થાર્દી જાયાએ. ૧૧

પ્રભુ ગ્રિત્યથ્રી પ્રશોભન જાણે, નહિ સ્વારથ ડો રંઘાએ;  
નિન સ્વારથની રેણા રહેઠો, તે કહાવે પ્રભંઘાએ. ૧૨

પરમ શ્રેમે રહેજ સમાધિ, ધ્યાનની દેલેયો ડોયાએ;  
પુરુષોત્તમને સર્વ સમર્પે થઈ, દાસ હરિ એ ચિત્ત પ્રોયાએ. ૧૩

સર્વ સમર્પણું રાગણે ગ્રહીને, આત્મ નિવેદન થાયછ. ૧૪  
 પદું વિધિ રાગણું અતિ સાચી અડે, તો થાપ સમ ધનજરાયછ. ૧૫  
 નિપિલ, કર્મનો ત્યાગ કરીને, વિહિત માર્ગે પળાયછ,  
 ભન, છુદ્રિ ખુખ્યાદિક જીતે, સદગરણું નીતિએ કળાયછ. ૧૬  
 શાત ચિત્તે તૃષ્ણુા રહિત થઈ, કરે સર્વ હોપ વળનછ,  
 દરિ વેદ શુદ્ધ સત્ત શાખેની આજા, પાળે તે સુસુધુ જનનછ ૧૭  
 દૃપા કરી પ્રભુ તેને અપે, પર અર્થપનુ જાતનછ;  
 પર્મ પ્રેમની નિરદાતુર ભક્તિ, તેતુ પણ તે જાતનછ. ૧૮

“પ્રશાંત ચિત્તાથ જિતેદ્રિયાય,  
 પ્રહીણ દોપાય યથોરતકારિણે;  
 ગુણાન્ધિતા યાનુગતાથ સર્વદા,  
 પ્રદેયમેતત્ત સતતં સુસુધુચૈ.”

કેવળ વેદાધ્યન તપાભ્યાડે, દાને ઈજીવ્યાએ ન પ્રાપ્તીછ,  
 શાખ પદ્ધન પાર્દન કુદ્ધિથો, અનયનાદિકે પણ ન સમાપ્તીછ ૧૯  
 એ ઉપનિષદ સંસ્કૃતાનો, ભાષ્યો છે આ ભર્માજ,  
 સાચી દદ પ્રીતિ નિષ્કર્મે, તેને એ પ્રાપ્તી પર્માજ. ૨૦

“ના વિરતો દુષ્ટ્યરિતાનું નાશાંતો ના સમાહિત:  
 નાશાન્તમાનસો ચાપિ જ્ઞાને નૈતમાણ્યાત.  
 (કહ ઉપનિષદે ૨-૨-૪)

કેવળ ત્યાગ વિરાગ વહે હે, શાત ચિત્તે પણ ના ભાસેજ,  
 નિહાન વિષુના જાને પણ ત્યામ, ન હેણે પ્રગટ પ્રભુ પામેજ. ૨૧

કેવળ શાને મુહિત ન થાયે, પ્રતિબંધ સરવ ન કૃપાયણ;  
 સત્યામૃત આસ્વાદન થાયે, કેવળ કૃપણ કૃપાયણ ૨૧  
 ખાડુ શુદ્ધ કૃત કદી કે તિક્ષણુ શુદ્ધિ, તદ્પિ દર્સ ના થાયણ,  
 શુદ્ધ પરમ અનુરોગ ભક્તિયે, પુરુષોત્તમ પરમાયણ ૨૨  
 સંત સમાગમે ઘલ છે સહેલા, મારે કર્યો તદીયનો સંગણ;  
 તાદરી સ ગે જોટ સહુ ટળણે, ન ગાખયો અસત્ત પ્રસંગણ ૨૩  
 સમ ભત્તિ મુહેં વિપદ પણે રહે, સત્ય પ્રથાએ વર્તેણ;  
 મન શુદ્ધ પરખણે પરેયે, દૈત પ્રપણે નિવર્તેણ ૨૪  
 કૃતક' વિકલ્પ કુવાસના ચિંતા, ચંચળ વૃત્તિ છોડેણ;  
 અભિલ ઘલ ભત્તિ રાખીને, વિવેક, નમન કરજોડેણ ૨૫  
 કયારે કોનુ' અહિત ન ધર્યે, કરે તરુંવર સમ પરમાર્થણ;  
 સંખત શક્તિ અનુસારે સર્વને, સન્માને એ રવાર્થણ ૨૬  
 જ્વધમ' શાન સહિત વિરાગે, કરવી સહા દરિ ભક્તિણ;  
 કે તે રીતે દરિ રાણ રહે, રાખે એજ આસક્તિણ ૨૭  
 ઉપાસનાનો ભર્મ' અતાયો, શિષ્ટ વચન અનુસારણ;  
 દ્વ્યો કહે સૌ શાસ્ત્ર તણુ' મે, કથન કર્યુ' નિરધારણ ૨૮



## વિનિતિનું પદ. (૧૨)

ગાગ ધનળ ધન્યાશ્રી

મતો દાતા બોક્તા દર્તા પન્થલ નજરાયજી,  
 તરણું તારણું સું સુખ કારણું, જરૂરેન વેઠાદિ ગામજી ૧  
 જેણો પાગ મેઘને ના લાખ્યો, નેતિ નેતિ કહી વેઠ વિરામેજી  
 તેને શું રીતિવશે ડેઢ જન ભારે ભજુ નિષ્કામેજી ૨  
 સમર્થ જાણી શરણે આ યો, સર્વ સમર્થું તમનેજી  
 ચિતા સવેં નિરતી એણે, પ્રસુ ર્વીકારો અધમનેજી ૩  
 દાથ જેહીને શીરા નમાવી શ્રી હરિના શુણ ગાઉજી  
 ડેઢીક કિલ્લિપ અનત જરૂરના, નિરતી પાવન યાઉજી ૪  
 ભાવે કરી તુજ શુણુંના ગાઉ, યાગે જળળ અપારજી  
 કુલ સર્વિથી અદુ મૂળાઈ ધુ, સ્વાર કરો પ્રસુ ભારીજી ૫  
 માઈક જરનોં સર્ગ ન રૂચે, અજાનીનો આવે અભારજી,  
 સાચા સતનો સુસરગ દેણે, દેખ તમ ભક્તિ હારજી ૬  
 ને ભારે દરિ તમો સરણ્યો, તેની ન જાણુ વાટજી,  
 ધડનાગ પ્રસુ પ્રગટ ન ભાજ્યા, મોહાઉ તમ રૂચના ધાટજી ૭  
 આપના કૃપા પાત્ર જનો હૌં, ને છે તમને ખારજી,  
 પ્રસુ પ્રયોગિ તે સત્કુરો, રહે છે સરળથી ન્યારજી ૮

નહુ ખાટે જન દુઃસંગને ભરિયા, તેવા જનોને જોઈજી  
નદિ રાયે કરી મનહું અદાડાં, માટે સજાન મેળવો કોઈજી. ૮  
કામાદિ પૂર્ણિપુ સંતાપે, તે કથા ન પડેજી;  
પ્રધાંચનું સુખ દુઃખ નવ વ્યાપે, આશા તૃષ્ણા અણગી દીડેજી. ૧૦  
ચલિત આધિભીતિક લક્ષ્મીજી, જેદ ધરો ધરો ઇરતીજી;  
તેને ત્યાગી અવિચણ ભક્તિ, ત્વાં મુજ મતિ રહે ઇરતીજી. ૧૧  
વેશ ધારી આડાંદ કરતા, દેખુ સંત જમાતજી;  
તે પણ સુજને લાગે નદિ સારા, તદ્વન સન્યાસી મલાંનજી. ૧૨  
મુણ્ણો સત્ય કહુ સહુ વીની, વિતાની કરી કરણું ધારોજી;  
દાસ દ્વાને ભરગાં વહેતાં, દૃપા કરીને ઉગારોજી. ૧૩

### અત અસત પુરુષોને ઓણખવા નિષે.

રાગ-ધનગ ધન્યાશ્રા પદ (૧૩)

અત અસત પુરુષો રહે જગમાં, સરખો સ્વાંગ આકારજી;  
સહૃદન માથે કાંધ મણ્ણું નદિ દરશે,  
સિંગ પુરુષ અસત ન હૈં લગારજી. ૧

જગત જનોની રીતે વરતે, નદિ કો પૃથક વ્યવહારજી;  
જળની મધ્યે કમળ રહે, પણ રૂર્ધાં ન જળોનો લગારજી. ૨

છુબન સુકત જનોની રીતો, જળ કમળ વત સારજી;  
કરી કોડતા અહુતા મમતા, રહે અળગા તે દરિ દેશારજી. ૩

ઝૌ જનને ચુખડારી સદા તે, જેનું સૌ પરમાર્થજી;  
ઇદ્રિ અત સાચા સતેખી, નદિ રંઘક જીડેને સ્વાર્થજી. ૪

પર ઉપકારે પ્રીત જાંનેરી, કીના અરગુણુ મનના આણે ૫,  
દોષ હેણી પર રેય ન કેદેને, સૌ ધટ હરિ પરમાણુભ ૬  
નિના ગુણી કરે ન ઢોની, સમ શ્રદ્ધિ વત હેઠળ,  
સંદળ ચગચરમા પ્રજ્ઞુ પેખે હૈત પ્રપદ ન હેઠળ ૭  
હુગણું લેથી હૂર રથા હે, સંકળ સુગુણુ ભડાણુ,  
શૂદ્ધ શાત વિવેળ ક્ષણે કરણું વત અપાણુ ૮  
નિર અભિમાની પર હુ અ બજન, જરૂને વધાતુ ન વિચાર,  
અગ્ન ગુણ લીના રસે ભીન્યા, હરિ રમગણુ સેવને સદા ચિનણ ૯  
“વી સ પદાના સાતિંક લક્ષ્મણુ, સદા રૂપે જનહા કરી તિવાસણ,  
નહિ ભય ડાઈનો ડાન ન ક્યારે, નહિ હો આશ કે ત્રાસણ ૧૦  
એવા જનના દંશન માવે, ભૂતાયે પ્રપદનુ ભાનણ,  
સગે જોહ કગવે હરિ શુ, ને ઠોડાવે અય અભિમાનણ ૧૧  
હુણ સંગ તો તેદેને જાણુયે, ને ભૂતાવે બગવતણ,  
રાનીસારની પણ શિખવે, તે કહીએ સાચા સતણ ૧૨  
પણ અગ્ન રીત અજાની જનતી, પરએ નહિ સુસતણ,  
હરિજન દૃપા પાત્ર તે પ્રીઠે, ને ધીમત ગુણવતણ ૧૩  
જ્યાંદા કામ ત્યા રામ નહિ, ને ગમ ત્યાંદા નહિ કામણ,  
રવિ રજની કય મ ઓછા વિનસે,  
ઉભયના પ્રથક વિચામણ ૧૪  
ત્યા અવિદ્યા ત્યા ક્યા સુવિદ્યા, જ્યાંદા માયા ત્યાંદા કામણ,  
જ્યાંદા સત્ય તો અસત્ય હોય ક્યાથી,  
પરમપર ન્યારા હામણ ૧૫

साचो ते कठी को मुरभने, उक्तो जुहो जखायल;  
 तेनु हुःअ नदि सलगनने कदा, नदि पापंडी गलायल. १५  
 नाग पंथभी हीने करता, खिने नाग भूमयल;  
 साचर नागने सालसे बहडी, रानमाँ मूळवा जायल. १६  
 झुगंधी पुण्ये सदा झुहु रहे, भस्ते पथु झुगंधी दाखेल;  
 निज स्वभाव ते कठी नां छोडे, ऐ रीत सुस तो भाषेल. १७  
 परैपकारी तडवर जडेवी, सदा कृति डेव संतल;  
 अहितकारीनु पशुमुहितताहे, ऐम संतलक्षण्यछे अनंतल. १८  
 असत पुण्ये कौचना जेहेवा, तेमाँ कर न धबायल;  
 दाथ परसताँ वजुर अडु थाये, रथेण धर्मे नां जायल. १९  
 साचा संतनो हुःअ हे तहेने, अभ्य हे छे भन साचेल;  
 दणायकाने दणवो भिथ्या, लही तेनुँ दिन शाचेल. २०  
 घुत रमणु पर निय ने दिंसा, लोभ, भुवणु भद्र पानल;  
 अधर्म उपी कलि त्याँ डेवये, लडो असत ते स्थानल. २१  
 वैराग्य, योग, तप, अक्षित, सांख्य ऐ, विद्यानां ज्ञां पर्वल;  
 १ २ ३ ४ ५ निअंध अंधे श्री भद्राप्रभुओ, भास्यां ते रीते सर्वल. २२  
 अह्म, द्विः, गुः, अह्मवित्, तुं पूजन,  
 १ २ ३ ४ पवित्र, सर्वा, पट कदावेल;  
 अह्मगम्भी, न, अहिंसा, मणि, अप्त शरीर, तप, दृश्यवेत्त. २३

નહિ કોને ઉચ્ચાર કરાવે, સત્ય પ્રિય હિત કર મૃતુ ભાગેદ,  
 વેદાધ્યન, વિદિત, કાળે કરે, પાચિક તપુન દાંડજ ૨૪  
 પ્રસન ચિત્ત, ડાખણ મન સપમ, આત્માભિમુખની વૃત્તિજ;  
 શુષેષછાએ મનનાં તપ કરે, એ છે દૈવી સપત્તિજ ૨૫  
 જાલાજ્યાંતર શુદ્ધિ સદા નહે, દા નિષ્ઠાએ નિશ્ચિત ગાનીજ;  
 પંચ પર્વ અવિદ્યા જ્યાં રહે તે નિશ્ચય અરૂપજ ૨૬  
 આધિ ભૌતિક, અધ્યાત્મિકને, આધિ દૈવિક, વ્રિત્તાપજ;  
 વિવિધ તાપ હરે એરિજન જટ, ગાખી સેવન ધ્યાનસુનતપજ. ૨૭  
 શુદ્ધિત ધન દારાદિ કલક, ઘોરન એ છે અનિશ્ચરજ;  
 જાણી કદી આસક્ત ન થાયે, લહે, ધર્મ ક્રીતિ એ રિથરજ. ૨૮  
 સુકલ-સુમુક્ષ, વિપથી, પાંચ, મનુધ્યના છે પ્રકારજ;  
 મૃદ અરૂપની મર્મ ન જણે, સંત પ્રીણે તે ચ્યારજ. ૨૯  
 નિત્ય નૈમિત્તિક માકૃત આત્મતિક, એમ પ્રથ્ય લહે ચ્યારજ;  
 વિવેકધી વૈરાગ્ય અહીને, અહે નિત્ય સત્ય એક સારજ. ૩૦  
 વિદ્યા, દાન, તપ, સત્ય, ન મૂકે, જાણી ધર્મ પ્રકારજ;  
 એ ચિન્હણી સંત ઓળખાયે, સુમુક્ષ કરે તે વિચ્યારજ. ૩૧  
 અદ્ધાર્મ-સત્ય, તપ, પવિત્રતા, ક્ષમા, અહિંસા, દાનજ;  
 નિયમ, શાતિ, પ્રમાણિકતા, ધર્મ દશ પાણે પુરાણે ગાનજ. ૩૨  
 . . . (પદ્મ પુરાણે ભૂમિ ખેડે)  
 કાયા, માયા, કૂળ, જાતિ, તપ, વિદ્યા પ્રશ્નતા ૩૫જ;  
 આડે મદ, ન જણેના હુદાયે, તે ઉર વસે મનભૂપજ ૩૩

પર સત્તાની વસ્તુ માત્રને, કદી ન ધરુણે સત્તા,  
પ્રસ્ત્ર, પ્રતિગ્રહ, પરિપ્રેક્તાને, તેને કદીએ મદંતથ. ૩૪  
 ૧ ૨ ૩

મુખ,-હૃત-મન દ્વારા ન યાના, નાણે મન નિયારથ,  
 ૧ ૨ ૩  
રના' પાણી ખલાપિત કરીને અહે પ્રસાદી સારથ ૩૫  
તેવળ હરિ ધર્મા અવદાને, ધરે માછ પુરુપતી કલાણીથ,  
વેદ રાચ્ચાનિ વચને અતુસરે, સ્વધર્મને લગે પુરુપ પુરાણીથ ૩૬  
વિષ્ણુ પચક નત ના ત્યાગે, જે સૌ અત્ય નાશનથ,  
કાભ્યક નત કદી કરે નદિ, નેણે હરિ પ્રસનથ ૩૭  
પચ વિષ્ણુમા મત કદા નદિ, ના નિય ભાવે સેનનથ,  
પ-મ ગ્રેમ અનુનાગે ભક્તિ, તેણે શુદ્ધ યાય મનથ ૩૮  
અનાધ્યાય તર્ફથું હોમ ભૂતદ્વાય, આતિથનો સત્કારથ,  
પચ યજુ આશ્ચર્ય લાયન સુને, કગતા દ્વિબ્રતે સા-થ ૩૯

॥ તાનિતાન્યજ્ઞાનરહ કુર્વતિ ॥

(આશ્ચર્યનાયન સૂત્રે)

શતપથ કાલજીને મનુ રમૃતિમા, ભાગ્યા છે એહ વચ નથ,  
જાણી અધર્મના કર્મ ન ત્યાગે, તે દ્વિબ્ર હરિજનથ ૪૦  
॥ પચૈવ મહા યજ્ઞા ॥ (શતપથ કાલજી)

પચ સુના હોય જવાને, ધાર્યર સ-તોપત્રા કાનથ,  
ધથા કાળે નિત્ય કર્મ તજે નહી, અધર્મનો એ સાજથ ૪૧  
ભૂષ સ્વરૂપ વિસરે નહિ ક્ષયારે, દેદ ઇપ ન માનેથ,  
અનુકૂળ પતાયે પણ નહિ પ્રીતિ, એ લક્ષ્યાણ અનુમાનેથ ૪૨

પ્રતિકૂળે પણ અગ્રયિ કરા નદિ, રાગ દેવ નદિ ઉરજા;  
 પંચક સેશ અવિધા નાં બાએ, ૬૫' શોકથી હરજ. ૪૩  
 રનાન સંખ્યા જય યજને, વૈશુ દેવ અલાર્યનજા;  
 એ પદ્મ કર્મો કરી નાં તાગે છે પારાશર રમૃતિ વચનજા. ૪૪  
 દેહ-દેરા-કાળ-કિયા-ગંગુ સંચિતાદિ સાદજુક રેષજા;  
 તેની નિરૂપિતિ અલ સંખ્યા, સદ ધાર નિર્દોપજા. ૪૫  
 શમ-દમ-તિતિક્ષા ઉપરતિ શર્દી, સદ સમાધાનજા;  
 ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮  
 તેનો કૃપારે ત્યાગ કરે નદિં, ને ન કરે તેદનું અભિમાનજા. ૪૬  
 કિંચિત ચિન્હ ઓળખવા ભાખ્યાં, સાધનીક દરિજાનજા;  
 કૃપાપાત્ર પરમહંસી નિવક્ષણુ, તે કરે પતિત પાત્રનજા. ૪૭  
 શ્રી હરિ ગુરજ્ઞન ભક્તાજન, વરણે વરતુત એકજા;  
 દ્વ્યો કર્ડે નામે ન બેન કાંઈ, સેવને રાખો વિવેકજા ૪૮



## કૃપા પાત્ર ભગવદીયનાં લક્ષ્ણ.

રાગ-ધવળ ધનંયાશ્રી. પ્ર- (૧૪)

- કૃપા પાત્ર ભગવદીયનાં લક્ષ્ણ, થી મુખે કલાં દરિ બીજાણ; ૧  
 તે સેવનાં નિશ્ચેં મળે છે, થી રાધાપતિ ગોપાયણ.  
 સુકૃપાલતા, ન મોહ ડોઈપર, સહને શક્તિ અતિ રહેણ; ૨  
 નિત્ય સત્ય ભાપણ નાં છોડે, ન અરિધા સુખ હુઃખ સમ લહેણ.  
 સર્વોપકારી નિષ્કામી સદ્ગતે, કામાદિકે ક્ષોભન થાયણ; ૩  
 બાળાભ્યંતર શુચી સર્વદા, ધ્રાદ્રિ અત સદ્ગયારણ.  
 અ સંશ્રદ્ધી, મૃહુ, ચિત્તવંતતે, કરે દરિ પ્રસાદી આદારણ; ૪  
 મન સંબંધી-ક્રદ સ્વધર્મે, શુદ્ધ કિયા નિર્નિકારણ.  
 અચલિત દ્રદાશયી નંદ નંદનના, સદ્ગ સાત્ય પ્રેમે ભજાનણ; ૫  
 મનન શીખ સુખ હુખ સમજણે, નહિં તૃપ્ણુ કો મંનણ.  
 નિર્માંતી, પરને આનદે, દક્ષ વિવેક સુખોધણ; ૬  
 નિષ્કૃપી પરશ્રેષ્ઠે તત્પર, નહિં ગર્વ લોભ વિરાધણ.  
 સર્વ પ્રાણી પર અતિ દ્વાળુ, વિજાને ભક્તિશું રંગણ; ૭  
 નિરાગી સાત્યાદિ સતોપી, લહે દરાધા ભક્તિનાં અંગણ.  
 અચલિત ભજની દરિશુણ ગાંતી, અન્યાશ્રયથી રહિતણ;  
 અતન્ય શરણે સદ્ગ આનદે, પરમાનંદ સહીતણ ૮

નિંદા ગતિ કરે નહિ કોની, કર્તિ અને સત્તા માનણ.  
 પરના દોપ ભામે નહિ કયારે, થી મૃતુ વળુ માને ન ગતણ. ૧  
 કો તિન વિગ્રહી તાદ્વા જલ, એને કરે પર્મ દસણ.  
 તેની નિથનિ દૃતિ દૃતિ પ્રકૃતિ, કદા હરિરત તે અશણ. ૨  
 જરડ, મુંગા, ગર્દેન સમ કયારે, એ પિણાચાત પ્રકૃતિણ,  
 કદી રૂપા દારી કર ઉપરામી, કદા આખક વત દૃતિણ. ૩  
 લૂભાચામ સુખ દુખ સમ, નહિ માનાપમાનણ;  
 દાર્ઢીઓફન્દ્યાએ ન કરાયે નહિ દ્વિતી પ્રથમનુ ભાનણ. ૪  
 કહિ રેના બારી, કરી મદાજાની, કર્તિ ભામે રના રદનણ,  
 કર્ષો રેહે વિઠો દર્દિ અધાપના, કરી પ્રસન પદનણ. ૫  
 કહિ કથા ધારી કહિ દુશાખ ધારી, કરી જોગી કહી બોગીણ,  
 કહિ દિગંબર પિતાંબર ધારી, કદા રોગી અરોગીણ. ૬  
 અટપડું અકળ અરિન રહે તહેમાં, પણ પૂજુ હરિના ભક્તાણ,  
 રઘો કરે તે સરારીન સમ. વિરોક્ત ન અન્યાભક્તાણ ૭

શ્રી કૃષ્ણ વિચોગ ચિરહના ૧૨ દ્વાદશ માસ.

રામ-યોગ-દ્વાદશ માસ-

પરમ લગ્નવર્તીય દ્યાશ-કરલાઈ હૃત્ય લિખ્યતે

અંચું ચરણું ઝૂભિનાશના, ભતી, થાવા પ્રકાશ;  
શ્રી લક્ષ્મણથું સુતતું રમણેણું હરી, રચું દ્વાદશ માસ. ૧

કારતગે ડેડે કાંમિનિ, હરી મધુ પુર વાસ;  
મૃક્ષયાં અમોને મંનથી, હાવાંથી આશ. ૨

ગોડુળીણું ગમતું નથી, શ્રી ગિરિધર પાખી;  
ડે દે સખી ડેંણું ઉપાયથી, ધીરજ રહું રાખી. ૩

શરદ સમે વાયે કુંજમાં, વાઈ વેણુ રસાળ;  
તે સુખ આવે સંપ્રણે, લાગે હૃત્યા જાળ. ૪

તે સુખ અવસર ગયો સ્ત્રવ્યમાં, હુઃખ ફૂર નાં ચાય;  
કૃષ્ણ ભળ્યાનો ડેડે સખી, કહે ડેંણું ઉપાય. ૫

(૫૬૧૬) પ્રાકૃત.

કાણું હરી ન વિસરતી; રાધીકા હુઃખ ધરતી,  
વદતી ઉદતી વાણી, નાય લીદા વખાણી;  
વિરહ વચન બોલે, ડો નથી કૃષ્ણ તોલે,  
સોદી તદ્દ દીધી, કપટની વાત કોધી.

॥ માસ ૧ ॥

भागशरे भन्त मादर, अतिरो अकुलाये,  
घेहेली जोविंद विना थए, चित व्याकुल याये. १

अन्य बोग भावे नहि, प्राणु पतीने त्याग;  
येकार अभिकाखी चंद्रनो, रविथी नासन. २

स्नेह छोड्यो छटे नहि, आध्यो प्रेमने पाथ;  
उभयांगी ज्यां प्रीती नहीं, त्यां हाँ सुखती आरा. ३

ठेठ लक्षी सुष्णो हे सभी, क्षीजे वडांकांगी वाढ;  
स्वप्न जगत सु सुपतीमां सुख, सुरक्षीना नाढ. ४

रखेवाप में नां एकली, रसीली सुन्त मन सोहे;  
मोर सुगट छण्डी शी कहु, मन भथ मन गोहे. ५

चंद्रभगा चंद्रावणी शाति हे णहु तोहे;  
सुख संभारी हमे स्वामिनी, सभी आसुआं लोहे. ६

### २४

तत मन धन माहाउ, वीसरे डेम वीसाह,  
सुखु सभी मुज वांछी, क्षी भरे नेत्र पांछी;  
वीना आधारे घेहेली, डो नथी हुःभ घेली  
कन्धु गत मादारी, नाथछ नां विच्यारी. ७

॥ भास. २ ॥

चोप विं प्रभु पर थाह, माँड्यो छे रे नेह;  
नगथु थथा छे नर दरी, मुने दीधोअ छेह. १

कर्मतष्टी छे गदन गती, लहे नंह कुमार;  
कुग सम यह निशा मुजने, क्यांहां रसिक रस सार. २

અત્ય થયો તિનિ અતિ હુંખેણો, જોઈ દારણું હું અ મહારા,  
જાગ્ર ખુલ્યા ટેડી ત્રિભવાદૃતિ, સાપત્ન્ય કુંજન્યાજુ  
તારા ૩

ચેન પડે નહિ ચિત્તમા, વિના શ્રી નારાયણ,  
રણ નદીએ પરંપરા, બ્રેહે તાપે કાય ૪  
મખી શીદ લેડે પરવેદના, સુખમા માણ્ણે,  
મુખું હું અની શીદ સાધણા, અતરમા આણે ૫

### ॥ શ્લોક ॥

કૃદે સખી ક્ષ્યમ યાશે, ક્ષ્યમ અદ્વાતીશી ગમાગે  
અદ્ર પ્રલાના લાગી, ડો નથી હું અ પિભાગી  
ને સાખી પિયુ આવે આશ હાસે મોનાવે,  
મનમય એ મારે વેદના બ્રેડે નિધારે  
॥ માસ-૩ ॥

માણા નિરો મૂજ માદાનથ, મહુપુરમા માણાને,  
સેકેન હું અ કરી, જાહુ છદ્યે સાને ૧  
ચારિધર ગોકુનમા હતો, શર્દનો માસ  
શ્વાસી પુન્યમની જામની, શરીર પૂરણ પ્રકાશ ૨  
ગાશ રમી હરિ સગમા, મન ગમતી જોડ,  
તે મુખ છાજું નહી, માણારા કરમની ઓડ ૩  
મે જલદ્ય સાચું સખી, પ્રભુની સગ રમીએ  
ગુણુતતા ગોવિદ્ધ, આપણુ ક્ષ્યમ ગમીએ ૪  
હુંખજા તાસી કસની કુનીકી કાઢાવે  
તે હીરે હુરિને ચલ્યો, હાવા શીફને આવે ૫

## ॥ શલોક ॥

મુજ કર ધૂહી લાગ, કુમરી સુગ છાગ,  
 અપન મતી આતી, નન લીધુ તપાથી  
 સુખ સખી હરી ડાઢા, કિરીથી વલ્લવાયા,  
 અતુર ચક્કપાણી પ્રીત રીતી ન જાણી  
 -  
 ॥ માસ ૪ ॥

દ્રાગણુ કુયો કુલડે, ૨૨ અગ્રણુ અનત,  
 મોદ નહિ મોદન નિના, રમીયે શુ વસ્ત. ૧  
 વાળે મૃદુંગ હે મજરી, ઉડે અમીન ગુનાન,  
 અગ ઉનડ આવે નહિ, વિના શા નદાન ૨  
 અંભર ડેસર ધાટણા, છાટે સહુ લોક,  
 મુજ પાણે સહુ મોદમા, માલાર મન શોક ૩  
 ક્ષ્યમ પૂણુરે હુતારની, પીયુ નહિ મુજ સગ,  
 હરિ વિના મન દરસે નહિ, જ્વાલા લાગેરે અગ ૪  
 સુખની જતુરે સુની ગઢ, લડે નહી મગ/ગાજ,  
 અવસર ચૂક્ક્યો ઘન ધણો, વરસે ગુ કાજ. ૫

## ૨લોક.

કેશમ ડેસર બીના, નીરણુ તો રી કમીના,  
 મહન કદક ભાસે, પુજ આનંદ વાસે.  
 સુખ દીન ક્ષ્યમ આવે, કૃષ્ણને ડાણ લાવે,  
 અકલ બુક્તિ ઓઈ, કર્મની ટાક મોઈ  
 ॥ માસ ૫ ॥

## શ્રોતું

ચૈત્ર માસે ચતુરા કહે, થયો વાસર પ્રૌદ;  
પાર પામું સખી ક્ષ્યમ કરી, પાણે થી રઘુછોડ. ૧

પદ મુને કલ પડતી નથી, પડી જતમાં ભાત;  
દિવસ થયો અતિ હુર્જો, આતી વેનણું રાત. ૨

ઘડું ચદયો રે આકાશમાં, ઘણું શીતલ તેજ;  
ઝાણું સખી નિર્દ્ય ઘણો, મનમાં નહિ હેઠ. ૩

સુખકારી સહુ જનનો, શીતલતા આપે;  
ઉલ્કા રીત છે એટની, વીરભીરે સંતાપે ૪

શરદ સગે પિયું સંગમાં, શરીરી એ સુખકારી;  
ચદ એનો એ વ્હાલા વિના, હે છે હુઃખ ભારી. ૫

## શ્રોતું

આખ વર વિધાતા, પેની સુખ જાતા;  
સુજ મન કર્ય શાતા, માહરી તુજ ભાતા  
નિધન વચન કેઢેતી, દોદલા દીન સેહેતી  
નયંમ તર્યમ પ્રભુ લાવો, હુખ ભાડાડ ગમાવો.  
॥ માસ-૬ ॥

વૈજાયે મજ ખાલિકા, ભાયે રોપ પચન;  
નડોડ થયા છે નાથળ, લેઢતા નથી મંન. ૧

ઓષ્ઠ કાળ હાવાં આવીયો, તથે તરણીનો તાપ;  
દીનિય પેલી રોક્ષણી, ક્ષ્યમ સહેવાયે પરિતાપ. ૨

સખી કદ્વપુષ્ક સોદામણ્યા, ઇલ લુંમતી લેણેર; ૧  
 નીરખી મુખા સુખડુ, મૃતો, લાગેજ તેર. ૩  
 રીતન તોપ ગુલાઅતું, મુને આગ ઉપજાવે; ૫  
 હૃષ્ણ વિના ડાડી વીધી, સુખ લેશ નાં આવે. ૪  
 હોજ જરે જલ ઉડતું, જવા તાપ ઉપાપ; ૬  
 અંતર આગ સમે નદિ, પાણે ગોકુલ રાપ. ૫

## સ્લેચ

મદન મેં તન વ્યાપી, ન રહ્યો દુષ પાપી;  
 રત પીયુ રણુ ચરીયો, માહરે જેહે પડીયો.  
 સુણ શિવે કામ આજ્યો, જગતમાંથીજ ટાજ્યો  
 શું ભાંગ્યો અદ્ય રેણેવા, મુજને દુઃખ દેવા.  
 ॥ માસ-૭ ॥

જયેષ્ઠ માસે જલ સુકીયાં, ચુકી સાગર તીર,  
 મુજ લોચન સરીતા સમી, ધારા વેહે નીર. ૧  
 અરૂણુ થઈ માદારી આંખડી, અતી નીરદિન રોઈ;  
 પાંપેણ્યો પાકી રહી, અંધર આંગુડાં કોઈ. ૨  
 હેસરી નાદ સરીખડો, ગરજે છે સમીર,  
 લધુ જુંહે જરમર જરે, માધવતું નીર. ૩  
 જેષ સમે સહુ જનને, ઘેર આન્યાના દીન,  
 પીયુણ વસે પરદેશમાં, રીતી જગથી લીન. ૪

ધન ગરનોરે ગગનમા, મેન ગરને મો તન,  
નિર્ભય થયો રનિનો પતિ, ન આવ્યા જુગજીવન ૫

## શલોક

સખી અતી હુખ ક્ષ૟મ સહીયે, પવનનો વાત કદીયે,  
મહુપૂર ભણી જાગે, માહારે। હુત થાગે  
વીનતી હરીશુ કરશે, પ્રીતથી શીખ દેશે,  
સમીર બોધ અહીને, આપજે વીજ વહીને  
॥ માસ-૮ ॥

આપાડે ધન આવીયો, ગાછ નાદ ગલીર,  
અભની શોભા એહેની થઈ, નેહેવો સ્યામ શરીર ૧  
ધોર ધટા સમે જામની, દામની ચમકાર,  
નીરખી સતાપે સામની, વાગે વીરહનો માર ૨  
સ્વજનને હુખાધ થયા, કર હોણું ગોધ,  
દીરસ ધણુની વાતડી, રહી છે આવી હોધ ૩  
આવી કૃપા, ને અરીખમ ગાઢ, પ્રગટયો ધન વોર,  
કાપ દ્રૂમે કરે ડોડિલા, મહુરે સ્વરે મોર ૪  
ગણ્યેયો પીયુ પીયુ જો કરે, સ્વાતી કુદ કુદ પ્રીત,  
પાતો નથી પથ અતને, એહેની રનેહની રીત ૫

## શલોક

હજુ સખી હરિ ના આવ્યા, હુ થકી શુ રીસાવ્યા,  
પૂણુ રનેહ કોવો, છેતરી છેદ દીધો

મધુપુર મન મોણુ, પુન આ દીરે ના જોયું,  
શું અપરાધે મૂર્ખી, કવણુ વાતે કું ચૂર્ખી  
॥ માસ-૬ ॥

આરણ વરસે સરવડે, રહી ક્ષણુ ક્ષણુ વાર;  
માદારે લોચને નીર લાચે નદિ, વેદે અચળિત ધાર. ૧

સાગર તે સમ સતા ચાઈ, પૂર આચ્યાં નીર;  
પૂર આચ્યો માદારે હુઃખ દ્વારી, કયારે પામીશ તીર. ૨

કંદર્દી જલ રે પૂરે ચદમુ, વર્ણે વેદે વરસાત  
પુરુષોત્તમ પરન વીના નરી-પામ્યાની વાત. ૩

કામ કટક ગોપે ચદમું, ધેર્યુ સુજ તન ગામ;  
મારશે કોણ ગોદન વિના, કરીને સંગ્રામ. ૪

કુષ્ટ દર્ભને દથા નરી, કુષ્ટ હે છે અપાર;  
કુષ્ટ સખી કયારે આરશે, વીકુલની વાદાર. ૫

### શલેષક

બોજન સુખ ના ભાવે, નિભીય નીરા ન આવે,  
જગે હુઃખ દીન જ્વારે, આરશે નાય ત્યારે;  
વિના કૃપણ કોટી, સુખ વિધિ જરન ખોટી;  
વિના શાતી વારી, ખૈયેંદ્ર નીર આધારી.

॥ માસ ૧૦ ॥

પુરુષોત્તમ દીન પુનના, નાહાયો મજા માસ;  
આજ ભજું એ જોવિને, જાપણ વદ્ધભદ્રાસ. ૧

લાડ કરે અં દરિ કનો, પુરાણા નાસ,  
મેરની પેરે સુકુદાની, સુને અતઃ અભિનાસ ૧

પ્રયમ ગરોડ્યમ આવી આવડી, નાહનો તુ નદીન,  
ગોવ્યન રાધાનરે, કરે તોષો કાન ૨

સાબળ સખી આસુ હું, માદરિ રે અતન,  
એકવાર દરિ આવી ચઢે, કરી રાખુ જીલન ૩

પુરોત્તમ નીન પુનથના, રાખ્યો શગણ મનમાસ,  
સૌમા થે તેણે શ્રો, એ દાયાતે છે આગ ૪

॥ માટે-૧૧ ॥

આરવો અર નરસતો, અતિ એ ડેનીના દીન  
સુખની એ હંડી રે ચાતિ ગઈ, પડયુ જરૂ પાખે માન ૧

દારીન અડે નેમ નેઘીકા, મૂડે નહી મરણૂત  
પ્રાણુ સમી એ પ્રીત છે, ન જાણે સુજ કાત ૨

જાણે તેણે કુરણ્યા, જેથી નાન્ય વગન,  
પતગ ભરે નીજ પ્રીતને, નહી દીક્ષને મન ૩

નાન્યા થપા એમ નાથણ, નથી કેણના નેદ,  
પ્રીતની રીતને પગદરી, દીપો જેદમા છદ ૪

વન્યા મૂળી હૂં લેણીની, સખી નેદતરે કાર,  
તન મન અ એ આનામા, તેણે ક્રાધા ત્યાજ ૫

## २ले।५

हरि चित्त पट नगरम् ॥ न ह रुद्रे परक अग्रय,  
 अभग्र कुमुक लोभी, त्यम् -ल्लु चीत थोली.  
 नदपर छपी भावे क्षण्णु क्षण्णु ध्यान आवे,  
 भधुरी भोग्नी वातो, नीहाणु छु वन जातो  
 ॥ भास-११ ॥

अश्विनभा दरि आवें, मुजने एम भासे,  
 साभज्य सभी कु वीनती, भादार अग उद्दासे १  
 शुक्ल यथा भूते हे सभी, इरुडे वाम सोयत,  
 रवेन यथु मुने हे सभी, लाखु अभृत्य गतन २  
 शन आंथो ने शुक्ल यथा, भज्या उभय सडेन,  
 न ह गवी गरें रमे, मन भोद समेत ३  
 दिलया आवी अनद्दृ, आया जोडन-४,  
 आनह पाम्या राधिका, सभी मग्न गाय ४  
 शक्ती वहरे सोल्लाभण्णु, यही आभभा वास,  
 मृष्णु कपाथी हये कर्धी, पुरण्णु द्वादश भास ५

## ३ले।५

जोडन हरि पधारे, राधिका भोद वारे  
 नग रस सभी साथ-पूजती आणुनाथ  
 कुप्णु वहन नीरभी, राधिका अत्य रुभी  
 गर्द वियोग पीडा, श्यामण्णु करता कोडा  
 ॥ भास-१२ ॥

स'पूर्ण.

॥ श्री जोपीजन वनभार्घुभरतु ॥

## “ਅਨਾਥਤਾ ਵਿਖੇ” ਪਦ (੧੬)

- ਛੁਪੀਤ -

ਵਦਤ ਥੀ ਗੁਝ ਪਾਧ, ਚਾਡੇ ਇਨ ਮੋਡੀ ਪਾਧ,  
ਜਿਨਾ ਦੀ ਕਾਥੇ ਉਪਾਧ, ਪਾਧ ਤਾਧ ਭਾਨੇ ਦੇ  
ਜਾਇ ਘੀਨ ਤੜਨਾ, ਥੀ ਫਰੀ ਹੁ ਅਸੱਜ ਨਾਲੀਂ  
ਸਾਥ ਵੇਨ ਵਾਰੇ ਰਾਖ, ਅਅਮੈਂ ਘੀਗੜੇਂ ਹੈ.  
ਫਰੀ ਝੇਂ ਗੁਝ ਗਏ, ਗੁਝ ਝੇਂ ਫਰੀ ਹੁ ਨਾ  
ਗੁਝ ਕੁਪਾ ਅਥ ਆਗੇ, ਕੋਈ ਪਲ ਲਾਗੇਂ ਹੈ.  
ਅਮੈਂ ਥੀ ਅਵਨਾਮ ਗੁਝ, ਤੀਨਥੀ ਪ੍ਰਣਾਮ  
ਕੋਈ ਕਰੇ ਵਾਹੋ ਸਾਸ, ਨਾਡੇਂ ਥੀਸਾ ਸਾ। ਆਨੋ ਹੈ। ॥੧॥

“ਛੁਪੀਤ”

ਥੀ ਛੂਪਣੁ ਪੁਰਨ ਅਲੀ, ਅਲੀ ਜਧਾਨੇ ਨਹਿ ਅਲੀ;  
ਨੇਤਿ ਨੇਤਿ ਨਿਗਮ ਚਦਾ ਚੁਨੇਂ ਹੇ ਪੁਕਾਰਤੇ。  
ਅਨਾਂਤ ਯੁਨ ਗਾਨੀ, ਗਾਨੀ ਰਾਕਰ ਪਦ ਪਾਨੀ;  
ਜੇਂਵੇਂ ਬਾਨੀ, ਥੀ ਰਾਨੀ, ਰਾਂਡੇ ਵੇਨ ਪ੍ਰਾਨ ਵਾਗਤੇ。  
ਪੁਖਧੋਤਮ ਔਤਾਰੀ, ਨਿਗੁਨਾਕਰ ਪਰੇ ਜਾਕੀ;  
ਚਦਾ ਕਾਲ ਸ਼ੀਰੇ ਭੀਤੀ ਮਾਥਾ ਕਾਲ ਧਾਰਤੇ。  
ਦਧਾ ਪ੍ਰਭੁ ਅੱਮੇ ਪਾਧ, ਓਗੁੜ੍ਹੇ ਅਨੇ ਅਥਾਧ,۔  
ਝੂਟੇ ਝੁਅਮ ਜਹਾ ਤਹਾ ਤੈਂਨੇ ਜਖ ਮਾਰਤੇ। ॥੨॥

॥ ਅਤ ਗਾਧੁ ॥

ਸ਼ੇਖ ਮਡੇਥ, ਸਿਖਿ ਯੁਤੀ, ਸਾਨਦ,  
ਵੇਂ ਕੁਨਿ ਸਮਕੀ ਸੀਰਵਾਰੇ;

अथवने पर कान अग्नपति, गिर्वाच नाथ नया नवारा  
 आर करे हु भरे हु भरे दिव  
 आप अभिन रहे श्री न्यारा  
 कर दें त्यो धन ओही, सदा मुही,  
 हाकुर नह उमार दमारा ॥३॥

### कवित.

देश पतिको आनंद, तासो सत युनानंद,  
 अहनिं को हे, सो शास्त्रमे भज्यान्यो हे  
 ताते सत युनो ॥१॥ अहर्निन तपो सत,  
 क्रमा सो युनो सुख सीवउँडै ज्ञान्यो ॥२॥  
 वाते सतयुनो मोक्ष अल्लानं गतनामे  
 भायासे पन्डे तेहु और भाया सान्यो हे  
 दया नाथ पुण्यानं झुण्यु ही दो गती भेरी  
 मन असीकरको अपुरन ना भान्यो हे ॥३॥

(मुख्यहोक्त तैतिरीयोपनिषदोऽत )

### - कवीत -

जोडा शेइ नाथ नही, जो शेइ ते लाय नही,  
 कोइ जोडा साथ नही, अवेच्छानुसारि ह  
 जुडु कहु आस नही, हीयो शाड नास नही,  
 किम्य आबास नही, आत्मसो गिलरी ह  
 जो कोइ त लयो नही, अत कोइ लखो नाही  
 असोही हे कखो नही, जो, जो, गती हारी ह  
 दीयो जोडा नही गयो, करौहु भजु नही भखो  
 सोही झुण्यु कहे दें अवती दमारी हे ॥४॥

## ભક્ત માહિત્યનું ૫૬ (૧૭)

ભક્તનકી અધિકાઈ સમનમેં ભક્તનકી અધિકાઈ,  
મોસેં અરણી અરણી ન જઈ,  
તદું કથતાનંદ ના સમાઈ -૨૬.

ત્રિગુન પર જોવે પુરોચનમ,  
ભક્ત હેતુ ઇતિ અનુસારે,  
જીનમ કર્મ દર્શ ગોકાદિ, કુદા તૃપા સાખી ધારે.  
સમનમેં. (૧)

પર્મ અદ્ભુત સૌર્યકી સીમા, દીન્ય ધામ નિમાણી,  
નાન આગનમેં આસ ઝીયે દરી, ગોચારન વનમાની.  
સમનમે. (૨)

અલાદિક જડે જનનકો, સુપને નાં જો અધ્યાત્મા;  
સો સત્ત અન્ન ભક્તનકે આગે, નિત્ય પ્રચિંતા આચાર  
સમનમે. (૩)

શ્રી ભદ્રાભક્તમીળું પતિ, ધન ધામાદિ કરે કો મિચાર,  
મેં તર રક્ત કુદામા વિહુર અડે, કાગ ભાણ્યે ખાર  
સમનમે. (૪)

નિર્માણી નંદ્લાલ સદા, જાણો નિગમ કહત અલચારી,  
શ્રી ગોપીજન અસ સદા ભાખે, અદ્યુત ગાસ વિદારી  
સમનમે. (૫)

ગિન્યુ સદા સાતરીક શુન પૂર્ણ, પ્રદ્વાહ અગેની આંતી,  
પૂર્જી તમોશુન પ્રકાશ શ્રીયો, ભડુન દિત મનમાની  
સાધનમે. (૧)

કાલે કાલ સાગળે રવામી, દુષે ભવનીત બારી,  
માન વિસેદા જરૂર હું પાવત, તમ તરી આગા ખારી.  
સાધનમે. (૨)

જીનકી છુંડા સત્ય પ્રતિના, નિઃમકી આગે ધીપાદ;  
અપનો એન તત્થન ત્યાય્યો, ભડુનેચા દીપાદ.  
સાધનમે. (૩)

દુર્વાના પ્રતિ શ્રી મુખ ઉચ્ચયરે, મેં ભડુનાપીન સદાધ,  
અંમરીય ઉત્કર્ષે આગે, ના, મેં અતંત્ર કરાદ.  
સાધનમે. (૪)

જીનકો અમરણુ સદા સાચ કરત હે, મેં શ્રી ગોડુકગર્ભ;  
સો સદા રમરણ શ્રી રાધાકા, કરત પ્રશસા ગાઈ.  
સાધનમે. (૫)

ભડુનને શુન ગાન કરત વધો, દરિ ભજનમે આસે,  
તામે નાયશુ ત્યા તત્થન, દુતી વયન નિજ ભાવી.  
સાધનમે ભડુનનકી અધિકાદ. (૬)

## ૫૮ (૧૮)

- સોઝો -

જરૂર તરફરકી કૂલ, તથ વાડો દ્વારા લ્યાંનીએ;  
વહ લણી, નર, મત ભૂલ, જે કૂલ્યો તો દ્વારા ગયો. (૧)

ગા, નટ નાચેક, લક્ષીત થી, સારંગ પાંખું કાંઠાંત;  
જ્યા હી જોરી શાંકર ભને, જદ્વિ રૂપ કલ્યાણ. (૨)

રે જંન જંન જંન નખ્યુ ધર,  
ધર, ધર, ધર, ધર આરા;  
સંગ થંગી સાખી ડરે, ઉપસુન પત્રી ઉત્તાશ. (૩)  
હંડે।.

મેરો મન તેરાં ભયો, તીલ તીલ ચાઢત તોંદ;  
તોસી ભૂરત છાંડી કે, કંડા કરે લે મોઢ.  
( શ્રી ગોડુલનાથજી બંડુ હર્યુ પ્રામ્યા હતા.)

“મિથ્યા શીદને માથાદૂટ ભાંડી રે શ્રીકૃષ્ણ શેંનાં ભને”  
તેનાજ જોટાની તરેફનું

૫૬ (૧૬) ..

તમો કોઇ એક બરદ વિચ્ચારી રે,  
દરી માડ રો દાથ અહો.  
અતુલિત અદ અડળિક દળીયારે,  
બંડુ એક બરદ વહો. ॥૨૬॥

પતીત પાવન તમો તો હું પતીત,  
દીન બંધુ તો દીન ધું સાચો;  
અધમ ઉદ્ઘારણુ છો તો મુજને,  
ઉદ્ઘારો, હું કોઇ અધમનાં કાચો.  
દરિ માદારો દાથ અહો. ૧

ગરીય નિવાર કો તો સુજને નીવાલો,  
હું થી ગરીય કો ના જાઓ,  
અનાય નાય કાદાવો તો હું અનાય હું હું,  
નાય થઈ માદારા ગાળે રૈ-દરિ માદારો १

શરણુંગત વછળ છો તો, શરણ આન્ધો હું હું,  
વિશુંભર છો તો પોપણ પીળે;  
ગણુંડોડ છો તો સુજને ગણ્યથી છોડાવો,  
ગક ગક્ષુ તો ગણ્યી લીજો-દરિ માદારો २  
અગત ગની કરતા છો કોરીક,  
એકેદાર્ચાં અળવત બરદ તમાર્ચા;  
મનમાં આવે તેકેમાં પણ સુને ભાની,  
દ્વ્યો કરે હું ખ કાપોની માદારાં રૈ-  
દરિ માદારો નાય અડો ३

### ૫૮ (૨૦)

રાગ મિનાબર-

“મી જોવરધન ધર લાડીદો સરો શ્વામા ઘારી—”  
તેનો નેટો દગે.

એ વર માણું તમ કને, કરણુનીધિ ગીરિધારી;  
કૃપા કટાક્ષ સુજ ઉપરે, સદા રાખો તમારી  
એ વર માણું—૨૬.

સદા બંકિત પ્રેમ લક્ષ્ણા, સહ અંગત હેઠે,  
નીજ સેવા સંભ્રણ સદા, ગુરુ પદ રતિ રહેનો  
એ વર માણું. ૧

પૂરણ રામ ગમે સદી, નીજનો કરી જણો,  
અતિ અપગાધ કુથી બણે, તોડે મન ના આણો ૬  
, એ વર માણુ

પગથય દૂત નસ્તુ ડેય તે, હુથી રેણો અગળી,  
નારમગી ભતી થઈ મારેરી, તવ અગણે ડાડો નગળી  
એ વર માણુ ૭

નટનર છખી કૃષ્ણ નિત્ય પ્રતિ, માણારે નૈણે નગખુ,  
મન ગમતુ ચુખ અનુભવુ, દેશ માડે હરખુ  
એ વર માણુ ૮

હપતી અય દ્વા કરી, સુજ દ્વાયામા રેણો,  
જન દ્વાનો વી કૃષ્ણાલ કર શી કરે દેણે  
એ વર માણુ ૯

## ૫૮ (૨૧)

દક્ષીણ દેશ અતિ શોભા તે, શ્રી પદ-પુર ગામજ,  
વ્યાપિ વૈઠદ્વિ પધારો, શ્રી પિંગા નામ-  
નેવા નાધારેલ.-૨૬ ૧

ચદ્રભાગાનો તીરે મેખા, ગર્દ ઉખમાછ કેના નાયલ,  
સસાર સાગરને પાર કરા, કરી પર ધરિયા દાય  
નેવા નાધારેલ ૨

ચરણ કમન સમાન કરીને, દ્વા દ્વાદ્શે જેયલ,  
નિનિધિ તાપને હર કરીને, હુખજ સરે ખાય  
નેવા નાધારેલ ૩

શ્રી કદે તુળશીની માળા, ચરણ લગે પગસાયેશ;  
મુખ ચંદ્ર છીરકે તેના, મનડાં અતિ હરભાય.  
જોવા જઈએશ. ૪

શ્રી અંગ શામળ વરણ સોહે, જાણે અંધુદ હોયશ;  
પિતાંથર કરી તરીએ રાજે, ચંચળ દાંભણી મહોય.  
જોવા જઈએશ. ૫

મહુર રૂપ સુંદરતા સીમા, અળભદ્ર ડેરા વીરશ;  
રનેઢ કરી અવયોકે જન ને, તેહેનાં નાં રહે ધીર.  
જોવા જઈએશ. ૬

અણ તણો મોહેટા છે મહિમા, સહુકો નાયે ગાયશ;  
શ્રી વિષ્ણુ પિંડાં કહેતાં આનંદ પ્રકુલ્પિત થાય.  
જોવા જઈએશ. ૭

કૃપા કરીને દર્શન આપાં, અવિદોક્ષા આનદેશ;  
દાસ દ્યો ભલિદારી જાયે, નિત્ય નિત્ય તમને વહે.  
જોવા જઈએશ. ૮



## ૫૮ (૨૨)

ગાગ-ખીડાગ

પ્રીતયની રીત્ય શુ વેહ પખાણુરે

અગ રૂષ અગોચર વળતુ એ એવી, અનુભ-રિનુ ઉર જ ણુ-  
પ્રીતયની રીત્ય ૦ ૧

પ્રેમની ચોથી પ દીતને અણણુ, ન ભણ્યાય ન ને રાણે,  
પ્રેમ પુરુષ ને પાંજ પુરમા-ને ચેમે તે ભાણુ  
પ્રીતયની રીત્ય ૦ ૨

શીએ સાબજ ન આવે એ ની રસ,

ના મણે તન અમ નાણુ,  
નેહ ગતિ લેડ એક નાથ દ્યાનો ઉપનિષત આય ભાણુ-  
પ્રીતયની રીત શુ ૦ ૩

## ૫૯ (૨૩)

ગાગ મુદાર

મે કેસે કૃ પીપા મને મહુપુર જ્યાય,

મેરી તો કદ્યુ લેડે ન પીર, મેં કેમે કૃ- ૧

એક આવન મેરે આગન મરો, દુન્યો આવન દ્યાર મૃહે નીર  
મે કેમે કૃ ૦ ૨

આસણી આદી અવધ વીન ગણી,

ખીડાય ભયો મન ધરે ન ધીર-મે કેમે કૃ ૦ ૩

કૃદે ભડુ અજ કસ્તરો મીતેરો,

નામે પ્રીતમ ખારો મનમો ખીર-મે કેમે કૃ ૦ ૪

## ૫૮ (૨૪)

રાગ

સામળ યો સનેદી અદાગે, કાગજનારી હોન,  
બાળ ચીતપણનો બોં-સામળોયો અનેહી અદાગે ।-૧૬  
પ જ્યો સુને પુરે ભા, સાચુ ન્યે ગોં,  
નષ્ટથી સુને ચેલ્યા હે છે, કચન કોં-સામળોયો ।  
એ નિના ના હોડે રે હેતનો અઠોન રે,  
દ્વા પ્રસુ ખાગે નથી, તે તો નર નારી કોંર  
સામળોયો સનેહી અદારાં ॥

## ૫૯ (૨૫)

ગાગ પ્રભાત

એહેના દૃષ્ટિ કીઅધી અન્ધીન સુજ મન વસા,  
કુખ અધ હરણુ સુખનેન ધામ, કાપુસ, ભામ દુર્ગા,  
ને ચાંતામણ્ય,  
તે થફી અધીન જન પુણુ ડામ-દેં  
નેહેની નથ ચદ્રિકા તેરી કાતિ થડી,  
તાપ નથ તિમીન અજાન વામે,  
નેહેને હર, દિનષ્ટયગલ્લી, શેષ, થા, સરીખદા,  
વહે, વાસર નીરા, નથ વીજમે એહેનાં ॥

કેળ પંને વિધે, ચીનદ પટદશ રાખાં,  
                  દક્ષિણે નવ તથા સપ્ત વાંમે;  
જક્તા હીત દારણે, સકળ શુભ, ઇણ સદન,  
ધારણ કીધાં છે, સદા સુંદર સ્થામે—એહેવાં ૨  
સ્વરિત, યવ, અષ્ટ કુંઘ, વળ, ધ્વજ, જમંઝુડળ,  
                  ઉધ્વરેખા, અંકુશ આજા લહીએ.  
ત્રિકોણુ—અનુ—કળશ—હરિ—ધનુપ,  
ગોચરણુ અરધ ધનુજ કહીએ;—એહેવા હૃષ્ણુ ૩  
તે ચરણ કમલ મુજ ચિત્ત વસો કે  
માદાદં ચિત્ત તે ચરણુશુરે લેહેન્યો કાગુ;  
હૃષ્ણુ કરણું નિધિ આપો મુંને એટલું,  
બણે દ્વ્યો દીન હું એજ માગું.—એહેવાં ૪

---

## ૫૮ (૨૬)

ગાગ સોહેણી

પતીત પાવની, તું કે શ્રી કસુને મહારાંની. ૨૫.  
અધમોદ્વરતી, અધૃતઃખ કરણી, થરણુંગત સુખદાની  
કલીંહ નંદની જક્તા વંદની, પુરુંગતમ પટરાની.  
                  પતીત પાવની. ૧  
હૃદ્ય પ્રિયા શ્રી હૃષ્ણુ દ્વારા, પ્રેમ પુન્ય હૃદ્યાંની;  
મનુ મીળન પ્રતિબંધ, દવની, જન કૃત લીલા ચિનાની.  
                  પતીત પાવની. ૨

લાને ન કણું જમ ધામ દુષ્પટ તરફ, એ માણી પયપાની  
દરશ પરશ ગુણગાન જનની રેણુ, નોદાસ ચેતે ચાની  
પતીત પાવની૦ ૩

— ૦ —

### ૫૬ (૨૭)

રાગ-અન્યો

અનજા હળવિસા તે દરિસા-એ પદની તરેદમા ગવાય તે  
જ્ઞાન તોડે ડેઢુ ઐર સમુજ્ઞો,  
તે મેરી શીખ ના માનીજ —૨૫

સત સગત, મેવન થી ધર કો, કણું ન કરો, અભિમાનીજ  
જ્ઞાન ૧

બેદ શાસ્ત્રકો અચન ન માન્યો ચુડ સતકી માદાની,  
તુ અપની અધ્યાત્મમે છાક્યો, ચોણી ગન્યો ગુની વ્યાનીજ  
જ્ઞાન ૨

પડીત લો પરમેષાખ ગતાવે, હુ તો કરે મનમાની,  
તેરી ગતિ કહા, મો હુ સુઝ્યો, જાળે નહી સારી જ પાનીજ  
જ્ઞાન ૩

હરી સંભ્રન ખીન જનેમ ગમાયો-માયા મન નપડાની,  
આખ અધ્યાત્મ મીચ ગણેગો, સો ન પરેગી જાનીજ  
જ્ઞાન ૪

કાળ જ્યાન, ભક્તિક સમ ભનકો, અહ્લાદિક લીત મા રો,  
જ્ઞાન શરણુ ગીરીધરન લાન થીન, કોઉન અચેગો પ્રાનીજ  
જ્ઞાન ૫

## ਪਦ (੨੮)

ਸਕੈਧਾ

ਅਵਿ ਕਾ ਕਲਿਧੇ ਪਰ ਪੀਰ ਨ ਕੱਪ,  
 ਭਾਈ ਨਿਰ ਹੈ ਤੁਂ ਗਡੇ ਅਮੁੜੀ॥  
 ਪੈਂਨ ਏ ਤੋ ਛੀਨ ਛੀਨੈ, ਕਥੁ ਐਖਡ ਸਾਧਕ ਤੈਪਸੁਰੀ ॥  
 ਅਤੋ, ਏ, ਝੁ, ਧੀ ਮੁ, ਟਰੈਨ, ਪੇਰੇ ਸਹਿਤੇ ਕਲਲਾਧ ਬਹੇਅਮੁੜੀ॥  
 ਦਮਤੋ ਰਨਡੇ ਬਚਿ ਐਂਧ ਤਵਤੀ, ਅਖ ਐਰਨ ਤੁਂ ਬਚਿਦੇ-  
 ਅਮੁੜੀ॥੧੧॥

ਕੁਲ, ਕੇਲੇ, ਸੁਅੰਦ, ਗੁੜ, ਜਨਕੀ, ਤਥ ਲਾਵ,  
 ਏ ਕਾਨ ਕੀਧੇ ਬੇਹਵਾਂ  
 ਮੋਹਨੀ ਗੁਡ ਤਾਰਿ ਧਨਿ ਧਨਹ,  
 ਅਅਲਾ ਪਰੀਸਾਦਸਾ ਪ੍ਰੇਮਕਥਾਂ॥  
 ਘਨਨੇਂ ਨ ਇਕਿ ਧਹਿ ਜਾਨਿ ਪਰਿ ਕੂਤਿ ਅੰਸੀ ਬਨੋ—  
 ਨਹਿ ਕੀਉ ਕਹਾਂ॥  
 ਭਾਗੇ ਛੁਪਣੂੰ ਦਾਨ ਛੁ, ਸਾਂਚ ਫਸੇ, ਅਜਹ, ਨ ਘਵਾਂ, ਨ ਘਵਾਂ,  
 ਨ ਘਵਾਂ, ਨ ਘਵਾਂ॥੧੨॥

ਏਕ ਸਮੇਂ ਨਿਜ ਆਖ ਕਿਲੋਕਤ,  
 ਕਵਿ ਸੂਵਾਰਿ ਥੀ ਧੋ ਫੋ ਅਦਿਸਾਃ  
 ਪ੍ਰਾਣ ਅਧੇ ਕਰ ਕੰਜ ਸੂਲੇ, ਕਥੁ ਬੋਲੇ ਨਿਨਾ ਹਿਰ ਥੀ ਬੁਗਾਦਿਸਾਃ  
 ਕਮਨਾ ਉਰ ਲਖ ਕਿਧੇ। ਅਧਨਾ,  
 ਤਥਨਾਥ ਧਧੋ ਅਪਡੇ ਸੁਨੁਸਿਸਾ॥  
 ਕਥੇ ਵਧੇ। ਫੰਤ ਪਤਿ ਸੇਂਨ ਕੰਠੀ ਕਹਾ,  
 ਬੇਦ ਅਖੇ ਮਿਲ ਪਾਂਚ ਪਚੀਸ॥੧੩॥

કેદનો અર્થ ન પ્રોચ્યો જાય, પ્રિત્ય ન ઉપને તે તે માલું,  
 અસ્પ આયુષ્ય કલિયુગ માનની, શકે નદિ નિધા અનુભવી ૭  
 તેદનો ભાધો એક ઉપાય, પ્રાણને જે અર્થ લખાય,  
 તો કો તોને આનરે, પાઠ શ્રોતાનુ મન દરે ૮  
 અજ્ઞાનીને 'જાન પ્રનાના, યાયે પાતદ હેરો નાશ,  
 તે માહે અજ્ઞાની દીન, મદ ઝુદ્ધિ ને નિધા હીન ૯  
 ચાડોદનો વિપ્ર અંનિધા ભયો, વૈષ્ણવ દુર્ગા અસ્તયો;  
 પ્રભુગમ પિતાનુ નાન, નામાનિધાને રહે દ્વારામ. ૧૦  
 લવસાગર તરસાને કાજ, અથ ચાર બ્યો ત્યાંયે ચાન,  
 માત મદાનદ્દમી મનસા બહી, ગીતાજ કથના ભતિ ચઠી ૧૧  
 દેખાડે જ્વમ ડોર્ટ જાન, રઘિને દીપનુ અનુમાન,  
 ત્યમ એ રાણી અલજ તણી, લદ્ય વાણી ગુર્જરી ભણી ૧૨  
 શુદ્ધિદારત ગુરુએ જે કંઠુ, તરન અદ્ય ત્યાનુ મે અનુ,  
 નોક મૂળ તણો આ સર્યો, ચોપૈયધ, તેદને નિર્ભર્યા ૧૩  
 રહિત જન તણી કેદી, અથાર્ભ કરે ત્યા વગા,  
 મનસાનો ગાતા તે હરિ, તણે એ છર્દળ મન ધરી ૧૪  
 ઝુદ્ધિ શ્રેષ્ઠ હૃદય સદાય, ત્ને ચચ્છુ ભનિ સદાય,  
 દળ બેચા થાયે આડોયો, પ્રૌદ ઉક્ખથી જ્વમ પણો ૧૫  
 મા ગુરુ કૃપા નગ ધરી જાન, ર્દમ ૮। એ કારો અન્યાસ,  
 જેદની કૃપાએ નનોન્ય થાય, નિષ્ઠ કનના પણ તે ગુરુ સદાય ૧૬  
 એ એ ધી કરી ઉગ્રતા, તેણે જુઝુદ્ધિ કરે પ્રદાન,  
 ઝુદ્ધન વિહનસૂદ કોર, ર્દમ ન ડગી નિપ- એ ૯૮. ૧૭

શ્રી

શ્રી ગુરુભૂષણ નમઃ શ્રી જોગીજન વલ્લભાય નમઃ  
શ્રી દૃપ્ધકુય નમો નમ  
અથ શ્રીમદ લગ્નવદ ગીતા પ્રાકૃત લાખા-  
પદ ખંડ લિખયતે.

અધ્યાય-૨ પહેલો-પ્રારંભ. “ચોપાઈ.”

શ્રી ગુરુ ચણું પ્રતાપે કરી, જોગિદ શુષ્ણ ગાઉ વિન્તરી,  
ગુરુ જોગિને કરી પ્રથ્યામ, મદા મગન મર્તિ ધનસ્થામ ૧  
રમરણુ કરીને ધર ઉર ધાન, વણું શ્રી ગીતા આખાન  
ગીતા મહાભાગતને આદ, શ્રી દૃપ્ધણ અર્જુન સવાદ ૨  
અર્જુનને યથાર્થ ન તત્ત્વ જાન, રહેતુ શોક મોદતુ ભાન,  
કેળુ રહેતો નહિ પિવેક, નિશ્ચય રહેતો નહિ મન એક૦ ૩  
કુડ ક્ષેત્રમા ને ને થયુ, સંજયે ગાળને તે કંચુ,  
દેહ વ્યાગે ભારત ભાય, એવી કથા અઠાર અધ્યાય ૪  
ઉપનિષદ માહેનો સાન, અત્ત જાનુ, ને તત્ત્વ વિચાર,  
શોગ ધાન ને મૂક્તિ પદાર્થ વિશ્વરૂપ તથા ગૂદાર્થ ૫  
શ્રી મુખ થકી અથ્યું ને સુધા, વાણી ગીર્ણાંછે નુસુધા,  
તેથે તથ્યો ત્યા દુર્ગમ અર્થ, મદધી નહિ પામના સમર્થ ૬

કેદનો અર્થ ન પ્રીત્યો જાય, નિત્ય ન ઉપકે તે તે માચ,  
 અશ્વ આખુષ કનિયુગ માનની, શકે નહિ નિધા અનુભવી ૭  
 તેદનો સીધો એક ઉપાય, પ્રારૂને જે અર્થ લખાય,  
 તો કો તેદને આપારે, પાછા શોનાનુ મન હુરે ૮  
 અજ્ઞાનીને 'જ્ઞાન પ્રનાના, થાયે પાતં હોરો નાગ,  
 તે માહે અજ્ઞાની દીન, મદ જુદ્ધ ને વિદ્યા છીન ૯  
 ચાડોદનો પિપ્ર અંનિધા ભયો, વૈષણવ દરિજન કુરા અવતયો,  
 પ્રભુગમ પિનાનુ નાન, નામાભિધાને કરે ત્યાનામ ૧૦  
 અવસાંગર તરફાને કાજ, અથ આરબ્યો ત્યાએ આજ,  
 માત મદાનદમી મનસા નહી, ગીતાજ કથના મતિ ચહી ૧૧  
 દેખાડે જ્યામ ડેર્ટ નાન, ગરિને દીપનુ અનુમાન,  
 જ્યામ એ વાણી ક્રલજ તાણી, વધુ વાણી ગુર્જરી ભણી ૧૨  
 ઝુભિદ્વાનત ગુરુએ જો કંઠુ, તરન ગરસ્ય ત્યાનુ મે અંતુ,  
 શ્રોક મૂર તણો ચા સયો, નોપૈગધ, તેદને નિમત્તયો ૧૩  
 શક્તિ અન તણી કેટલી, અથારભ કરે ત્યા વળી,  
 મનસાનો રાતા હે હરિ, તેણુ એ દર્દા મન ધરી ૧૪  
 જુદ્ધ પ્રેરક હૃદ્ય સદાય, ત્ને ચન્દ્ય મતિ સદાન,  
 દરી વેના થાયે આડળો, પ્રૌઢ દ્વાર્થી જ્યામ પાગળો ૧૫  
 શ્રી ગુર કૃપા ગળ ધરી આગ, જમ રા એ કુદ્ધો અભ્યાસ,  
 તેદની કૃપાઓ મનો થ થાય, રિદ્દ રના પણ તે ગુર સદાર ૧૬  
 શ્રી રહિ એ ધી રી ઉગાશ, તેણે સુખુદ્ધ કરે પ્રનાગ  
 ઓ ગિનિધિ રિદુનસ્તા હો, રનાભ કુરા ૧૭ એ ૧૮. ૧૭

વંશ ભૂપણું શ્રી હેવકી નાના, સદગુરુમા મતિ શ્રી ગોનિંદ,  
 તેના અગ્રણું પ્રતાપે મન ધરી, અથ આગ બ્યો ઉદ્ઘામ કરી ૧૮  
 સત્ય સંકલ્પના રાતા હરિ, એવી પ્રદત્તા મનથી કરી,  
 સમય ગીતાનો ને સાર, રહણું રેવા ચ્યો વિચાર ૧૯  
 ન્યાસ ધ્યાન એક હરિનું નામ, સંકલ ભનોાથ પૂર્ણાં કામ;  
 ન્યાસાદિ ગતિ નદિ છું ખાળ, મયા કન્દળ્યો યુડુ હિન વ્યાળ. ૨૦  
 કાદાં ધેરેલાનો દાતાર, ભવસાગર ઉતારે પાર;  
 કૃષ્ણ કૃપાનિધિ કરણું સિંહુ, દીનજન તણેં તે કાદાવે અ હું ૨૧  
 તેદને નામે કથની કથી, શુદ્ધ અશુદ્ધ જાણુંતો નથી;  
 એવી પ્રેરી તે મતિ અનુસાર, ગીતાસાર અપ કરે ઉચ્ચાર. ૨૨  
 શ્રી કૃષ્ણાસ કૃતિ કહેવા ભાગ તરતાથય ન જાણુંચા પાન,  
 તથપિ સાદસ આદ્યું કામ; કૃષ્ણ કૃપા અણો ગણી કામ. ૨૩



## શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ લે

દરિતનાપુર આવ્યા વેદ વ્યાસ, ત્યાંથી ધૃતરાષ્ટ્ર કેરે આવાસ; ૧  
 રાયે પૂજા કાખી, ધણી, પૂછી વાત સાંઘામજ તણી.  
 વ્યાસ કહે રાજી એ ધાર, દેવ ચક્ષુ હુંને આપું સાર;  
 અહીં રહાં તે સૌ દેખરો, કૌરવ પાંડવ યુદ્ધ પેખરો. ૨

## ॥ ધૃતરાષ્ટ્ર ઉચ્ચાય ॥

સ્વામી જન્મ લગી હું અંધજ રહો,  
 ધણો કાળ આણ દેખે ગયો;  
 પૃત્ર મરણ જોવાને કાળ,  
 શું દેવ ચક્ષુ માણું મહારાજ. ૩  
 પછી વ્યાસે ત્રિભ્ય સંજય છે જોદ;  
 આપી નેત્ર બેસાડ્યા તેણ.  
 કુરુ ક્ષેત્રમાં ને કાંઈ થશો,  
 તે સંજય અહીં એડો દેખરો. ૪  
 એવું કહીને વ્યાસજ ગયા,  
 સંજય પ્રત્યે રાય બેદિયા.  
 કહો સંજય દુમણું શું થાય,  
 દોષું દોષું મળિયા છે રાય. ૫

## ॥ ગીતા પ્રારંભ ॥

ધર્મ ક્ષેત્ર કુરુ ક્ષેત્રન સહી,  
ધર્મશ્રદ્ધ જ્ઞાનથી ત્યાં એકદિ ગઈ,  
માહાગોપ ને વળી પાડવા,  
સંજય તે શુ કેતા લવા ૬

અધાર કોણી મૈન્યા ભળી,  
અજ્ઞાન સરખા જરૂર પાણુ વળી;  
રવામી તે યુધ્ય કેમ ચેપીએ,  
ધર્મશ્રદ્ધ એ પણ નહિ હેઠીએ. ૭

## સંજય ઉવાચ.

અવિ લોલયું પાંડવ સૈન્યને,  
બાંડ મોદું ત્યાં દુરોધને;  
આચાર્યની પાસે જઈ, રાજાએ ત્યાં વિનતી કરી. ૮  
સંજય કરે રાજ એ ધાર, હમણાં દુરોધન કરે લિયાર  
દ્રોણાચાર્યને વાણી કરી,  
પાંડવ સૈન્ય ગણ્યું એ સહી. ૯

જુઓ કોણુ કોણુ આભ્યા છે નેહ;  
આચાર્યા નીરખીએ તેહ.  
નિરખો આ ફલને આચાર્ય,  
બળિયુ પાંડવનું માહાગ. ૧૦  
દાઢુ ઘુમન શિષ્ય ને તમ તણો,  
તેહનો આદર છે અતિ ધણો.

કુપદ પુત્ર તવ શિષ્ય છે નેહ,  
ભીમ અજૂન સમ અણિયો તેહ; ૧૧

ઓહમાં અતિ શગ રાજાન,  
અગિયા અજૂન ભીમ સમાન.  
મદારથી કુપદ સાત્યકી,  
નિયાટ વીર્યવાન તે થકી ૧૨

એટ તેતુ ને કાર્યાનાજ,  
ચેક્ષીતાન જુખદ સમ સાજ.  
કુંતી બોજ પુરંદત બલી,  
સૈનને નર પુંગવ વળી. ૧૩

શુધામન્યુ ઉત્તમ તે નેહ,  
મદા પરાહભી છે ત્યાં તેહ.  
અભિમન્યુ ને ચુન દ્રૌપદી તણ્ણા,  
એ સર્વે અક્ષરંતા ધણ્ણા. ૧૪

હવે આપણું કહું તે જણું,  
ત્રિયોડ સંદારડ છે હુજ આણું;  
સૂર્યેન આપણા ભાણું,  
પ્રીણો તેહ તમો દીજરાય ૧૫

તે માહે નાયક મલારથી,  
નામ સર્વનાં કહુ ત્યાં કહી;  
પ્રયમ તમો લાખને કર્યા,  
કૃપાચાર્યને તથા વીઠદર્દી. ૧૬

सोम दत्त ने अनुरथाम्,

समरथ ग्रीतवाने संग्राम्.

सत्प सरभा छे महारथी,

सेनापति भीष्म जाये। अतिरथी १७

भीम अहु पराक्रमी धण्डा,

शन्त्र बाणु धर नही कांच मधुा;

अहेवुं मुण्डी हुयोधन गयो,

मेन्यामां ज्ञाई उबो। रघु. १८

भद्रा ग्रीष्मक पठवा भडराज,

मरणु आद्युं अहारे कान्त;

पशु पूरणु दक्ष नही आपणुं,

अनवाणु त्या भिष्माज तणुं. १९

पूरणु इण पांडवनुं सही,

राखे भीम अहु आहर वही;

ते कारणु आ सर्वे योद्ध,

ते सहु डोने करो श्रेष्ठ। २०

हांम हांम मेन्याना धण्डी

रक्षा करे पितामह तण्डी.

वणती वृद्ध पिता दुर राज,

रहेने ह्युं उपजावा कान्त. २१

मुख थडी काधी सिंह नाह,

थरो वगा शंखनो साढ़;

ત्यारे बदु शंभने भेर,

પણું આનક ગોમુખતી ૨૨.

સહસા શાખ સુંદર ને હવા,

મ્રીછયા નન્ય જાચે જુજવા;

શંખનાદ સેન્યા બેઉ કરે,

• સંજય ધૂતરાષ્ટ્ર પ્રત્યે ઉચ્ચયરે. ૨૩

તદનંતર માધવ પારથે,

એત અશ્વ જોડયા છે રથે;

એટા તેણું મહત પ્રસાદ,

• દિવ્ય શંખના ઝાંધા નાદ. ૨૪

પાંચ જન્ય દેવદાતા કેદ,

વાલા દૃષ્ટિ ધનંજય તેદ.

પૌંડ નામ માહા ને શાખ,

કીધો નાદ લીમે નિઃશાંક. ૨૫

કુંતી ચૂત રામ ધુધિંજિરે,

અનંત વિને તાં જાચે રવરે;

કુદોષને સ્વર નકુદે ભયો,

મણ્યુપુષ્પક સહદેવે ધરો; ૨૬

કાશીરાજ ધનુર્ધર ઘલી,

મહારથી શાખંડી વળી;

દષ્ટ દુર્ગન વિરાટ સાત્યકી,

જીતે નહીં કો એહાજ થકો ૨૭

અજુન વયન શી દૂઃખ આભળી,  
લડ્યો ચથ જ્યાદા મેણા મળી ૩૩  
નો સભાળી નેય તેદ,  
યોદ્ધ સફન ગાંગો છે તેદ,  
ગળમાં યુદ્ધ નાણી મને દામ,  
ગે કર્ણો કો શુ અમામ ૩૪  
યુદ્ધ લઘ્ની કર્ણા મન ધરી,  
ગે જા માણે ના પગરી;  
દુર્જિત ને ધૂનાંક નન,  
રેના દિનનિખરવા મંન ૫

## ॥ સંજ્યોગાચ ॥

તતકાય હપીંદર ત્યા એન,  
ગુણકેશને એવી નતએન  
ઉત્તમ રથને ત્યાદાયી લઈ,  
ઓ રા સાચે રાહેં જાઈ ૬

દુપ્તને દુપ્તના તન,  
તથા ભાડા ખાડ અભિમન્ય,  
એ સવેના ગંભીર જુગના,  
રાજી સુણો નાદ ખણુ કુણ ર૧

મુદ્રા શાખા એહવો થયો ઉંદે  
થતે ભાતના દ્વારાં હૃદે  
પડ્છદ તેદના જેકરા,  
પૃથ્વી નભ કાળાં ભોતના ર૨

પદી સદસ્ય<sup>૧</sup> મોદ અગ્રને,  
દૃતગઢના સૂત સરને  
સાવધાન દીઝા જવ પ્રમુખ,  
સભાણ્યુ<sup>૨</sup> પોતાનુ ધનુષ ર૩

ત્યાં અગ્રનું કરચ થસુ શતખાં,  
શરૂવીર વાધ્યો અસાંડ;  
અગ્રનું કંકે સાંભળો ભગવાન,  
એઉ એન્યાનુ<sup>૩</sup> મધ્ય પ્રમાણ. ર૪

હૃપીકરને કલ્ય વચન,  
તે તો તમો કુણો રાજન;  
ત્યાં રથ આપણો મેલો એહ,  
લોઉ કોણુ કોણુ આવ્યા છે ટેદ. ર૫

સ્વામી ચા રથ ઉત્થાપિયે,  
ઉભય સૈન્ય મધ્યે રથાપિયે;

अर्जुन स्वयं श्री कृष्ण भाभणी,  
दाक्षेण रथ त्यादा मेन्या भणी ३३  
तो सभाणी लेयु तेद,  
थोक समन गिमो ते नेद,  
गणमा शुद्ध नाणी भने दाम,  
मे क्षेत्रो को शु सग्राम ३४  
शुद्ध तप्ति धूरा भन धरी,  
मे इन भाष्टे रहा पर्वरी,  
हुक्षुद्धि ने धून-धू तन,  
रेना 'रितुनिर्भवा भन' ३५

## ॥ संज्ञेत्वाच ॥

ततक्षण छपीउरा त्या ऐव,  
गुडाउरने अही नतभेर,  
उतम रथने त्याकाथी नध,  
मे एगा मन्ये रथाओ जध ३६  
पउ भाष्म द्रोष्ण देखना,  
बीज थोराने पेखता  
श्री कृष्ण अर्जुनने क्षेत्र,  
ले आ क्षीर्य इन ले रु ३७  
ते नारे दीक्षा त्वा इन भाष,  
पिता पितामह गुड स-साय,

વડો ધણુ માતુક ને ભાત,  
પૂત્ર પૌત્ર સખા સાક્ષાત. ૩૮

તથા ક્ષમુર સુહેદ ત્યાં ધણુા,  
એહુ એ હળમાં પોતા તથુા;  
નિરખ્યા કીંતે તેણુવાર  
અધું એ સર્વે નિરધાર. ૩૯

તે દૈખી ત્યાત મન ચયું,  
એદ પામતાં એદશું કંદું. ૪૦

## ॥ અર્જુનનોવાચ ॥

અર્જુન કહે સાંભળો મદુરાય;  
સ્વામી એ શું મેં મુખ્ય નાં થાય.  
એ તો મમ રૂલન માદારાજ,  
આચ્યા છે ને વદ્વા કાગ. ૪૧

એ દૈખીતે અંગ પિણાય, સુખતો મારું સુધી જાય;  
થરથર કપે આખી કાય, રોમાંચ શરીર જીભાં યાય. ૪૨

ગાંડીવ ધનુષ્ય હાયથી પડે,  
તથા દહે ને મન ઉંઘડે;  
શરીર મારું ગળોને જાય,  
અર્જુન લોહી દિગ્ભૂજ યાય. ૪૩

ગાગ ગળિત ચરણુ ભંગિત થયો,  
ગાંડીવ ધનુષ્ય નાંખીને રહ્યો

निभ्रमयी चित्त नये यही,  
ऐयं गडेनाये नदि वजी ૪૪

रही तणी अवग्या सकળ,  
आभी विपरीत निमे विकળ;  
दण्डां स्वज्जन पोता तण्डां,  
ऐय नदि सर्वे आपणां. ૪᳚

हु तो नव वाहु मुख राज,  
જप पामनाने भादागाज;  
अगुँन कडे धिक् धिक् ए राज,  
अटेनुं भदारे नथी अभु काज. ૪૬

डि, थ गल्य ने शो ए भोग,  
जो ए उत्पानो सज्जेग;  
ए नो सकव भोग मुख राज,  
धिक्के भीजे लेइने काज. ૪૭

ते तो सर्वे मुख धनने तज,  
भग्वा आव्या छे त्या सज,  
अहु आचार्य पिताने पुत्र,  
पितामह भामाने पौत्र. ૪૮

ससगा ने साणा अम तण्डा,  
तथा समधी दीमे धण्डा;  
आभी कुणा काय क्यम भीछये,  
ऐ पतिक रार क्यम लीछये. ૪૯

છન્દું નહીં, એ, લાયુવા, કદા,  
 અમને જો એ મારે જરા,  
 અપિ ત્રૈકોડ્ય રાજ્યને હેત,  
 હે મહું ભૂતન તો મહી તેત. ૫૦  
 દાયતાં ધૃતરાષ્ટ્રના તંન,  
 રીતે નદિં અમાર્દ મંત,  
 આતતાર્થ પૂર્ણ વિધ છે એદ,  
 તો હે પાપ તે દાયતા તેલ. ૫૧  
 ગોય નહીં અગો એ મારવા,  
 ધૃતરાષ્ટ્ર સુત સહ બાંધવા;  
 તે માટે ચુણો યદુનાય,  
 સ્વરૂપ મારે સુખ શું થાય. ૫૨  
 યદ્યપિ એ લોભાંધક હવા,  
 પોતે નહીં કાઈ કૌરવા;  
 કૂળનો ક્ષય કરે નર નેદ, ધોર નરકે પડે જન તેદ. ૫૩  
 કૂળનો ક્ષય કીધાનું પાપ,  
 મિત્ર પ્રોદ તણો અનિશાપ.  
 તો કથમ અગો ન પ્રોદું કર્મ,  
 કરવો ન ઘટે એદ અધર્મ. ૫૪  
 કુળ ક્ષય કીધાનું હિયાસુ,  
 દાયિ હેઠું મહુસૂદન.  
 કૂળને ક્ષયે સકળ કુળ માંયે,  
 અધર્મ તણો પ્રવેશજ થાયે. ૫૫

धर्म सनातन ने कुण तथे,  
 जये, उपने, अधर्म धरे।  
 अधर्म थकी हुणी जी जत,  
 हैप जनीत थाये विष्यात् ५६  
 ते तो जन्मे संकर वस्तु, -  
 ऐ हुःप स्वामी अरारथ शहौ..  
 संकर ज्यां, होमे नारकी,  
 पितृ धो तेहेना कर थकी ५७  
 पांमे नहि उद्द ने पिंड,  
 पडे नहौ सहे यम दंड.  
 संकर संभंधा होपथी,  
 जाति धर्म जये कुण थकी ५८  
 पदा पूर्वना ने कुण धर्म,  
 सवैं नाश पामे गुभ कर्म-  
 कुण नेहेना थाय नाश,  
 ते प्राप्तीने नहौ निवास ५९  
 पाप कुण क्षय कीधा तथे,  
 स्वामी ऐ पातिक न अथे,  
 ह तो सत्यो भदा पातकी,  
 ऐ उद्यम कीधा भन थपा ६०  
 उच्छु रात्र सुध पोता तथे,  
 ते अर्दौ गुं स्वर्गने लाखौ।

પદ્ધતિ મેં ત્યારાં દખિયાર,

કૃત્તુન રામે કરે પ્રદાર ૧૧

રણુ ભાડિ ભારે લે એમ,

એણું વાને ભદ્રાં ક્ષેમ.

તે ભારે હું સુદ નદિ કરે,

તથાપિ હું એકસો જઈ ભરાં ૧૨

નાખી ધનુધ્યને કાયર થયો,

અજ્ઞુન મર્છાગત વચ ભયો;

ભીખ ભાગીને ભોજન કરે,

પણું એ રાજ્યને નદિ અનુસરાં ૧૩

## ॥ સંજ્ઞય વિચાર. ॥

વળતા અજ્ઞુન એણેવું કલી,

એઠા રથે એસરતા યાછ;

ધનુધ્ય શર લેછ અજ્ઞું ધરું,

શેકિત મન ઉદ્દેશે ભર્યું ૧૪

ક્ષાત્ર ધર્મ છોડવા થયો તૈયાર,

પર ધર્મ પાણવા કરે વિચાર;

દિતોપહેશ કરશે પ્રભુ સાર,

જગ દિત ભારે હરિ અવતાર. ૧૫

ધર્મ જીનનો ગુપ્ત થરો ઉપહેશ,

એ સમય ગીતા આદેશ;

द्यारामे गीता पद अधि,

कही हैतना छृष्टवा ६६. ५५

योग शास्त्रने अह विद्याय,

पूर्ण धयो प्रथमो अध्यायः ६७

इति श्रीमद् भगवद् गीता सूपनिषत्सु ब्रह्म विद्यायां  
योग शास्त्रे श्री कृष्णार्जुन संवादे  
अर्जुन विपाद् योगो नाम  
१ प्रथमो ध्यायः



## ભગવદ્ ગીતા અધ્યાય બીજો

- પ્રારંભ -

### ॥ સંજ્ઞય ઉત્પાદ ॥

પણી ને વારે મધુમદને,  
અર્થાત્ રિય કૃપયા મને,  
કુખ પાંચે નયણે જલ ધાર,  
એકેના વચન કલ્યા તેણી વાગ. ૧  
સંજ્ઞય ધૂતગઢને કહે,  
અર્થાત્ ગોડ સાગરમા વહે,

### ॥ શ્રી ભગવાનુવાચ ॥

દ્વાદ્ય કદે અર્થાત્ શું થયુ,  
ત્રાણ પાપ તુજ હિં વરી રહ્યુ. ૨  
દ્વાદ્યથી મોદ ઉપજયો મન,  
વિષમ સમે માટે અર્થાત્  
એ તો ઇમ્મ નીચને ભાય,  
ભલુ નહી અપકીર્તિ-ચાય. ૩  
માન ક્રઘનુ ધારે કામ, ।  
લોઽ દસાન્તનો એ દામ,

ते अर्जुन दूर्लक्षिता धरी,  
धटे नदि नपुंसक तरी. ४  
तमो परंतप ते भने धरो,  
तथ क्षुद्रता उद्घम करो;  
हाँडी भोड़ धीरज भन धरो,  
पारथ युद्ध तमो शोने करो. ५

### ॥ अर्जुनउवाच ॥

ते अरि ग्रुदन कडो कथंभ आज,  
भिष्म, दोषु युद्धे महाराज;  
अर्जुन कडे सुणो भगवान्,  
क्रिष्ण, दोषु, प्रत्य पिता समान. ६  
द्वाजुनो छाने विनि योग,  
गुड पितामह प्रवदा योग्य;  
ने गुडने काने राज्य कीछये,  
ते गुडनो वध कथम कीछये. ७

### पूर्व छाचा

भादांतुभाव भार्या विना,  
भिक्षा वृत्तिये छपये,  
गुडने टप्पाथीं संपटे,  
इधिर समानना भोग ते,

ते अा लोट भोजार;  
ने सार भाँडे सार.  
दृष्ट्य अर्थ ने काम;  
लोगवदा धनग्राम. ८

નથી જાણુના એ અમો,  
કે ડોછ વાને સિદ્ધિ,  
અમે ગતીયે કે અદ, જય પામે રણુમધ્ય  
જે માટે કીશ્યે આશ રજવા આજ,  
તે તો કાકાના કુચર, આદ્યા વહવા કાજ ૬  
કુણે। કય કરવા તણે, હોણે લખીયુ ચિત,  
કારર કાર ધર્મમા ભૂજાઈ મુજ મત્ય.  
પેતાની પૃષ્ઠ કુગળ, નિઝે કહેાની વાત;  
શિધને શિક્ષા દીખ્યે, શરખુાગત તરતાન. ૧૦  
જે આ પૃથ્વીને વિદે, શાનુ પાખે રાજ,  
પ્રાતી હોયે ત્યાંડા વળી, દેવાધિપતિ કાજ.  
તોહે તે નથી દેખતો, ભર્તિ જીવનો શોય,  
આજે મને ઉપજ્યો, ધર્દિ શોયક દેય ૧૧

## ॥ સંજય ઉવાચ ॥

રાય સુણો તવ એહ વચન,  
શ્રી કૃષ્ણને કહે અર્જુન,  
યુદ્ધ કરનહિ એમ કદી રજા, ત્યાગપતી અધ્યાત્મા થયા. ૧૨  
ત્યારે એ દળમા અર્જુન એહ પામતા દીહા મન,  
ફસતા તદા રૂઘણે રાજુન, પાડવ પ્રત્યે કલા વચન. ૧૩

## ॥ શ્રી ભગવાન ઉવાચ ॥

શ્રી કૃષ્ણ કહે તુજ મિથ્યાવાદ,  
સાભાત્ય અર્જુન કથા અનાદ,

આચ પક્ષ ને ખલ જાન,  
તે જોતાં છે સહુ સમાન. ૧૪

કોણ ગુરુ શિષ્ય ભાતને તાત,  
કોણ ખુલ જી કુદુંખ ભાત;  
જરૂર મરણ આત્માને નથી,  
વ્યાપકને નો શું કણીએ કથી. ૧૫

ન્યમ ભાતુ પૂર્ણ ભાતુ આવે જાય,  
ઉદ્દ્ય અસ્ત ન્યમ સૂર્ય કણેવાય;  
પ્રાર્થ દિશા નદિ સૂર્યની ભાત,  
પૂર્વાં પ્રાર્થય હોય પ્રભાત. ૧૬

અખંડ ખીજ જ્યોતિ છે જેદ,  
વ્યાપક રૂપ જાહુણે તેદ;  
અશોચ તણો તું શોચ અતિ ધરે,  
વળી નિવાન પંડીતનો કરે. ૧૭

મુખા ઉચ્ચતા કેરો શોંક,  
કદમ્પિ ન કરે પંડીત લોંક;  
હું તું ને આ ખીજ રાય,  
પેહેલા ન ઢેતા પૃથ્વી ભાય. ૧૮

ઓમ આં જાળીશ ને વળી ઓમ,  
નહીં લેયે આ સહુ યે તેમ;  
બાલપણ ને જોખન જરા,  
રારીર સંખ્યા ભાવજ ખરા. ૧૯

नेम ए प्राण हेदान थप्पे,  
 धीर्जन तो नह मजाय  
 छन्दियोने विषयम् भ्रीत,  
 तेवा सुख हुअ तातु भीन २०  
 चेकोचे पश्च ते ग्यार्ह नदि,  
 ते भान्त ते सेतु सही,  
 ओ टा। ले नम् भीडाय,  
 भुण्ठने हुअ संख भन थाय २१  
 धीर्जन छोये ने काय,  
 अर्जुन चोक्त ते नग्ने रोय  
 असिवभान तष्टु। नदि भान,  
 निवभाननो नदि अभान २२  
 तत्सत्तानी ले ले काय, निर्व्ये तेषु झीवो भोय,  
 लेषु आ सर्वे भडाय, झीतु ते अविनारी भाय २३  
 ते तो आने ने अनिनाय, भोग नहि को करथा नाय  
 भाकृष्ण कहे गो भग्नु नथी, तु आत्मज्ञानेनेन कथी २४  
 न्यग्र व्रक्ष अवन्या आने हेद,  
     • परमेश्वरी र्घुँ तेद  
 वगी जणमा पर्सेटा थाय,  
     ते भागे ने तेमा समाय २५  
 आत्माराम कहीये जेद,  
     ५५९ शोक्यी अण्गो। तइ,

સેકેને ઉપને રહેને સમે,  
અસ્થિર માયા એણી પેરે રમે. ૨૬

શું ખાડું કરતા નર જેદ,  
પારથ માયાનું બળ એદ;  
જીવ આત્મા નિત્ય રવાંપ,  
એ પ્રમાણે અવિનાશી ભૂપ. ૨૭

પડી દેદ ને જીવે ધર્યો,  
તે માટે ભારત સુદ્ધ કરેદ;  
એદને ને દખુાયો વદે,  
અને દખુનાર તેદનો બૃદ્ધ. ૨૮

તે તો એ અગ્નાની જાણ,  
નહીં દખુનાર દખુયો પ્રમાણ. ૨૯

### ખૂબી છાયો

જાણે ન કો એને, કરા ભરે ન કરો ઉપાય;  
નથી ઉપન્યો આજને, ન આગળો ઉત્પત્તિ ચાય;  
એ તો અજ ને નિત્ય છે, જાણું કાળનો પ્રાણુ,  
દેદ હણે એ નાચ ભરે, અજુંનું એદ પ્રમાણ. ૩૦

આવે અવિનાશી અજ નિત્ય,  
ને કો જેદની કરે પ્રતીત;  
તે શા માટે કહેને હણે,  
કેને દખુના શાનેને ભણે ૩૧

શરૂ વન્ન ભાષુસ લ્યમ તણે,  
ધીળાં નવાં રારીરે સણે;  
તેમ તે તણે આત્મા દેદ,  
જુનો નવો અદે તેદ. ૩૨

અહેને છેદે નહિ ફથિયાર,  
બાળી ન શકે અગ્નિ લગાર;  
કાદ્વ ન કરે જળ એદને,  
વાયુ ન સુકવે ત્યાં તેદનો. ૩૩

અછેદ, અ દાદા, અક્ષેદા, અદોાપ,  
નિત્ય, સકળ, વ્યાપક નિદોપ;  
સિથર ને અચળ આત્મા એદ,  
સદા નિરંતરનો ત્યાં તેદ. ૩૪

આદાવોજ છે એમ કલો ન જાય,  
ચિત્વે ન આવે ચિત્ત ભાંય;  
નિવિકાર કલો તે જાણ્ય,  
હેનો શોક ન હું મને આંણુ. ૩૫

અથવા જો હું ત્યાં અશુર્નાન,  
અહેની વાત વિવ્યારો મંન;  
પ્રાણ દેહની સાથે ભટે,  
તોડે શોચ હેનો નવ્ય ધટ. ૩૬

કે જન્મ્યો તે નિશ્ચે ભરે,  
નિશ્ચે મુખો તે ઇરી અવતરે;

જે વાતનો નહિ ઉપાય,  
શોય કરો તહેનો મન ભાંલ. ૩૭

આદે એ શરીર અરપણ,  
ભારત મધ્યે દીસે રૂપણ;  
અંતે માયામાં લય થાય,  
તહેનો શોય કરો મન ભાંલ. ૩૮

### પૂર્વ છાયો।

કો એક હેઠે એહેને, જેહેલું આશ્રમ હેઠાય;  
આશ્રમ સરખું વળી, બાખે બીજે ટોય.  
અને વળી જે સાંભળે, આશ્રમવત તે થાય,  
પણ તે સાંભળે તે થકી, પ્રીણે નહિ મન ભાંલ. ૩૯

સકળ દેહમાં દેખી પ્રાણુ, સદા અમર છે તે તું જાણુ;  
નિર્વિકાર અવિનાશી સહી, વાણી શ્રેહેવા ક્ષમય નહિ. ૪૦

અગમ્ય અગોચર શુદ્ધિનાં ધરે,  
તહેની ચિંતા તું શીદ કરે.  
વાયુ ન શોધે, અદ્વિતી નવ બળે,  
જળે ન જુડે ગગને નાં ગળે. ૪૧

શરૂ ન કેદે અમર નવ્ય ભરે,  
તે આત્મની ચિંતા શીદ કરે.

તे કારણે તુને અજ્ઞુંન;

શોય ન કરવો છોનો મંન. ૪૨

નો ચેખે ચોતાનો ધર્મ,

ક'પ વાપ નહિ ઉત્તમ ધર્મ;

હે અજ્ઞુંન હું એવું જણ્યું,

નિર્ભયપણું હુંથે હું આણ્યુ. ૪૩

ક્ષત્રીનો ધર્મ યુદ્ધથી,

અધીક એવ ભીજું તો નથી;

ક્ષત્રીને નહીં લાગે પાપ,

સ્વર્ગ પમાડે દાળે તાપ. ૪૪

સ્વર્ગ દાર તો યુદ્ધું થયું,

સમર્સત યુદ્ધનું પાતિક ગયું;

ભાગ્ય વિના સ્વર્ગનું દાર,

દિધ કું પામ્યો નિરધાર. ૪૫

ભાગ્ય વિના એ નહીં પાંખીયે,

કલી મજ દોપું સર્વ વાંખીયે,

અડ ભાગી ક્ષત્રી હોય ક્ષેદ,

અહેવા યુદ્ધને પામે તેદ. ૪૬

રણું સંગ્રામે ક્ષત્રી ભરે,

તે તો સ્વર્ગ થડી ઉદ્ધરે;

માટે એમાં પાપ ન હોય,

અજ્ઞુંન સત્ય કરી ભાનજે સોય. ૪૭

धर्म युध्य जे तु नय करे,  
पेतानो हेह पाये भरे;  
भुमि धर्म पेतानो पायी,  
अपश्चित्ति घोके सहु मणी. ४४

नय पाभी नडो अर्जुन,  
सुभट कडेशे हार्या कुंता तन;  
सदा सकल प्राणी तावरी,  
अपश्चित्ति कडेशे विस्तरी. ४५

जग भांडे भानीतो लेद,  
लेने भर्याथी अधिकुं तेद;  
भदारथी सहु सुद्धने विषे,  
भय पाभी नडो भानी ५०

मान धरी के नामे शाश,  
ते आगण लधुता पाभीश;  
तादरा के शनू ते धख्या,  
उडेशे वाक्य कक्षक्ष तथां. ५१

सअणपत्तुं तादोइं निंदगे,  
तेथी दुःख अधीकुं शुं दशे;  
रथुमां भुमि स्वर्ग पाभशो,  
ने छतो तो पृथ्वी पति थशो. ५२

धरमां सुधि रहे नर लेद,  
कठीये नोक्षा न पामे तेदुः.

ਹੇ ਕੁਂਠੀ ਸੁਨ ਤੇ ਚਿਤਾਮਾਂ ਧਰੋ,  
ਜਿਨੇ ਨਿਥੇਂ ਸੁਖਗ ਕਰੋ। ੫੩

ਸੁਖ ਕੁਝ ਤਥਾ ਲਾਭਨੇ ਲਾਂਘੁ,  
ਛਾਰ ਛਤ੍ਰ ਸਵੇਂ ਸਰਪੁ' ਜਾਂਘੁ;  
ਤਰਪੇ ਯਾ ਪਈ ਸੁਖਨੇ ਆਪ,  
ਏਮ ਕਰਤਾਂ ਨਈਂ ਲਾਗੇ ਪਾਪ। ੫੪

ਅਗੁੰਨ ਰਾਨ ਤਣੀ ਨੇ ਕਥਾ,  
ਤ ਤੇ ਹੁਨੇ ਛਲੀ ਸਰਧਾ。  
ਕਮੰ ਧੋਆ ਵਣੀ ਸੁਣੇ ਉਪਦੇਸ਼,  
ਨੇਥੀ ਕਮੰ ਅਧਨਨੋ ਨਹਿ ਲੇਥ। ੫੫

### ॥ ਅਗੁੰਨ ਉਵਾਚ ॥

ਸਵਾਮੀ ਵੇਦ ਵਿਡਿਤ ਨੇ ਧਰਮ੍,  
ਸਵਧਰਮ੍ ਰਾਨ ਜਪ ਤਪ ਏ ਕਮ੍;  
ਮੂਕਿਤ ਲਈ ਛੇ ਵੇਦ ਵਿਚਾਰ,  
ਸਵਾਮੀ ਤੇਮਾਂ ਥੁੰ ਨਿਰਖਾਰ। ੫੬

ਤ ਮੁਨੇ ਸਤਿ ਕਹੋ ਸ਼੍ਰੀ ਫਰਿ,  
ਏਕ ਨੇ ਵਾਤ ਫੇਲ ਨਿਸ਼੍ਚਿਧ ਕਰੀ;  
ਤਮੇ ਅੰਤਰਤ ਜਾਣੁ ਛੇ ਜੇਹ,  
ਮਾਹੁੰ ਮਨ ਭਮੇ ਛੇ ਤੇਹ। ੫੭

### ॥ ਸ਼੍ਰੀ ਭਗਵਾਨੁ਷ਾਚ ॥

ਅਗੁੰਨ ਹੁ ਕਹੇ ਛੇ ਤੇ ਸਤਿ,  
ਵੇਦ ਤਣੀ ਛੇ ਵੀਵਿਧਿ ਮਤਿ;

निगुणातित शुद्धि तु आणु,  
कर्म भांडे निःकर्म तु जाणु. ५८

जानी पुण्य के कर्मने करे,  
ज्ञप्त तप योग तीरथ आयरे;  
स्वधर्म भाटे करवुं ओड़,  
इतनी छन्ता न करे तेव. ५९

उदास थर्द मन राखे क्लेम,  
क्षयी छतां न क्षयी सम तेम;  
जान योगे मन वश याप,  
जान रहीतथी नन्य ओणाप. ६०

हर्द शोक आखुप्प ने दाणु,  
पाप पुण्यथी अणगो ते जाणु;  
ते रहेने भोइ सागर तरे,  
भोइ लक्षणी अमणु उरे. ६१

### ॥ अर्घ्नन उवाच ॥

कहो स्वाभी रिथर शुद्धि द्वाप क्यम,  
भोइ सागर तरवनो अंम; (भर्म)

### ॥ श्री कृगचानुवाच ॥

मन विप्रयथी सधगुं छांडीये,  
अर्घ्नन उवाच यध चालीये; ६२

મને કરી મનનું સોધન,  
                         થાએ રિથર શુદ્ધ પત્રન.  
 દુએ કરી ગોડે ન સીધાય,  
                         સુખથી, મને મોદ ન, મહ થાય. ૧૩  
  
 રાગ દ્રોષ મનેથી તરણય,  
                         તો મનથી કદી મોદ ન થાય;  
 જો લક્ષણે રિથર ધી થાય,  
                         એક મન અતેથી સર્વ અતાય. ૧૪  
  
 એ ને કર્મ ચોગ નિષ્કામ;  
                         પાપ નહિ ઝાંધે ઇણ હાંમ.  
 રંઘક ધર્મ હોયે એ તણો,  
                         તોહે તે ભય ટાળો ધણો. ૧૫  
  
 કુર નંદન એ કર્મ વિવેક,  
                         નિશ્ચયાત્મક શુદ્ધ ત્રૈની એક;  
 અને ને જરી શુદ્ધિના ખણી,  
                         ત્રૈની શુદ્ધ બહુ શાખા ધણી. ૧૬  
  
 ૩। એક મૂર ધીણું નવ્ય લઢે,  
                         કર્મ માર્ગને સત્યક કઢે;  
 વદ વાદનો માને મત,  
                         આ વાધ્યને વહે પુણ્ય વત. ૧૭  
  
 અભિજાપે આતુર ને જને,  
                         અને સ્વર્ગ ઉપર અતિ મંન

બોગ, અધિકાર ઇથ જન્મ કર્મનું,  
કહે ખણે પુણ્ય હોયે ધર્મ. ૧૮

બોગ, અધિકારે, વિપ્પય પરમત,  
કર્મ ભાગ માદારાં ચિત્ત;  
તેની ખુદી સદા સર્વદા,  
તત્ત્વજ્ઞાનમાં ન હોયે કદા. ૧૯

નિગુણાત્મક છે વેદ વચન,  
ગુણાતીત તું યા અગ્રૂંન;  
સુખ દુઃખ તળ શુદ્ધ સત્ત્વે રહે,  
નિપ્કામ મારને રહે. ૨૦

સકળ નવાંશુ તણો ને અર્થ,  
સારવાને એક દદ સમર્થ;  
તેમ ને આલાંશુ જાની હોય,  
વેદ અર્થ સૌ જણે સોય. ૨૧

કર્મ તણો તુજને અધિકાર;  
દ્રણને તાડારે દિર નઢિ ભાર.  
મેં શાધું અહેતું નવ્ય કહે,  
અગ્રૂંન કર્મ વિના નવ્ય રહે. ૨૨

યોગાભ્યાસ યકો કરે કર્મ,  
સંગ ત્યઙ્ક આચ્યર એ ધર્મ;  
રીદ અસર્દી ને હોય સમાન,  
તેને કહીયે યોગ પ્રધાન. ૨૩

અજુન જાન ભારગ ઉત્કૃષ્ટ,  
 તથી કહું તે ઘણું નિરૂપ,  
 તે માટે તુ જાની થા,  
 કદી ન કરીય ઇવતી છંચિલા. ૭૨  
 જાની કહે એ આ મર્મ,  
 શુંકું ભલું રૂપને તે કર્મ;  
 તે કારણું તું આચાર યોગ,  
 યોગ કર્મથી ઘણો નિરોગ. ૭૩  
 ને એ જાની પરિત હોય,  
 કર્મ તથ્યાં કળ છૂટે મોય;  
 જરૂર વિઘની છૂટે તેદ,  
 નિર્મય પદનો નદિ સહેદ. ૭૪  
 જ્યારે તાડારી ખુદિ અજાન,—  
 કુળે, ગઢત ગતિ પામો જાન;  
 સાંભળવું હોય તાડારે ભાગ્ય;  
 ખૂખ્યા તથો પામે વૈરાગ્ય. ૭૫  
 શુલ્પ પ્રમાણે એહની શુદ્ધ,  
 નિશ્ચલતાએ થાયે શુદ્ધ;  
 સમાધિ યોગે હોય જે ખાન,  
 ત્યારે તુજને થાશે જાન. ૭૬

## ॥ અજુન ઉવાય ॥

જાન ખુલ્ખિનું કલશું કશું,  
 સ્વામી વળો સમાધિ તે શું ?

યોગાન્ધ્રસ ખુદ્ધિ શું હેઠે,  
ચાલે કેમ બેને કેમ રહે એક ૭૫

॥ શ્રી ભગવાતુવાચ ॥

ત્યજે મતોરથ મનના જેદ,  
આત્મા એ સંતોષી દેદ;  
ભારત વહેની એ ગતિ હોય,  
જાન ખુદ્ધિ કથીયે તે બોય. ૮૦

હુઃખે મન માનવી ન પીડાય,  
સુખે ધથું રળીયાત નાં થાય;  
ક્રોધ રાગ ભય નર નેં નહીં;  
જાન વિયે તેણી ખુદ્ધિ સહી ૮૧

જેહેતું મન નહીં કર્યોઃ આસક્તત,  
કરું ભૂદું દ્વિપ વિરક્તત;  
અહેવી હોય ત્યાં મતિ જેહની,  
જાન ખુદ્ધિ કથીયે તેણી. ૮૨

કેમ ઝર્મ પોતાની કાય,  
કરિ સંઅહે પોતા ભાંદ;  
તેમ ઈન્દ્રી ભોગેથી અહે,  
જાની વિ તેજુદ નરને કહે. ૮૩

ઈંગ્રિ લથ્યા આડાર ન ત્યજે,  
નિપ્યય તહેને ન રહે રહે;

तेम अभिलाप विना आसकत,  
परम हर्षनथी थाए मिकत ८४

अग्रुन ईदिने अडे डाय,  
अने वणी नर पडीत लेअ;  
तोडे बिंधा गुण्य ने धरे,  
बधारकारे भन तेङेनुं दरे. ८५

योगी ज्ञन छहि वश करे,  
यितनी शत्य हुं साथे धरे;  
वश देअ छहि नेहने,  
ज्ञान शुद्धि कषीये तेहने ८६

विष्णु निहत ज्ञारे भन थाय,  
आहार तजे तो सर्व तर्गाय;  
रसना सङ्गने त्यागे सोअ,  
ते हरि पामे संराय नदि कोय. ८७

तो पछी विष्णे वासना डेम थाय,  
आहार अताये सहु अताय;  
रसना छहि रसने नां त्यजे,  
त्यां लगी भन विष्णेने भजे. ८८

विष्णु भाडे राणे ने ध्यान,  
पामे तेहनो संग निधान;  
संग थभी उत्पति होये काम,  
कामे होय उपनया हाम. ८९

हेह थभी व्यापे त्यां भोद,  
भोदे निभ्रम तथे। सभोद;  
हेह भोद उपने अभिमान,  
अभिमाने उपने अज्ञान;  
अग्नाने हेह शुद्धिनो नारा,  
शुद्धि नारथी होये विनारा. ६०

राम हेह रघीत निरधार,  
धर्दि तथा करे व्यापार;  
भाटे धर्दियोने अतवी,  
शुद्धिने जाने वश राखनी.  
भनने वश करता वश थर्दि,  
भादा प्रसाद ते पामे सद्दी. ६१

भादा प्रसाद थभी निर्वाण,  
सरवे दुःखनी थाये हाण;  
प्रसन्नपथुथी त्यां तत्पोन,  
पक्ष पुरुषि त्यां थाये एव ६२

स्वधर्मे न्याय नीति वडेपार,  
हु भाइ तरवे। अदंकार;  
अर्जुन ऐरो ऐ उपाय,  
इस धर्दि गाने अताय. ६३

धर्दि वश न, होये जेहने,  
रान ध्यान न होये तेहने;

ध्यान नहि रहेने नहि रहति,  
 शानि विना सुखती शी भाति ६४  
 यथा छ दि नु अन करे,  
 ते अन तेरनी शुभ्यने लरे,  
 जनम जणमा, वा, वेगे वादाण्य,  
 आसी डासे विना प्रभाण्य ६५  
 सधगी छ प्रो वश ज्वेदने,  
 तेदना अर्थ थगी तेदने,  
 हुँ न हन अडेवो ने होय,  
 जान शुभ्य इहीये त्या सोम ६६  
 सडण भूत तण्यी ने निरा,  
 ते निरि जगे जानी दरा,  
 जगे ज्वाहा ए भ्राण्यी भाव  
 माहा मुनिने ते त्याहा रात्र ६७  
 मोह निरा स सारी जन वृत्ती,  
 येारी जलनी त्याहा निर्दिचि  
 येारी भानाहिये जाहत होय,  
 स सारी विपर्यमा सुझी होय ६८  
 ॥ खूर्द छायो ॥

अति प्रतिष्ठित ने अचण, पूरणु जगे सदाय  
 भाण्यी जेम आवी भणे, ऐहना सागर भात  
 त्यम वे जानीने विरे, काम करे प्रवेश,  
 ते तो खामे मोहु खण, झारने नही लेश ६९

तजे सङ्ग अभिवाप ने कोध,  
 ममता रहीत निस्पृष्टी होय;  
 निरसंकार करे जे भन्न,  
 शांतिभथु पामे ते जन. १००

अे जे आली रिथति भें कही,  
 ते पामे भूंजाये नहीं;  
 अंतकाले ते तेभां नहीं,  
 पारथ गोक्ष पामे ते सही. १०१

द्याराम श्री कृष्णनो दाम,  
 देशे पदभां कर्यो प्रकाशः  
 योग शान्तने अहं निदाय,  
 सांख्य योग द्वीतियो अध्याय. १०२

इति श्रीमद् भगवद् गीतासुपनिषत्सु व्रक्षविद्यायां  
 योगशास्त्रे श्री कृष्णार्जुनसंवादे सांख्ययोगो  
 नाम द्वीतियोध्यायः



ભગવદ ગીતા અધ્યાય ઉ નીળે

॥ અર્જુન ઉવાચ ॥

અર્જુન કહે સાંજનો ભગવાન,  
દીવિધિ વચન બોલો છો જાણ;  
કે તેથન તમો પર્મ ધી,  
કહો તે રૂપ એવું કર્મથી. ૧

કો સમે પ્રતિપાદો છો કર્મ,  
કો સમે રૂપનો ધર્મ;  
તો તે ધીર કર્મની વાડ,  
મુને હેખાડો શા માટ. ૨

કર્મ જુનમાં બેળાં વચન,  
કહી મૂંત્રવો મહારં મન;  
તે માટે કહો એક પ્રમાણ,  
જેણે મહારં હોય ઉદ્ઘાણ. ૩

ખરી વાત નિર્ધારજ કરી,  
એક માર્મ હેખાડો શ્રી હરિ;

॥ શ્રી ભગવાનુવાચ ॥

હે નિર્ધાય મેં આ લોકમાં,  
એ પ્રકાર કલા મોક્ષના. ૪

કૃષુ કહે અજ્ઞુંત મન આણ,  
બાને મારગ સમ કરી જાણ;  
સાંખ્ય શાન ને યોગે કરી,  
કર્મ પામે કર્મ આચરી. ૫

ઉભય ગળીને એકજ થાય,  
. શાનીને વિજ્ઞાને સમજાપ;  
કર્મભાં નિષ્કર્મ છે તેમ,  
ધાપાણુ કાણે હુતાશન તેમ. ૬

કર્મ આરંભ વિના નિષ્કર્મ,  
હેણે નહિ ધૈધા વિના અમ;  
અને લે કોઈ કરે સંન્યાસ,  
સિદ્ધિ તણી રહેને નહિ આશ. ૭

એક ગૃહસ્થાશ્રમ મૂડી વને જાય,  
વન્ન તરજુ સંન્યાસી થાય;  
તેણે અલ ન પામે ડોય,  
તરવ શાને મોક્ષજ હોય. ૮

કદાપિ ને કણુ એક પણુ ડોય,  
ન કરે કર્મ એહવો નભ્ય હોય;  
અલ થણી ઉપજ્યાં જાહુ કર્મ,  
સર્વને આચરતા ભાખ્યા ધર્મ. ૯

અભાવ જનીત લે ગુણુને ધરે,  
તેણે સર્વ કર્મ આચરે;

વ्यापक अहनो अभिक निवास,  
अदेव तु ने याए प्रकाश १०

ने को कर्म ईद्रिय वश करे,  
अने सिप्पय तड़ना भने धरे,  
ते तो मृद विरेण्ये सत्य.  
मिथ्याचारी दानिक भत्य ११

ज्ञान ईद्रि भने वश करे,  
कर्म ईद्रिये कर्म आचरे;  
नहि आसन्त जडेनु भन,  
ते तो अति ज्ञानी अर्जुन. १२

कर्म अल्पार्थ भति झोने,  
त्रिगुणातीतने निये पूजे  
ते कागङ्ग निये करे कर्म,  
नहीं काधारी काघे धर्म. १३

न कह कर्म अहेवा तु जहा,  
निष्टि पामे नहीं ते कहा,  
विष्णु ग्रीत्यर्थ पाए ने कर्म,  
तडेनु अधन यावत् जन्म १४

पूर्व जनकादि ज्ञानर्थी कर्म,  
बहित धुत करता लही धर्म;  
ते भाटे सुत हुती तथा,  
करो कर्म कामना विना. १५

निय कर्म आचरवा सही,  
कर्मनो क्षेत्र करवे नहीं,

આગે અજે<sup>૧</sup> પ્રજા યક્ષણું,

અજાડી તર બોલ્યા એ શું. ૧૬  
૨

એણે કરી તમો વિસ્તરે,

ચૂંછા પૂરે ને મને ધરો;

આ યજે સંતોષે દેવ,

તે તમને સંતોષે ઓથ. ૧૭

માંડે માંહે લ્યો સંભાળ,

તેણે ઉભય યાય પ્રતિપાળ;

દ્વારે સંતોષાયા નેહ,

મનવાંછીત ઇલ આપે તેહ. ૧૮

દેનું લેનો આખ્યા વિના,

ખાયે તે તરફર તેહના;

અશન કરેહ યત્નો શેષ,

હેને ન રહે પાતિક લેથ. ૧૯

આ સ્વર્થે ને પાકવે,

તે પાપી પાતિક મોંગવે;

અખુસની ઉપત્તિ અજથી,

અજ ઉપજે વર્ષી થકી. ૨૦

તે જૃદ્ધિ યજેથી હોય,

યજ ઉપજે કર્મે સોય;

\* ૧ અજે : અલા—પ્રજાપતિએ.

૨ અજાડી : ઉત્પત્ત કરી.

૩ અશન કરે : આય.

વेद થણી ઉત્પત્તિ હોય કર્મ,  
ખીજ વેદનું અક્ષર અલા ૨૧

અહિ સકળ વ્યાપકને નિત્ય,  
એહિવા અહિની પજે ચિથતે;  
એમ ચક ને ભવનું ફરે,  
પાદય તેદને નન્ય અનુસરે. ૨૨

ચોગે ધંદ્રી ચોતા તથાં,  
વ્યર્થ ભરે, પગળાં પાપનાં;  
જ્ઞાનેં પ્રીતિ પરમાત્મા વિશે,  
તૃપ્તિ હેઠે ને આત્મા થડે. ૨૩

એહિવેદ સતીપી ને કોય,  
તેદને કંદુ કાંઈ ન હોય;  
ત્હેને કાધાનું નદિ મુન્ય,  
પાપ નહીં ક્ષાયે હૃત રહ્ય. ૨૪

સકળ ભૂતની શિથતિ ને કંદી,  
કો શું કશું પ્રયોજન નહીં;  
તે માટે નિત્યે કરે સોય,  
કર્ત્વા યોગ્ય કર્મ ને હોય. ૨૫

અનાસકલ નિઃકામ નર જોહ,  
પરમ મોક્ષ પદ પામે તેહ;  
જનકાહિક પામ્યા ને સિદ્ધિ,  
કર્મ તથા ચોગે મહા નિધિ ૨૬

તે કારણું માટે ચિત્ત ચેત,  
કરવું કર્મ લોકને હેત;  
જ્યારે કરે અદ્યજન કર્મ,  
બીજા જોઈ આચરે તે ધર્મ. ૨૭

પ્રમાણું વરતુ અદ્ય જન કરે,  
સકલ લોક તેદને અતુસરે;  
પારથ માદારે તો ત્રૈશોષ્ય,  
કર્મ નથી કાંધ કરવા ચેત્ય. ૨૮

ન કાઈ અપ્રાણ્ય, ન પાણ્યા જણુ,  
તોહે પણ કર્મભાં વસુઃ;  
ન લેવું હેવું તદ્દ્વારી કરું કર્મ,  
શા માટે જે લોકના એ ધર્મ. ૨૯

આળસ મૂકુને જે કદા,  
દું તો કર્મ કરું નદિ થદા;  
તો તો પારથ સર્વે માનવી,  
રકે મારગ માદારો અતુભવી. ૩૦

જે દું કર્મ ને નંદુ બેદ,  
તો વરણા વરણુનો તુટે બેદ;  
દું તો કર્મ કરું નદિ ચેદ,  
તો આ લોક પામે છંચેદ. ૩૧

કર્મભાં નિષ્કર્મ જાણુશે,  
પદ મદારું તે નિષ્ઠે માણુશે;

સાંકરનો કરતા હું થાઈ,  
 પ્રગત તણો ઉણતા કેદેવાડિં. ૩૨  
 જીવના જોહ ધર્મ તે તે કરે,  
 બીજાં ધર્મને નાં અનુસરે;  
 ભારત ને અરૂપાની જન,  
 કરે કર્મ આસક્ત અતિ ભન. ૩૩  
 અનાસક્ત ગુણી પણુ એમ,  
 કરે કર્મ લોકને ક્ષેમ;  
 કર્માન્ધિત ને મૂર્ખ અશુદ્ધ,  
 બેદ ન કીને રહેતી શુદ્ધ. ૩૪  
 સાવધાન ગુણી છે જોહ,  
 સર્વ કર્મને સેવ તેદ;  
 ભાયા તણે તાંત્રણે ગણે,  
 કર્મ આયર્યાં છે ને જને. ૩૫  
 અહંકારે મૂર્ખ ભતિ રહે,  
 તે કીધું પોતાનું કહે;  
 તરન ગુણી ભારત જોહ,  
 શુદ્ધ ને કર્મ ભાગને તેદ. ૩૬  
 જણે વતો શુદ્ધી તે તણે,  
 પોતાને કરી નાય ગણે.  
 જોહનાં શુદ્ધે મૂંઝાં ચિત્ત,  
 કર્મ ધર્મિભાં તે છે આસક્ત. ૩૭

મૂર્ખ શુદ્ધિ જહેની એમ થથ,  
જાની એ દેસવાની નાદિ;  
મહારે વિપે સમર્પ સૌ કર્મ,  
ચિત્તામાં રાખી પૂરણુ અલ ૩૮  
આશા રહીત, ને ભમતા ત્યાજ,  
શોક રહીત શુદ્ધ કર્મ સાજ;  
આ મહારા મતને ને જન,  
વિચારે શુદ્ધ રાખીને મન. ૩૯  
નીદા કોઈ તણી નવ્ય કરે,  
કર્મ બંધથી તે નીચરે;  
મહારા આ માગને જેદ,  
નીદિ, ન અનુસરે, મત એદ. ૪૦  
તે સર્વને મૂર્ખ વિરોધ,  
શુદ્ધિ નારા તું જણ્ય નરેશ;  
અને ને કોઈ જાન પણ ધરે,  
પરંગતિ સ્વભાવે સૌ અનુસરે. ૪૧  
સ્વભાવ સરખી એદ્યા કરે,  
રહે ન નિઅડે છાંડી તણે;  
સધળાં એ છાંદ્રીમાં સદા,  
રાગ દેય વમે સર્વદા. ૪૨  
તેડ તણે પરા યાતું નાદિ,  
મોખ તણું એ દાતું સદી;

નિધિ પૂર્ણ કરી એ પર ધર્મ,  
તેથી શ્રેષ્ઠ પિણુણ હુળ કર્મ ૪૩  
ઓ ધર્મ મનુ પણ શ્રેષ્ઠ  
પર ધર્મ તો ભય નિશ્ચેષ,

## ॥ અલ્લાન ઉનાય ॥

પાપ આચરે ને આ જન,  
શ્રેરે તોણ તેદનું મન ૪૪  
કોનુ ગ્રેહું મન કર્મજ કરે,  
ગ્રેહનુ ગ્રેહું મન પાપ આચરે,  
યદુવર કર્દ ધર્યા ન હેઠ,  
બનાતકારે પણ થાય તે મોષ ૪૫

## ॥ શ્રી લગ્નવાન્દુવાય ॥

આ ને ઠામ કોષ આ કોષ,  
રનો શુણે ઉપજ્ઞા તેષ,  
રનો શુણુ ઉપજ્ઞા ને વાર,  
સાન વન્દ ઢાકે નિરધાર ૪૬

આ નરિને મહાપાપી જાણે,  
વેરી આ સસારે ગ્રમાણે,  
નેમ પાવક હુણે આવયો,  
થથા અરિસો મેલે ભયો ૪૭

દર્શય જાંખુ હોય નેમ,  
 કામ દોધ શત્રુ છે તેમ;  
 શાન નાય ટકે તેતું જોઢ,  
 એમ નિર્દ્ય થાય છે તેઢ. ૪૮  
 પછી વળતું ઉપજે અજ્ઞાન,  
 અજ્ઞાને આવે અભિમાન;  
 મન ખુદ્દિ છંડ્રોનાં હાંમ,  
 તાં રહી હુષ્ટ કરાવે કામ. ૪૯  
 તે માટે છંડી વશ આવે કરો,  
 રને ગુણુને રાખો પરો;  
 હે અજૂન એણુ ઉપાય,  
 આત્મજ્ઞાને આત્મા વશ થાય. ૫૦  
 વિપ્ય વાસના કરો વેગળી,  
 પડરિષુને નાખો દળા;  
 મન ગીતે ગીત્યો સંસાર,  
 અજૂન એનું જાન વિચાર. ૫૧  
 ગભ્ય જરાયે વીંટ્યો નેમ,  
 જકત વીંટીયું કામે તેમ;  
 એ કે વેર રાખો નિત્યનું  
 ટાંકયું જાન જો જાનીતથું. ૫૨  
 કામ અભિન હુલિલ એડ,  
 મદા હુઃખે પૂછાયે તેઢ;  
 આ કે કામ અંહેયા ગુણુ જાનો,-  
 છંડી મન ખુદ્દિયે ઉપજે. ૫૩

ગોઠ ઉપરવે તેણે કરી,  
 જાન સર્વનાં કે આવરી;  
 જાન ઉપર રાખીને મન,  
 કર્તા કર્મ પણ નહિ તે સેપન. ૫૪  
 ભારત તે કારણે મન ધરી,  
 છદ્રીને વશ રાખી કરી;  
 હરતા જાન વિજાનજ તણે,  
 ચેહેરું એ પાપાને દણે. ૫૫  
 પંડીત ઈન્દ્રી કહે ઉત્કૃષ્ટ,  
 તે છદ્રીથી તો મન શ્રેષ્ઠ;  
 ખુદ્ધિ શ્રેષ્ઠ તો તે મન યક્ષી,  
 શ્રેષ્ઠ આત્મા તે ખુદ્ધિથી ૫૬  
 એમ આત્મા ખુદ્ધિથી પર જણે,  
 તે આત્માએ તે રિથર જાણે  
 કૃષ્ણ જરૂર એહેવો વર્ણરી કામ,  
 મહા ભાગુ રહેને હણે હામ. ૫૭  
 દ્વારામ થી વલ્લભ દાસ,  
 તૃતિથા-ધ્યાપનો કથો પ્રકાશ;  
 ચોગ શાખને ઘણ-વિશાળ,  
 કર્મ પ્રશંસ તૃતિયો અધ્યાય. ૫૮  
 ઇતિ શ્રીમद્ભગવદ્ગીતાસ્તપનિપત્સુ બ્રહ્મયિદ્યાયાં  
 યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંધારે કર્મયોગો  
 નામ તૃતિયોધ્યાય:

## અધ્યાય ૪ ચોચો.

### ॥ શ્રી ભગવાનુવાચ ॥

અર્થુન મેં તુને જે ને કહ્યું, તે પૂરે સત્યથી સૂર્યે અહૃતું;  
પહેલો આ અન્યય યોગને, સૂર્યે પ્રત્યે કહ્યો છે મેં. ૧  
સૂર્યે મનુને સંભળાવ્યો, મનુંએ રાય ઈક્ષવાકુને કહ્યો;  
ઈક્ષવાકુથી અંબરીશ નેહ, ત્રિભુવન જ્યે વધાર્યો તેદ. ૨  
અંબરીશ જ્ઞાન ભક્તિમાં રહ્યો, રાજ થડો જ્ઞાન યોગ પામ્યો;  
પરંપરા એ પામ્યો યોગ એહ, રાજ નઃપી તો જાણે તેદ. ૩  
૫મે ભક્તો મહારો તું નિજદાસ, તુજુને સંભળાવ્યો યોગાભ્યાસ;  
ભારત તે ને યોગાભ્યાસ, મહાકાળો તે પામ્યો નારા. ૪  
આ તે જુનો યોગ અભ્યાસ, દ્વદં તુંને કહ્યો પ્રકાશ;  
અકત ને વળી સખા છે તું, ઉત્તમ રહસ્ય તે માટે કહું. ૫

### ॥ અર્થુન ઉવાચ ॥

અર્થુન કહે સ્વામી વિનતિ, સુરજ તથી તો છે અધ્રોત્પચિ;  
જન્મ તમારો તો દમણું યયો, તો સૂર્યને ક્ષારે શા પેહે કહ્યો. ૬  
તો તે કહો તેમ જાહું અમો, સૂર્ય પ્રત્યે કહ્યો છે તમો;

### ॥ શ્રી ભગવાનુવાચ ॥

કષ્ણુ કહે હું હું હું કહું કથી, મહારા જન્મતી ગણુના નથી. ૭

જન્મ કર્મ દ્વિત્ય ભમ એહ, તરત્તરાને જાણે જેહ;  
 હરી જન્મ જે ન ધરે હેહ, અર્જુન સુજને પામે તેહ ૧૬  
 મોહ મતસર હુર્યાણુને તજે, સદા મહારા થઈ સુજને યજે;  
 રાગ દૈપ અય કોધને તજી, સુજ અય થઈ રહી સુજને બજી. ૧૭  
 મોક્ષ પદારથ તે પામરો, રાગ દૈપ જ્યારે વામરો;  
 તેને મુક્તિ નથી વેગળી, જડેની મનસા સુજમાં ભગળી. ૧૮  
 જાને તેપે પવિત્ર ને લવા, મજ્યા બઢુ મદારા ભાવમાં;  
 ને જેહની જુદ્ધિમાં ભગે, તેને તેની સિદ્ધિ ભગે. ૧૯  
 મૂર્તી ને પામે ને ભને, કું પણુ તેમ ભજું તેમને;  
 પાર્ય આ સર્વે માનની, રહે માણારા મારગ અતુભવી. ૨૦  
 કર્મ તણું ઇણને અનેવ, આજે લોક યજે તે હેવ;  
 તે ભાણુસને ઉતાવળી, સિદ્ધિ કર્મની હેણે વળી. ૨૧  
 મેં ગુણુ કર્મ વિભાગે એહ, ચ્યાર વણું સરળત્યા જેહ;  
 તેદનો કર્તી છું તો જદી, અન્યય જાણું અકર્તી સદા. ૨૨  
 અર્જુન એ ભતે જાણેં સહી, મુને કર્મનો લેપજ નહિ;  
 કર્મના ક્ષેપે મુને કાંય, ઇલની ધર્મા નહીં મન માંય. ૨૩  
 સુજને એહેવો જાણે જેહ, કર્મ નેવ્ય અંધાયે તેહ;  
 પૂર્વે જાની હવા નર જેહ, કર્મ કરતાં અવ દૂટ્યા તેહ. ૨૪  
 આગળ જનકાદિક ને તર્યાં, મુક્તિ હેત એમ કર્મ આચર્યાં;  
 અહેની જુદ્ધ ને જાણુંશે, કર્મ મુક્ત મદાસુખ માણશે. ૨૫

जन्म अतीत था अति धर्षा, झड़ारा ने अर्जुन तुं नथा;

श्रीमद्भागवते—

॥ अयताराद्युपसंख्यात् हरे मन्त्रनिधेदिजाः ॥

॥ अन्ये चांशकलाः पुंसो शूणास्तु भगवान् स्वयम् ॥

शुं शुं वरणुं कथी ते गति, मुज्ज्यी अल्पानी उत्पत्ति. ८

झड़ारी भाषानो नहि पार, निर्माधुकि झड़ारा अवतार; ते कर्वे तुं जाखुं सही नान तेदतुं तुज्जने नहि. ९

अधर्म वृद्धि ज्यारे ज्यारे थाय, वेद धर्म ज्यारे कोपाय; धर्म ज्ञानीनो ढोय प्रसंग त्यारे प्रगटवा मुने उभंग. १०

अज ने आत्मा, अन्यथ दुं, प्राणी भावनो उच्चर छुं; तोडे रहुं प्रदृति आश्रयो जन्मूं आत्मा भाषा थथी. ११

आरत ने क्ले काणे धर्म, ज्ञानि ढोय ने थाय अधर्म; दुं तो सरणुं ते ते काण, धर्म तष्टु। करवा प्रतिपाण. १२

झड़ारा बक्त दुःखी जन थाय, तेतुं उष्ट न मुज्ज्यी रहेवाए; साहु तष्टी गक्षाने काज, अने पातीकनो दण्डुना साज. १३

दुष्टति हेष्टी लागे मुने दाज, अभदुं तेनो रहवा त्याज; अर्जुन ऐसुं शान विचार, दुं छुं कर्म रहीत निरधार. १४

दुःखतिनो उद्वाने नाश, दुं आत्मा इसे कहुं छुं प्रकाश; धर्म स्थापवाने त्यां दुं, युग युग विषे अर्जुनुं छुं. १५

જન્મ કર્મ દ્વિપ ભમ એદ, તરત્વનાને જણે જેદ,  
 દરી જન્મ તે ન ધરે દેદ, અર્જુન સુજને પામે તેદ ૧૬  
 મોહ ભત્સર હુર્ગણુને તજે, સત્તા મહારો થા સુજને યને,  
 ગગ દ્વૈપ અપ હોધને તળ, સુજ ભય થતુ રહી સુજને બજુ ૧૭  
 મોક્ષ પારથ તે પામગે, રાગ દ્વૈપ જ્ઞારે વામગે  
 તેને મુક્તિ નથી વેગળી, જડેતી ભત્સા સુજમા ભગી ૧૮  
 જાને તપે પરિન ને લના, મત્યા બહુ મંડાગ ભાવમા,  
 ને નેદવી બુદ્ધિમા ભગે, રહેને રહેવી સિદ્ધ ભગી ૧૯  
 ભૂતે જે પામે ને ભને, હુ પણ તેમ ભજુ તેમને,  
 પાર્ય આ સર્વે માનવી રહે માડારો મારગ અનુભવી. ૨૦  
 કર્મ તથ્યા કળને અનેર, આજે લોક ધને તે દેન,  
 તે માણુસને ઉતારળી, સિદ્ધ કર્મની હોયે વગી ૨૧  
 મે શુણુ કર્મ નિભાગે એદ, વ્યાર વણ્ણ સરમાડા નેદ,  
 તેદનો કર્ત્તી ધુ તો જદા, અ પય જણું અકર્તી સદા ૨૨  
 અર્જુન એ મતે જણેલ સવી, સુને કર્મનો લેપન નદિ,  
 કર્મના વેપે સુને ઠપ, ઇનની છંગળ નહી અન માપ ૨૩  
 સુજને એરેવો જણે જેદ, કર્મ ના સંધારે તેદ  
 પૂર્વે જાતી હના નર જેદ, કર્મ કરતા ભર ઘૃટયા તેદ ૨૪  
 આગામ જનકાદિક ને તથી, સુભિત હેત એમ કર્મ આચયો,  
 અહેવી બુદ્ધ ને જણુંગે, કર્મ સુક્ત મદાસુખ માણુંગે. ૨૫

તુ પણ કર્મ કર્મ તો તેહદુ, યુગાતરે પૂર્વ જામ હતુ

## ॥ અજ્ઞુન ઉવાચ ॥

અજ્ઞુન કહે સ્વામી વિનતિ, કર્મ અકર્મ તથી કોણુ ગતિ ૨૬

## ॥ ઓ અગલાનુવાચ ॥

હે અજ્ઞુન એતુ તુ વિચાર, કર્મ અકર્મ વિકર્મ હૃપાર,  
કર્મ અકર્મના બેદ અનેદ કનિ ન પ્રીઠ્યા તેદ વિકેક ૨૭

હુજને તે કર્મ કલીશ, તેથી અન બધન છુફીશ,  
કર્મમા નિષ્કર્મ હેણે કેદ, અકર્મ લક્ષણ કણીયે તેદ ૨૮

શાલ વિહિત કસુ કિયુ કર્મ, નિષ્ઠિક કિયુ કર્મ અધર્મ,  
અને અકર્મ કહે શુ તે જાણુ, કર્મ ગહનગતિ નાદ પ્રમાણ,  
કર્મ વિ હેણે અગ્રમ, અકર્મ ભાડે હેણે કર્મ ૨૯

વળી કર્મમા કર્મ લેપાય, વિકર્મ કર્મ તે તો કહેવાય  
ખુલ્લિવાન ન કણીયે સોય, યોગી સર્વ કર્મ કર હોય ૩૦

સર્વ આરભ કામના જેદ, અને સક્રિય વર્તત હોય ટેદ  
શાનાનિયે કર્મ ને દહે, વિશુદ્ધ તેને પદિત કહે ૩૧

ત્યને કર્મ ફલ ઈચ્છા હોય, નિત્યે તૃપ્તિ નિરાશ્રયી હોય,  
અને આગરે જો તે કર્મ, કરતો થકો તેદ નિષ્કર્મ. ૩૨

નિરારી ચિત્ત આત્માશ્રતા, શ્રહેવા તથી તને વારતા,  
હેવળ દેદ તથા સુખ સને, તેને પાય ન લાગે રજે ૩૩

વણુ માગે પામે સુખ પ્રીત, દંદભાવને કોપ રહીત;  
 સિદ્ધિ અસિદ્ધિમાં સરળું મન, તે કન્નાને નુહિ બંધન. ૩૪  
 સંભ રહીત સુખ દુઃખ સમાન, એમ હોપ નો ચિત્તમાં જાન;  
 પજુ અથે લે કર્મ આચરે, તોડે સક્રિ કર્મ પરલેર. ૩૫  
 દાન પુષ્પય ઈત્યાદિક જેદ, નિષ્કર્મ કદીયે અલાવેત્તા તેઢ;  
 અલિ ખુદ્ધિ અનુભવ જેદ, એ અલ લક્ષ્ય તેડ. ૩૬  
 કર્તા અલાર્પણુ યજુ, જાણુ અલ દવી ને યજુ;  
 કર્તા કર્મ કિયા સાદિત્પ, અલરૂપ, અલાર્પિન રીત્ય; ૩૭  
 ધરતો ધ્યાં અલકર્મને, એવો ડો પામે અલને.  
 અલ મય યદુ અલરૂપ સાજ કર્તા દાતા બોક્તા નગરાજ. ૩૮  
 ગૃહને વિષે રહી નર જેદ, યથા લાભ સંતોષી તેઢ;  
 દુષ્ટ સંગથી અગ્રગો થાય, કામ કોધથી નવ્ય કેપાય. ૩૯  
 તે તો શુદ્ધ જાની કહેવાય, મન ખુદ્ધિ જહેને વચા થાય;  
 કર્મ દ્વા યોગ્ય છંછે જેદ, યજુને પજે દેવતે તેડ. ૪૦  
 જાની અલ રૂપ અભિનને, યજે કરી હોમે યજુને;  
 શ્રોત્રાદિ જાન ધારિ કોય, તે અભિનમાં હોમે સોય. ૪૧  
 કોએક શબ્દાદિકને વળી, હોમે જાન ધંગ્રીમાં વળી;  
 કો યોગી કર્મો સૌ જેદ, અવણાદિક પ્રાણ્યામે તેઢ. ૪૨  
 નિયમ ચોગ જાનાભિમાં, હેને હોમે તે યજુમાં;  
 વળી કો દ્વા યજુને કરે, કો એક તપ કો યોગજ ધરે. ૪૩

शे अाध्याय ४७ को शान, कड्यु तत्ता को नेम निधान  
 कोर्ट अपानमा होमे प्राणु को होमे प्राणुमा अपान ४४  
 प्राणु अपान गति सुधी कीय प्राणुयाममा तत्पर होय  
 शे रहे नियमे, अहार प्रभाणु, प्राणु विरो तो होमे प्राणु ४५  
 यह वेद ए सर्वे सही, रक्तना पाप पजे गया दही,  
 उक्ते यजे शेषाम्यत जेह, अल सनानन पामे तेह ४६  
 यह रहीतने नहि आ कोइ, तो कोइर क्याथी पर लोइ,  
 शुद्ध द ये यह अहिसक होय, अज्ञापित भतिथी सौ जोय ४७  
 अलभय दन्तथी करे, अलार्पणु भतिए आदरे,  
 यह तथा एम धण्डा प्रकार, वेद विरो छे विस्तार ४८  
 मत किया शुभ हेशने काण, सग पान शुद्ध तो नहि आण,  
 स्तरापराधादि जागती, अल व्यतिरिक्त भति जागती ४९  
 नाम समीरन श्रीते करी, यह पूर्णता विधि विस्तरी,  
 कर्म यक्षी उपन्या ने जाणे, भोक्ता प्राप्ती जाणे निराणे ५०  
 अहता भमता गर्द न राखे, अलार्पणु करवानु भाखे,  
 दव्य यस्थी त्या श्रेष्ठा, शान यह परतप सदा ५१  
 पारथ सर्व कर्म ते जेह, शान विरो लय पामे तेह,  
 ते तो शानी अति प्राणु पते पूछे ने सेचानी जते पर  
 शानी तत्पर्शी उपहेश, तुजने करशे तर पामेश,  
 पाइन एमज शाने करी, तुजने भोड नही व्यापे करी ५३

वेणु देखीश सर्वे हैं, आत्मा मांडे मुने तुं ल्लेष;  
 जो तुं सर्व पापयी धण्डे, छो ते करता पापक तण्डे. ५४  
 शानउपी ऐ नावे करी, उतरीश पातिक परहरी;  
 अग्नुन प्रत्ये कुंड भगवान, तने कल्पु में तत्त्वज्ञान. ५५  
 पावक पवननो ग्रेहो वले, असंभ्य जंतु तेमां ग्रन्थे,  
 अग्नुन ऐ दृष्टांत क्षेत्राय, पावक पापे नदि देखाय. ५६  
 कोटी योजन खणे नव अँड, पाप न वेपे त्वेने पिंड;  
 सर्व अक्षणु करे दुताशन, तदपि पाप के नदि भक्तीन ५७  
 अग्नुन दीप्त अग्नि तो जेम, करे भरम काष्ठने तेम;  
 शान उपी ऐ अग्निरे सेम, सर्व कर्म भरम भय हाय. ५८  
 आ क्षेत्रमां छे जे जान, पवित्र नथी कांध तेद समान;  
 तो योगे सिद्ध थये थडे, जाणु सज्जान आत्मा विषे ५९  
 अद्वुं जान विचारे भन, त्वेने न क्षेपे पाप अग्नुन;  
 जान लक्षण वहि छे लेद, काम क्षेधादि बागे तेद. ६०  
 जान सरभु कांध पावन नथी, वात ऐ वेद पुण्डे उथी;  
 अतेंद्रीय वगी जानमां ध्यान, अद्धाए ते पामे जान. ६१  
 जान पामतां थोडे दीन, परम सुख पामे ते नन्न  
 नदि अध्या नदि जान प्रकाश, सहेदे ले पामे नाथ. ६२  
 संयामतकने सुख, नदीं शोक, अने नदि आ लोक परवोक,  
 जान तण्डे अद्वित भद्रमाप, औरे लोक जेणे वग ध्याय. ६३

आत्मा विषे परमात्मा रेखे, अदा भूर्कि नेत्रे चेपे,  
 ज्ञान दीपक ज्ञेया चार, ज्ञाने तम भाजे निरधार. ६४

हु अनुरुन कहुं हृषि विचार, अज्ञाने उपरे अदंकार;  
 अद कारे भोद मन ते भेत्तिये, ज्ञान भडगे ते छहिये. ६५

योगाभ्यासथी तज्ज्यां कर्म, ज्ञाने छेदो संहेद ५र्म;  
 योग ज्ञानथी भागे कर्म, सशय हुटे भागे भर्म. ६६

योग युक्तथी कर्म विचार, कर्म अकर्म तथे अतिलार,  
 अनुरुन आत्मज्ञान नेहने, नदि कर्म अधन तेहने. ६७

ते भाटे ने आ सहेद, अज्ञाने दैवाभा नेद;  
 छेद ज्ञान भडग अही भूत्य, योग विषे रहे भारथ उत्थ. ६८

जास ह्याने शुद्धि छे नहेवी, अनना आ अध्याये छे त्वेवी;  
 योग शाखने अल विद्याय, कर्म योग चोयो अ।. ६९

इति श्रीमद् भगवद्गीतायां सूपनिपत्सु ब्रह्म विद्यायां  
 योग शाखे श्री कृष्णार्जुन संवादे कर्म मन्त्यास  
 योगो नाम चतुर्थियाय ॥ ४ ॥



## ભગવદ્ગુરીતા અદેશાય-૫

### ॥ અર્જુન ઉવાય ॥

કર્મ તથું ત્યાગને વહોં, અને કરી યોગ ને ખહોં;  
તે બેમાં શ્રેષ્ઠકારી જેદ, નિશ્ચે કહો કૃપણું તેદ. ૧

### ॥ શ્રી ભગવાનુવાય ॥

કર્મ યોગ ને ત્યાગ વિચાર, તે બેદું એ કલ્યાણ પ્રેકાર;  
તે માંહે કર્મના ત્યાગ થે, કર્મ યોગ તે ઉત્તમ થડે. ૨

અર્જુન કર્મ તથેં ને નાશ, વળો યોગ ક્ષમા અભ્યાસ;  
ખંને માર્ગ સરખા કરી જાણુ, અહિનુભવી પદ હોય નિરીણુ. ૩

તે સાંન્યાસી જાણો નિત્ય, આર્કિકા ને દૈપ રહિત;  
કાનો દૈપ ધ્રિંગી નાં કરે, અદૈત બુદ્ધિએ આયરે. ૪

દાદ વિના તે સુષે થડો, ભદ્રાભાંડો છૂટે ખંધ થો;  
હે અર્જુન તે ભક્તા નિદાન, જેણે જાપ્યું તત્ત્વજ્ઞાન. ૫

સાંખ્ય યોગ ને જુણુઅા ખદે, આત બુદ્ધિ પર્દીત નવ્ય વહે;  
બેમાં વિદે કરે એક જેદ, બેના ઇલને પામે તેદ. ૬

સાંખ્યે પ્રાપ્તી રથક હોય જેદ, યોગે પણ પામીએ તેદ;  
એક દિન એ બેમાં હોય, પર અહને હેણે સોય. ૭

એમ યોગ તિના સત્યાસ, ભાગું નહિ પામતા આરા,  
 કર્મ યુક્ત કુનિ જ હોય, રિપ કલ તા પામે માય ૮  
 યોગ યુક્ત ને શુદ્ધ આરાના, દોયે રત રતી અતાતમા,  
 સર્વાત્મા આય નમ ધરે, નન્ય સેપાય પાય લે કરે ર ૯  
 કર્મ કુનિ ને જાણી હોય, કર્તા હું નન્ય જાણું મોષ,  
 રેખે ચુંચું ને અપર્ય અનિ ન ચાલે એમે ભૂણો કરે શાસ અસત ૧૦  
 જોતા આજગતાં તે સહી, શુદ્ધ જેતા જમતા સહી,  
 મુત્તો બેદે ને ચાનતો, શાસ જેતા ભક્તો ને નિઃઅતો ૧૧  
 મનમા સાર અસારજ ભહી, હું કર્તા એમ જાણું નહિ,  
 અદંતા મમતાનો નહિ દેશ, તેને કરા ના અભિ નિવેદ ૧૨  
 ચનણુ વનણુ જે કાંઈ વિચાર, તે ઘર્દીયોનો વર્તો વેડેનાર,  
 હું કર્તા એમ જાણું નહી, અદેત અજ નિરતર ભહી ૧૩  
 અનુર્ધુન તે યોગી એમ જણુ, અત્યપદ પામે તે નિરીણ,  
 પવે વસિષ્ઠાદિક ઋપ્ય જોહ, વેદ વિદિત રમને કરતા તેદ, ૧૪  
 જાન દ્રષ્ટિ આભ્યતર ભર્મ, વેદ વિદિત તે કરતા કર્મ,  
 ચિત્ર ઘણુ કેમ પદમા હોય, તેમ અતરાત્મા હેણે મોય, ૧૫  
 ધણું ચિત્ર પણ પડ તો એદ, જાણી જન ઉદ એજ વિવેક;  
 આત્માભુત જેચા નાપી જોહ, શરણુ અત્યપદ પાભ્યા તેદ ૧૬  
 શ્રીમહુ ભાગ્યતમા એમ ગાય,  
 તજે ભગ મૂર જોને ને અહે, નિઃકામ રનેહ સમનહિ કોથાય;  
 મેળોન્મેર પણ કરતો રહે. ૧૭

ન છે એમ પદ્ધોનો ભાગ, એ પોતા તણોં અભાગ,  
 કર્મ આગે અલ મેળાગ, ઇથા સહૃત ન કાઢ લગાગ ૧૮  
 એમ કરે ત નાય વેપાન, યથા કમન પત્ર જળ માલ,  
 નરન જળમાંકે કમન ઉંઘ, ત્યબ જાનીતે ર્મ નિગાર ૧૯  
 રેને આરાગમનની ક્રમણુંનિ, જે ર્મ કલને અપો સહી,  
 મન ખુલ્લ રાયા એ ડરી, કેંગ ચદ્રિયે પરંરી ૨૦  
 આત્મા તણી શુદ્ધતા ભજ, કરે ર્મ ઇણ ધંગ તજ,  
 નિષ્ઠામ ને કર્મ યુદ્ધા, નને તજે તે પામે મૂઢા ૨૧  
 કાનીને આસકા મનમાલા, અદિરૂખી કર્મ અધાર,  
 યોગેશ્વર મહત હે જેદ, કામના કર્મ દરે તે તેદ ૨૨  
 તે આત્માની શુદ્ધિને કાજ, કરે તદ્પિ પણ ઇનો ત્યાગ,  
 અજ્ઞુંન જે રહીએ મદાનત, તદ્પિ મોદ છાડે લહી ભાત ૨૩  
 મનથી કર્મ કરે સહૂ ત્યાગ, મન નશથી મનમા અનુગાગ  
 નગર દાર નવનામા ગહી, તે કાઢ કરે કરવે નહી રાજ ૨૪  
 એમ ન જાણે પ્રભુ લગાગ, તુ કર્તાં ડ સર્જનદાગ,  
 કર્મ તદ્પ ઇણ તેદને નકિ, વર્તો તેદેની માધ્યા સહી ૨૫  
 ડાકોનુ પૂન્યને ડારોનુ પાપ, અહે ન તે ત્યા ધશ્વર આપ,  
 મોદ અજાને ઢાંધુ રાન, જ્યસ ચાંગ ઢાક્યો ભાણુ ૨૬  
 અજાને ને જુન ધર્મિયુ, તેણે સર્વ મુજાહિ રણુ,  
 જાનેથી જેદનુ અજાન, નારી થયુ ડોપ રૈનુ જાન ૨૭

अहित्यनी ऐते त्वा धर्षु, प्रकाग याये तेहज तथु  
 शुद्धिने आत्माने शु धरे, तात्पर्य तेहने आरारे २८  
 शाने पातिक बोया होय, पुनर्जिति न पामे सोय,  
 विनय च प्राज्ञसु विज्ञान, तथा गायने इनित श्वान २९  
 अने चाणान होय ने डोय, पडित ते समदण्डे ज्वेय,  
 समदण्डि ए अवतार, अडी बोय श्रीत्यो संसार ३०  
 निर्देषने सम ते अह, अहाभाव ए पाम्यो त्यंभ,  
 गमतु पामे नही काई सुधी, अशुगमतु पामे नही दुधी. ३१  
 मोह रहीत शुधि दृ होय, अहाभाव अहमा रहे सोय,

## ॥ वह्निदि वह्निव भयती तिश्रुते ॥

आख छद्रीना लोगज विं, नहि आसकत सुख आत्मा थके ३२  
 आख योग मृक्त आत्मा होय, अक्ष शुभने पामे सोय,  
 र्पय छद्रीना ने ने लोग, ते तो उत्पत्ति दुख संयोग. ३३  
 डती शुत तेहने आघात, पडीत ते भाडे न अमत  
 शरीर मूळवा येहेतु कीय, कास झोख जनीत वेग होय ३४  
 तेहने सहेता सर्व ममर्य नेह, योगी तेह शुधी नर तेह  
 अतंरात्मानु सुख नेहने, ते शु न्हो हेहे तेहने ३५  
 योगी अह ३५ ने देह, अह भाडे लय पामे तेह,  
 क्षीण्य पाप ने सहुता हितु, दृ रहीत ते आत्माङ्ग हु. ३६

सम दर्शी कृषि लेहे नेहु, अल विंगे लय पामे तेल;  
क्षेत्रे यतिए उत्तुं चित्त, काम क्षेत्री लेख विरक्त. ३७

आत्म वित मुझे ज्ञाते, लय पाम्या छे अहाज विपे;  
आब करे इंद्रिने विंगे, आणु असु भमे ने विंगे. ३८

प्राण अपानने करे समान, चाले नासिंडा भधे धान;  
ज्ञाते इंद्री ने भन घुळ, अदेवो मुनि भोक्त फर शुध. ३९

तजे क्षेत्र इच्छा ने भय, ऐटवो नेहु सदा गूढत छेप;  
सक्त लोङ्नो धर्म तथा, तपने यज्ञ तयो बोक्ता. ४०

अंतर्दमि सदुभां लडे, मुज्जने ते भोक्त फर अडे;  
भति ध्याने दीधी नडेवी, रथना धी अनुसारे तडेवी. ४१

योग शास्त्र ने अल विद्याय, कर्म नाश पंचम अध्याय. ४२

इति श्रीमद् भगवद्गीता सुपनिषत्सु व्रद्ध विद्यायां  
योग शास्त्रे श्री कृष्णर्जुन मंवादे संन्यास योगो नाम  
पंचमोद्याय ॥ ६ ॥



## અગવદગીતા અધ્યાય-૬

### ॥ શ્રી અગનાતુતાચ ॥

કે કો કર્મ રહને ન આશ્રયે, કરવા યોગ્ય કર્મ તે કરે;  
 અર્થાત્ વેદ વિહિત ને કર્મ, વાદ કરે ને લોપે ધર્મ. ૧  
 નહીં સંન્યાસી નહીં તે પતિ, નહિ દોષ તહેની ઉત્તમ ગતિ;  
 તે સંન્યાસી યોગી ખુક્ત, નહિ નિરભિન્ને કિયા વિસુઃક્ત. ૨  
 પંડિત વહેને કહે સંન્યાસ, પાંડવ તેજા યોગાભ્યાસ;  
 ત્યજયા નહીં જેણે સંકટ, યોગાભ્યાસી નદિ જુહી અદ્ય. ૩  
 યોગ પામવા છચ્છે ભર્મ, વેદ અંગ તે કારણુ કર્મ;  
 યોગથી મોહને છચ્છે જેઠ, ક્ષમા અદ્ય લે કારણુ તેદ. ૪  
 એવો જ્ઞાની તે સંન્યાસ, છદ્રિશ્ચત સંસારે ઉદાસ;  
 તહેને શનુ મિત્ર સમાન, સુવર્ણ કાષણ ને લોદ પાપાણુ. ૫  
 એવા યોગી હેણે જેઠ, પાપ પુન્યથી અળગા તેદ;  
 પવિત્ર પણે આસન દદ કરે, સભ્ય અસભ્ય દ્રષ્ટ નથ્ય કરે. ૬  
 યોગ વિષે હોયે મન જેદનું, કર્મ નિપ્કામ કારણુ તેદનું;  
 યોગ તણે ભારગ વે અદે, કારણુ તેજ ધંદ્રી વરા કરે. ૭  
 ધંદ્રીનાં શામદાદિક કર્મ, નોહે આસક્ત તેદની ધર્મ;  
 સર્વ સંકલ્પથી ત્યાગી રહે, તેદને યોગારૂદજ કહે. ૮

આતમાએ આત્મા તારવો, આત્મા ઉંઘો ન વિચારવો;  
આત્મા અંધુ આત્મા તારો, તેમ વેરી આત્મા આપણો. ૮

આત્માએ આત્મા વર હોય, આત્મ આત્મનો અંધુ મોય;  
આત્માને આત્મા અગાન, કરે શકુનટ શકુ સમાન. ૯૦

ઈતાત્મા ને ગુણુ હોય થાંત,  
માન અપમાંત સમ જાણ્યાં જેણ્યાં, ગીત ઉપશુ સુખ હુઃખની આંત;  
સંભાળ્યો પરમાત્મા તેંબુ. ૧૧

જાને ને વિજાને નુભિ,  
મૃત્યિંડે કાંચન પાણાંશુ,  
કોદને સમ તે યોગી ગાંધુ. ૧૨

સમ લોટા સમ કાંચન થાય,  
યોગેશ્વરે ડહી યોગી રીત,  
શુદ્ધ, યોગી તે કદેવાય; ચૈણી પ્રીતે ધરણે નિત. ૧૩

દિતકારને શનુ ભિન,  
સાંધુ પતીન સમતોલે ગણ્યે  
મધ્યવર્તી અંધુ નાદિત  
શ્રેષ્ઠ સર્વયા તેવે નાંદે. ૧૪

યોગી એકારો સ્થિતિ કરે,  
એકાધી ધત વિતાત્મા આત્માએ આત્માનું દિરે;  
આરા પરિગ્રદ નહિ મજમાં. ૧૫

આત્માનું રથાનક સ્થિત કરે,  
અતિ ઉંચું નીચું નન્ય હોય,  
પવિત્ર રથાનક તેદને ધરે;  
કુશ મૃગ છાદા વલે સોય. ૧૬

એકાઅ મિતે તે ચિંતા,  
એમ થડો આસન ત્યાંડાં કરે,  
મન વરને ધાન્ધિને વિંદિ;  
આત્મ શુદ્ધ ને યોગ આદરે. ૧૭

કાપા શિર અર્થા સમધરે,  
રાણે દ્રષ્ટિ નાસાની અદ,  
અને સ્થિત અચ્યત મન કરે;  
નન્ય અવિલોકે દિશા સમય. ૧૮

शात्तात्मा ने निर्भय थह, अल्पर्याँ पृतने अको  
 चयन भन चिथर निर्वयन करी, हुँय प्रकाशनी मादे दरि १६  
 ज्ञान द्रष्टे अनिरोडे ज्ञेद, खलभूत नर जाहीये तेद  
 भन वश चित्तमा सुजने धरे, भता पर योग साधना करे. २०  
 योगाभ्यासी उधी भन, ज्ञेडे आत्माने आत्मन,  
 तदा परम सुख मादारे ज्ञेद, तेद समे ते पामे तेद २१  
 अतिरो असन करे ने ओय, काध न खाय दो ऐदो देय,  
 अति जगेने अतिरो सोय, योग न पामे ते तो डेय. २२  
 अति आहार निशा ज्ञेहने,  
 अद्य आहार लघु निशा ज्ञेह, धाने धीगज नव्य गहे तेहने,  
 आहार विहार युक्त ने छोन, आसन धान सुक्त गहे तेह २३  
 युक्त उपचे जगत तथे,  
 आहार विहार युक्त ने छोन, युक्त कर्मनी चेष्टा सोय,  
 युक्त उपचे जगत तथे, योगाभ्यास दूष द्वेनु फथे २४  
 त्यारे चित्त नियमभा अडे,  
 एवा ज्ञानी छोय नर ज्ञेद, अने ते चित्त आत्मामा गडे,  
 एवा ज्ञानी छोय नर ज्ञेद, भोक्ष भाग्ने पामे तेह २५  
 सौ अभिभावे नि रम्ही छोय,  
 काध उच्ची भनभा न य करे, योगाभ्यासी कर्दीये सोय,  
 काध उच्ची भनभा न य करे, जाने शुद्ध उर्म आयरे २६  
 ज्ञेम दीप्तनी चाने आत,  
 योगाभ्यासीतु चित्त नेभभा, तेम ते शरीर तथी त्या धात,  
 योगाभ्यासे इधु चित्त, योगी ते संयोगे आत्मा २७  
 चेजे आत्मा आत्मा भाव,  
 योगाभ्यासे इधु चित्त, पामे परमात्मा शु निवत  
 सते सी योगी ० केहेनाच २८

એમ અતિ સુખ ને ખુદિઓ જરૂરે, નિશ્ચકે છાંદ્રિ, ના વશ પડે;  
 તે યોગ તર્ફે સાધતે, ચળે નહીં તે આરાધતે. ૨૮

આત્મ જ્ઞાન સુખ પામી નેહ, તેથી અધીક ન જાણે તેહ;  
 એહવા સુખની મધ્યે રહી માદા દુઃખે ચળે તે નહીં. ૨૯

એહવે નામે યે એ યોગ, દાણે દુઃખ તણે સંલેગ;  
 તે યોગ ચૈરાય ચિત્ત ધરી, અભ્યાસવો નિશ્ચે કરી. ૩૧

સંકદ્યે ઉત્પત્ત થયા નેહ, સર્વ અભિજ્ઞાન તજે તો તેદ;  
 સકલ સમોદ્દ ને છાંદ્રિ તણ્ણા, મને શું નાખે મનમાં. ૩૨

એહવી ખુદ્ધે ને ધીર્ય અદ્દે, નિવત્તે તણે શને: શને:  
 મન તે આત્માને વશ કરે, બીજું કાંઈ મનમાં નવ્ય ધરે. ૩૩

મન આત્મા વશ અહેવો સહી, તે તો કાંઈ ચિત્તવે નહીં;  
 મન ચંચળ છે માટે વળી, બ્યાંદાં ત્યાંદાંથી જાય છે તે ચળી. ૩૪

ચંચળ ને અસ્થિર મન નેહ, ચળે યે એ નિષ્પયે તેહ;  
 નિષ્પમે રાખે ત્યાંદાં ત્યાંદાં યકો, રાખે વશ આત્મા વિને. ૩૫

ત્યાંદાં મન ખુદ્ધિ આકર્ષણું કરી,  
 પક્ષી મુને સધળે હેખશે, દર્દિ અર્થન કરૂતી રેહેશે હરી.

સૌના આત્મા જણે સમાન,  
 ચંચલ મન સાચવવું અદી, સર્વત્ર મુને વ્યાપક પેખશે. ૩૬

શુદ્ધ અલાનું થાતાં જ્ઞાન,  
 તે માટે મન જતે નેહ, અનેદ ખુદ્ધિનું રહે ભાન;

ચંચલ મન સાચવવું અદી,  
 તે મન જતે હરી પામીએ સહી. ૩૭

નહિ લેશ રહે કો અજ્ઞાત;  
 મન જતે હરિ પામે તેહ. ૩૮

મન થકી મન તેથો યેખગે હુંય કુમળમા પ્રચુ પેખગે  
એમ કરતા રહે ગુણ સમે, રોય મન શાત પાતિન નિર્ગમે ૩૬  
એમ યોગે પરન થયો ને, અલ હૃપ કુખ પામે તેદ,  
યોગીના પાતિક વરન ટળો, આપ થકી આત્માને ભગે ૪૦  
જુઘે અલ અર્પણ થયો જેદ, અતિશો કુખને પામે તેદ,  
ફેંસ સર્વને ચેલા માલિ, ચોતે સર્વ પ્રાણીમા થાય ૪૧  
ને યોગે યુક્ત આત્મા ડોય, સમાન દ્વારા જેયે ઓય,  
મુજને સધગે હેંસ કેદ, ન રિ નિસ સર્વ લ્યમ તેદ ૪૨  
તેનો થાના દેઉ નહિ નાશ, મદારિા તે નાય થાન નિનાશ  
સર્વ ભૂતમા હું રહું જેદ, એમ જાણે એ તત્ત્વે તેદ ૪૩  
ભગે ને રિચિન કર્મ જે થાય, તોપણુ તે જોગી હું માલિ,  
પોતાનો આત્મા લ્યમ હોય, સધગે હેંસ સર્વાં ડોય ૪૪  
જુખને હુખ સમ જાણે મન, યાગી પર્મ તે તો અજ્ઞુંન,

### ॥ અજ્ઞુંન ઉવાચ ॥

મહુસુરને ભીજને તમે, આ જે યોગ ર્યો અનુક્રમે ૪૫  
સ્વામી તમે સૌ સત્યજ કલ્યુ, પણ મન નિઅહ ક્ષેમતે નાકી રહ્યુ,  
ચચળ મન ત ક્ષેમ ઋતાય, તેનો ભાયો સરળ ઉપાય ૪૬  
પરન બધાયો તે ક્ષેમ રહ્યે, તે વિધિ જાણુનાને મન ચહે,  
ધન્નોને નિપયનું તાન, તે નિધર રહેક્ષેમગતિ ગળાન ૪૭

અદ્વિતીય નિયમ કેમ થાય, તે ઉપાય હોએ યુગાય  
 ચચળ નને ન હેઠું એદ, ઘરૂસાર એક વિધિ તેદ ૪૮  
 હે કૃષુ ચચળ મન જોએ, ક્રિયાનાન પ્રમાણી તો,  
 તે મન નાં કરાને હો, રીખુ નાયુ તરી ગતિ લું ૪૯

### ॥ શ્રી લગ્વાનુનાય ॥

મન ચચળ હુએ અડેસાન, સહેલ નહી અજૂન તે ભાલ,  
 અજૂન તુ કેદે છે તે સત્ય, મન તરણી છે ચચન ગત્ય ૫૦  
 કૃતિમુત મેગારી થધ, અજ્ઞાયે ગ્રદેશયે સહી,  
 નિયમ મારે કરાને અજ્ઞાન, પૈરાગ-યાગ-મહિં અડે ગારી ૫૧  
 નાને સહીનથી થાય પ્રકાશ, એમ કદે તે શ્રી અવિનાશ,  
 આત્મા નહી નભે જેદને, યોગ પ્રાપી હુએ તેદને ૫૨  
 જેદનો આત્મા નભે રોય, પામે યોગ ઉપાયે એથ  
 પૈગાયે કરી મન ગીતીયે, મન ગીતી યોગ કીજને ૫૩

### ॥ અજૂન ઉનાય ॥

શ્વામી હો સન્યાસી થાર, ગૃહી પણું તજુ વનમા શાય  
 તિન પૈગાર ન મનથી આર, તે નિયે ચળો ભાડાજ હોર ૫૪  
 યોગ માર્ગમા યત્ને પો, અધ્યાત્માન ઓ લો થગો,  
 યોગ થફી ચન્દ્રો એમ જાડ, હૃદ્દુ ડોણુ ગતિ પામે તેદ ૫૫  
 પડો લો ગે માર્ગથી ઝાય, શ હેઠે અમૃતત નારાજ રોચ  
 અલ્લ મારગમા ને સુજાય, નિગાથયાની ગતિ શી થાર ૫૬

થીકૃપણુ સકળ માદાગ સર્દેલ, યોઽય છેદવા છે। તમે તેથે;  
આને સર્દેલ ભાગે સોય, તમથી અવર ન પામુ કેય. ૫૭

## ॥ લગ્નવાતુવાચ ॥

પારથ તેહને તો આ લોક, અને વિનાશ નહિ પરલોક;  
કલ્યાણુનો। કર્તા ડેય તાત ન રહેની દુર્ગતિ હેય. ૫૮

ખરાદિક કર્તાનો। દામ, પામી બહુ દિન કરે વિરામ;  
પછી પવિત્ર મહા ભાગ્યેલ, યોગ ભષ્ટ અવતરે તેલ ૫૯

અથવા ખુદ્ધિવાન કુળ માલા, યોગીને કુળે ઉત્પત્તિ થાય;  
અતિ ફુર્કાંબ આ લોક મોઝાર, જન્મ પામવો ત્યાં નિર્ધાર. ૬૦

તે તો તે જન્મે ખુદ્ધિવાન, પૂર્વ જન્મતું રહે છે જાન;  
ત્યારે તે ક્રી કરે ઉપાય, કુરુજી સિદ્ધિ અર્થાને ધાય. ૬૧

પૂર્વ તણ્ણો અભ્યાસી જેહ, અવસ્થ પામે લેને તેલ;  
યોગ નાં જણે લો તે યદા, શાખ ઘસુ ઉલલથે તદા. ૬૨

યોગી ધતે કરે ઉપાય, તેલ તણ્ણાં પાતીક યોવાય;  
અનેક જન્મે સિદ્ધન્ય થઈ, પર્મ મોક્ષ તે પામે સહી. ૬૩

યોગી તપસી થાતાં અધીક, ગુણીયી પણુ માનો વધિક;  
કર્મ પણુ યોગીયી ધટે, અજ્ઞુન યોગી યા તે મારે. ૬૪

સધગામાં ને યોગ આયરે, અંતરાત્મા સુજગ્યું ધરે;  
જાજન કરે અદ્ધારે જેહ, માદારે શ્રેષ્ઠ માનવો તેહ ૬૫

अर्द्धनने कहे छ श्री दरि, लेगथी जडेनी भनसा इरी;  
 काम्य कर्मनो। कष्टो त्याग, ते पुण्ये पामे वैराग. ६६

को काणे तेने जान उपने, जान थकी ते भुजने भजे;  
 दुर्गति तेनी हुएन नहि, ते नेहे भद्रारी भक्ति लही. ६७

शुभिं ग्रेरक श्री मृधुरुज थया, दास हया पर कीधी भया;  
 गोग शास्त्र ने अहन विवाह, वेद कर्म छडी अध्याय ६८

आत्म संयमनी भाष्मी रीत, योगी जन ऐ शुं करे प्रीत;  
 यम नियमादि पाणे लेह, आत्म संयमने लेडेश तेह. ६९

इति श्रीमद्भगवद्गीता सुपनिषत्सु ब्रह्मविद्यायां योग  
 शास्त्रे श्री कृष्णार्जुन संवादे आत्म संयम योगो नाम  
 पठ्ठमो ध्यायः ॥ ६॥



## ભગવદ્ગીતા અધ્યાય-૭

### ॥ શ્રી ભગવાનુપાય ॥

હે અર્જુન તે છૃપન સુકૃત, સુજ વિષ મન રાખે આસકૃત; સુજ આસકૃત પારથ મન કરે, યોગ આચરે ભરુ આરારે. ૧

સમય જાંણે સુજને તેમ, સુષ્પૃય પ્રકૃતિ નિઝેં કરુ તેમ; હું, તુને વિજાને સહ લેછ, કદીશ રાંન સર્વે તો તેઢ. ૨

ને જાંનને જાંણે કરી, જાંખુબા યોગ્ય નહિં રહે કરી; ઉન્મનિ દર્શે યોગ અભ્યાસ, અહેવા હળવરમાં હોય નિજરાસ. ૩

એ વિ ॥ ભીજન એડા મળો, મદારી ગતિને તે નવ કળો; સહસ્ર માણુસમાં તો ડોય, સિદ્ધ અર્થનો આદક હોય. ૪

અહેવા સિદ્ધ અર્થી ને રહે, તહેમાં કો તરતે સુને લહે, પૃથ્વી જળ અભિને પવંન, આકાશને છુદ્ધિને મંત ૫

અવતી, ઉદ્દે, વહિ ને વાય, આકાશ મન છુદ્ધિ એકજ થાય; વળી અદ્દાર એમ કરી, આહ પ્રકૃતિ રુજાવી માલરી. ૬

અદ્દાર મળાયા તે જાણુ, અધ્ય પ્રકૃતિ છૃપ પ્રમાણુ; એ નિરૂપ પ્રકૃતિ ને કહી, તેથી અન્ય છૃપ તે સહી ૭

માદાખાડુ જાણ્ય તું તેદુ, ખરી રહે જગતને નેદુ;  
એ ગ્રહિતિ બેદે જગ ઉત્પત્તિ, તેમાં અધિકારી છે મન. ૮

સર્વ ભૂતની ઉત્પત્તિ નેદુ, તેદુ તણ્ણ રથાનક તે એદુ;  
એ સમય જગ મુજદ્ધી થાય, લય પામી મુજમાંહે સમાય. ૯

શિથિતિ ઉત્પત્તિ ને લયતણું, જગત સમયતું તે હું ભણું;  
સુણેના ધનંજ્ય હું થી પર, નથી કાંઈ તો ઉત્તમ નર. ૧૦

મુજદ્ધી જગ અણગું ન લગાર,  
જગત પ્રોયું છે મુજમાંલા, એક સુને લ્યમ પ્રોયો હાર;  
જગ ઇપી આ મણુઢાએ કરી,  
કુંતી ન જગમાં રસ નેદુ, ચંદ્ર સુર્યની આભા તેદુ. ૧૧

ઉદ્દક વિષેનો રસ છે નેદુ,  
પ્રાણ વિષે વને છું ઢાર,  
ચંદ્ર સુર્યની કાંતિ તેદુ;  
તે માંડે હું છું નિરધાર. ૧૨

પ્રશુદ્ધ સર્વ વેદમાં વ્યકૃત,  
અવની વિષે સુગંધ છે સહી, શાખદાકાશને હું નર સકત;  
અવની વિષે સુગંધ છે સહી, વહી તેજથી અળગો નહીં. ૧૩

પવિત્ર ગંધ ને પૃથ્વી ભાંલા,  
પ્રાણી ભાત્રમાં અવનપણું,  
તથા જ્યોતિ અભિનથી થાય;  
તે, હું, ને તપ તપસી તણ્ણ. ૧૪

તપસીનું તપ છે તે સત્ય,  
પાણ્ય સકળ ભૂતમાં નેદુ,  
સર્વ ભૂતમાં અભિજની ગત્ય;  
અજિવાનમાં અદ્વિ નેદુ, અજિવાનમાં અજ તે હું તેદુ. ૧૫

અજિવાનમાં અદ્વિ નેદુ, તેજસ્વીનું તેજ હું તેદુ;  
અજિવાનમાં અજ તે હું, રાગ હું વિના તે કદુ. ૧૬

કામ સર્વ ભૂતનો જેદ, ધર્મ વિરોધ રે નહિ તે  
પારથી પ્રશ્ન કરે વાગુ, તુભથી અગોનહિ નથી ૧૮  
ત્રિયુણુ પુરુષને આત્માકરી સહી, કર્મ કરાવુ અગો નહી  
સાત્ત્વિક રાજ્ય તામસ ભાવ, હથી જણે ને ત્રણુ અનામ ૧૯  
તે હભા, હં તેમા નહી, બગ્રતાંભ તે જણો સહી  
એણે નથુ ગુણે તો સહ, મિશ્રતાપુ મોચુ છે ખન ૨૦  
એથી પર અ યપ એમ કોય, મુજને તો નન્ય જણે સોય,  
ત્રિયુણાતીત મુજને જાણુશે, દુષ્પ સગથી અગો થશે ૨૧  
ગુણુભપ દૌરી ભાયા એડ, તર્યી કદણુ માદારી તેડ,  
પામે મુજને તો જે ડોય, તરે તે ભાયાને સોય ૨૨  
હુદ્ધતિ ને અધમ નર જેડ, કથમે ન પામે મુજને તેડ,  
ભાયા એ કોષાયે જાન, અસુર ભાવ પામે નિદાન, ૨૩  
ચતુર્વિધ ભક્ત છે જેડ, શદ્ધાયે આરાધે તેડ,  
પુણ્યાત્મા માદાર્દ અર્જુન, પ્રકાર ચ્યારથી કરે બજનંન ૨૪  
આરત, લગાસુ, અર્થાર્થી, જાનીને મુજ દર્શાય્થી,  
એડ પીડિત તે મુને સેરતો, ખીને મુને જાણુના ધર્મછતો ૨૫  
ત્રીજે કામના જુખ્યે ચદાય, ચોધો મુમુક્ષુ જાની કહેનાય,  
તે મધ્યે જાની ભક્ત એક, નિષ્કામે ભજન કરે તે નિરોપ ૨૬  
એ સર્વેમા જાની સાર, તે મુજને પામે નિર્ધાર,  
જાનીને હુ વધાલો અત્ય, મુજને પણ તે વ્ધાના સત્ય ૨૭

માનને અતો દર્શાએ કામ, તેના ૩૫ પણ તે હામ  
 અપ્રાત અપે મુને પીગણું, જન માડું સગુણું કરી જાણું ૨૬  
 મુજને સગુણું કરી ને જ્ઞાય, તે મુજા થળી મુખ્ય કહેવાય  
 ભૂત અવિષ્ય ને વત્તમાન, લિકુનઅગાધિત નિગમે ગાન ૨૭  
 વેદાદિકને પણ કુ અગમ્ય, ને તિ ની વીરમે તે ૦૫  
 નિગુણી જન્મ કર્મને જાણું, અગુણી અતુભૂત ના આણું ૨૮  
 કુ જાણું પણ તે ન ય લદે, મદિધી ભાગ લેમ પણનો વહે  
 એ સવે તો ઉત્તા પ્રમાણિ, જાની માદારો આત્મા જાણી ૨૯  
 જેનાચિતે કુ મુજ વગ નેટ, અતિ ઉત્તમ અતિ પામે તેદ  
 મુજ ભજન કરેથી પાતી-કુ ખ જાય, મુને નજતા મુજમાડે સમાય ૩૦  
 જાણી ક જન્મને અત, મુજને તે પામે સિદ્ધાત,  
 વાસુદેવ મય આ ભન, અહેવા મદારો આત્મા દુર્લભ ૩૧  
 જાન રહીત અભિનાયી નેદ, પામે અન્ય દેવને તેદ  
 તે તો તે તેનામા રહેદ, પ્રકૃતિ પૂર્વ અભ્યાસજ અડે ૩૨  
 ને કે ભન્ત ને કે દેસને, અધ્યા એ દર્શા સેવને  
 તે તેને તે દેવજ પ્રતે, કર કુ અધ્યા અવિચન અતે ૩૩  
 તે તો રહેની પૂજા કરી, આનાધે છે અદ્ધા ધરી  
 તે દ્વારે કામ હિત રી નેદ, માદાના આપ્યા પામે તેદ ૩૪  
 અન્ય બુદ્ધિ તો રહેની કઢી, તેજના દળનો અતજ સહી  
 તે દેસને તે પામે આસડત, મુજને પામે માદાના ભક્ત ૩૫

શુદ્ધ હીન, હુ અવ્યક્તને, ભાને ભત્યાદિક વ્યક્તને,  
 પરમ ભૌત ઉત્તમ ભમ જોહ, અવ્યપ્ને નવ્ય જાણે તેહ ૩૮  
 થોગ માયાએ વિધ્યો જોહ, પ્રકાશ સર્વને નહિ હુ ટેદ,  
 મુજને કોક આ મૂઠ એકળ, નવ્ય જાણે અવ્યય ને અજ ૩૯  
 પૂર્વે હતા આણી જોહ, આજ વર્ત્માને પણ તેહ,  
 જાણું હુ કે આગળ હોય, લહે ન ત્રણુમા મુજને કીય ૪૦  
 ભારત ધર્મા દૈરે કરી, દ્વા મોદ રહ્યો વિભત્તરી,  
 સર્વ ભૂત સંસારી જોહ, પામે ગોદને તેણે તેહ ૪૧  
 પૂર્ણ કર્મ છે જન જોહના, થથા નાશ પાતિક તેહના,  
 તે તો દ્વા મોદને તજે, દ્વા ધૃતેથી મુજને ભજે ૪૨  
 જરા ભરણુથી તે સુકાય, તે કાગળુ ભમ શરણે યાય,  
 સમગ્ર ઘલને જાણે તેદ, સર્વ કર્મ અધ્યાત્મિક જોહ ૪૩  
 તે અધિભૂતાધિહૈન સહ વર્ત્ત, તથા અધિયજ પામે ભમ વર્ત્ત,  
 અવસાને પણ થોગો સુકત, મુજને જાણી પામે સુકત. ૪૪  
 દ્વારામ શ્રી કૃષ્ણનો જન, તેણે પદે કલા વચ્ચન,  
 થોગ શાખને ભહ વિદ્યાય, જ્ઞાન વિજ્ઞાન સપ્તમ અધ્યાય. ૪૫

ઇતિ શ્રીમદ્ ભગવદ્ગીતા સુપનિપત્તસુ બ્રદ્ વિદ્યાયા  
 યોગ શાખે શ્રી કૃષ્ણજ્ઞન સંયાદે જ્ઞાન વિજ્ઞાન યોગો  
 નામ સત્તમોદ્યાય. ॥૭॥

---

## ભગવદ ગીતા અધ્યાત્મ-૮

### ॥ અર્જુન ઉવાચ ॥

હે પુરુષોત્તમ શું તે અથ? શું અધ્યાત્મ? ને શું કર્મ? અધિભૂત તે કહો શું કહું? અધિ દૈવ ક્ષમ જાયે લઈએ. ૧

અધિ યત તે આ દેહમાં, કેમ ને કોણું હે સર્વાત્મા; પરમાત્મા પરાથ્ર કહેવાય, અધિ દૈવિક ભૂળ કોણું ને ધાર. ૨

આધિ દૈવત મહા મુક્તાના ધર્મ, પુરુષોત્તમ તે છેદો ભર્મ; જેદનો આત્મા તત્પર નેમ, પ્રયાણ કાળે જાણે કેમ? ૩

### ॥ શ્રી ભગવાનુવાચ ॥

અક્ષર એહેવો ઉપમ અથ, ઉપજો તે તો અધ્યાત્મમ; અવ ઉપજો છે જેહ, કર્મ સંશો કહીયે તેહ. ૪

દેહાદિક તે અધિભૂત જાણુ, અધિભૂત તે પુરુષ પ્રમાણુ; દૈવિમાંદે શ્રેષ્ઠ સુણું હું, અધિયત્ત તે દેહમાં હું. ૫

અર્જુન પ્રાણ અધ્યાત્મે ધાર, અધ્યાત્મ અથ તે કહેવાય; યજુ-દાન-જપ-તત્પ ને કર્મ, અધ્યાત્મ ભક્તાના કહીયે ધર્મ. ૬

અંતકાળે મુજને મન માંલ, રૂમરે શરીર તજને જાય; તે તો મુજને પામે સહી, એ વાતમાં સહેલ નાદ. ૭

ज्ञान योगे करे भाव ध्यान, अधि हैनिक ते कहीये ज्ञान  
 तेह सदा तु सेवे सही, भाव ध्यान करने ग्यथर रही ८  
 अप्सुरुन् युद्ध करो जय थगे, अते पद भाव पामगे  
 इती कुत अतकागे ते लेह, बावे रमरते। छाउ देह ९  
 ते बावे युक्त ते तेह, ते ते पामे ते ते देह  
 ते भार तु मुजने रमरे, सदा सर्वहा जो युद्ध करे १०  
 भद्ररे विरे भनने युद्धिधरी, पामीश मुजने निश्चे करी,  
 पारथ योग अव्यासे युक्ता, अन्य भजनथी चित रिमुक्त ११  
 दिव्य परमपुरुषने लेह, चित राखे ते पामे तेह १२

### - पूर्व छाये। -

सर्व ज्ञानी अर्णुने, सहने शिक्षा देह,  
 अति सूक्षमथी सूक्षमने, धरे सर्वने लेह,  
 अचिन्त्य उप लेहनु अने आचित्य करे वर्णु,  
 भाषाथी पर ते तथु, जे ते करे रमण्ण १३

भक्ति युक्तने भन अयण, प्रयाण डागे डेअ,  
 प्राणु तथु आवेश त्या, करे भमे भा सोअ,  
 योगाभ्यास करे वणा, भने ग्रहारे तेह,  
 अहेना पामे दिव्य जे, परम पुरुषने तेह १४

वेद जाणु अक्षर लहे, अयन नही जे क्षेश,  
 वितराग अहेवा यति, अहेभा करे ग्रवेश,  
 अहायर्य जे आयरे, तेहनी धर्मा नहं,  
 ते पद सक्षेपे करी, कर्माय तुजने तेह १५

## ॥ शापाध ॥

अभ्यास योगे भन वरा आणु, भन आणु पद पामे निर्वाण;  
नियमे राजे सर्वे द्वार, भनने इंधे हृदय भेऊद्वार. १६

प्राणु नियमनी सक्तें अडे, योग धारणा भांडे रहे;  
अला ओङ्कार प्रथम ले कडे, स्मरण मुहारै करतो रहे. १७

अहेवो तत्त्व ज्ञान ले हेद, पामे परम गति मुज तेह;  
अन्य न चित्त निरंतर लेह, नियमे मुजने चीतवे तेह. १८

निये योगाभ्यास लेहने, पारथ दुः सुखन मेहने;  
परम सिद्धि ले पामे करी, भाङ्गन मुजने पामे इरी. १९

हुःअनु रथानक अने अनिय, अहेवा जन्म न पामे सत्य;  
अला क्षेत्री ओङ्कारी रिथिति, अग्नुन लेहने पुनरावृत्ति. २०

मुने ले पामे कौतय, इरी जन्म धरे नहि तेह;  
मुदाहं पद ते अचण प्रभाणु, ऐ सहस्र सुग अदोसनी जाणु. २१

सहस्र ओङ्कारी मुग पर्यंत, अलानो दीन ओक वदंत,  
अहोशवने जाणु लेह, दीन समान रानी कहे तेह. २२

वर्ष सो ओक अलानां थाय, ओङ्कारी पेरे काण संभ्या गाण्याय;  
सो वर्ष अलानो क्षम साही, मुदारा भक्तने पर्वतु नही. २३

ते हिने आदे सहू डॉय, अयक्तथी उत्पनि हेय;  
अने रानीने आदे वणी, अयक्तमां ते जाये भणी. २४

ને શુદ્ધ સર્વ ઉપાત્મા ઉપજાય, ગરી આગમે તે નથ થાય  
 વર્ગસ દ્વિસ આગમે કરી તે પ્રાણી સુ ઉપરે દરી ૨૫  
 તે બગતથી પર તે નેહ, પ્રગટ અન્ય સનાતન તદ  
 પ્રાણી માત્રનો થાયે નાથ, તેહ તથ્યો ત્યા નદિ વિના ૨૬  
 અન્યકંત ને અકાર નેહ, પરમ ગતિ કલીયે તો તદ  
 નેહને પામીને ન પડે કોમ, પર્મ ધામ માહાત તે સોય ૨૭  
 પારથ પરમ પુરૂષ તે સોય, અનન્ય બગતને પ્રાપ્તી દોય  
 નેહને અતર ગતિ સૌ ભૂત, જદેની કીધી સકગ વિભુતિ ૨૮  
 ને ખોલે યોગી અથા નેહ, પુનરાશ્રતિ ન પામે તેહ  
 ને કાગે ને આવત્સં હોય, ભરતદ૰ભ મલીથ તે સોય ૨૯  
 અલઘવિદ અડેરા ને જરન, પદમાસ બાજ ઉત રાજજ  
 શુક્ર કૃષ્ણ એ પક્ષ કહેવાય ઉત્તરાયણ દક્ષિણાયણમા થાય ૩૦  
 શુક્ર પક્ષ પામે દિન અગ્રન, એમ અલમા થાયે મળન  
 પટ માસ દક્ષિણાયન માછા, કૃષ્ણ નિશાએ ધૂમે જાય ૩૧  
 ત્યાથી ચદ્ર જ્યોતિને ભગી, યોગી દરી અનતરે વગી  
 શુક્રલ કૃષ્ણ પક્ષ એ વિગત, વર્ત સદા નિરેતર જક્ત જીત ૩૨  
 એક પુનરાશ્રતિ ન હોય, બીજે દરી અનતરે સોય  
 એ એ ભારગ જાણે નેહ, યોગી મોહ ન પામે તેહ ૩૩  
 તે માટે તુ અજૂન સદા, યોગે શુક્ર રહે સર્વદા ૩૪

## ॥ पूर्व ७।।

वेदमां अने यजुर्मां, तप दाने वेद,  
दृष्टि भाष्युं ते तो सद्गुण, ज्ञेयी ज्ञाने तेद;  
ते इण्ठने ते अतिकृमी, आदि परम ने धाम,  
पामे ते निश्चये करी, योगी उत्तम हाम. ३५

## ॥ चौपाई ॥

अथवा काशी-क्षेत्र-मर्यु(भरथ) म्हारा लक्ष्माने नदि अवतरण;  
न्यां त्यां थो। कठी देह भूक्षेपे पशु अंते सुज पद पामयो. ३६  
पद्मिं श्वप्य देह कठी थाय, तद्पि हुर्गति तेनी न थाय;  
लक्ष्मा तथो छे अति भद्रिमाय, म्हारा लक्ष्माने संतोषाय. ३७

भाटे पार्थं सुज लक्ष्मि करो, काम शोधादिने करो परो;  
दास द्यो। हरि गुड व्याधीन, रस सागरे रहे मन भीन. ३८  
योग शास्त्रने अहं पिद्याय, अप्टांग योग अप्टम अध्याय;  
कोई कहे भद्रा पुरुषनो। योग, भद्रा पुरुषनो। थाये संज्ञेग. ३९  
उभय वाक्यनी ऐकता लडी, भिन्न तत्त्वे कांधये नडी. ४०

इति श्रीमद्भगवद्गीता सुपनिषत्सु ब्रह्म विद्यायां योग  
शास्त्रे श्री कृष्णार्जुन संवादे महापुरुष योगो नाम  
अन्दमोद्यायः ॥ ८ ॥



## શ્રી ભગવન્દગીતા અધ્યાય-૯

### ॥ શ્રી ભગવાનુવાચ ॥

કહું પાણ્ય ગૂહારય જાન, જે જણે તરણે મોક અજાન;  
 ન કોને નિદે એદવો હું, કદીસ હુજને ગુજ આ હું. ૧  
 જાન વિજાને સદ વર્ત, જે જણે હોય પાપ નિર્ત;  
 શાન્દિવિદ્યા ને રાજગુહમાં, અતિ પરિત અને ઉત્તમા. ૨  
 હોય જે મુખને પ્રત્યક્ષ હુણ, અધ્યપને રહે ધર્મ અથળ;  
 હે પરતંપુ આ ધર્મમાં, હોય પુરુષ જે અદ્વા વિના. ૩  
 અદ્વારી પ્રાપ્તિ તો તેને નહિ, મૃત્યુ લોક બમે તે સહી;  
 અજા વિજાના કર્મ જે કરે, લોક માંડે દંબિક આયરે. ૪  
 શાન્દિવાદ હુડો કરે જેલ, અદ્વારં પદ નાચ પામે તેલ;  
 અદ્વારી મૂર્તિ જે અર્થપદ, નિપળે તેણે આ સુષ્ટ. ૫  
 સકળ ભૂત હું માંડે સહી, પણ તે માંડે તો હું નહી;  
 રહું સૌમાં પણ સૌથી ન્યારો, પર પુરુષોત્તમ મુને નિરધારો. ૬  
 અદ્વારા યોગ અન્યાન્ય ને જે, માઢરે નહીં ત્યાં પ્રાણી હો;  
 હું તે ધર્મ ન હું તે માંદ્ય, અને કર્મ તે તણી રહાય. ૭  
 આકાશમાં હવા જેમ, સધગે હાંમ રહ્યો છે તેમ;  
 નયમ આકાશમાં વાયુ સમાય, પણ વાયુ આકાશ ન ભાય. ૮  
 તેમ સર્વ ભૂતમાં અદ્વારા વાસ, સુજમાં સર્વ હું પર નહિ પાશ.  
 સકળ ભૂત પ્રાણી હું માંદ્ય, ધરી રહ્યો હું તે જે ન્યાય. ૯

ने वारे छृष्ट तरुण क्षय थाय,  
लय पामे ते हे कौतेय, सकण भूत मम माया माँद्व;  
सकण भूत प्रवश एम ज्वेद,  
तेदने तेद तरुण आधार, कृष्णाते सरग्नवुं तेद. १०  
हे धनंजय धर्मी धर्म,  
रुहु उदासी, राघो संदा, प्रदृति आश्रय भद्रारी तेद;  
हुं स्वामी तरुणी आ प्रदृति,  
तेद ग्राहे हे कौतेय, सरग्नवुं सरग्नवर जडत;  
भद्रुष्य देद धर्यो भे ज्वेद,  
प्राणी माननो धक्षर भाव, एम जगत लय थाय तेद. १३  
निष्कल आसा, निष्कल कर्म,  
प्रदृति आसुरी ने राक्षसी, निष्कल रान, न वश चित धर्म;  
पारथ भद्रा मुहृष्ट ने छिद,  
आदि भूत अन्यथ मुने लडी, तथा भोड़ी भाड़े रहे वसी. १४  
नित्ये भद्रां कीर्तन कहे,  
बहुति करी शिर चरणे धरे, ६६ वृत्ते भन नियमे रहे;  
रान धरा करी को अन्य,  
विश्वतरुं मुख ते हुं ज्वेद, योगे शुक्त उपासन करे. १७  
श्रीत धरा हुं अने रमार्ता,  
मंत्र हृतप्रथ्य पशु ते हुं, पितृकर्म हुं औपध भाव;  
ते अने हेमवु. १८

જગત पिता ભાતા ધરનાર, પિતામદ ને પવિત્ર વિચાર  
 હું સર્વેને હું તે પ્રથુન,<sup>૧</sup> હું ને પ્રથુન સામ એ સર્વ ૨૦  
 ગતિ પોતથુન ને સાક્ષી પ્રથુન, નિવાસ શરણ સુહંદ તે હું  
 અને આધાર ઉત્પત્તિ લય સ્થાન, અ યથ ખીજ ને વગી નિધાન ૨૧  
 તપુ છુ હું ને વરસુ હું, અહુ તે હું ને હું સૂડે,  
 અમૃત તથા મૃત્યુ ને સત્ય, અથુન તે તે હું ને અસત્ય ૨૨

## ॥ પૂર્વ છાયો ॥

ત્રય વેહે	મોમખાને,	મુક્તત	પાગથા	નેદ,
યન કરી સુને	યજ્ઞ,	સ્વર્ગ	પ્રાર્થે	તેદ,
ત ચૌદે તોઘને	પામી,	ગર્ભ	નિરાસી	હોય,
લદા બોગ તે	દૈવનો,	અશાન કરે	નર	મોય ૨૩
તે વિદ્યાળ ગર્ભસોક લોગવી,	મુન્ય	ક્ષય	જન	થાન,
કરી અપતરે તે વગી,	નૃત્ય	લોકની		માદ્ય
એમ ધર્મ વેહોકત પાગતા,	ધર્મશૈ	ધર્મજા		નેહ,
કર્ત્વ આવા ને ગમનના,	પામે	કળને		તેદ ૨૪

## ॥ ચોપાદ ॥

યોગ જીન જીપ તપે કરી,	અદ્યાએ પદ પામે દુરિ,
યોગ જીન દૂળ અદ્યા નેહ,	ઓસડ મન અભિન હોત્ર તેદ ૨૫
જગ આચાર વિદ્યાદિ નેહ,	સર્વ જીપ સુને જાણે તેદ,
ત્રદા અરણુદિ સર્વાચાર,	સર્વમા સુને લહેઠ નિગ્ધાર ૨૬

મૂર્ખ રૂપે તપે છે જેહ, કાંતિ, કર, અવણુ, હું માહે તેહ;  
 ચંદ્ર શૂર્પોહિ નેત્ર ઇપ લહોા, અંગ અંગી ભાવે સૌમાં હું કહો. ૨૭  
 ને જન અનન્ય ભાવને ધરી, ઉપાસે મુજને ચિંતન કરી;  
 એહેયો નિત્ય યોગ જેહનો, યોગ ક્ષેમ હું વહું તેહનો. ૨૮  
 અદ્ધારે અન્ય દેવ ને યજે, તે ભાવે પણ મુજનો ભજે;  
 હે કીંતેય ભક્તા તે સાડી, પણ તે તો વિધિપૂર્વક નહીં. ૨૯  
 સર્વ ધરુ ભોગી પતિ ભૂ, તે તો હું ને વળી પ્રભુ;  
 તત્ત્વે એમ ન જણે જેહ, તે માટે પડે છે તેહ. ૩૦  
 યજે દેવ તે પામે દેવ, પિતૃ યજે તે પિતૃ એવ;  
 પામે માણુસ માણુસ ભજ, મુને પણ પામે મુને યજ. ૩૧  
 અધિભૂત અધ્યાત્મિક અધિદેન,  
 કૃત અકૃત ને સર્વાતીત,  
 પૃથ્વે ઇગે તે કરતાં સેવ;  
 ક્ષર અક્ષર ને સર્વાતીત,  
 તેહ સમજવા ભાપી રીત. ૩૨  
 જહેને જેહ ભજે ને જન,  
 સકામિક ગુણ ઇચ્છાને અનુસાર,  
 તે પ્રાપ્તિએ તેહ પ્રસંગ;  
 જહેને જેહ ભજે ને જન,  
 ઉપાસન કરે નિર્ધાર. ૩૩  
 નિગુણાતીત શુદ્ધિએ ધાર,  
 નિગુણ ઉપાસન લહો કનિષ્ઠ,  
 તેહ તણો સાંભળ ભદ્રિમાધ;  
 નિગુણ ઉપાસન લહો કનિષ્ઠ,  
 નિગુણાતીત જર્વેથી શેષ. ૩૪  
 કુદ, મલીન, તો સહુથી અધમ,  
 તામસ બુદ્ધિએ ને નર ધાર,  
 ન વેદ પ્રમાણ તે અધમાધમ;  
 તામસ બુદ્ધિએ ને નર ધાર,  
 તે યોગે તે દૈત્યજ થાર. ૩૫  
 સાત્ત્વિક ભાવે ભજે જેહરિ,  
 નિગુણાતીત ભજે નર જેહ,  
 અહસેઝને પામે તેજો કરી;  
 નિગુણાતીત ભજે નર જેહ,  
 માહારા પહેને પામે તેહ. ૩૬

पन पुण्य इक्ष के जल भरी, करे अलार्पण भक्ति करी;  
 ऐहवेा नेम धरे निरधार, आवे अहुं ते सौ उपदार. ३७  
  
 ३८ अध्या ग्रीतिथि करे, अगिकार करे प्रभु घरे;  
 करे ने तु अशन वणी लेड, ने हामे, ने आपे तेड. ३८  
  
 अने छोतेय करे ने तप, ते सर्वे तुं मुने समर्प;  
 ने जन दान पुन्य आयरे, होमे भखमां के जप तप करे. ३९  
  
 मुन अर्थे करी, अपी अग्नो थाप, पाप पुन्ये ते नव्य देपाप;  
 आत्मा तृप्ते पंच प्राण्य, अलार्पित भति तुं त्यां आंषु ४०  
  
 अलार्पणी पूर्वे कही रीत, ते रीते लही ग्रीति सहीत;  
 आपत काम ने पूरण्य काम, आवे भूम्य धरे धनस्थाम. ४१  
  
 भक्ति रहीतनो धूप खण्डाण्यो, अहे नहिं परम्परा ग्रमाण्यो;  
 रसात्मक शीश रसने अहे, स्नेह रसे भडेवाने यहे. ४२  
  
 ग्रीतिशत्यनुं काम न लागे, ग्रेम रहीतनुं हरि सौ त्यागे;  
 माटे रान सहीत करी ग्रीत, कृष्णार्पणु करवा कही रीत. ४३  
  
 अलभुक्ते सत्यामृत थाप, अलार्पित प्रसादी चढाप;  
 हरि अर्थे निर्गुण्यता जाण्य, श्री भागवतमां रप्प ग्रमाण्य. ४४  
  
 एकादशी उपधव प्रति भास्यु, तेनी संगतिथि कही दास्यु;  
 अन्य स्थणमानां पथ वेणु, भागवत श्रुतिमां द्वरवे नेणु. ४५  
  
 अलने संजे निर्गुण्यता, तेथा जिन्हे संगुण्यता;  
 निर्गुण्यतानो आ निर्देश, भुक्ते हरि प्रसादी शैप. ४६

निर्गुणसंघे निर्गुणयाथ, २५६ पुराणयी सरय जाय,  
 एम शुभाशुभ इण जेदना, छग्या कर्मधन तेहना ४७  
 सत्यासने योगे सुप्राप्तम, उनभुक्त पाप्या भम भद्रात्म,  
 सकृद भूतमा हु समसही, देव न लोनो, त्रिय डा नही ४८  
 अमित्येभजे भुने वगा जेल, तेमा चने ह भा तेल  
 यद्यपि हुरायागी ते द्वैप, भजे अनन्य आवे ले चोप ४९  
 तोडे ते डो जायुवो, भाड्यो उद्यम शुभ हायुवो,  
 ते धर्मात्मा शीओ द्वैप, शाति निरत्य भामे चोप ५०  
 ड तीर्थुत तु एम विभास, भद्रारो भग्न न पामे नाश,  
 पाप्य लडेने भद्रारो आरारो पाप योनि कठी ना अवतर्यो ५१  
 अनीने वैस्य शद्यप्य सत्य, पामे परम भद्रारी ते गत्य,  
 अश्वद अधम अनित्य डाग, ने भुज ५२ पामे तत्काण ५२  
 आलय, क्षत्रि, वैस्य, एद्विज सही, भुने पामे तेमा डो सरय नही  
 तो शूचि आलयुने अग्नियुक्त, राजपिं डेम थाप न भुक्त ५३  
 ते भाग आ अभुप्य अनित्य, पामी लोक, भुने भजे चित्त  
 हु मनमा एम था भम भक्ता, भम यज्ञन भम नभस्तुत ५४  
 अम परापृष्ठ योग करीथ, एम कर्ता भुजने पामीश  
 दास द्ये हृष्णाश्रम धरी, नपमाध्याप गीता विभट्टी ५५  
 योग शास्त्र ने अल्प विद्याप, गज विद्या शुद्ध योग अध्याप

इति श्रीमद्भगवद्गीताया सुपनिषत्सु व्रह्मविद्याया योग  
 शास्त्रे श्री कृष्णार्जुन सप्तदेव राज विद्या राज शुद्ध  
 योगो नाम ९ ननमो ध्याय ॥९॥

## ભગવદ્ગીતા અધ્યાય-૧૦

### ॥ શ્રી ભગવાનુવાચ ॥

મહાયાઙ્કો મહાર્થ તે વળી, પર્મ વચન નેને સાંભળી;  
તુ સંતોષી સવોપરી, કંઈય હું લિતકામે કરી.

હે અર્જુન! એમ માનને સહી, દેવપર્િપણ યथાર્થ મુને જણે નહિ;  
અજ્ઞાદિ દેવ કાયિ પ્રભૃતિ નેહ, મહારો પાર ગતિ ન કળે તેદ.

દેવ સમૂહ મહા ઋવિ નેહ, ન લહે જન્મ મહત મમ તેદ;  
રા માટે ને હું દેવધી, અને હું આદિ કાયિ સર્વથી.

અનાદિ એમ ને મુને કહે, અને લોકને સ્વામી લહે;  
મૂર્ખ નહિ તે ભાષુસ માંય, સક્ત પાપથી તે મૂકાય.

શુદ્ધ જીબ સહ મોહ ન થાય, ક્ષમા સત્ય શમ દમ ને માંય;  
સુખ હુઃખ ને ઉત્તુતિલય નેહ, ભાય ને અભય વળી હોય તેદ.

અહિસા સમતા સંતોષ, તપ દાન પર અપ્રયા હોય;  
એહના સર્વ ભૂતના ભાવ, ઉપજે સુશ્રદ્ધી પૃથ્વ રદ્માન.

સપ્ત કાયિ તે અહે ચાર, જનકાદિક ભતુ બે બાર,  
માહારો ભાવ, હુંથી ઉપજ્યા, લોક વિં આ નેહની પ્રગત.

ને એ સકળ વિભૂતિ મારી, અને યોગ લડે તત્ત્વે કરી;  
સંશ્યારહીત યોગ તે સાહી, પામે ત્લેમાં સંદેહ નહીં. ૮

હું તો સૌનું ઉપર્યાસ સ્થાન, હુંથી સર્વ ઉપરે તે માનઃ;  
પ્રીતિયુક્ત નર પંચિત રેખ, જાણું એમ ભજે ભમ તેદ. ૯

ચિત્તમાં હું પંદ્રિ હું ભળી, અને. પરરસ્પર પૂર્ણ વળી;  
નિત્ય કરે મહાર્દી કથન, રમણ કરે સંતોષી મન. ૧૦

યોગ નિરંતર સાધે તેદ, ભજન કરે અતિ ધર્ઘે નેદ;  
તેદને તેદવી આપું ભત્ય, તેથી સુને તે પામે સત્ય. ૧૧

તેદ તણું દ્યા મને ધરી, દિવ્ય શાનતે દીવે કરી;  
તેદની જુદ્ધ માંહે પરવર્ણ, લિમિર અત્માન ત્લેનું છદ. ૧૨

## ૧૧ અજૂન ઉદ્ઘાટ ॥

અજૂન કહે સ્વામી એ વિચાર,  
આપ છો સૌના આદિ સાહી, એ મહોદાને પણ નન્ય લાદે પાર;  
કંધાં કંધાં વિભૂતિ આપની રહી. ૧૩

શ્રી હૃષ્ણ તમારી વિભૂતિ રેખ, તોણું તોણુમાં હું જાણું તેદ;  
પર અન્ધ તે તમો વિચિત્ર, પરમ ધામ ને પરમ પવિત્ર. ૧૪

પુરાણ પુરુપ દિવ્ય તે તમો, આદિ દેવ ને અજને પ્રમો;  
સર્વ નાદિ અહેવા તમને, નારદ દેવ નાદિ અન્ધને. ૧૫

કહે અસીલ દેવલને ધ્યાસ, અને તમો પળ કડો પ્રકાશ;  
તમો કહો છો તે તો સર્વ, હું સાચું માનું કેદાર. ૧૬

તર માણે ભગવન એન, જાણે નકી ફાનન ને કે  
કે બૂનેરા દો ભૂત સભાગ, કે ૧ દેસ જગત પ્રતિપાદ ૧૭  
હે પુરોત્તમ જણેના તમે, ચોને ચોતાને આત્મે  
આત્મ રિભૂતિ હિ ૫ તે ક્લેદ, ક્રો ૩ તમારી સર્વે તેઠ ૧૮  
તે રિભૂતિ તો કેળે કરી, રથા સોક આમા વિસ્તરી,  
હે ડેસન તમને ડેમ કરી, જાણુ નિતે ચિત્તમા ધરી ૧૯  
હે ભગવાન કો ૩૮ કેમ ચિત્તરાય, કિયા શિયા પાઠ્ય માય,  
આત્મ યોગ જનર્દિન ક્લેદ, અને રિભૂતિ કરી કો ૩૯ તેઠ ૨૦  
સાભજય તે તોએ અસૃત, નથી પામતો હ તો તૃપ્ત,

### ॥ શ્રી ભગવાનુરાચ ॥

હે અર્જુન તુ સાભજ્ય સં, સુજ સુખ્ય રિભૂતિ તુજને કહુ ૨૧  
કુર એષ્ટ કે હિ ૫ રિભૂતિ, કદીશ સુખ્ય હુ રૈની ધુનિત,  
ગુજારી વિભૂતિ તણેના વિસ્તાર, તેઢ તણેના તો છે નહિ પાર ૨૨  
નિશ્ચ ૩૫ યઈ સુધિમા ૨૩, યોગ રિભૂતિનો તુને કદુ,  
શુશ્કેણ હુ પ્રાણી માત્રમા, આત્મા હેણે આભ્યતર માત્રમા ૨૪  
અને સકળ ભૂતમા આદિ, હ મધ્યે હુ અતે અનાદિ,  
હ નિષ્પત્ત આદિય આરમા, અનુમાન રવિ જ્યોતિશાસ્મા ૨૫  
તેજ માણે રવિ હેણે તેઢ, ને માહન માણે મરીયિ નેઢ,  
વાયુ માણે મરીયિ હું હ, નક્ષને પણ શશી મુને લદુ ૨૫

નક્ષત્રમા ચદ્ર પણ હૃથ, એમ વ્યાપક ઉપમા જણે હુય,  
અને વેદ માહે સામ ને ગાય, અને છદ્રી દેવતા માય ૨૯

ઈદિમાહે દું તે ભન, પ્રાણી ભારમા રૂજ ચૈતન,  
દેવ માહે છક્કાદિક ગાય, મૂળ સીયતા હુમ સીયાય,  
શર માહે શક્ક કદેનાય, તે હું ને અગ્નિ વસ્તુ માય ૩૦

વસ્તુ માહે પાવક રુ જાણુ, ગુગ્ણિયો માહે મેળ અમાણુ,  
યક્ષ રાક્ષસમા હુ કુશેર, પર્વત માહે હું તો મેળ (મેળ) ૩૧

પૂરેલિતમા ગુડ ઘૂંઘરૂપતિ, અવામી કાર્તીંડ સેનાપતિ;  
સેનાપતિમા પરમુખ પણ હુ જાણારાય માહે પણ સાગર હુ ૩૨

કાપિ માહે અગ્ન કણીયે જોદ, વાણી માહે પ્રાણુન હુ તેદ,  
અક્ષર માહે વર્ણ ઝોકાકાર, થત માહે હૃદયન તે સાર. ૩૩

ધર માહે જરૂર ધરા-જ, કિનુ, ગ્રાનાર માહે લિમાનય હું દુ,  
ધક્ષ માહે અખત્ય તે જોદ, દેવર્ધિમા નારદ હુ તેદ ૩૪

ગધર્મા ચિત્રનથ કિનુ, સિદ્ધ માહે કર્પાસ સુનિ હુ,  
ગાનીમા કણીયે શુક્રદેવ, સર્વન વ્યાપક રુ નાશુદેવ. ૩૫

અશ્વમાહે અમૃતજન જોદ, ઉચ્ચે અરા અશ્વ હું તેદ,  
ગારેદ માહે અંગેપત દુ, નર માહે તે નારન કિનુ. ૩૬

દર કણે જે આયુધમા, હુ તો ધેનુમા કામ હૂધા,  
દરત ધીજ ધ્યાનક કદ્દર્પ, સર્પ માહે વાસુકી સર્પ. ૩૭

શેષ નાગમા મુજલ્ને જાણુ, નલપતિ મધ્યે વરણુ મમાણુ  
પિંચીમાહે હુ અર્યમા, દર નિરમે નાણે તેદમા -૫

हैत्येभा प्रदुनाद्य गाण,  
 राक्षसभा विनिष्टु ३५,  
 मृग भधे जाणो डेसरी,  
 परित्र करे अडेवाभा पवन,  
 अने भगर भत्य माहे तु,  
 विद्याभाहे अध्यात्म ज्ञेम,  
 अक्षर माहे तुतो ओकार,  
 अक्षय काण कडे ते पशु तु,  
 क्लीओ भधे सीता तु सार,  
 अर्ति लक्ष्मी सरसन्ती ज्ञेह,  
 नर माहे एकादशी नाम,  
 घृष्णुत् साम सामभा क्षेह,  
 मास आरभा भार्गवी तु,  
 छल माहे द्युत चण ज्ञेन,  
 ज्य हू उद्यम हू ए तत्त,  
 उद्दक रसभा धृत तु जाणु,  
 वासुदेव तु वादनभाहे,  
 मुनि माहे व्यास पशु ज्ञेह,  
 उपायमा ग्रनीषु धनतरी,  
 धातु माहे हेग प्रभाषु,

भ्यारे वसा कर्माहे काण  
 सठगमा अक्षण इपे तु अनुप ३६  
 पदीभा गङ्ग ने वाढन दरि,  
 शख्खारी राम रघुतन ३७  
 नरीभाहे गगा पहू,  
 भधे अते तो तु तेह ३८  
 वाह विवादभा पशु तु तेम,  
 समास भधे दद्द प्रकार ३९  
 रिश्ये सुख वेदे ते पशु तु,  
 तुज्ज भाविभाहे उत्पत्त ४०  
 तेनो ग्रथक ठाठ कहु विस्तार,  
 रम्मति क्षमा भेदावती तेह ४१  
 वेद भाहे गायनी साम,  
 वेद भाहे गायनी तेह ४२  
 वसत कहु भाहे ते कहु,  
 तु ते तेवर्सीभा तेज ४३  
 सातिक भाहे तु गुण सत्त,  
 ज्यम यादनभा तु इष्यु प्रभाषु ४४  
 अने धनतर्य पान भाहे,  
 कवि भाहे शुक त्यम तेह ४५  
 ज्व मुख्य और्ध्विभा भरी,  
 पतिनता नारीभा जाण ४६

तत्त्वमां दभं भाषुने हुंप, सर्व विभूतिमां हुं हुंप;  
 दम भाषे हंड हुं चित्य, व्रथ वांछे तेमां हुं नित्य. ४७  
 गुल भाषे ले भौन विधान, हुं ते जानि भाषे जान;  
 भीज सङ्कण भूत्युं ज्ञेह, अर्जुन हुं तो पेते तेद. ४८  
 रथावरते जंगम मांय, हुं पाए नदि ते कीथ;  
 दिव्य विभूति ऐ भदारी तथो, अंत नदि परंतप सूचो. ४९  
 कषी ले आ विभूति अतिसार, संक्षेपे शीघ्रो विस्तार;  
 ले ले वसु भाषे अधिकार, संपत्तियुक्त अने अतिसार. ५०  
 ते ते जंतु ३५ मुज जाणु, भम अशे उत्पत्य ग्रमाणु;  
 हे अर्जुन अथी अति धाणु, कहुं शुं हुने जानज तथु. ५१  
 हुं तो एक अंशे करी, जगत समग्रे रबो हुं धरी;  
 हुवते कांधभेद डीधुं कथी, कांध वसु मुज वणु आशी नथी. ५२  
 अर्जुनविभूतिनो पारज नथी, सौमां व्याख्य हुं सर्वथी;  
 अंशांश अंश विभूति अभ, व्युह विभवाटि इपमां तेम ५३  
 आवेश धूरणु अभ अनेक, सौमां तत्वे हुं हुं एक;  
 ह्याराम आनहे कहे पारंवार आज विचारे रहे. ५४  
 अंगअंगी अहनो भाव, सौमां हुप्तें क्यों दर्शन;  
 योग राज ने भल विद्याप, विभूति योग दरमो अध्याप. ५५

इति श्रीमद् भगवद्गीता सुपनिषत्सु ब्रह्म विद्यायां योग  
 शास्त्रे श्री कृष्णार्जुन संवादे विभूति योगो नाम  
 १० दशमो द्व्याय ॥ १० ॥

## ભગવદ્ગીતા અધ્યાય-૧૧

### ૧। અનુભૂતિ ઉથાય ॥

તમો અતુઅદ કરવા મમ, પરમ શુદ્ધ તે અધ્યાતમ;  
કહું તેથી કૃતારથ થયો, મોઢ સર્વ તો ભારત ગયો. ૧  
હત્પત્તિ ને લય પ્રાણી તાણી, જો તે સર્વ તમોથી સુણી;  
વળી ભદ્રાત્મય ને અભ્યય તણું, કમજનયન તેઢ પણ સુણ્યું. ૨  
આત્માને કહો છો નેમ, તે તો છે પરમેશ્વર રોમ;  
પુરુષાત્મ ને ધ્યાન રૂપ, જોવા ધ્યાન તેઢ રૂપ. ૩  
પ્રભુ રૂપ એવું તે જેઢ, મુજને જોવા સામર્થ્ય ધી તેઢ;  
નાણ્યો જોગેશ્વર મનમાંય, હેખાડો આત્મા અભ્યય. ૪  
અનુભૂતિ કહે પ્રભુ પાળો લાડ, કૃપા કરી વિશ રૂપ હેખાડ;  
તે રૂપ જોવા આરત ધણી, અભિજાપા પુરો સેવક તણી. ૫

### ૨। શ્રી ભગવાનુથાય ॥

જો તે પારથ ભારત રૂપ, કંઈ રાત કંઈ સહસ્ર રૂપ;  
અનેક વણ્ણું આકૃતિ અનેક, બહુ પ્રકારનાં દિવ્ય વિશેક. ૬  
વણુ રૂપને આદિત્ય બાર, મારતને અશ્વની કુમાર;  
જો ભારત અણુ ધીઠાં ધણ્ણું, આશ્ર્યકારક બહુ વિધ તણું. ૭

ગુડાકોરા ખીણુ નગી જેદ, જેવાને ધને હુ તેદ,  
જગત સમગ્ર જો આ દેહમા, સચગાયર સામડુ તેહમા ૮

આ રહાગ નેત્ર લે જેદ, નહિં જેવાય તેણે તેદ,  
આપુ હુ તુને દિવ્યાર ચક્ષ, જો તે મુજ યોગીશ્વર્ય પ્રતચક્ષ ૯

કે હુ જાણે ને તે અડેમાય, અભિન તેજ કણે પેખાય,  
મદાન અનત રૂપ છે જેદ, દિવ્ય ઇદિ કરી નીંઘો તેડ ૧૦

કે તે રથદુ એ ગીય નહિં, ભારે વિં ને તે ચિંદુ ગડી,

## ॥ સુંધર ઉવાચ ॥

સન્ય ધૂતગઢને કણે, અર્જુન દિવ્ય ચતુને અડે. ૧૧  
આપી નેત હેખાડયું રૂપ, તે ડેનુ છે અકગ સ્વરૂપ,  
દે ધૂતગઢ એમ કણી કરી, યોગીશ્વરને ગ્રામિ દરી ૧૨

અશ્વર્ણનું પરમ સ્વરૂપ, પારથને હેખાડયું રૂપ,  
અનેક મુખને અનેક લોચન, અનેક આશ્રમ ધરણી ગગન ૧૩

અનેક વિધ અસખ્ય અપાર, અનેક નેત્રને અનેક વિચાર  
અનેક દુર્ગત ચગણું ને શિય, અપાર રત્ન અને દરા દીરા ૧૪

અહુ નિધને તે જાનભાળ, અનેક દિવ્ય ઘોટે દયિચાર,  
અનેક રાજામૂર્યણું નળી, અહુ ધરુષને માણૂનળી ૧૫

ધરે દિવ્ય પુણ્ય ને વસન, દિવ્ય ગધનુ છે લેખન  
સિદ્ધિ પુણે મુગધ અનેક, અતિ આર્થાંજ વાધ્ય નિવેદ ૧૬

આવય્ય હૃપ સર્વે એન, અતિ રિષ્ય સુખ એદવો દેવ,  
મધ્ય વિશાસ અમલ જુઓ ચરિમાણ, દાનરો ભૂર્ય નત તેજ પ્રમાણ ૧૭  
સહલે ભૂર્ય નેમ ઉગ્યા હોય, એક સમે આકાશો સોય  
તેડ તથી કાતિ નેમ થાય, તેદવી કાતિ તે મદાત્મામાય ૧૮  
શરીરી દર્શના અવૃપ માહે, ડોડી અલાડ દેખ્યા છે ત્યાડે,  
એક સામદુ બાધ્ય જગત, બદુ પ્રકારે જુનત્વી રિંગત. ૧૯  
હેવાધિ દેવને દેહ અનુભવે, તેચે દામે દીકુ પાડવે,  
અદભૂતતા પેણને વિભમય થયો, ગદ ગદ કદ થકી બોલિયો. ૨૦  
કરે ત્યારે તે પ્રશ્નુપત્રય, વિરભમય પામ્યો રોમાચિત;

### ॥ અર્જુન ઉવાય ॥

મસ્તક નામી જોડિને જુગ પાણ, અર્જુન દેવ પ્રત્યે કહે વાખુ ૨૧  
આપના દેહ વિશે દેવેશ, દેવો પ્રાણી સૌ કરે આવેશ ૨૨

### ॥ પૂર્વ છાયો ॥

દરિ તમારા દેહમા દેખુ સર્વે દેવ,  
કમનાસન અલાય ને વળી મદાદેવ,  
પ્રાણી માત્ર સમુહને સર્વ કાય સેનાય,  
દિય નાગ દેખું સકળ, દેહ તમારા માય ૨૩

### ગોપાઠ

અર્જુન કહે પ્રભુ આખુનાર, તમ વધુમા સર્વે નિરધાર,  
આપના દેહ વિશે દેવેશ, વિવિધ વિચિત્ર સૌ ગેર અશેર ૨૪

શિર અન્ના અમુખ હેઠ અપાર, સર્વ કાળ લેણા નિર્ધાર,  
કિન્ન પક્ષ ને ગાંધસ તેહ, ગાંધર્સ સર્વને લેડે છુ લેહ ૨૫  
દીત્ય દાનર હેણુ છુ વગી, પાડવ સૈન્યા સી ટોગે મગી,  
દ્રોષુચાર્ય ભિમાદિક લેહ, પ્રાણી ભાવ નજરે પડે એહ ૨૬  
અનેક બાદુ ને ઉદ્ગ અનેક, અનેક શિષ્ય ને પણ વહ ૨૭

## ॥ પૂર્વ છાયો ॥

અનત અન એહેયા લમો, હેણુ છુ સર્વન  
કૌન્ચ પાડવ ઉભય દળ, આપમા પેણુ અન  
અત મધ્ય અને આદિ નહિ, સર્વો સયગચં,  
વિશુદ્ધ એ તમ તથુ, હેણુ વિશેષં ૨૮

મુગટ ગદા ચક છે લેહને, તેન કદેણુ નન્ય નન્ય  
દિલ્યમાન દીમે સકળ, કદે તે પેખાય,  
દિપ્ત અજિને સૂર્ય ને, તેહ કાતિ હોય લેમ  
પ્રમાણુ કન્વા યોગ્ય નહિ, તમને દેખું તેમ ૨૯

પ્રમ જાણુવા ગોર્પને, અશુર એમ ભમત  
પ્રમ ધામ આ વિશુદ્ધ, નમને નાડ સત્ય,  
સત્તા અર્વદા ધર્મનો ગ્રહાકારી નેદ.  
અભ્યય ઇપ ને સત્તાતન, માન તમને વા ૩૦

આદિ અતને મધ્ય નહી, અનત વીર વિચિત,  
અનત બાદુ લેણે, સૂર્ય ચરમા નેન  
મુખ હેણુ એહેણા લમો, પ્રદીપન અજિન દોષ ગેમ,  
પોતાને તેને ફરી, તો વિશ્વમા તેમ ૩૧

આકાશ પૃથ્વીને વિશે, અધ્યે દેખું જોઈ,  
જો દિશા નમો એકનું, વ્યાપું દીમે તેજા;  
કે મદાતમન નમ તથા, ઘોર ઇપ એદવું વધા,  
તે ઇપ દીડે થકી, ગ્રણ્ય શોક પામે વ્યથા. ૩૨

આ સમૂદ કે હેઠના, તે તુજમાં કરે પ્રવેશ;  
અધ્ય પામી કહેના રાયે, જેડી દાય વિગેય;  
મદા જરૂરિ ને સિદ્ધ ના, સમૂદ તે એ જોઈ,  
અધ્ય અધ્ય કષી અતિ ચુનું કરી, નમે તે તમને તેદ. ૩૩

ઓને આદિત્ય વસુ, અને સાધ્ય ત્યાં જોઈ,  
વિશ્વેદેવા અધ્યિતી, વાયુ પિતૃગણું તેદ;  
હેવ યક્ષ ગંધવની, સિદ્ધ સમૂદ ને ઝાય,  
સર્વ વિરસમય થયા થકા, જેયે તે તમને મોય. ૩૪

અહુ સુખ નેત્ર એને ધર્ણાં, આહુ ઉડ ને પાય,  
ઉદ્ર આદ્ય અહૂએ કરી, અતિ વિકરાશ દેખાય;  
મદાદ્ય ને તમ તથું, એહેદું દેખી લોક,  
સર્વ વધા પામે અને, હું પણ પાસું શોક. ૩૫

રૂપાં કરે આકાશને, દિસ વર્ણ વિચિત્ર,  
સુખ નિકાસ ને જગ્યાકતાં, અતિ વિશાળ તે નેત્ર;  
હું વિષય અહેવા તમો દેખી, હું પાસું વધા,  
ધૈર્યતા ન રહે મારી, ને પાસું નહીં સુખ સર્વથા. ૩૬

દાદ્યો એ વિકાણને, કાલામિ સુખ જોઈ,  
તે દેખી ભૂલ્યો દિશા, અને નહિં સુખ દેદ;

તે માટે એ વિનિતિ, સર્વાત્મ	સર્વેશ,
પ્રસંગ થાઓ તો હવે, જગ નિવાસ	હવેશ. ૩૭
હૃતરાખ્રુ સૂત સર્વ આ, સહીત બાંડું	રાજન,
બીજમ દ્રોષુ અને વળી, કર્ણુ સૂતનો	તંન;
તથા અમારા સૈન્યના, મહાગોદ્ધા ને	કોણ,
સુખ્ય સકળ તે માંલના, સરખા દીસે	સોય. ૩૮
ફાદ્યો એ ચિકાળને, અત્ય ભયાનક	કોદ,
સર્વે નમારા સુખ નિયં, કરે પ્રવેશ તો તેદ,	
વળી ડેઢલાં દંત શું વળાયા દીમે	એમ,
મસ્તક કયાનાં થક્કા, સુખ્ય હેઠે	તેમ. ૩૯
નહિ તણું નેમ નીરના, વેગ ધણું ત્યાં દોય,	
હોડે સાગર સન્મુખે, બળે તે તેમાં સોય;	
તેમ ને સુખ તો તમતણું, નેહેની જ્વાદા અગ્રન	
પૃથ્વીના આ વીર તે, તેદમાં થાયે	મગ્ન. ૪૦
જ્યમ પતંગ અતિ વેગશું, વિનાય થાયે	સોય;
દિઘમાન મહા અનદમાં, પ્રલ્યય પડીને હોય.	
વિનાસ થાલા વેગશું, તેમ આ લોકમાં તો નેદ,	
વહુ તમાય સુખને કિયે, કરે પ્રવેશ ત્યાં તેદ. ૪૧	
મહા ભયાનક ગુખ કરી, સખળે તે પ્રત્યક્ષઃ	
લોક સકળ પ્રસાન થકા, કરો તે અતિશો ભક્તઃ	
દે વિષ્ણુ તેને સકળ, જગત પૂરીડ આપ,	
ઉમ કાંતિ તો તમ તણ્ણી, ઉપજાવે સંતાપ. ૪૨	

જ્યથ પતા દીપકે બળી અણે, ત્યથ તવ સુખમાં આરી ભણે;  
 અજુનું કહે સાંભળો જગદીશ, હું હુષ્ટ સંદાર ને વાધ્યો ધરણ. ૫૨  
 ધન્ય ધન્ય રવામી આ અવતાર, દાસ રહ્યો અડો નમરકાર;  
 કર નોડીને લાગુ પાય, રવામી આ તેજ સચ્ચિ ના જાય ૫૩  
 હુભમાં સકળ જગત છે દરિ, એ વાત અદાગ મનમાં ફરી;  
 અવામી ઝડાડો મોદ ચૌ ગયો, આપ હૃપાએ પાતુન થયો. ૫૪  
 આગા નેવી કરે પ્રભુ આજ, નિશ્ચે તેદ કરીશ હું કાજ;

॥ શ્રી ભગવાનુખાચ ॥

॥ પૂર્વ છાયો ॥

હિત અથ તમો કોણ છો, મુજને કહે ધનમ્યામ  
પ્રસન્ન થાઓ દેવર, તમને કહે પ્રચૂમ ૪૩

આડે અલેના ને તમો, ન-ઝૂ રહેવા તેદ,  
નથી જણુતો તમ તથી, સર્ગ નાર્તો જોદ ૪૪

### શાપાધ ॥ અર્જુન ઉત્તાચ ॥ (ચાલુ)

અર્જુન કહે વ્યામી પિનતિ, ન આદ અત અપાર એ અતિ  
મધ્ય આગ અવદ્ધનો જોહ, અર્જુન એ નથી દેખનો જોહ ૪૫

ચદ સૂર્ય બાસે નેરને હામ, અમણ રૂરૂપ દીકુ એ ધામ  
હેઠ દાનવને કાયિ પિશુનિ, અનેક અજ શિદ, મૈઠે ગુનિ ૪૬

વ્યામી અવદ્ધ ધણુ વિષાગ, જોવા યોગ નદિ હુ માળ  
ન સૌભૃત્પ આખ ભયકારી, પિશુએ તમો દેખુ હ દનિ ૪૭

ધૂતરાજ્ટ્રના પુરો જોહ, તે પણ તુજ વિરો દેખુ તેહ  
ભિજુ પિતા ખીળ ગજન, ઓ કૌશ્વને હુરોધન ૪૮

શર રણુને ખીળ ગય, તે પણ તમ મુખમા દેખાય  
વળી આપણા પણ યોદ્ધા જોહ, સર્વે મુખમા પડિયા તેહ ૪૯

એમા તોસ્યામી આ સી દેખિયે, સર્વે નાશ થતુ પેણીએ,  
કૃત્વાએક તો દાદ્યમા રજા, તેમના પ્રાણુ દીમે લે ગયા ૫૦

અનેક શિશ વળુ દેખુ છુ જોહ,  
જનમ નહી નીર સાગરમા જાય, પ્રાણુ રહીત તજના હોય દેહ,  
ત્યમ શ્રીમુખમા આ રોઈ ધાય ૫૧

ન્યમ પતંગ દીપકે ભળી અળો, ત્યમ તર મુખમાં આવી મળો;  
 અજુનું કહે સાંભળો જગડીશ, તું હુષ્ટ સંદાર ને વાધ્યો ધશ. ૫૨  
 ધન્ય ધન્ય સ્વામી આ અવનાર, દાસ તણો અડો નમરકાર;  
 કર જેડીને લાગુ' પાય, સ્વામી આ તેજ સંચું નાં જાય. ૫૩  
 તુજમાં સકળ જગત છે દરિ, એ વાત મદાય મનમાં હરી;  
 સ્વામી મદારો મોદ જી ગયો, આપ કૃપાએ પાતન થયો. ૫૪  
 આજા જેવી કરો પ્રશ્ન આજ, નિશ્ચે તેદ કરીય તું કાજ;

### ॥ શ્રી ભગવાનુવાચ ॥

#### ॥ પૂર્વ છાયા ॥

અજુનું તું તો કાળ છું, લોક ક્ષય કર્યા સલી,  
 વાધ્યો લોક સંદારવા, રદ્દી પ્રથત્ત તે અહીં;  
 સૈન્ય સૈન્ય માંડે રદ્દા, યોદ્ધા છે સદુ જેહ,  
 તું પાણે કો એ અવર, નહિ જુવે એ તેદ. ૫૫  
 તે માટે તું જીને ધરને પામની આજ,  
 શત્રુજોને જતીને સમૃદ્ધિ યુક્ત કર્યની રાજ;  
 આ શત્રુ મેં પૂર્વે માર્યા છે તે દામ,  
 નિમિત્ત માત્ર તું થા લવે, આણુવલી દક્ષિણ વામ. ૫૬  
 દ્રોણાચાર્યને બાધને જયદ્રથ ને કણૂ,  
 યોદ્ધા જીજા પણ ધણા, તેદ પમાદ્યા ભણૂ;

\* કડી ૪૫ થી ૫૪ નુધીને માટે મૂળ ગ્રતમાં આ પ્રગાણે લખાય છે  
 “ નીચેની કડીયો પુનરદ્વિતી જણ્ણાય છે ”

તેણે તુ તો મારીને, વ્યયા ન મન પામીશ,  
સુદુ કરી તુ રહ્યુને કિએ, રહ્યુને હતીએ ૫૭

### ચોપાછ

ણેછ મેન્યાના યોધા જેઠ, પ્રાણુ વિનાના યોખા એદ,  
અજ્ઞુંન કાળ ન્યાયેા છે સહી, વષુ માર્યાં પણ છવશે નહીં અટ  
તે માટે તુ જય પામીશ, રહ્યુ હતી લય વામીશ,  
ગંગય ધર્મ એ લાય તુ સહી, એ મે પૂર્વે માર્યાં સહી ૫૯

### ॥ એ ઉગઘાતુવાચ ॥

#### વલલણા હંડો.

કાણે અજ્ઞુંન એ અક્ષજ કર્યો, તુ નિમિત્ત માર કરી જાણુ  
પૂર્વે પણ એદ મે માર્યા, સહેલે લીધા પ્રાણુ ૬૦

મહાકાળ સુજને લહો, કાળ પણ અહાર હૃપ,  
કાળ તણો હું કાગ હું, રસ્યમ સુજ અડળ અનુપ ૬૧

### ॥ સંજ્ય ઉવાચ ॥

સંજ્ય ધૂતરાધ્રરને કટે, અજ્ઞુંન પાયેા ત્રાસ,  
ગાઠગાઠ કદુ થયો થડો, કરે હરિ થરણે નિનાસ.  
વચન સુણી જગડીશના, પડયો પ્રશુને પાય,  
અનત રૂપ દીય હું, સ્વારી વિકળ ચિત્ત થાય ૬૨

કડી ૬૦ તથા ૬૧ માટે “નીચેની કઢીયો પુનરૂદ્ધિત જણ્યાય હે”  
એમ મૂળ પ્રતમા છે

કેરવનાં એદ્વાં વચન, સાંભળી અજુનાં;  
 કરી પ્રણામને હૃત્તા, બીહીતા બીહીતા મન.  
 કરી દરી નમસ્કાર કરી, ગદગદ્યા જોડી પાંથી;  
 શ્રી કષ્ટ્યુ પ્રત્યે એમ યદ્ધને, એલતા નમ્રન વાણી. ૬૩

### ॥ અજુન ઉત્તાચ ॥

કૃતિં તમદારી એ કરી, પામે દાં જગત;  
 હુપિકૈશ તમને ઘટે, રનેહે થાયે મમત.  
 દિરી દિરી રાક્ષસ અઙુ, નાદાસે બીહીતા હેઠ;  
 સગોદ સિધ્ધના સર્વ ને, નમે તે તમને સોય. ૬૪

કેમ તે ન નમે તમને, કે અનંત દેવેશ;  
 કર્તા અદ્વા આદિ પણુ, જગ નિવાસ સર્વેશ;  
 કે મદાતમન અતિ ગુરુ, માને માદારી મત્ય,  
 પરમાપા ને લગુણુથી, તમે તે અક્ષર સત્ય. ૬૫

આદિ દેવ તમે અને પુગણુ પુરુપ તો જોહ,  
 પરમ નિધાન આ જગતનુ, તમે વળી તો તેહ;  
 વિશ્વ જાણુ જાણુવા સરખા, પરમ ધામ લ્ય ર્થાન,  
 વિસ્તાર્યું છે વિશ્વ આ, અનંત ઇપ મદાન. ૬૬

વાયુ ધમ અર્દિન અને વડણુ અર્દમાં જોહ,  
 અલાને પ્રધિન મહ, દહીયે તમને તેહ;  
 તે કારણુ તમને નમૂં, નમૂં તે વાર હળર,  
 વળી વળી નમૂં દરી તમને, કરું તે નમસ્કાર. ૬૭

આગળ ને પાછળ નમૂં, તમને કરું પ્રણામ;  
 સર્વ ઇપ તમને નમૂં, દરી તે સધળે કામ.

અનંત વીર્ય તમો અમીત, વિક્રમ છો ધનસ્યામ,  
વ્યાપક છો તે સર્વમાં, સર્વ ઇપુ તર નામ ૬૮

તર ભદ્રિમા જાળું નાલિ, એહેવો હું તેણે કરી,  
પ્રમાદથી અયથા રનેહે સખા ભાવ મનમાં ધરી,  
તિરુરક્તાર કરતે થકે, કંચું હોય તે જેદ,  
હે હૃષ્ણુ, હે સખા, ને, હે યાદુ એમ તેદ. ૬૯

અનાદરે હસતો થકા, ને ને કીધા હોય,  
રમતો ચુતાં બૈસતોં, લોજન કરતાં સોયાં .  
એકંતે અયથા વળી, કોઈ દેખતાં જેદ,  
અપરમિત અહેનો તમો, ક્ષમા કરો સૌ તેદ. ૭૦

## ॥ ચોપાંદ ॥

કર જોઈને કરું પ્રથુામ, હું સેવક તમો મહારા સ્વામી;  
અનંત ઇપુ છો દૈવ દૈવશ, અકળ ઘણનો કર્યો ઉપદેશ. ૭૧  
આપ બૂ-તલ, ને આકાશ, વળી સર્વ ભૂતે હુજ વાસ;  
પુરાણુ પુરાય તુ આદિ જેદ, મહારો સખા કરી જાણ્યો મેંતેડ. ૭૨

## ॥ પૂર્વ છાચો ॥

સ્થાનર જંગમ જગત આ, તમો તેદના તાત;  
યોગ્ય પૂજાવાં જગતને, ગુરુ મહા ગુરુ વિષ્ણ્યાત.  
તર સમાન કો બીજો નથી, ત્રણે લોક મેઝાર,  
તો અધિક તે ક્ષયાં થકી, તર ભદ્રિમા નાલ પાર. ૭૩

તे માટે કાયા કરી, પ્રથમાને રખામીની,  
અતુલ કરવાને યોગ્ય છો, તમને કરું પ્રસન્ન;  
દેવ પિતા ત્યમ પૂજનો, સખા સખાનો નેમ,  
અનીનો અવામી નેમ સહે, મમાપરાધ સહેં તેમ. ૭૪

અદસ્ય પૂર્વે એ ઉપને, દેખું તો દર્શાયું દેવ,  
ભ્રમ એ મનમાંદે વ્યથા, વળી ઉપજે એવં;  
જગન્નિવાસ થાએ પ્રસન, સર્વાત્મા સર્વેરા,  
તે અવધ તો પ્રમ તણુ, દેખાડો , , , દેવેશ. ૭૫

કુષ્ટ શીર અને ગા, ચહેરા લાયમાં નેદ,  
એદલું ઉપ તો તમ તણું, દર્શાયું જોવા તેદ;  
હે સહન્ન બાડો અને વિશ્વમૃત્યુ દવે ત્યમ,  
કરો ચતુર્શુંભ ઇપને, પ્રગટ પૂર્વે ત્યમ. ૭૬

### દુદ્ધા

કુપુરના અભ્યાશ સહી, પિતા કરે ત્યમ લાદ,  
ત્યમ અપગાધ ક્ષમા કરી, દવે શાત ઉપ દેખારા;  
આશ્રય અતિ દેખીને, ભ્રમ પામ્યો હું તેદ,  
કૃપા રી મુખ દાસને, શાંત દરો પ્રભુ એદ ૭૭

### ॥ શ્રી જગવાણુવાચ ॥ . ,

હે અજુન મેં પ્રસન અછને, આ ઉદ્ધૃત્ય અતુપ,  
આત્માને ચોગે થડી, દેખાડ્યું તે . ઉપ;  
ન અંત આદિ તેનોમથી, વિશ ઉપ તું નેદ,  
તુ ચેહેરું દીકું નથી, બીજે ક્ષોધેંએ તેદ. ૭૮

વેદ પત્ર અધ્યયન અને, દાનેથી તે કોણ,  
કિયા કરે અને વળી, ઉથ તપાંચ દોષ,  
તિર્યાં નન જાપે કરી, એ ઇપ જોવાયે નહિ,  
તે તે અદેશે સુજ કૃપાયે, પ્રગટપણે પેખ્યુ સંદી ૭૬

કુરુ પ્રવીર તુ રિના અવગ, મનુષ્ય લોક મેઓઝાર,  
જોવાને સમરથ નહિ, અડેવેદ દું નિરધાર,  
ધોરણ્ય આ માલેરં, દેખીને અર્જુન,  
મૂહ ભાવમા યારા ને વ્યથા, મા પામીથ મંન. ૮૦  
નિર્ભય થધ સતોરે પામતો, અડેવો તો દું કેદ,  
નિરખ તે ઇપ માઢાર, દરી આગે હતુ તેદ,

### ૧૧ સંજય ઉવાચ ॥

નિશ્ચદ્રષ્પ સ કેલીને, ચુદ્રણ્ય ધર્યું તે વાગ,  
દિવ્ય ચનુ ઐ ચીયા ચર્મચનુએ જુઘે સાર. ૮૧  
અર્જુનને કૃષ્ણે પછી, કણુ પ્રખારે એહ,  
દેખાડયુ પોતાતણુ દરી ઇપને તેદ.  
મહાઆત્મા લેદોનો થધને સૌમ્ય શરીર,  
આશ્વાસન આદે તદા, ભયભીત ને વીર ૮૨

### ૧૨ અર્જુન ઉવાચ ॥

દાણદેર દોહરો.

સૌમ્ય ઇપ માણુસનુ જેદ, દેખીને જનાર્દન તેદ;  
દમણુ પ્રસન યયુ તે ચિતા, ડેકાણે આવી ભમ ભત્ય ૮૩

## ॥ શ્રી ભગવાનુચાચ ॥

યોપાઠ

જાન ચક્ષુ ગયા તુજ કરી, સૌખ્ય તપે દ્રષ્ટ તુજ ખરી,  
જોવા સરખુ અત્ય અનુપ, દીકુ જે તૂ માહાત રૂપ ૮૪

નિત્યે જોવને તે ઓથ, આકાશા કરે છે હૈલ  
ચેદેને તપે આચરી દાને ને વળા યોગે કરી ૮૫

યોગ્ય નહિ હો જોવા તેણ, તે દીયે તો હુ તે જેણ,  
નિષ્કામ ભક્તિ તે આચરી, મુજને જોયો તે જાને કરી ૮૬

ભક્તિ અનન્ય ભાવ ને ધરી, અજ્ઞુન સુજને તત્ત્વે કરી,  
જાણુના જોવા ધર્ષણે જેણ, પ્રવેશ કરવા સમર્પ તેણ ૮૭

પાસના રહીત કર્મ આચરે, મહારે રિષે સમર્પણુ કરે,  
હે અજ્ઞુન ને ભક્ત કહેવાય, દુષ્પ સગથી અળગો તે થાય ૮૮

આણી ભાગને વસ્તુન નેદ, મહારા ભક્તના લક્ષણુ ઓણ,

॥ પૂર્વ છાયો ॥

કર્મ કરે હુ નિભિન્ને, તજે શુતાદિક ક્ષગ,  
ઉત્કૃષ્ટ એક સુજને ગળે, માહારો ભક્ત અભગ,  
આણી ભાગમા કોઈસુ, વૈ ન રાજે જેણ,  
હે પાપવ એહુવો થકો, સુજને પામે તેણ ૮૯

दास देवो अधिदेवा सक्त, यावा परम युत्पन्नो भक्त;  
योग शास्त्र ने अहं विद्याय, विश्वर्णन अगिपां अभ्याय ६०

इति श्रीमद् भगवद्गीता सुपनिषद्सु शब्द विद्यायां योग  
शास्त्रे श्री कृष्णार्जुन मंथादे विश्वरूप दर्शनो नाम  
एकादशोऽत्यायः ॥ १२ ॥



## ભગવદ્ગીતા અધ્યાય-૧૨

### ॥ અજુન ઉવાચ ॥

અજુન કહે સાંભળો મહારાજ, આપ દૃપાણે સર્થો મુજ કાજ;  
એમ નિરંતર યોગે ખુક્ત, તમને અક્ષર ને અભ્યક્ત. ૧  
આરાધે અને ભક્ત પણ ધાય, એષ્ટ ડિયો તે એ એ ભાંય;  
ન્યાભી ભક્ત તમારા કહેરાય, કોણુ લક્ષણે તે ઓગભાય. ૨

### ॥ શ્રી ભગવાનુવાચ ॥

વળતાં વચન કહે ભગવાન, મદારા ભક્ત કરે સુજ ધ્યાન;  
યોગી પરમ ને અદ્ધ ધરી, મન આવેશ હું માડે કરી. ૩  
મુજ વિષે મન રાખે આસક્ત, અહેવા લોય તે લહો મમ ભક્ત;  
ઉપાસના ને માહારી કરે, માહારે મન તે યોગી શીરે. ૪  
પર્મ ગ્રે દઠ અદ્ધ ધરી, હદ્ય પ્રહુદિવિત ભજતા શ્રી હરિ;  
કે કો અક્ષરને અસ્ફૃષ્ટ, અભ્યક્ત અને કુટરથ. ૫  
સર્વ વ્યાપી અચક ચિત્ત ધરી, કરે ઉપાસના માડેરી;  
સમ દર્શી ને સધણે હોય, સર્વ ભૂત હિતકારી સોય. ૬  
ઇદ્રિ નિયમે રાખે જોઈ, ભજને મુજને પામે તેઢ;  
એકાગ્ર વૃત્તિ ધરી કર્મ કરે, અદ્ય વૃત્તિ ન મનમાં ધરે. ૭

અલ અર્થે અલ્લાર્ખું ભતિ,  
અવ્યક્ત આસક્ત ચિત્ત નેહને, લ્યમ સાધ્યા સેવે નિર પતિ  
અને અર્પણ અશુન તેહને ૮

દેહ ધારીને અન્યક્તની,  
ને હોયે હુ મત પર્મ,  
ઝુજને સોપે સર્વ કર્મ. ૯

અનન્ય ભાવ મન માહે ધરે,  
નેછે ઘારે વિને ભારત,  
ઘાર ભાન ઉપાસના વરે,  
નેછે પોતે આરોધ્યા છે ચિત્ત ૧૦

હેને મૃત્યુ સાગર સસાર,  
થોડે કાળે કર ઉદ્ધાર,

### ॥ અશુન ઉવાય ॥

સ્વામી મનની ચંચળ ગતિ,  
અલ વિરો ક્ષ્યમ રહે દિયર ભતિ ૧૧

### ॥ મી હૃપદ્ય ઉવાય ॥

અશુન મન ચચળ કલેવાય,  
માદારે વિરો-૦૪, તુ મનને ધર,  
અભારે વિરોઝ, મુહ્લિને કર. ૧૨

અતે પામીશ મુજને સહી,  
માદારે વિરે ચિત્ત ધરવા યદા,  
મુજને પામવા ઈરી આશ,  
એ વાતનો સહેદ નહી, ૧૩

જે તુન્યથી અભ્યાસ ન થાપ,  
કરતો કર્મ અર્થે માદારે,  
તો કર્મ માદાગ ને ધ્યાપ,  
સિદ્ધ હરી પ્રાપ્તી લાદરે ૧૪

આસક્ત હોય એ કરવા વિરે,  
આત્માને નિયમમા રાખ્ય,  
તો ઘારે શરણુગત યકે,  
સર્વ કર્મનુ કળ કર્ય ત્યાગ ૧૫

अन्यास थकी त्रैय ते ज्ञान, ज्ञान थकी निशेप छे ध्यान;  
 ध्यान थकी कर्म इव त्याग, त्याग थकी शांति अनुराग. १६

ने करी न शकाय अन्यास, कर्म अल्पापित्तन धर्म को आश;  
 सर्व कर्म सुने अपीय, कर्म थकी ते धूमी जप. १७

तप तीरथ योग ने याग, कर्म करे पशु इत्यनो त्याग;  
 पारथ ग्रत्ये कहे भगवान, अन्यास योगथी उपने ज्ञान. १८

ज्ञान योगथी ध्यान उपने, ध्यान थकी कर्मकरने तजे;  
 कर्म इव तजे भोक्ष पानीये, भोक्ष थकी भय भवनो वानीये. १९

प्राणीभावनो न करे दैय, निर्मात्र अहंकार न रैय;  
 तथा भित्र ने करण्यावान, क्षमावंतने हु अ सुख समान. २०

योगी अदर्श संतोषमां, द्रष्ट निर्यथ नियमे आत्मा;  
 अनने भुष्मि राखे हु भाव्य, एवो मुज्जने वाहाको सदाय. २१

ओमग्र भिय वयन उच्चयरे, सत्य लितकारी सौ श्रवणे धरे;  
 डेने उद्देग न करे ज्ञेह, पामे उद्देग न डोथी तेह. २२

ह्यायुक्त रहीत अहंकार, हु गहाँ नव्य करे लगार;  
 धर्म शोक भय उद्देगथी मुक्ति ग्रिय मुज्जने सर्वथी. २३

डोहने भय न उपलवे ज्ञेह, कोयी भय नव्य पर्मे तेह;  
 हर्म शोकने सरणे वेभवे, आत्म ज्ञान अंतर अनुभवे. २४

दक्ष पवित्र अपेक्षा रहीत, पक्षपात अने हुःभ वहीत;  
 पवित्र, उदार, विचक्षण ज्ञेह, मुख हुःभ इंद्रादि सभ लडे तेह. २५

सर्व आरंभ त्यागी नेह,  
 राग हैप मह पर्वत सही,  
 हैप नहि हर्ष नव्य धरे,  
 लाभ थये न मोह उपने,  
 त्यागी शुभ अशुभथी नेह,  
 शनु भिन विषे सम इष्टि,  
 शीत उध्युसुभ्युः असम सोप,  
 मौनी निदा रतुनि समान,  
 नहि गर्व लेह अभिर्मान,  
 नवधा असत धय वर्तु नेह,  
 इसा असत पथ वर्तु नेह,  
 नवदारा इतुगामी नेह,  
 एवा भक्त कहावे नेह,  
 स्थानक नहीं खुद्धि रिथर होय,  
 है अर्जुन तु जाणुने तेह,

प्रिय भक्त ते शुजने तेह;  
 आरा छोनी क्यारे हृष्णे नही. २६  
 आकंक्षा के शाच नव्य करे;  
 लाखु थये सममति नां ताने. २७  
 भक्तिमान प्रिय भम तेह;  
 भानां अपमाने समतुष्टि. २८  
 अने निरासक्त ने होय;  
 खमुक्षु ने न रहे की रोप. २९  
 नेहे तेहे अंतोपवान;  
 अहारे विषेथी रहे अणगो। नही ३०  
 स्वधर्मे दह धीमान;  
 अहा युक्त स्वधर्म आचरे. ३१  
 अहास भग्ननथी संतोपाय;  
 शुजने आत्म निवेदन करे. ३२  
 डुड कपटथी रहे अणगो। तेह;  
 भारा भक्तता एवा धर्म. ३३  
 अहर्यम् नर भर्तुमि तेह.  
 भारा पदने पामे तेह. ३४  
 भक्तिवंत प्रिय शुने सोप;  
 भारा भक्तनां लक्ष्य एह. ३५

धर्माभूत क्षेत्र आ नेह, उपासे तेहेने तो नेह;  
श्रद्धा सुकृत भत पर हैय, ओहेवा अकृत प्रिय मुने सोय. ३६

जीपाल कृष्ण हयाना धृष्ट, तेथी ते वाणी अत्य अभिष्ट;  
योग शास्त्र ने अहं विद्याय, अकृत योग द्वादश अध्याय. ३७

इति श्रीमद् भगवद्गीता सुपनिपत्सु ब्रह्म विद्यायां योग  
शास्त्रे श्री कृष्णार्जुन संवादे भक्ति योगो नाम  
द्वादशोद्यायः ॥ १२ ॥



## ભગવદ્ગીતા અધ્યાય-૧૩

### ॥ અર્જુન ઉવાચ ॥

અર્જુન કહે હે વિશ્વાધાર, પ્રકૃતિ પુરુષનો કરો વિચાર;  
હે દૈશવ મમ ધર્મા એહ, જાણું પ્રકૃતિ પુરુષ તો તેદ. ૧

ક્ષેત્ર અને ક્ષેત્રજીવના જાણુ, તथા જીવન ને જેવ પ્રમાણ;  
ક્ષેત્ર ઇપ તે જાણુ કહેવાય, ક્ષેત્રજીવ તે ધ્રુમ ઓળખાય. ૨

જીવન કહેનું કહેવાયે નેહ, જીવને કરીથું જાણવું તેદ;

### ॥ ઓ ભગવાતુવાચ ॥

હે દૌન્તેષ દેહ આ નેહ, ત એવું કરીયે તેદ. ૩  
શરીરનો ધરતા છે નેહ, ક્ષેત્ર જીવની કરીયે સુષુપ્ત તેદ.

અમ કરી જાણુ દેદને, ક્ષેત્ર જાણુ કરીયે તેદને. ૪

દેહ આત્માનો કે વિવ્યાગ, એ તે જીવજ કરીયે સાર;  
સર્વ ક્ષેત્ર માંહે ક્ષેત્રજી, તે મુને જાણુ હું અર્જુન. ૫

ક્ષેત્ર ક્ષેત્રજી તથું જાણવું, તે જીવન માણાડું માનવું.

### ॥ પૂર્વ છાચો ॥

નેહેનું છે એ ક્ષેત્રને, જવિક્રમ રહે એ નેહ,  
અને જ્યાંથી ઉપલબ્ધ છે, ને નેહેનું તે તેદ;

तथा वणी क्षेत्रजने तेहो। भहिमा होय,  
संक्षेपे ते सर्वने, सांभल ने तु सोय. ६

## ॥ श्रीपाठ ॥

अपिञ्चे गायुं अहु विधि करी, वेद प्रथक भाव विस्तरी;  
वेदांत सूत्रे वाहु विधि, पहे, अने दृष्टांत वाक्यने वहे. ७

पंच महाभूत ने अदंकार, अने शुद्ध भावा विस्तार;  
ऐकाहश धूषि तो नेह, गोचर पांच शब्दादिक तेह. ८

धृष्णा होप सुख हुःअ ने होय, चेतन्ये विकार ते सोय;  
हे अर्जुन एम वहे भगवान, गुड सेवाये लक्ष्मीये शान. ९

संक्षेपे क्षेत्र तो एह, विकार सुकृत क्युँ ए तेह;  
भान दंब ने दिसा नहीं क्षमावानने सरलता सही. १०

उपसे आचार्यने नेह, शुचि रियर नियमेआत्मा तेह;  
धृष्णियार्थे वेदाय नेहने, अने अदंकार नहि तेहने. ११

पहार अंदर शुद्ध वैदाग, आत्मा अने धृष्णिनो त्याग;  
दूनम भूत्यु जडा हुःअ नेह, व्याधि हुःअ होय न है तेह. १२

कुत शराहि अने गेहने, न होय आसक्तन संग तेहने;  
संसार ओग ते विषय समान, अर्जुन ए ते कहीये नान. १३

इडा भूडानी प्रापत्य, समान होये ने नित्ये चित्य;  
अनन्य भाव विषे भाइ, अन्यभियादिष्टी भक्ति आयहे. १४

એકાંત સ્થળને મેવે સદા, સભા મનુષ્યની પ્રોત્ય ન કદા; ૧૫  
 અધ્યાત્મ જ્ઞાનમાં નિત્યે હોય, હેથે તત્ત્વ જ્ઞાનાર્થ ને સોય.

એમ કહું તે તો એ જ્ઞાન, એથી અન્ય તે સર્વ અજ્ઞાન; ૧૬  
 જાંખું વા યોગ્ય વસ્તુ તે કહીશ, ને જાંખેથી મેલા પામીશ.

શુદ્ધ કહું તે સાંભળ વાત, સ્વર્પ અજ્ઞાને નહિં માત કે તાત; ૧૭  
 પર અજ્ઞ આદિ નહિં જેહને, અને સત અસત નહીં તેહને.

તેહને દર્શન પાછ સર્વત્ર, તેહને સમગ્રે શિર મુખ નેત્ર; ૧૮  
 બોક વિશે સધળે તે કર્ણ, સધળે તેહેનું આ આશર્ણ. ૧૯  
 શોભાવે છાંદ્રી શુણ જેહ, સર્વ છદ્રિથી વર્ણત તેહ; ૨૦  
 પ્રાકૃત છદ્રિ વર્ણત જેહ, ત્રિગુણુતીત સૌ વ્યાપિ તેહ.

નહિં આસક્ત સર્વને ધરે, નિગુણ શુણુના બોગજ કરે; ૨૧  
 સર્વ ભૂતમાં સધળે વાસ, બાહેર ભીતર સર્વત્ર પ્રકાશ. ૨૦  
 બાદ અંતર પ્રાણીને હેહ, સ્થાપન ને જગમ તે તેહ;  
 સર્વ ગુણુનો બોકતા છે જેહ, દૂર સમીપે રહે છે તેહ. ૨૧

એ ત્યાં જ્ઞાન કહું છે સાર, શાને શુણ ત્યાગે નિરધાર; ૨૨  
 મુખ કેમે કરી જણ્યાયે નહિં, દૂર રહ્યુ ન પામે સહી. ૨૩  
 ત્રિગુણુના વિપ્ય છે જેહ, અમૃત સરખા જાણે તેહ;  
 ભૂત વિષે થયા નથી વિભાગ, દીસે છે જેમ થયા હોય ભાગ. ૨૪  
 પોતે અસે ઉપજાવે જેહ, સર્વ ભૂતમાં જાણ,  
 તે તો તેજસ્વીતું તેજ, અજ્ઞાનથી પર.

જ્ઞાન જેવ જાને લડે, સૌના હુંમ માઢે તે રહે,  
 ક્ષેત્ર જ્ઞાન જેવ તે જેહ, સંક્ષેપે કહું તો તેહ ૧૫  
 ભારે ભક્ત એમ જાણે મોય,  
 પ્રકૃતિ પુરુષ એ તો એહને, મુજબ ભાવ પામના ચોંગ તે હોય,  
 અનાદિ જાણું એ તુ તેહને ૨૬  
 વિકાર સર્વને ગુણું તો જેહ,  
 અન તથુા ગુણું કહીયે જેહ, પ્રકૃતિ થઈ ઉપજના તેહ,  
 એનો નિયાર એક છુ તેહ ૨૭  
 પ્રકૃતિને સંજોગે રહી,  
 સયોગ મારે ગુણું કહેનાય,  
 પ્રકૃતિના ગુણું બોગવે સહી,  
 વસ્તુત તત્ત્વે તે ના લેપાય ૨૮  
 રાષ્ટ્રિક મણીના ગુણું કહેનાય,  
 કાર્ય કારણ રત્નાં તણું,  
 જેરા સાથે તે તહેના થાય,  
 મદત પ્રકૃતિ એમ મુનિએ ભષ્યુ ૨૯  
 કલી હતી એક પુરુષ પુરાણું,  
 જીવાત્મા પરમાત્મા એહ  
 એવો ભર્મ અજુનું તુ જાણું  
 વસ્તુત તત્ત્વે એકજ તેદ ૩૦  
 એ જ્ઞાન જ્યા લગી આવે નહિ,  
 સુખને દુખનો બોગી જેહ,  
 ત્યા વગી પશુવત જાણો સહી,  
 પુરુષ એમ કરે તે તેહ ૩૧  
 પુરુષ પ્રકૃતિ આધારે રહે,  
 શુભાશુભ ચોનિ જન્મને હોય,  
 પ્રકૃતિજ નિત્ય ગુણું બોગજ અડે,  
 ગુણું સગને કાગણ સોય ૩૨  
 ભરતા બોક્તા આ દેહમા,  
 સર્વ વસ્તુ દેખાડી તેહ,  
 પરમ પુરુણે પરમાત્મા,  
 મે તે કદ્વી પરમેશ્વર તેહ. ૩૩  
 સર્વ કર્મ તે પ્રટૃતિ બેદ,  
 આત્મા અગરો અભેદ અછેદ,  
 પ્રકૃતિને આશ્રીતે જેહ,  
 પ્રેરી કર્મ કરાવે તેદ ૩૪

જે ડો એમ પુરુષને લડે, પ્રકૃતિને શુષ્ણ સંગે કરે;  
તે જે વિધિ સર્વે પરહરે, તોડે જરૂર કરી નાચ ખરે. ૩૫

આત્માએ આત્મામાં હોય, ખાને આત્મા હેઠે સોય;  
પરમાત્મા આત્મામાં હોય, ખાને કરી આત્માને જોય. ૩૬

સાંઘ્યે ને યોગે ડો અન્ય, કર્મ તણે યોગે ડો ભિન્ન;  
ખીળ કોઈ અગાંધે કરી, અન્ય કોઈથાં શ્રવણે ધરી. ૩૭

ભાવ થણો ઉપાસન કરે, અવણુ માત્રે તે ઉદ્ધરે;  
સ્થાવર ને જરૂર ગમ જે હોય, પ્રાણી માત્રની ઉત્પત્તિ હોય. ૩૮

ક્ષેત્ર ક્ષેત્રનુ કલાં તે જેહ, ભરતર્ભ યોગે તે તેહ;  
સર્વ ભૂત માદારે સમાન, પરમેશ્વર જે પર્મ નિધાન. ૩૯

નારૈ નારા ન થાયે જેહ, તેવુ જાણે હેણે તેહ;  
સધળો રહ્યો સમ ઈશ્વર જેહ, સમાન તેહને હેણે તેહ. ૪૦

દાણે ન આત્મે આત્મા જદા, પ્રાપ્તી હોય પરમ ગતિ તદા;  
કર્મ કરે તે કર્તા પ્રકૃતિ, હેણે એમ કર્મની વ્યક્તિ. ૪૧

કર્તા ન હિં કાંઈ આત્મા એહ, એમ હેણે તે હેણે તેહ;  
પૃથક ભાવ પ્રાણીનો જેહ, એક સામટો હેણે તેહ. ૪૨

તેહ થકો હેણે વિશ્વાર, તદા અલ હેણે નિર્ધાર;  
પરમાત્મા અવ્યય છે એહ, અનાદિ નિર્ગુણ માટે તેહ. ૪૩

રહે હીતેય શરીરજ માંય, કરતા છતાં તે નાં લેપાય;  
પંડ અજ્ઞાને વ્યાપ્યે છે સહી, વરસુતઃ તત્વે કાંઈ અંધન નહીં. ૪૪

સર્વે વ્યાપક જેમ આકાશ, સૂર્યમ છતાં કથીં ન પડે પાસ;  
ન્યમ આકાશ નિરંતર વાસ, સમગે હિંકર કરે પ્રકાશ. ૪૫

ત્યમ આત્મા વ્યાપક કરી જાણુ, જરા મૃત્યુ નહીં લાગુ કે હાંણુ;  
તેમ સર્વના દેહમાં રહી, આત્માને કેપાયે નહીં. ૪૬

આ સમગ્ર લોકનો જેમ, કરે પ્રકાશ સૂર્ય એક તેમ;  
ભારત સર્વ શરીર તો એહ, કરે પ્રકાશ આત્મા તેડ. ૪૭

તે નર જીવી કથીયે વેદ, પ્રકૃતિ પુરુષના જાણે બેદ;  
પ્રકૃતિ ભાપાનો વિરતાર, આત્મા અળગો રહીત નિકાર. ૪૮

એમ કરી નર જાણે જેડ, ભાપા રહીત જાણુન્યો તેદ;  
જે ડો જીબ નેત્રે કરી, ક્ષેત્ર ક્ષેત્રનુ જીબ ચિત્ત ધરી. ૪૯

શુદ્ધ પ્રકૃતિ ગુંડિત લડે જેહ, પરમ મોક્ષને પામે તેડ;  
દ્વ્યો દાસ લહી કદણું કરી, તેણે કાણ્યે કથા ઉચ્ચરી. ૫૦

યોગ શાસ્ત્રને ઘણ વિદ્યાય, ક્ષેત્ર ક્ષેત્રનુ નયદશ અધ્યાય. ૫૧

ઇતિ શ્રીમહ ભગવદ્ગીતા સુપનિપત્સુ વ્રહ્મ વિદ્યાયાં યોગ  
શાખે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ નિર્દેશ યોગો  
નામ ચ્રયદર્શોધ્યાય: ॥ ૧૩ ॥



રજેયણું છે રાગાત્મક સોય,  
 દે કીંતેય પ્રાણીને દેહ, તૃષ્ણું સંગે ઉપત્તિ હોય;  
 તમો ગુણ અજ્ઞાનથી થાય,  
 પ્રમાદ આખસ નિદ્રા ધરે, પ્રાણી માનને મોહ ઉપલય;  
 મોહ નિદ્રાને આખસ નેહ,  
 સતત ગુણે ને દેહ બંધાય,  
 તમો ગુણે તો બંધાયો દેહ;  
 સતત ગુણુથી શાન ઉપને,  
 સતતગુણુ સુખને મેળવે, શાન યુક્ત થઈ મુજને ભને;  
 રજેયણે કરી લોભ ઉપને,  
 જાનને હાંકી ભારત,  
 રજેયણે કરી લોભ ઉપને,  
 જાનને હાંકી ભારત અનુભવે. ૧૧  
 તમો ગુણે ઉપને અજ્ઞાન,  
 ધરી જ્ઞય રજ તમ ગુણ પદા,  
 તમ ને સતત ધટેં રજ હોય,  
 શ્રોત્વાદિ દ્વારાએ પદા,  
 અને શાનનો સંબન્ધ હોય,  
 ભારત લોભ ગ્રવતો તે નેહ,  
 તથા અસમ ધર્યા તો મોય,  
 અ વિવેક અનુધમ જેહ,  
 તમો ગુણ વધે હોય તે પદા,  
 જ્યારે સતત ગુણ વૃદ્ધિ હોય,  
 રજેયણ વિષે નાશ જત્ત હોય,  
 સંગ કર્મને બાયે તેહ. ૯  
 પ્રાણી માનને મોહ ઉપલય;  
 ભારત તહેને બંધન કરે. ૧૦  
 બંધન કરી હરિ સેવા તજે;  
 રજેયણ કર્મને અનુભવે. ૧૨  
 લોભ થકી હરિ સેવા તજે;  
 તમઃ પ્રમાદમાં પ્રેર ચિત. ૧૩  
 અજ્ઞાન તે તો નરક સમાન;  
 ભારત સતત વૃદ્ધિ હોય તદા. ૧૪  
 ધટેં સતત રજ તમ તે સોય;  
 પ્રકાશ હોય આ દેહે તદા. ૧૫  
 જાણે સતત ગુણ પ્રગટ્યો સોય;  
 અને કર્મ આરંભ વળી તેહ. ૧૬  
 રજેયણ વૃદ્ધે એ તે હોય;  
 અને પ્રમાદ મોહ તો તેહ. ૧૭  
 કુઝ નંદા એ ઉપને તદા;  
 અને શરીર તને તે કોય. ૧૮  
 જેહેના લોકને પામે તેહ;  
 કર્મી લોકે જન્મે સોય ૧૯

નારા થાપ તમોગુણમા જરા,  
 સાતિનાનુ ઇવ નિર્મલ જોડ,  
 રલેગુણનુ ઇન ને દુઃખ હોય,  
 સત્ત થરી તો ડોયે જાન,  
 તમો ગુણે અજાન ઉપજો,  
 ઉત્તમ ભધ્યમ અધોગતિ જોડ,  
 સત્તવગુણી તે હિચા જાય,  
 નીચ ગુણે આત્મયા જોડ,  
 હેઠે રઘુનાર જરૂ જરન,  
 ત્રિગુણાતિત અહેવા જે જરન,  
 ગુણથી પર એમ જાણે જોડ,  
 દેહ જત રષ્યે ગુણ જોડ,  
 દુઃખ સુખ જરા સૃદ્ધુને જર્નમ,  
 પગુ ધોનિમા ઉત્પત્તિ હોય તરા,  
 સુદૂર કર્મને ડરીયે તેદ ૨૦  
 તમો ગુણે અજાન ને સોાન,  
 રને ગુણે લોભને માન ૨૧  
 મોદ પ્રમાદ ભાને ભજે,  
 ત્રિગુણના દરખ્ય છે તેદ ૨૨  
 રાજકી ભધે સ્થિર થાય,  
 નીચા જાપ તામસી તેદ ૨૩  
 કરી ગુણોથી આત્મા બિન;  
 જર્નમ ભરણ રહિત પાન ન ૨૪  
 ભાદાગ ભાને પામે તેદ,  
 તેદને અતિકરી હેઠી તેદ ૨૫  
 તેથી સુકત તે પામે પદ પર્મ,  
 અનુભૂતિ હિચાય ॥

કોયે ચિનહે કરી પ્રશ્ન કોય,  
 અનુભૂતિ કરે ત્રિગુણ અતિકરે એહેવા કોય. ૨૬  
 અનુભૂતિ કરે ત્રિભોગન રાય,  
 વ્રણ આયાર ઉપાય તે જોદ,  
 ત્રિગુણાતીત તે ક્ષયમ ઓળખાય;  
 વર્ણે ગુણો અતિકરે તેદ ૨૭

॥ શ્રી ભગવાનુપાય ॥

પ્રકાય પ્રટપ્તિમાર્કો પાડનેદ,  
 તેદને દ્વૈપ કર દુઃખ વહી,  
 પ્રજ્ઞે ગુણે ઉપજાય તેદ;  
 નિરાત્મે સુખ આકાશા નહી રૂપ ૨૮

रहे तदन्थनी पर्यो थध, शुश्रे करी थगे ते नहीं,  
 वते शुश्रे तथो स्वभाव, एम एडे अथव रिह भाव २६  
 दर्श गोइ छे तेने समान, शुश्रे क्षोह काप्ट पायाण,  
 शुभ हुःअ सम द्वय चित रहे, लाप्ट कांचन सम लही ना यहे. ३०  
 हेखालो ने काचन ऐ सम लहे, दृ भावने सम्प्रक दहे,  
 वाढालो अथुनादालो सम द्वाय, सम निंदा शुति धरिए हाय ३१  
 अर्जुन अष्टे राने करी, सधपे व्यापक हेजे हरि;  
 शनु मित्र गण्डे उभय समान, शुति निंदा नदि भाव अपभाव. ३२  
 शुश्रे धर्म करी थाय प्रवर्ती, शुश्रे दोपयी सदा निर्वाय,  
 सब आरभे इणने तरे, निवाण अकित मे शुजने भने. ३३  
 सर्वावे परियागी होए, शुश्रातीत ते कहीये भोय,  
 अहा कुत थध मुजने धाय, ते तो विशुश्रातित कडेवाय ३४  
 अव्यभियागिष्ठी अकित आचरे, एम धडा भम भेना करे,  
 शुश्रे उद्दनंधीने तेह, पामे भोक्तु विना सहेह ३५  
 निशुश्रे अकित महाग निवास, सदा भायाथी है उदास,  
 अमृत ने अव्यय ते केह, धर्म ३५ सनातन तेह ३६  
 अने अकिति क सुभ ने कह, एकेवा धर्मनी प्रतिभा है,  
 दास द्वाने करी हरि भेहेह, तथे लही अध्यायनी पे ३७  
 थोग शाख ने अहा निवाय, शुश्रे विभाग चौदमो अध्याय ३८

हति श्रीमद् भगवद्गीता सुपनिषत्सु व्रह्म विद्यायां योग  
 शाखे श्री कृष्णाञ्जुन संवादे शुणचय विभाग योगो  
 नाम चतुर्दशो ध्यायः ॥ १४ ॥

## ભગવદ્ગીતા અધ્યાય-૧૫

### ॥ પૂર્વ છાયો ॥

અથ ઇપી મૂળ છે ઉંચું, ભવ ઇપી અખૃત્ય;  
 શાખા હેરી તેહની, અલાદિક જે કરેણ;  
 વેદ પત્ર તો તેહનાં, તેહ ન જાણે નેદ,  
 વેદ તણું તો અર્થને, પ્રોષે સર્વે તેદ. ૧

ઉંગી નીચી તે તણી, અલાદિક જીવાદિ,  
 શાખા વાધી છે ગુણે, વિવ્ય પ્રવાદ રાખાદિ;  
 મતુષ્ય લોક માંહે ધણું, કર્મ બધ તે નેહ,  
 મૂલયી અનેક પ્રકારનાં, પ્રસયો છે તે એહ. ૨

અને ઇપી તે એહનું, પામી ન રહે ડોય,  
 આદિ અંત પણ નવ્ય જરૂરે, રહે ક્રમ તે સોય;  
 દ્રદ મૂલ અખ્ય ત્યારે, અહુકાર માપાય,  
 એહ અસંગતે શરૂ બળે, તે તોં છેદું જાય. ૩

પદી ઐળવું પરમ પદ, નેહને મહિમા એહ;  
 દરી ન આવે ભવ વિષે, જે પદ પામ્યા તેહ.  
 અહિત કરી જવા શરણું, મનમાં કરે નિવ્યાર,  
 પ્રશ્નરી છે જે મુદ્દ્યથી, પ્રવત્યો નેણે સંસાર. ૪

અહંકાર ને મોદ રહિત, સંગ હોય જીત સોય,  
આત્મજાને પડવને, કામ નિવત્યો હોય;  
દુઃખ બાબ મુખ દુઃખથી, મુક્ત હોય તે જેહ,  
અભ્યાસ પદ પામે સહી, એકેવા જાતી તેહ. ૫

### ચૌપાઠ

અનંત કૃપા અજ્ઞુનને કરી, સંસારનું હૃપ કહે શ્રી હરિ;  
એ અશ્વત્થ નામે વૃક્ષ વિશાળ ઉંચા મૂળ ને નિમાં ડાળ. ૬

શ્રીધર સ્વામી કરે વિસ્તાર, એક હેઠ ભીજે સંસાર;  
સંસાર વૃક્ષ તે હેઠ પ્રમાણુ, મરતાક મૂળ પદ ડાળ નિર્ણાણ. ૭

મૂળ સીંચે શાખા પુષ્ટિ થાય, મુખ દારે ઈદ્રિ સી સંતોષાય;  
વધુ વૃક્ષ જોતા વધુસી જાય, માટે અશ્વત્થ વૃક્ષ કહેવાય. ૮

હેઠ વૃક્ષ વર્ણવું અજ્ઞુન, સંસાર વૃક્ષનું કહે વર્ણન;  
વિપરિત ગતિ અન્યો સંસાર, ચોવીશ તત્ત્વ શાખા વિસ્તાર. ૯

પર અલ મૂળ તે જિચું રહ્યું, સંસાર મૂળ તે એ થણી થયું;  
દ્વારા ઈદ્રિ પંચ ભૂત અહંકાર, ભહતત્ત્વ માથા અહુ વિસ્તાર. ૧૦

નિગમ પત્ર કદ્દિયે નવ સ્વરે, યુગમ ઇણ ઉપજે નિસ્તરે;  
એ વૃક્ષની ગતિ જાણે જેહ, વેદવેતા પુરુષ છે તેહ. ૧૧

વળા તે વૃક્ષને વર્ણને દરિ, ખીજ મૂળિયો અહુ વિસ્તરી;  
રાગ દ્રોપ મહુ મોહ અહંકાર, કર્મ મૂળનો અહુ વિસ્તાર. ૧૨

દેદ વૃક્ષ થયો નીચા સૂર્ય નડે, વાર ગર ઉપજે તે પડે,  
કર્મ જીવન શાખા દુમ તાણી, નિયુણુ પુષ્પની ગોભા ઘરી ૧૩

એ દુમનું દર્શન નન્દ થામ, સ સાર વૃક્ષ છેદો નન્દ જાય  
ન જણ્યાય આધ મધ્ય ને અત, સ સાર વૃક્ષ મેદાહ અત્યત ૧૪

વૃક્ષ છેદવા તથે ઉપાય, કહુ વિસ્તારી અર્ગુન રાય,  
તારવા અદ-ખન-સુત-સુફરી, અસગ લક્ષ્યણ આતુખ ધરી ૧૫

ખીણુ જાન ખડગ ચેદેવુ જ્ઞાતકા<sup>૧</sup>, ત્રીજે વિવેકધ્યા તે કૃદાર<sup>૨</sup>,  
નપુ આધુધથી કીજે પ્રદાન, તો છેદાય ખૂળ સહીત સ સાર ૧૬

સ સાર વૃક્ષ સમૂર્ગો ગયો, મુદ્દિન પામવા ચાંદ્ય તે થયો,  
જતુની જરૂર તે પામે નહિ, મમ ચરણેણુ નેની મત્ય સહી ૧૭

ગીત્યો મોઢ સ સાર પરદયો  
તે સુખ હુએ નિરૂત થાય, સર્વાંત્મ ભાર જરૂને ઉં હયો,  
અક્ષર ખલ ધામ સુજ તણુ, અશગતિત પં દૂર છે ધણુ,  
સર્વ પ્રકારા તેનોમય રવિ, મોગે કળા શચિ પાવક દરિ ૧૯

સ સારમા તેજ એનુ સર્વથી,  
દિનઅર ઉગે શચિ તારા મેદ, સુજ ધામે તેજ એ પ્રેરાચતુ નથી,  
રવિ શચિનો પ્રકાશિત દુય, સર્વ પ્રકાશિત દુ ગોનિદ ૨૦

સુર્ય પ્રકારા કરે નહિ નખા, સુજ ધામે પ્રગાશ કરે તે શુય,  
નહિ ચન્દ અજિન લાદા ૨૧

૧ અદ્યા -ગામડામા પ્રયવીત શાન્દ છે તેનો અર્થ સુજ તેજારી  
અને બગાનાન એવો થાય છે

૨ કૃદાર -કૃદારી

કે પાંખને ન છરે કોય, પર્મ ધામ માડાઈ તે સેથ;  
ન પહોંચે ગાતર્વાણી ગુણુ આમ, મન બુદ્ધિ ન તર્કનો હામ. ૨૨

અગોચર ધારે તે ન આવે દૂરી, નિશ્ચસ પદ રિથર કહે શ્રી હંદિ;  
પરથ મુજને પુછીશ તુંય, ધામ ગયો ન પડે તે શુંય. ૨૩

સત્ય લોક લગીના સર્વે લોક, પ્રાતે પુનરાવર્ત્ત ન દોઃ;  
અહુ ભુવનથી પાછો પડે, મુજ પદ પામ્યાને આધક નાં અડે. ૨૪

ચૌદ લોક પર્વતનાં ધામ, ત્યાંદાં લગી સૌ માયાનાં હામ;  
કશે સંજીકનાં સર્વે રથાત, પ્રકૃતિ જન્યતું રહે છે ભાન. ૨૫

મ્રાહિતિના અવ માયાથી થાય, મહારા અંશ મુકું તે માંદિ;  
વાયુથી પરપોઠા નેમ, મુજ માયાથી ઉપજે તેમ. ૨૬

જળ મૂકે નવ સૂકે ભાત, વિન્દથી અવીષ્ટ શ્રી અગવાન;  
દિંગ શરીરનો અંગ ને કરે, તે મુજ લોક વિને સંચરે. ૨૭

ઉધજે વણુસે સૌ અહાંડ, મદાઈ ધામ અભંગ અખરં;  
અવ લોક વિને અવંદા, ભૂત સનાતન માડારા અંશ. ૨૮

પંચ ઈંદ્રિને છું મજ, સ્વભાવે રદ્ધાં કરે આકર્પણું;  
નસે શરીરે કુશ્ચર નેલ, મૂકીને વળો જયે તેદ. ૨૯

ઇંદ્રિનેં તે લાઘે ન્યાય, કુસુમગંધ વાયુ ને ન્યાય;  
રથ્યુદ્ધ શરીર પલન અવ થાય, તવ અવ મન ઈંદ્રિ કેતો લય. ૩૦

સુદેસ દેહમાં પૂરે વાસ, લઘ એકાદરણે બાબે પાસ;  
સુષ્પ વાસ કેદ ન્યાય પવન, અવ સાથે કરે ડિનું ભાવન. ૩૧

કર્ષું તથા નેતરો નેલ, અને રપર્શ છદ્રિ તો તંડ; ૩૨  
 ગુંડા નાસા મનને મળો, સેવે છે વિપયને વળો. ૩૨  
 રાષ્ટ્ર રપર્શ રસ ઇપને ગંધ, એ પાંચ ગુંને કમ્બ સંખંધ; ૩૩  
 છુંં મન ગું સાથે જાપ, જ્યામ શરીર પુણી છાપા ધાપ. ૩૩  
 દેખાંતર થાયે ને રહે, બોજન કરે છંગ્રી સંગ અહે; ૩૪  
 દૃષ્ટે જોન અસ્તુ ને હોપ, તેહને મૂદ ન દેખે હોપ. ૩૪  
 યોગી ધ્યાન પ્રયત્ને તેહ, દૃષ્ટે આત્મામાં રહે નેલ; ૩૫  
 અસ્તુ શાંત અભ્યાસી હોપ, અયાને નાય દૃષ્ટે સોપ. ૩૫  
 સંશય અસ્તુને થયો મનમાંલા, પ્રગટ આત્મા ન દીસે તે કથાંપ; ૩૬  
 દેહ છદ્રિથી અળગો ડેહવાય, તો શા માટે તે ન પ્રગટ જણાય. ૩૬  
 શિત ઉખુસુખ દુઃખપુન્યને પાપ, દંડ જન્મ જરા સંતાપ; ૩૭  
 આંતર મેલ અવિદ્યા અહી, માટે આત્માને તે દૃષ્ટે નહિ. ૩૭  
 મહારી કૃપા વણ અથ્ય ન સરે, જાની આત્માતું દર્શન કરે; ૩૮  
 પુન્યવાન વિવેકી સત્ય રવદ્ધપ, એવા સાધુ દૃષ્ટે આત્માતું હૈ. ૩૮  
 તીથે નહાય અવનિ પરિક્રમે, વૃત્ત કરે દિમાલયે દેહ શિત દમે; ૩૯  
 થઈ યોગી વનમાં રહવડે, તોહે ગું સ્વરૂપ ન જરૂર. ૩૯  
 ને સમદર્થી સૌને હિતકારી, સદાકાળ કરે ભક્તિ ભખારી; ૪૦  
 તે કરે આત્માતું દર્શન, એમ કહે શા જગતુવત. ૪૦  
 દેહી સર્વેશર દેહનો પતિ, અવિદ્યા આધીન ગું થયો અતિ,  
 આત્માતો અનંત સમરથવાન, માયા સંગે થયો દિન સમાન ૪૧

જવતુ વર્ષનને એ રીતે આણો,  
આદિત્યને પાખ્યુ કે તેજ,  
અને ચક્ર અભિનમા જોદુ,  
સૂર્ય ચક્ર ને દિવ્ય દુ તારા  
એ તથા નેતા માદાન અર્દુન,  
રવિ ઘણણે ગોપુ નિરધાર  
પૃથ્વીમા હુ તને ધરી,  
અનનિમા વૈર્ય ક્ષમા ગળ ધણુ,  
કુમ ગિરિ પ્રણનો ધરે છે ભર,  
ચક્ર રસાતમક દુ સપદી,  
સીચુ ઓપંચી ચક્ર રૂપ થઈ,  
દુ વૈશ્વાનર ઉપે અધ,  
અજ મતુાય સુને જાણે રાય,  
દેહ મધ્યે જાહેરાંતિ જીવન  
શુક્તે પ્રાણુ અપાન પવન,  
જી પાચા દ્વા પાડન ભૂપ,  
પ્રાણુ અપાન ને વ્યાન ઉદાન,  
ઉદ્દ્ય સવની રહાં રથાન,  
જીને સુખ દેઉ દેહમા રહી,  
સીને વિરે દુ દુ અભ,

સુજ રવિષ મુ ત મને આણે।  
અભિલ જગત હોભાવે એજ છુ  
જાણુ તેજ મેદાં સૌ તેદ  
એજ તેજ મે દ્વા પ્રકાર છુ  
શરિય કીનણે સુધા વરસુ પરજ ન્ય  
એ મારો મે ડલો વિન્તાર છુ  
પ્રાણી માનને રથોદુ ધરી,  
તે ખગ અર્દુન છે સુજ તણુ છુ  
છે વસુધાને મારો આધાર  
પોપુ ધુ સવે ઓપંચી છુ  
વગી સૌને વખ્ત કહ અતગમાર્ગી  
પ્રાણી માનને દેણે ગહી છુ  
ઉદ્દ્રમા જરાંતિ પણ દ્વા  
અતુનિધ અત તે બોજન છુ  
ચ્યાર પ્રકારના પચણુ અન  
પચ પ્રાણુ વાયુ પણ મેદાં જરૂપ છુ  
પાચમો વાયુ નામ સમાન  
સુજથી રમણુ મોદને સાન છુ  
પણ અણુધ સુજને જાણે નાદિ,  
કાદ્યમા દુતારાન છે તેમ પ્રુ

धर्म कर्म जलेन अत इर्ष्या,  
 हु वे जनसुवा प्रसार्य,  
 तर्ने वेष्ट जाननु न अपार्य,  
 वेदाचार्त वेद त ज्ञानु पर  
 वे इती त वेदाय जाण्य,  
 आ चार श्लोक संक्षेपे करी,  
 मुख दार्ग मे इत्यु भने आय  
 शुभ विशुनि श्ले ते दरि ५३

लोकने सिंह पुड़ा ते जेद,  
 क्षरनो क्षारे देख तिरोभाव,  
 क्षग्ने बीने अमर तेद,  
 क्षरने वगा तेद थाए नशीर ५४

क्षर ते देहे प्राणी वास,  
 अक्षर श्य न पामे नास  
 अक्षर अल धाम उप जो,  
 अल सन्न कडे निर्विशेष ५५

क्षण पुड़ा अक्षर नाम,  
 उत्तम पुड़प ५६ ते जेद,  
 सर्वने नित्य थानो द्वाम,  
 पुड़ोत्तम क्षीओ तेद ५६

निगुणु कान अग्नि पर जेद,  
 अक्षर कानातित दरि तेद,  
 अक्षर आनातित अद,  
 अन्यन धर्म तेदने धरे ५७

क्षर ने जगतेथी अतिकम,  
 क्षर अक्षर अक्षरातित अद,  
 अक्षरथी पण ते उत्तम,  
 तार तम्यता इरना तेद ५८

पर पुड़प अक्षरातित श्रीदुर्गि,  
 लोकाने वहे ते भाट,  
 व्यापक ने पर निर्णय उरी,  
 पुड़ोत्तम हु हु विष्यात ५९

नाम उपने जेहे उरी,  
 अदक्षर अनेक उप धरी,  
 दैत वक्ष कार्ष सेश न जरी,  
 निर्म भद्रिमा दाए निर्गतरी ६०

ने अमृद मुने अम उरी,  
 नरधा अक्षित करे ने भक्ता,  
 जाणे पुड़ोत्तमने परी,  
 रहे पुड़ोत्तम यरणे अमासक्त ६१

सर्वं समर्पणे अधि मुकाय, पुण्योत्तमं सरणे ते थाय,  
 हे भारत के जाने युक्त, भजे ते मुजने भाने :युक्त. ६२  
 हे अनधि मे आ अत्यत, ५८ शुभं शालं ते तत,  
 धुद्धिवान् ए जणे होय, अने कृतार्थं होय नरं सोय ६३  
 माया धीरं ससारन तथ्, तेथी पुण्योत्तमं वेगलो धण्,  
 सर्वं व्याप्तं पुण्योत्तमं जणो, परं अहं उपं हृष्यमा आणो ६४  
 पुण्योत्तमं योगं अनणु भद्रिमाय, मुदं पशुं सूर्यना शानि थाय,  
 जेमं सरुवनी विधा भगे, तेणे करीने रोगं सी टजे. ६५  
 साक्षणा अर्णुनं लाग्यो पाय, थयो पूर्णु ५६ अध्याय,  
 भीधरी वीक्षनी लीधी सहाय, जेणे करी अपर्णता थाय ६६  
 प्रति अध्याये अभिवाप्तं वगे, मनं पाचित् कार्यं सौ सो,  
 सचिवदानदं सक्तं सुख धाम, भद्रा भागल्य श्रीकृष्णु नाम ६७  
 गाता सूर्यता अति अद्भात्, एवोऽप्युपार्जनं संवादः;  
 अहा एकने अदु शुशु आम, अनना ग्या कही सुदूरं स्याम ६८  
 विगुणं कालं अम परं जेह, दासं द्याना सराभीं तेह,  
 शोगं शावने अहं विधाय, पुण्योत्तमं योगं ५६ अध्याय ६९

इति श्रीमद् भगवद्गीता सुपनिषत्सु ब्रह्म विद्यायां योग  
 शास्त्रे श्री कृष्णार्जुन मंथादे पुरुषोत्तमं योगो नाम  
 पञ्चदशोऽध्याय ॥ ६६ ॥

---

## ભગવદ્ગીતા અધ્યાય-૧૬

### ॥ શ્રી ભગવાનુવાચ ॥

ગ્રંથ શોપાઠ

તેજી સૃષ્ટિ લક્ષણુ મહિમાય, કરે શુણે કરે નિર્ભય ચાય,  
નિર્ભય ચિત્ત નિર્મળ ડોય ગ્રાન, યોગ ઉપાર કરે ને દાન ૧

નમ, ને યદુ અધ્યાયે તે લેદ, તપસ્વીને ડો વા નહિ તેથ  
નય તપ યજન અહિસા તેદ, દ્વા નાન ને શમ દમ લેદ ૨

દિસા કોધ ચાડી નય કરે, સત્ત્વ શાત ઉદ્ગતા ધરે,  
શાત સમ મતિયે આનંદ, અનિયળ મન વિરે જોવિં ૩

લલા દ્વા ભૂતસુ અહી, ડોમગ લોભ ચપનતા નહિ,  
લોભ ન, વિનયી ડોમગનામન, ક્ષમા ધીરજ ઝુદ્ધ પાવન ૪

તેજ ક્ષર્મા ધૈર્ય તે ધરે, શચિ પ્રોદ માન ન ર કરે,  
હૈવી સપતિ પામ્યો લેદ, ભારત એ સુક્રતે લોય તેથ ૫

હૈવી પ્રકૃતિના ગુણુ જાણુ, એ એધાણે નક્ષણુ પ્રમાણુ,  
હૈવી પ્રકૃતિ મોક્ષ ઉપાય, લેણે શ્રી હરિ સતોગાય ૬

આસુરી પ્રકૃતિ દુર્યુણુ એન, અવસ્થ નરેદ પમાડે તેદ,  
આસુરી સપતિના જન લેદ, કષીએ મોક્ષ ન પામે દેદ. ૭

અંકડાર દભ અભિમાન, કોધ કીશુપણું અત્તાન,  
મોદ સત્તર માયા અત્તાન, ગર્વ કોધ લોમ અભિમાન ૮

આમુરી સપત્ય તે મોય, ભારત એ યુગ્તે તે હોય,  
મોમ લોય દૈવી સપને, નધત તેમ આમુરી ભતે. ૯

શોક ન કર્ય પાડન કાઈ ચિત્ત,  
આ લોકે છે ઉષ્ણ મારી, તુ પામ્યો દૈવી સપત્ય,  
એ પ્રતાર દૈવી આમુરી ૧૦

દ્વી મિસ્લાર દૈવી તે લેદ, શુષ્ણો પાર્થ આમુરી તેદ,  
આમુરી જન પરિત્ર નવ્ય રહે, પ્રવર્તિ નિવૃત્તિ ન ન વહે ૧૧

નહિ કાઈ તેદેને શુદ્ધાચાર,  
અસત્તને અપ્રતિપિદિત તેદ,  
અને સત્ય પણ નહિ લગાર,  
જગત અતીશર રહે છે લેદ. ૧૨

પરંપરે ઉપજયુ કામથી,  
અદ્ય જુદ્ધિએ દખિજ ધરે, બીજુ શુ કહીએ તે કથી,  
આત્મા તણ્ણા નાશને કરે. ૧૩

જગત ક્ષણાર્થ રિપુ આત્માલેદ,  
દુષ્પુર્ણિત કામે આઅથી, ઉચ કર્મ ઉપજાવે તેદ,  
દુષ્પુર્ણિત કામે આઅથી, દભ માન મા સુકને થઈ ૧૪

જે તૃષ્ણાને પાશ બ્રધાય,  
અધમંદી પ્રવ્ય સચય કરે, કામ, કોધ દોરે સધાય,  
અદતા ભમતા ભનથી ધરે ૧૫

અપનિત્ર અક્ષાની થઈ,  
પ્રતો અસન વસુને અહી,  
અપરિમિત ચિત્તાને કરે ૧૬

દામ ભોગમા તત્પ્ર રહે,  
મોજ તત્ત એમ નિશ્ચે કરે,  
આધા રાત આશા સધશું, દામ કાવ ને સગધ શ ૧૭

અહુકાર ખળ કામને હોથ, તેહેને આઅયે કરે વિરોધ,  
 કામ બોગ અર્થ અભિનવા, છુંછે અન્યાયે સચવા ૧૮  
 દનડા ને જે સુજને આ જેદ, પામીગ આ મનોન્થ છે તેથ  
 કુ કર્તી ને આ છે ઘણાં, અવિદ્યાયે ઉરે અધાં ૧૯  
 કુ સર્મર્થ કુ બોગી સુખી, કુ કર્તી કુ કુદુથી સુખી,  
 આ જે છે ને વગી જે મન, માલારે દ્શે દરીને ધંત ૨૦  
 આ શાનુને મેતો હથ્યો, બીજા તેથ દખાણ્યો ગણ્યો  
 કુ અળિયો મે માર્યો એદ, સુજ સગયો નહી બગીયો તેદ,  
 ઘણગ કુ બોગી કુ સિદ્, સુખી અનિમા પરમા નિદ ૨૧  
 કુ ધનવત કુ દાનેશરી, રહે લક્ષ્મીએ મદ દાને ડરી,  
 જાતિનત કુ ધનવાન કુ સહી, કુ સગયો બીજો ડો નહી ૨૨  
 દસ્પીશ કરીશ દાન ને યતા, મોદ્દા એમ અગાને મગન,  
 ભર્મે બુ ચિતાની ચાનમા, વિદ્યા મોહ તણી જાગમા ૨૩  
 કામ બોગમા તત્પર જેદ, અશુદ્ધ નરક પડે છે તેદ,  
 નમે નહી આત્મા ચેપાતા, ધનને માન તણે મદ મતા ૨૪  
 નામ માત્ર ધને તે પણે, દાને વિધિપૂર્વક નહિ રણે,  
 અહુકાર ખળ દભ દર્દો ભર્યા, કામ તથા કોધે આવર્યા ૨૫  
 આત્માને પરહેદે કરી, કરે દ્રેપ નિદા માલારી,  
 ભાગ ભક્તનો દ્રેપજ કરે, માગ દાનનો મદ મન ધરે ૨૬

એકેના હું હેતુને, સસાર ભાડે તેણે,  
 નાખું છું નિત્ય સંદર્ભ, અશુભ યોનિ આખુરી માલ ર૭  
 - મી પાકાચિ નર્કો પડે તે, એ ગર્વ મન જાણે તેણે,  
 એના હુંટ અદ્ભરી ધણ્ણા, તે અધિમરી તે યાતના તણ્ણા ૮૮  
 યોની આખુરી પાંચા જેણે, ભૂદ જરૂર જરૂર ત્યા તેણે  
 અખુર યાનિના ને અસતરે, જરૂર એ અણારો હેઠા કરે, ૨૬  
 મુજને પાંચા વિના સંદર્ભ, અજૂન અધમ ગતિઓ તે જાય  
 અપિદિત માર્ગ ને જરૂર ધાર, તેણા હુષ્ટ અધોગતિરે જાય ૩૦  
 તે નાટે અજૂન કુ ભર્મ, પિલિત ધર્મના અન્ને કર્મ,  
 આતના તરોં નારા કળાર, નથુ પ્રકારતુ નર્કો દાર ૩૧  
 અજૂન નર્કો તણ્ણા નથુ દાર, કામ કોધ અને સોભ અપાર,  
 એ નથ દુર્ગાખૃથી અગોધાર, તેણે મુજને ધાર ૩૨  
 કામ કોધ નોભ તો જે, તજના તે માટે નર્કો તેણે  
 તામસ ગુણ્ણથી ઉપજાયા જેણે, નર્કો નર્કો દારને સહે છે તેણે ૩૩  
 નર્કો નર્કો દારથી ડેય, ભાગત ને મુકાયો ડેય  
 એ નથ દુર્ગાખૃથી અગોધારથ, તેદ જણને મુજને ધાર ૩૪  
 આત્માના ત્રૈયને આચરે, ત્યારે પરમ ગતિઓ પરવરે  
 ને અદ્દાર એ પામે જણી, તેણે મોક્ષ દેવ નથય નહિ ૩૫  
 શાન્દ નિધિ છાડીને જેણે, ગવેચાચાચારી તેણે તેણે  
 તેણને સુખને સિદ્ધિ ના હોય, પરમ ગતિને પામે નહિ મોય ૩૬

કાર્બિકાર્ય પિણે તે ભાઈ, તાડારે પ્રમાણુ શાસ્ત્રની પાતા;  
શાસ્ત્રે નિધિન કષું છે લેદ, કરવા ચોગ્ય કર્મ છે તેદ. ૩૭  
દૈવી આસુરી ભત્તિ કહેવાય, નિગુણુ પર દૈવી મહત મહિમાય,  
નિર્યાણુ બક્ત કાંઈ વાંછે નાદિ, ભાઈ તે મુજાહદ પામે સહી. ૩૮  
દૈવી સંપત્તની ખુલ જેદ, દાસ જ્યાને દીધી લેદ;  
તેણે કરી સોણ અધ્યાય, સંપુરણુ પદ જદ યાય. ૩૯  
જેહનો જેદ વિભાગી હોય, તે જન તે ભતિથી ચિત્ત પ્રેરાય;  
ચોગ શાસ્ત્રને ખલ વિદ્યાય, દૈવાસુર સંપત્તિ અધ્યાય. ૪૦

इति श्रीमद् भगवद्गीतायां सुपनिषत्सु ब्रह्म विद्यायां  
योग शास्त्रे श्री कृष्णार्जुन संवादे दैवासुर संपत्ति  
योगो नाम षोडशोऽध्यायः ॥ १६ ॥



શ્રીમદ ભગવદગીતા આદ્યાય-૧૭

॥ અર્જુન ઉવાચ ॥

રાગ-ચોપાઈ.

જે પુરુષ અદ્ધાયે કરી, યજે શાસ્ત્ર વિધિ નહિં, પરહરી  
સહને મૃષ્ણુણ થાગે શું? અને સત્ય રજી તમ તે કિં શું? ૧  
જે જન શાસ્ત્ર રીતને તજે, અદ્ધાયી તમને ભજે;  
તેની કોણું ગતિ કહે સ્થામ, અર્જુને ત્યાં પૂછ્યું આમ. ૨

॥ શ્રી ભગવાનુવાચ ॥

અર્જુન પ્રતિ કહે પુરુષ પુરાણુ, નેહી અદ્ધા તેહી ગતિ જાણુ;  
સહુને સ્વભાવ યકી ઉપની, છે અધ્યા પ્રકાર નાણ્યની. ૩

ગ્રહ્ય પ્રકારની અધ્યા ડેવી, સાત્ત્વિક રાજ્યસ લામણી એવી,  
સાત્ત્વિક રાજ્યસી લેટ, અને લામણી સુધૃષ્ય તું તેલ. ૪

ગાળ પ્રમાણે સહુને ચિત્ય, ભાગત અધ્યા છે તે સત્ય;  
અધ્યા ઇપ પુરુષ છે એદ, નેહુને જે અધ્યા ઇપ તેડ. ૫

સાત્ત્વિક તે દેવતાને ધજે, યક્ષ રાક્ષસને રાજ્યસ ભજે,  
ખૂટ ધજે તે લામણ નેહ, તથા પ્રેત ગણુને તો તેહ. ૬

આશાથી મહે યોગ તપ કરે, રેદ એમે ને હેઠાટ મરે,  
 તપે યોગ તપ તપસી કોય, રાખું વિહિત તે જે નવ્ય હેણ્ય ૭

અહેડાર ને નિબે યુક્ત, કામ ગગ ને અલ સયુક્ત,  
 ચિત્ત તે વશ નહિ પોતા તણુ, રેણુ ધરીને હૃદ્ય ને ધણુ. ૮

મુજનો કષે, અતર રેડે, અમુર ભાય ગાય તૂ તેઢ,  
 આદાર તણુ પણુ નરણ્ય પ્રકાર, ત્રિય સર્વને છ નિરધાર. ૯

કોમળ અય્ય મનોદર જેઢ, સાતિક જન ખુક્તે છે તેઢ,  
 ખાડું તીખું વળ્ફત કરે, સાતિક વસ્ત વણુ ચિત્ત ન ધરે ૧૦

નરણ્ય પ્રકારે વળ તપ દાન, સાભળ તેઝના બોધ પિધાન,  
 આયુધ સતત અથ ને આરોગ્ય, સુખને પ્રીતિ વધારના યોગ્ય ૧૧

મદારી ભક્તિનો કરે સંજોગ, અલ્બાપિત વણુ ન કરે બોગ,  
 જિન્યધ રસાલ રિથરતા ને ધરે, સુખના આદાર સાતિક તે કરે ૧૨

ખાડું ખાડું ઉહુનું ધણુ, કહે તીખું લૂખું દાખણુ,  
 એ આદારે રાજ્યસ દિત ધરે, તે હુદ્ધ રોક અજરણુ કરે. ૧૩

કષે રોગ ઉપઘને તેઢ, ગર્મસ બોજનનું ઇળ એઢ,  
 ટાડું ને નીરસ તે જેઢ, ગધાતુ નિપિધ હોય તેઢ. ૧૪

વિચિદ્ધ ને અશુદ્ધ ને હોય,  
 દરિ પ્રસાદ લ્યાગે ને જન, તામસ આદાર કરે તે સોય,  
 વિષણુ ભક્તિથી વિસુદ્ધ થાય,  
 દુલની આપાલા નન્ય ધરે, અશુ પ્રસાદી કરે બોજન. ૧૫

તામસ આદાર કરે તે સોય,  
 અશુ પ્રસાદી કરે બોજન. ૧૫

તામસ બોજનનો ભહિમાય,  
 યજાર્યન વિધિ પૂર્વં કરે. ૧૬

દાન થણુ પણુ તિરિધિ પ્રકાર, સાત્ત્વિક ગજસ ને અહંકાર,  
સત્ત્વાત્મ મગાતા જનજ કરે, યે જ્ય કાળતું પણુ સાત્ત્વિક હો ૧૭  
યજવુ એમજ જણે જેલ, સાત્ત્વિક ભાવ તે છીએ તેલ  
દલ રહીત અદ્ધારે જેલ, સાત્ત્વિક દાન તો કષીએ તેલ ૧૮  
પરોપકાર ખજાપણુ મતિ, ઇનની આરા ન અભિમાનજગતિ,  
દૃણ તણ્ણી આશાએ કરી, દલ અર્થ મન માણે ધરી ૧૯  
સત્તાર્થ કુદ્રિ પજન ડરે દાન, તે તો ગજસ નિવે માન,  
અકારો કે અશ્વાએ નેલ, તામસ દાન કફેવાએ તેલ ૨૦  
ભરત એઠ યજે એમ જેલ, ગજસ યજો જાણ હુ તેલ,  
અશ્વધારી હોમે નેલ, જ્યે-ત્યે-કર્મ કરે સૌ તેલ ૨૧  
લે શ્રદ્ધા પૂર્ણક દેખે નદિ, તો તે સૌ નિધળ દોષ સહી,  
નિરિધિ પાણે વિના પારે દાન, નદિ ભત્ત નદિ દલિષ્ણ વાન ૨૨  
શ્રદ્ધા રહીત યજે તે જેલ, તામસ યજને કષીએ તેલ  
કુદ્રિ ભાઈ ઉપજવે રોગ, મહારી બહિતનો કરે વિચાર ૨૩  
પૂર્ણ દેખ શુદ્ધ પહિત નિષ્ઠ, શમે ભારો અને પનિન,  
અલચર્ય અદિસા જેલ, શરીર કરી તપ કદિયે તેલ ૨૪  
અન ઉદ્દેશ વાક્ય ને ટ્યુપ,  
વેદાભ્યાસ કરે વગી નેલ, સન્ય પ્રિન દિતમારી મોય,  
મન પ્રસના સૌભ્ય મુનિ હોય,  
ભાવે શુદ્ધ દોષ વગી નેલ, આત્માને વય રાખે સોય  
માનસ તપને ગ્રેએ તેલ ૨૫

શ્રદ્ધા યુક્ત કરે ને ડેસ,	ત્રણ્ય પ્રકારનું તપ તે સોથ
એક ચિત્ત, ઇન્દ્ર ઘણા નહિ,	સાત્ત્વિક તપ તે કંઈએ સહી ૨૭
પૂજા-માન અને સત્કાર,	તે અર્થ ને દલ પ્રડાર,
એમ કરે ગજસ તપ સેસ,	તે રે ચન મિતાશ કર હોય ૨૮
અવિવેક ને તપ આચરે,	આત્માની પોણને ડરે,
મિતાશ અન્યનો વાન્છે નેહ,	તામસનું તપ કંઈયે તેઢ. ૨૯
દેવું દાન એમ કરે વિચાર,	વાગે નહી તે પ્રતિ ઉપકાર,
દેશ કાલ પાત્ર શુભ હોય,	સાત્ત્વિક દાન કંઈયે તે સોથ ૩૦
પ્રત્યુપકાર મન માડે ધરી,	ફલની આડાક્ષાએ કરી,
કલેશ પામનો આપે નેહ,	રામસ દાન તો કંઈએ તેઢ. ૩૧
દેશ કાન ને પાત્ર મિદિન,	અને વળી સત્કારથી હીન,
અનગણુનાએ આપે નેહ,	તામસ દાન તો કંઈયે નેહ. ૩૨
પ્રણુદ તત્ત સત્ત કંઈએ નેહ,	અહુ નરૂર પ્રકારનું તેઢ,
વેદ યજ ને ભાલણું પણ્ણું	પૂર્વ એ નરણેથી નર્ણય. ૩૩
તે મારે પ્રણુને મુખ્યાજ કંઈ,	અલરારી નિતે સહી,
થતું દાન કિથા તપ નેહ,	કરે અનેક પ્રકારે તેઢ ૩૪
તે કારણે તત્ત પદને કંઈ,	મોક્ષાયું ઇન્દ્ર ઘણા નહી,
થતું કિથા તપને આચરે,	દા। અનેક પ્રકારે કરે. ૩૫
શૈષ્ટ કર્મ સદ્ભાવે મોય,	સત્ત શખ્દે ઉચ્ચારણું હોય,
માગણ્ય કર્મ પણું તે એદ,	પાર્થ શખ્દે કંઈએ તો તેઢ. ૩૬

यत् दान ने तपनी भाँख, तत्प्रीत्यर्थ ते सत् क्षेवाय;  
सत् अक्षेवुं क्षीये जेहने, कम् पण् अर्थे तेहने. ३७

डोम-दान-अध्या विषु करे, तप तपे ने के आयरे;  
पारय असत् क्षीये तेहने, आलोक परलोक शुभनधन्ता जेहने. ३८

गुण अध्या आवर्णु क्षेवाय, भाटे भारी प्राप्ति न थाय;  
अध्या गुणे भजे नर जेह, भकारा पहने पामे तेह. ३९

शुध सत्वगुणे अद्वाचे करी, चङ्कर्निंश भनमां राखे हरि;  
अहार्षे निर्गुण थाय, निर्गुण थानानो अभिप्राय. ४०

निगुण परात्परे दधे भति रंगी, भूमि संभाध रहो अंगाअंगी;  
योग शास्त्र ने अह विद्याय, गुण अद्वा नाम सत्तर अध्याय. ४१

इति श्रीमद् भगवद्गीतायां सुपनिषन्तु ब्रह्म विद्यायां  
योग शास्त्रे श्री कृष्णार्जुन संवादे निगुण विभाग  
योगो नाम सप्तदशोध्यायः ॥ १७ ॥



## ભગવદ્ગીતા અધ્યાય-૧૮

### ૧૮ અર્જુન ઉચ્ચાય ॥

સ્વામી તમે કણું નિરધાર, સુજ ભક્તિ વિના ન રહે લગાર;  
તો તે ઉત્ત્ર પોપણું કયમ કરે, ગૃહસ્થાશમી શી રીત્ય આચારે. ૧

### ૧૯ શ્રી ભગવાનુષ્ઠાય ॥

મહારી ભક્તિ હૃદયમાં ધરે, હેદ અથે વિહિતોધમ કરે;  
મનથી વિપયે ન હોયે પ્રીત, એ છે નિરાસકૃતની રીત. ૨

પથા લાભે સંતોષી રહે, વિપ્ય સૂખે આસક્ત ન રહે;  
મનથી વિપયે ન હોયે પ્રીત, એ છે નિરાસકૃતની રીત. ૩

પારથ પ્રત્યે કહે પુરુષ પુરાણુ, સુખને નિવિધ પ્રકારે જાણુ ૪

### ૨૦ અર્જુન ઉચ્ચાય ॥

મહાઆહો કહે સંન્યાસજ તાણુ, છચ્છા છે ને તત્ત્વ એ સૂધ્ય;  
અર્જુન કહે સુણો ભગવાન, સંન્યાસતું કહો તત્ત્વરાન. ૫

હે હૃદીકૃત ત્યાગ પણ જેદ, ડેશીમર્દન કહો સુને તેદ;  
ત્યાગ તણો ને નિવિધ વિચાર, તે જાણુના સુને છચ્છા અપાર. ૬

સાડા ત્રણ કરી સુધીની વરતુ ભક્ત કવિશ્રીના હૃદયની વરતુ  
અનાસકૃત-યોગી લડન-શામદ ભગવદ્ગીતાનો ભાવાય્ આ સાડાત્રા  
કરી આચારમાં મુક્તનાર-માં આ લક્ષ્ણ દેખ.

## ॥ ભગવાત્પાદ ॥

અધનનું કારણ મુખ્ય મન, વિવયાસકત ન થાપ દરિ જન; ૧  
 કામ્યક કર્મ તણો એ નાગ, કલિ કઢે છે તે સન્યાસ. ૨  
 કામ્યક કર્મ સામ્યક હોય નારા, અજ્ઞન તે કલીયે સન્યાસ; ૩  
 જ્યુ તપ તીર્થ ચોગને પાગ, કલાશા તજે તે કલીયે ત્યાગ. ૪  
 સર્વ કર્મનું ઇલ પરિત્યાગ, કરે વિચિક્ષણ તે તો ત્યાગ; ૫  
 પંડિત તણો એક એ મન, કરવું કર્મ કઢે હોય વત. ૬  
 ખીજા કઢે યજ નપ દાન, ત્યજયાં નહિં એક વિધાન; ૭  
 અહુ પ્રીતયર્થ નિત્યના કર્મ, તેદ ત્યને તે વિદિન નહિં ઘર્મ. ૮  
 લ્યાં લગી દેલાનુસંધાન, ભજ મુત્રાદિનું રહે ભાન; ૯  
 લ્યાં લગી વિદિત કર્મ સૌ કરો, દ્રશ્યાશા ના શેરમા ધરો. ૧૦  
 કરો કર્મ આવન્યક સર્વ, અદંતા મમતા નહિં ગવ્ય; ૧૧  
 ભરતોત્તમ તે ત્યાગજ તણો, મુજ નિથ્ય કઢું તે મુણો. ૧૨  
 પુરુષ માંડે સિંહ સુરુપ એઠ, ત્યાગ પ્રકાર ગ્રણ્યનો જોહ; ૧૩  
 યજ દાનને તપને પર્મ; તજનું નહિં કરવું એ કર્મ. ૧૪  
 યજ દાનને તપ તે જોહ, કરે પવિત્ર પંડિતને તેદ; ૧૫  
 કરવાં એટલાં કર્મજ સરી, ત્પદ સંગ, ઇલ ધર્યા નહિં. ૧૬  
 હે પારથ ઉત્તમ તે એઠ, મહારો પણ નિથ્ય ભત તેદ; ૧૭  
 હવે કહું ચ્યારે વર્ણના ધર્મ, આલણુ-ક્ષત્રિય-વૈશ્ય-શાદ્રનાં કર્મ ૧૮  
 નિત્ય કરવાનાં પ્રતિદિન કરે, નૈનિતિક નહિં રેઝ આયરે; ૧૯  
 નિમિત્ત કાર્મ પ્રસંગના જોહ, પ્રસંગ આવે કરવાના તેદ. ૨૦

કર્મ કર્મભાષક વનું જાણી, તેથે તને તેની ધી શાણી  
ને મિલિક કર્મ તણો તે ત્યાગ, (પણ) નિત કર્મનો નહિ પરિત્યાગ ૧૬

મોહે ત્યાગ કરે ને કોથ, તામસ ત્યાગ તે કહીએ સોય,  
કર્મ દેહ ને હુખ ને બને, તે કોશ ભયદી ને તને ૧૭

રાજસ ત્યાગ કહીએ તે સોય, તે ત્યાગનું ઇણ નવ્ય હોય,  
કરવું કર્મ એમ જાણી મળ, કરે કર્મ નિત્યે અર્થું ૧૮

ઇણને સગ ત્યજને જેણ, સાત્ત્વિક ત્યાગ કહીએ તો તેથ,  
કર્મ શુદ્ધ મર્યાદે થાય, બેદ્ધ પ્રતિ આગમતે ભણાય. ૧૯

હરિ સેવન ઇથી ને કર્મ, નિર્ણયતાનો ભાષ્યો છે કર્મ,  
આત્મ ધર્મ તો શ્રેષ્ઠ કહેવે, વર્ણાશમ ધર્મ તે તુલ્ય ન આવે ૨૦

દેહ સાથી કર્મ તે ગૌણુનું જાણો, ભગવદ ધર્મ તે શૈષ્ય પ્રમાણો,  
અશના અરી પરતે ધર્મ, નહિ તાગ કઢી લહેવો પર્મ ૨૧

અવાત્માનો નિત્ય સાથથ, તેહ તજતા નહિ શ્વરૂપ પથ,  
હરિ અર્થ વિશુન નહિ આસદી, નિર્ગંડ કામતા રહિત કરે ભક્તિ ૨૨

રાન ભક્તિસુત્રહરિહિત કાજ, રહેના કર્મ ન કરના ત્યાજ,  
તાદાત્મ્યક તન્મય થધ જાય, દેહાતુસધી વિસ્મૃત થાય ૨૩

કર્મ તથા ઇણ રહેણે ટળે, કરું તજી વિચાર સી ટળે,  
નિદ્રાવશનો પણો જેમ, કરમાધી તે છો પડે તેમ ૨૪

પર્મદુસ સમ દૂત ન ભાન, તહેણે કર્મની રહે દ્વારા સાન,  
અવાથી કર્મ તળયે જ્યારે, ભાષક ઉપ ગણાય ન ત્યારે ૨૫

પણ કર્મ કરું કે છોડું એમ, સંભવ મતિ ઉરમાં રહે વિદેશ; તેણે તો કર્મ ત્યાગન નહિં, બલય પક્ષ સંગતિ લ્યો અહિં. ૨૬  
 પ્રીતિ કર્મ કુશળે નન્દ ધરે, કુરુળ તણેા ત્યમ દ્વેપ ન કરે; કુશળ અધિવાન સાત્ત્વિક કુશળ જોહ, સહેલ રહિત ત્યાગીતો તેહ. ૨૭  
 આત્મ પરમાત્મનો નિત્ય સંબંધ, જ્યમ પુષ્પે સુવાસીત ગંધ; કુશળ અરાકૃષ્ણી સંન્યાસી જોહ, જલદેવા સદા રહે વન મૃગ તેહ. ૨૮  
 પણ ત્રણ ને જોગી થાપ, વશુ સદભા તે નજી ગણ્યાપ; જ્ઞાન ભક્તિ વણુ પશુપત એહ, એવા સંન્યાસી ચોગી તેહ. ૨૯  
 જાને ભયે ભક્તિ ના કરે, તે તો વ્યર્થ આયુષ્ણને હરે; દરિભક્તિ વિષુ વિતાવે કાળ, તે પાણી વલ્લા પણી જાધે પાળ. ૩૦  
 હેને હૃપા જળ કર્માંથી ભણે, ભક્તિએ કરી શી દરિ હળે; દરિભક્તિલાગી અન્ય અમ કરે, તે પુરુષોત્તમને નહિ વરે. ૩૧  
 પ્રેમ ભક્તિનથ પરમાનંદ, એ ન ખડે અન્ય સાધન હંદ; સાંકળ ભૂકી તાળુ ભારે, ખાગે દાટા દે દુર ભુલ્લાં ન વિચારે. ૩૨  
 ભક્તિ રહિતનાં કર્મને જ્ઞાન, ડેવળ વ્યર્થ શ્રમ અનુમાન; નારિતક હૃપુ અવતારી જોહ, જનુની જોગન હરવા તેહ. ૩૩  
 કુદાર શ્વાસ ધમણુ જ્યમ ધરે, દરિભજન વિતા આયુષ્ણ નિર્ગમે; હરિભક્તિ વિષુ પશુ લમાન, અમૃત ત્યાગી કરે અન્ય પાત. ૩૪  
 દરિ શુષ્ણ ગાન શુણે ને નહિ, તેના કણ્ણ પૃથ્ર કોતર સરી; હરિ શીર્ફન કરે નહીં વાણુ, તે અન્ધા દાહુર સમાન. ૩૫

दरि अउपने नमे न जेद, मनुष नहि तु भी इण तद  
 के हाथे दरि अर्यन ना थाय, तो तउनी याखा लडेराय ३५  
  
 छने नेचे दर्शन करे नही, मधुगपीचु चाहवावत ते सही  
 दरि दर्शनने चग्यु ना थाय, जडनार ते कडेनाये पाय, ३७  
  
 कुप्यु कडे साभण अर्गुन, एमुज अकित महिमाधर्य मन  
 अडत् पुउप चर्ण मेवे नहि जेह, अवना छतो शमना तेद, ३८  
  
 हरिगुयु सुखी रोभाचित ना थाय,  
 तीनतर त्याग बेद्य नहि जेने, वध सम कुप्यु झूँय सेप्याय.  
 आधक वृति रहे ठे तेने, ३९  
  
 सम्यक त्याग पैराये थाम,  
 सन्यासी ताण्यु पण्यु विरिध प्रकार, ऐध सन्यासी तेह गण्याय  
 अस्त्रभय रुति अभीत होय,  
 मन पर अल्ले जेउनु होय, तेने कर्वु खाडी न कोय ४१  
  
 अभन अभ डित सिध्य निरोध,  
 अविचिन भननी गति थाय,  
 तेने कर्मनो होय न ऐध  
 पर अक्षे वज्रवा करे छिपाय, ४२  
  
 तेना साधक सन्यासी जेद,  
 देह धारी ने को कडेराय,  
 तेनो कर्तव्यता रहे छे ऐह  
 लेहे कर्म त्यन्या नाय त्यन्य, ४३  
  
 अह कनिष्ठ अधम अधिकार,  
 उत्तमाधिकारी रानी होय,  
 होय त्याहा लगी कर्म सुसार,  
 ते पल्लु कर्म अकर्मने जेय, ४४  
  
 कर्म भर्मने जाहे कोय,  
 दोक सअह अर्थे पण्यु करे,  
 तदपि ते कर्मने कर्ती होय.  
 आसक्ति चित्तमा ना धरे, ४५

ચિત્ત વૃત્તિની શુદ્ધિ કાગ, કર્મ તપો જિપથોગી સાજ  
 અત કરુણની શુદ્ધિ થાય, તેદ કર્મ તો વર્ષ લડાય, ૪૬  
 ત્યાગ કરે કર્મ ક્રણ ક્રોદ, ત્યાગી કહીયે તો જન તેદ  
 રહુ ભુહુ મિશ્રિત ક્રોદ, નણુ પ્રકાર કર્મ ક્રણ તેદ, ૪૭  
 પર કાકે ત્યાગ હીનને હોય, સ-યાગીને કાઈ ન સોય  
 સર્વ કર્મના ને સિદ્ધાર્થ, વેદતો તેદના હે પાર્થ, ૪૮  
 અત કલ્પો ને એ પ્રપદ્ય, તેદ તણુ એ કાણુ પદ્ય  
 શર્ગિને અહુકાર તે ક્રોદ, તથા અનેક છન્દિય તે તેદ, ૪૯  
 ૧ ૨ ૩  
 વગી ખૂ ચેષ્ટા ને હોય, આજા પાચમુ અહીએ સોય  
 નન્વાણી મન ને કાય, ૪ કરે -પાય અથવા અ-યાય, ૫૦  
 ૨ ૩  
 કર્મ આગભ કરે તે ક્રોદ, દેતુ પાચ તેદના છે એદ  
 એવા નિલે પ આત્મા શુદ્ધિ, કર્તૌ ને દેખે દુર્જુધિ, ૫૧  
 પુન દુર્મત્ય કદીએ એદ, નથી દેખતા કાઈ તેદ  
 અહુકાર કાઈ નહી ને માચ, તેણે ને આ કોઈ દણ્ણાય ૫૨  
 કર્તૌ છતા અકર્તૌ વત્ થાય, દણ્ણતા તેદ ન તે ખધાય  
 જાણુ જાણ્યા યોધ્ય જાણતાર, પ્રદૃતિ કર્મના નર્ણય પ્રકાર, ૫૩  
 કારણ કર્મને કર્તૌ નેદ, સ અદ કર્મ પ્રકાર નર્ણ એદ  
 જાન કર્મને કર્તૌ નેદ, ૫૪૪ પ્રભાર ગુણુ બેદે તેદ, ૫૪  
 ગુણની સખ્યા કહીયે જ્યમ, તેદને પણ સાભળતા ત્યમ  
 પ્રદ્ય સકળ પ્રાણીમા નૈ, તેને એકે ભાવે લડે, ૫૫

અભિજન અધ્યય જાણે જોદ, સાત્ત્વિક જીવન જાણે તુ તેદ  
 જીવન પ્રથક પણેથી રોપ, અનેક પ્રગત ખડુ ભાવે મોન પણ  
 જાણે સર્વ ભૂતમા જોદ, ગજસ જીવન જાણે તુ તેદ  
 એક વંતુ રીપરે જે રોપ, જીવન ગદિત આસણ જે હોપ પણ  
 અને તત્ત્વ અર્થ ન કે બડે, એ પ જીવન તે તામસ કે  
 ઇલતી છચા પાણે ડાય, સગ નહિતને દ્રોપ ન હોપ, પણ  
 નિયે કરે કર્મ એમ જોદ, સાત્ત્વિક કર્મ કહીયે તો તેદ  
 આમ તણી ઘણા મન ધરી, અથવા અહુકાર અનિ કરી, પણ  
 કર્મ કરે આયાસે જોદ, રાજસ કર્મ તો કહીયે તેદ  
 શુભ અશુભ હિસા ને હાનિ, શક્તિ વિચારે નહિ અનાની, ૬૦  
 એમ આરજ કરે તે જોદ, તામસ કર્મ તો કહીયે તેદ  
 સગ રહીત અહુ વાદી નહિ, યુષ્ટ ધૈર્ય ઉત્સાહ એ સહી ૬૧  
 સિદ્ધિ અસિદ્ધિ વિધે સમજેહ, સાત્ત્વિક કર્ત્તી નહીયે તેદ,  
 પ્રીતિ યુક્ત રેન ઘણા ધરે, લાભી અશુભ હિસા કરે ૬૨  
 હર્ય જોક યુદ્ધ હોપ જોહ, કર્ત્તી રાજસ કહીયે તેદ,  
 અયુક્ત અનભ અનિવેદી જોહ, શા આળસુ પર નિહે તેદ ૬૩  
 જોકી દીવ્ય સૂતી હોપ, તામસ કર્ત્તી કહીયે મોન,  
 બુધ્ધિ ધૈર્ય તણ્ણા શુષ્ટ જોહ, ત્રણ્ય પ્રકાર ધનજ્ય તેદ ૬૪  
 સમગ્ર કલા તે તુ ચિત્ત વરી, સાભળ્ય સર્વ શુભસા કરી  
 બુધ્ધિના પણુ ત્રિવિધ પ્રકાર, તેહનો પ્રથક કહુ વિભાર, ૬૫  
 બધન મોદ્દ થઈ જે જણ્ણાપ, તે બુધ્ધિ સાત્ત્વિક કરેવાન  
 કાર્ય અકાર્ય અભય બધ જોહ, પ્રદૂત ને નિહૃત તે તેદ, ૬૬

તथा ખંડ ગોકુલ ને નહે, સાત્ત્વિ-ખુદ તે તેજને કહે  
ને ખુદે ધર્મને અધર્મ, કાર્ય અગ્રાહી તણેં ને ભર્મ ૬૭  
જેણું ઘટે તેણું નંય કહે, પાન્થ ગાજસી ખુદ્દિ તે ૬૮,  
અધર્મ મિથા ઓઠે જેણ, ગાજસં ખુદ્દિ કહીયે તેદ ૬૯  
અજાને વીળી ખુદ્ધિ સોય, તેણે ધમ અધર્મજ લોચ,  
પાન્થ સર્વ ને અવળું નહે, ખુદ્ધિ તામસી તેને કહે ૭૦  
રામ દ્રોપ કામને કોધ અપાર, તે ખુદ્ધિ તામસ અધિકાર,  
જેણે ધૈર્ય કરી મન પ્રમાણુ, તથા નાર્ય દ્રાદ્રિધિના જાણુ ૭૧  
ધરે અચન એકાય ચિત્ત જેણ, પાન્થ ધૈર્ય સાત્ત્વિક જેણ  
ને ધૈર્ય ધર્મ કામાર્થ, તે સર્ગે ક્ષલ છીનું પાર્ય ૭૨  
અર્જુન એમ ધગવે જેણ, ગાજસ ધૈર્ય કહીયે તેદ  
જેણે સુધ્યાનું ને ભર્પ જેણ, ગો-પિપાં ને ભ તો તેદ ૭૩  
મૂર્કે નહીં ને દુર્જુદ્ધિ ડોય, પાન્થ ધૈર્ય તામસ તે મોય,  
ભરતરંભ સાભળ્ય તો હુ, નંય પ્રકારનું સુખ ને કુ ૭૪  
અભ્યાસે એ શુભર્મા રો, તે તો દુખ સર્વ નિર્ભે  
પ્રસાદિ ખુદું આત્મા તણે, જિપનાયુ તે સાત્ત્વિ શુભ ભણે ૭૫  
આગાથી પિપ સરખુ જેણ, અતે અમલ વત તો તેદ  
ધયાનાન સતોધી ? ચિપયનાયું શુભ મનનનય અર્થે ૭૬  
નાનાક્ષયામે રહે સુન્દરી મન, તેદ સુખ સાત્ત્વિક ગાજન  
આદે અમૃત સરખુ ડોય, અતે પિપ અરખુ તે મોય ૭૭

વિપરેંદ્રિ સયોગે જેદ, નામસ સુખ કહીયે તો તેદ,  
 છન્દ્રિ તથા વિપરો છે જેદ, અમૃત સરખા જાણ્યે તેદ ૭૭  
 તે સુખ તો શામસ કરેવાય, પરિણ્યામે તે વિપ સરખા થાય;  
 આહિ અત કેણે સુખ કરી, આત્મા માણે રહે આરરી; ૭૮  
 પ્રમાદ આખસ નિદ્રા જેદ, બિપળવે નામસ સુખ તેદ.  
 'પર અપવાહે સુખીયો જેદ, વળો આગસ નિદ્રા કહીયે તેદ; ૭૯  
 દુષ્ટ સેધને ને સુખ થાય, તે સુખતો તામસ કહેરાય;  
 પ્રકૃતિ જનિત ગુણુત્ત્યજયડે, પૃથ્વીને સ્વર્ગને વિયે; ૮૦  
 પ્રાણી ભાવ હેવતો સોય, મૂક્યાયો એહેવો નહિ કોય;  
 સ્વભાવ થકી ઉપજ્યા ને શુણ્ય, દેણે કરી ક્ષત્રી આહણુ. ૮૧  
 પાર્થ વૈસ્ય શક્ના ઘર્મ, તેનાં વેદેંચાયાં છે કર્મ;  
 શામ દમ તપ શૌયતા હોય, ક્ષમા અને પાંખદં સોય. ૮૨  
 શાન આચર્યને આસ્તિકપણું, કર્મ સ્વભાવીક આહણુ તણું;  
 શામ દમ શૌય ને તપ જેદ, ક્ષમાવાન સતોધી તેદ. ૮૩  
 સમ ભતિ રહેતાં શાંતિ થાય, છન્દ્રિય દમન નિયમ બિપાય;  
 આલાભ્યંતર શુદ્ધજ રહે, તેવી કિયાને શૌયતા કહે. ૮૪  
 શાન વિજાન જરૂહેમને ઘર્મ, એ વિધિ છે આહણુનાં કર્મ;  
 ધીર્યવાન તેજસ્વી સર, રણે ન નાસે અને ચતુર. ૮૫  
 દાની ધંશર શું હોય ભાવ, કર્મ જનીત ક્ષત્રીનો સ્વભાવ;  
 રણ ધીરજ લજ્યા વળો જેદ, સ્થિર ભતિ દાન દ્વિજ સક્રિત તેદ. ૮૬

યત્થ થાગ જ્યપ તપ નિધિ કર્મ, એ છે કાન્તિય ડેગ ધર્મ,  
 એતી વણુજ ગો રક્ષા જેદ, વૈશ્વ કર્મ અભાવિક એદ ૮૭  
 સહૂની એના નતિ પ્રણ્ય, કર્મ અભાવિક શરૂઆત તણ,  
 પણ પાગે ને વણુજ કરે, એતીદાન ને નત આચરે ૮૮  
 તીર્થ સેવન પાગે અધર્મ, એના રૈસ્ય તણ્ણા છે કર્મ,  
 દ્વિજ સેરા કરે વ્યાપાર, અનાન દાન ને શુદ્ધાચાર ૮૯  
 ત્રણે વણ્ણ સેવે ભતિ ખલ, એના ચદ્રાચારના કર્મ,  
 અષ્ટકર્મ સિધે તત્પર હોય જેદ, પરમ સિદ્ધિ પામે નર તેદ ૯૦  
 અષ્ટકર્મ તત્પર પામે ને સિદ્ધિ, સાખળ સર્વે તેદેની વિધિ,  
 અષ્ટકર્મ ધર્મને પાગે જેદ, ખલ બોકને પરમે તેદ ૯૧  
 જેથી સર્વ આ ભૂત ઉપન્યા, જેપળ યુ સર્વ જેદનુ,  
 તેદને અ કર્મ તણ્ણી ને નિધિ, પૂજ માનવી પામે નિધિ ૯૨  
 નિધે કર્મ કીધા પર તણે, વેદ નિશ્ચય અધર્મે આપણે,  
 કર્મ કણું અભાવિક જેદ, કીચે પાપ ન પામે તેદ ૯૩  
 અજ્રુન કર્મ અભાવિક જેદ, તજનુ નર્દિ સર્વોપણ તેદ,  
 સર્વોરભ છે દોષે ભર્યો, જ્યમ અગ્ન ધૂમે આર્યો ૯૪  
 સધગે મુદ્ધિ આસકન નહોય, અવાતમા નિગ્રદી હોય,  
 તે સન્યાસ તણ્ણો ને ધર્મી, પામે સિદ્ધિ નિકર્મન તપ્પી ૯૫  
 સિદ્ધિ પામતો તે તો જેમ, પામે ખલને પણ તે તેમ,  
 કી તેવ સાખળ તુ તેદ, સથેપે કરુ હ જેદ ૯૬

તिर्मल શુદ્ધિએ ખુક્તાને દોષ, યેવો નિયમે આત્મા તે મોષ;  
રામદાનિક વિપયોને રૂપને, રાગ દોષ ન ગાયે રૂપ. ૬૭

જથું આદારી એકાસે રહે, વાદ્ય કાય મન નિયમે અકે;  
ખ્યાન યોગ પર નિત્યે હોય, તથા વૈગ્યરાય આથરો સોય ૬૮

આહંકાર હૃપ્ય લાય નેદ, શામ શીથ પણિયડે તેદ;  
તથ હે રમત્ર શાંતાર હોય, ખરણા ગેજ્ય અહને સોય. ૬૯

તરતાં મમત રાત્તિ હોય, પામા યોગ્ય અહને સોય;  
અલ રૂપને આત્મા પ્રસાદ, શોય આકાંક્ષા કરે ન મળ. ૧૦૦

સર્વ ભૂતશું હોય સમાન, પામે મારી ભક્તિ મદાન,  
નેહેવો હું છુ તહેવો નેદ, ભક્તિ કરી લડે તત્તે તેદ. ૧૦૧

તત્તે જાણ્યા પૂર્ણ સોય, પ્રવેશ કરતો મુગમાં હોય;  
અવધિ સર્વ કર્મને કરે, અને રહે મારે આશરે. ૧૦૨

મમ કૃપાએ અવ્યય નેદ, શાશ્વત પહે પામે તેદ;  
સર્વ કર્મને મત પરાયણ કરે, સમૃપ્તિ ચિત્તે મારે વિદે. ૧૦૩

શુદ્ધિ યોગનો આશરે, અડે, હું ચિત્ત ભાંડે સદ્ગ એમ રહે;  
સુજનને જો મનમાંડે રાખીશ, મમ પ્રસાદી હુંઘને તરીથ; ૧૦૪

આહંકારે જો અવશ્ય વિદે, નહીં અંણો તો નાથ દરે;  
આહંકાર અધીત જો યદા, જાંખે સુદ કરું નહીં કરા. ૧૦૫

પ્રકૃતિ તુજને મિથ્યા એદ, પ્રેરશે ઉઘમે તો તેદ;  
આપ કર્મ સ્વામાવિક નેદ, હુંતીલ અરૂને તેદ. ૧૦૬

કરવાને નહિ છચ્છા સોય,  
સર્વ ભૂતના હેઠામાંદા,  
કરીશ તે તે પરંતુ હોય;  
અજૂન ધ્યર વસે સદાય. ૧૦૭

સર્વ ભૂત ભવ યંત્રે ભરી,  
સર્વ ભાવે હેતું ભારત,  
ભમાડે માયાએ કરી;  
તેહ તણેં થા શરણુગત. ૧૦૮

પરમ સનાતન સુખનું ધામ,  
શુપ્ત અત્યંત ગુપ્તમાંનેહ,  
તેહ પ્રસાદે પામીરા દામ;  
જીન મેં તુંને કલ્યાં તે તેહ ૧૦૯

એ સમગ્ર વિચારી જોય,  
શુપ્ત માંડે ને સરોપરી.  
કરજે છચ્છા આશે સોય  
મહાં વચન પરમ શુષ્ય દીરી. ૧૧૦

સર્વાદ્ય છે તું ભમ તણો,  
હું મનમાં એમ થા ભમ ભક્ત,  
કહીશ તુજ હિત આશી ઘણો;  
ભમ યજન ભમ નમસ્કૃત. ૧૧૧

તું મુજને પામીરા પ્રિય લઢી,  
સર્વ ધર્મથી થઈ વિશામ,  
કરું પ્રતિરો તુજશું સહી;  
એક શરણ માદારાને પામ. ૧૧૨

અનન્ય શરણ પરાપણ રહે,  
એક હરિ શરણની આડે આવે,  
શુપ્ત મંત્રનું દાર્દ કહે;  
તહેવા ધરો સર્વ તજવે. ૧૧૩

અનન્ય શરણમાં રોધ ને ફરે,  
પાપ સર્વથી તો દાદ લોક,  
તેવા ધરોને પરહરે;  
મુક્તિ કરું હું ન કરીશ રોક. ૧૧૪

વણી અમાદિ અનેક સ્વર્ધર્મ,  
વિવિધ પ્રકારે ધર્મ ભણુની,  
સૌ ધરો રહે ધરો માંડે,  
સૌથી શિખર જાણુવો સોય. ૧૧૫

દૈહિક ધર્મો ગોય છે જેમ, આત્મ ધર્મની શૈષ્ટતા તેમ,  
ભગવતું ધર્મ સર્વોપરી, એહ તત્ત્વને ભાગે દર્શિ. ૧૧૭

નિના તપણિને આ શાસ્ત્ર, ડેટેનું નદિ અભિત ને પાત્ર,  
નિહે મુશ્રૂના નવ્ય કરે, કનાપિ કડેનું નહી તો સરે. ૧૧૮

પરમ ગુલ માદાડ એ જેણ, માદાગ ભક્તને ડેડેશ તેદ;  
પરમ ભક્તિ મુજ ઉપર દરો, નિદ્રે તે મુજને પામરો. ૧૧૯

માણુસ ભાડે તેથી કોય, વાદાતો અધીક અનગ ના હૈય,  
તેથી ખીજો પૃથ્વી ભાગ, વાદાનો અતિ ખીજો નહી થાય ૧૨૦

ધર્મ સંનાદ આપણો એહ, ને કો અધ્યયન કરશે તેદ,  
તે જ્ઞાન યજે દે સત્ય, હું વાદાતો થાડી ભર્મ ભર્ત્ય. ૧૨૧

નિદા ન કરે નર ને કોય, અદ્વાવાન સાભળો સોધ,  
મુક્તિ પામતો તે પણ તેદ, પામે પુણ્ય બોક શુભ જેણ. ૧૨૨

પાણે ચિત્ત એકે ડાઈ સુષુપુ, હે ધનંજ્ય ને મે ભષ્ય,  
અશુને મોદ ઉપલયો જેણ, નાચ દ્વો કાર તાડારો તેદ. ૧૨૩

## ॥ અનુંન ઉવાચ ॥

અનુંન કહે સુણો પુર્ય પુરણુ,  
પ્રભુ આપે ને ને કંઠુ સહી, આપ વચન સી કર્દુ પ્રમાણુ,  
અન્યુત મોહ રહારો થયો નાચ,  
નિ સદેહ થયો તે હું, તન પ્રસાદે થયો જ્ઞાન પ્રકારા, ૧૨૪

અન્યુત મોહ રહારો થયો નાચ,  
નિ સદેહ થયો તે હું, વચન કરીરા તમાર કંઠુ ૧૨૫

## ૧૧ સંજ્ય ઉવાચ ॥

સંજ્ય કહે છે મુણ્ઠો રાજન, કૃષ્ણ કહે તે કરે અર્જુન;  
મહાત્મા વાસુદેવને પાર્થ, જેના નાગે ભવ થાપે સાર્થ. ૧૨૬

અદ્ભુત રોમ હર્ષણુ તેઢ તણ્ઠો, આ સંવાદ મેં અવણે સુધ્યો;  
ગોગેશ્વર શ્રી કૃષ્ણે જેઢ, આ સાક્ષાત પોતે કલ્યો તેઢ. ૧૨૭

પ્રગટ યોગ ઉપરોક્ત છે એઢ,  
પરમ ગુલ્ફ ને યોગાભ્યાસ,  
પ્રત્યક્ષ કલ્યો અર્જુનને તેઢ;  
સુધ્યો પ્રસાદમેં દેદ વ્યાસ. ૧૨૮

આ અદ્ભુત ને પુણ્ય પ્રસાદ,  
તે સમરી સમરી રાજન,  
શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ;  
વારંવાર હર્ષ હું મંન ૧૨૯

શ્રી હરિનું અતિ અદ્ભુત ડાય,  
મુજને મહોદેશ વિરભય થાપ,  
સમરીને ધૂતરાષ્ટ્ર ભૂપ;  
કરી કરી હર્ષ મંન માંદ. ૧૩૦

શ્રી કૃષ્ણ ગોગેશ્વર જ્યાંદા,  
લક્ષ્મી વિજય વિભૂતિ હુન નિત્ય,  
ધતુર્ધર અર્જુન ડોય ત્યાંદાં;  
ડોય ત્યાંદાં એ માદારી ભત્ય. ૧૩૧

રાજ ધર્મ મૂર્તિ છે જ્યાંદે,  
નમન મંગલે જયનો ધોય;  
સંજ્ય કહે જય લોશે ત્યાંકે;  
શ્રી હરિ નામે અમિત ગુણ ડોય. ૧૩૨

આવ ભખ ને કરે એઢ,  
આ યોગ રાસ્તે નર નારી ગાય,  
હરિ સંજ્ય છે નિઃસંહેદ;  
તેનાં સર્વે પાતિક જય. ૧૩૩

એક અકાર પણ સુખુગે જેઢ,  
વારાદ પુરાણે મહિમા સુધ્યો,  
વિષ્ણુ લોક પદ પામગે તેઢ;  
જાણુને અનુભવથી માણ્યો. ૧૩૪

પદ્મ પુરાણે બેના ધૂનિદાસ, નાનાવતાર વળો છે બ્યાસ,  
અરેશ્વરપણે ખજુ લેખી ભાસે, નાન્નિદુઃખનો સંગ્રહ ગતો ૧૩૫

અંડીખૂરી ખારન વિષ્ણુાત, હી ગોદાવી વિને સાઝાત;  
ત્વારા કલિન હેરા વાસ, ઉંઘ દૂષ્ય વણુ નદિ તો આરા ૧૩૬

કલિન દૂષ્યદાસ સૌ કરે, દ્યારામ એ નામથી લડે;  
યોગ શાન્દને અદ્ભુ વિદ્યાય, સંન્યાસ વા મોક્ષ નામક અધ્યાય. ૧૩૭

અદ્ધા દરથી લભાતિ કરી;  
શોતા દરિ દરિ જોતો કરી.

ઇતિ થીમદ્દ ભગવદ્ગીતાયાં સુપનિપત્તુ યત્ત્વ વિચારાં  
યોગ શાન્દે શ્રી કૃત્યાર્જુન સંયાદે મોક્ષયોગો નામ  
અષ્ટાદશોઽચ્ચાય: ॥ ૧૮ ॥



- मुख्य श्वेतार्थ<sup>१</sup> उपर भन धरी, चौपाई के होय ज्ञाती भरी;  
तेहेनो होय न धरेना भन, क्षमा करन्योऽग्नेया कवि जन. १
- नव्य जाणु<sup>२</sup> कांधि कविनो धर्म,  
श्रीधर वयन ने अन्य पुराणु, हरि रस पीवा ग्रीष्मा अभ;  
तेहेनो मिश्रित रथना जाणु. २
- पूर्व<sup>३</sup> वयन उथेनो करी हरी,  
अन्य वयननी संगति करी, द्रष्टा भूण वयननी करी;  
उपर भवननी संगति करी, २५४८८२८ वदकाय न जरी. ३
- ते कारण्ये पुनरावर्ति न होय,  
रहीत कामना रथना करी, गुणीजनगुणु अहीथाय सतोय;  
जेहेनो प्रसन थशे श्री हरि. ४
- करे हृपा कमलानो धणि,  
ओ वयु नहिं डामनथी आश, आये भेवा निज पद तथी;  
स्वामी सतोय किंडू अभिकाय. ५
- साठोहरा नागरनी शात,  
उत्तर अट रेवारी संग, सुर्जर देश भाँडे निघ्यात;  
उभय अट करे पावन अंग. ६
- चंडीपुरी पावन विघ्यात,  
तेहेमां श्रीवंत भट्ट कुल साय,  
श्री शेय शायी पसे साक्षात;  
वैष्णवी दीक्षा महा प्रभु माय. ७
- कविने हृष्णदास सौ कहे,  
श्री हरि चरण्ये पिता प्रभुराम,  
ध्याराम ओ नामथी लहे;  
विघ्मान भातु मदालक्ष्मी नाम. ८
- पिता पाम्या महापदे विश्राम,  
गुरु हृपातु<sup>४</sup> खण भन धरी,  
राजकौर भातुनु उपनाम;  
पथा भति रथना कांधि करी. ९
- शुद्धि ग्रेरह धृष्टि श्री नाय,  
नहिं मुजमां शुद्धि सामर्थ्य,  
शुद्ध भगवदीनो भेण्यो साय;  
संग समागमे नप्यो अर्थ. १०

तेद तथी कर्थाए ईरी, प्राकृतमा गीता वीरती;  
 इव रत्नि वागदने खाले ईरी, तेद प्रभाषे गायती भरी. ११

इव हर्षन श्रुति आजा जागी, हर्षनिष्ठत माटे कही वभाषी;  
 सर्व रीते निहोप एक दरि, अन्य सर्वमा अपूर्णता भरी. १२

स्वयनामां ज्यां ज्यां भासे होए, अब आवभति होनो डोरा;  
 दंस कीर नीर भिथ्य होए, वारि तछ पर असवा ज्ञेप. १३

तेम समझ गीता रचान्त, उपनिषद रदस्य सिध्यान्त;  
 सत्याभूत दरि रसमुत गान, तत्वसारे हेपे आध्यान. १४

भिप श्री दृप्यु अर्जुन संवाद, मुष्णे उपजरो मन अदलाद;  
 क्षेष्णी रक्षेष्णी कर्षणी एम रहे, निघे पर्म पर आप्ति लहे. १५

यह इपाए भति शीधी ग्राप्त, प्राकृत भापा प्रयोग समाप्त.

यादशं पुस्तकं द्रष्ट, ताद्रशं लिखितं मया;  
 यदि शुद्धमशुद्धं या, मम दोषो न दीयते. ॥१॥

॥ भग्नपृष्ठिकविग्रीया, वैधमुष्ठिरधोभुखः ॥  
 ॥ कोटेन लिखितं शाष्ट्रं, यत्नेन परिपालयेत् ॥२॥

॥ शुभं भवतु ॥ श्रीरस्तु ॥ श्री कल्याणमस्तु ॥  
 ॥ श्री कृष्णार्पणमस्तु ॥  
 ॥ समाप्ते ॥



## સાખી હુહા-

( પૂર્વી-તંત્રજ્ઞાયા )

- અલ પ્રમટ દરસે નહિ, અસ અનુભવ જિન લેદ; ૧  
 તેમલ જ્ઞાની અમ મતિ, શબ્દ અચ સંદેશ. ૨
- અલા જ્યાખી કથન તે, પરોક્ષ કરછિ બાત;  
 જિજાની વે અનુભવે, અનડોં વે સાક્ષાત. ૩
- નાગ પંચમી દૃતાસની, દિવારી છક વાર;  
 અભિજીત નક્ષત્ર સમ લહિ, કરી દરિપેં ઘાર. ૪
- અમ ધી તેં ચરચા કરેં, શબ્દ અલ તેં ભેદ;  
 બેદાભેદ નિકાસીકે, મથન કરત વહ ઐદ. ૫
- અમણુ બેદ કે! છેદ, ગૃહ શૂંખલ અધિન હેં;  
 યાદિને કષુ હોધનાં, મો ટારન નહિ કૈદ. ૬
- અદુંકાર એકાર તે, ભાઈ સખન ઉત્પેત્ય;  
 ॥ દરિઃ ઊં ॥ અસ જાન દિ, વે સખે અધિપત્ય. ૭
- આકાર અહોડો નામ હેં, અ અલ યહ નામ;  
 વહ જુ મહુદાકાર તે, વ્યાપક અલ જ્યુ જ્યામ. ૮

सर्वे अल्ल सभमें रहे, अल्ल जीन काहु न आनः  
 तत्त्व अंश विशुद्धि सभे, पहिं पुण्यो मान. ८  
 जिदा अजिदा शक्तिको चेतन्य इरहि दान;  
 चेतन अह भ्रेक रहे, चेतन्य अल निधान. ९  
 सभ रे चेतन मान ऐ, अनाही सत्ता द्वेष;  
 विनको सत्ता अल रहे, भिरका जने दोष. १०  
 सत्ताधीश सभैर है, सभके सासु सभीप;  
 साक्षी अल विनकों कहे, तटस्थ रहि अभीप. ११  
 जतो साक्षी होत है, वे हैं त्रिगुण अधीशः  
 रम तम सत्त त्रिगुन पारी, सगुन कहावे धू. १२  
 त्रिगुन सदा आधीन हैं, त्रिगुनातित धू ओह;  
 विनकों निर्गुन अस कहे, पह भर धर हि २५. १३  
 परापर्स्यांति भभ्यमावैभरी,  
 १ २ ३ ४  
 अल अल अस हृच्यरै, अस गीरा है थार;  
 अनुभो अल अनु भाव सभ, नहि अनु भों अनु लमार. १५  
 भावी कथनहु भाव ते, वाच्य अल अनुभाव;  
 अनिवाच्य भिग्नानी जन, अनु भों करत निधान. १६  
 अनु भों अल अनु भाव सभ, भिणिध अनांत अनुभाव;  
 रसानंद निभम डों, धरभानंद डो दान. १७  
 अक्षर डे आनंद डों कहे गनितानंद;  
 अक्षरा तित पर अनुभवै पूरन परभानंद. १८  
 ॥ छाक्षरात् परतः पर ॥ (भुङ्गो पनिपद)

ધર્મગુરોદ	તૈત્તિયમે	આનંદ અલ હે જેલ,
મોદી અક્ષર અલ કો,	ગનિતાનંદ પદ તેલ ૧૮	
તદાકાર તદ્વાપ વડે,	તન્મય તત્ત ચિથ્તિ ભત,	
તદાતિભિક અનુ બો બડે,	વે અપાર અનત. ૧૯	
વાગે ડિભ મન ખુદ્ધિ અરુ,	સગ્ને અગોયર જેલ,	
વે ખર પુરુષોત્તમ સદા,	કુર્ભ દુર્ભિટ એદ ૨૦	
એટ અપ્રાભ્ય અનડો કડે,	વહ ત્રિયુતાતિત એક,	
તદ્વત વહે જુ નસિદ અન,	અન ડો વિનાદી ૨૧ ૨૧	
સમ કરુન સમર્થ સદા,	સ્વતન સર્વતિત,	
સર્વ વિદ્યા સુખ સાધન	દિન શુને અગનીત ૨૨	
અનાદિ અય શાશ્વત સદા,	સુત તર મહ પ-મેશા	
સ્વેચ્છિત એક અનેક વહે,	જૃનેશ રોપ અગેપ ૨૩	
સગડો સદા નાથુ પુનય પરમ,	કરું સેન્ય સન્માન,	
અન આગ્યામે સમ રહે,	વહ હે પરમ નિદાન ૨૪	
અનિત્ય સળનડો તોાગ કે,	ઇક રસ અચન સુદાપ,	
એમે ખર તે પર પ્રશ્નો,	થી કૃષ્ણાચદ અ-ત્રય ૨૫	
અપનો સુખ અસુ ના અહે,	પરડો સુખ નિત અહાય,	
પરમ હિતકારી પ્રભુ બીના,	કો કરદિ અસ અદાય ૨૬	
જસ બાધુ સર્વત્ર હે,	સદાકાન ઇક ૩૫,	
જસ પગત્પર અલ હે,	લો હે અજરકે ભૂપ ૨૭	

મત સનત તે કૈવીજન, પનટલિ અપનો મેળ,  
 પ્રગટ શુભ્ર કુ હોત હે, પર કાયા જથુ પ્રમેશ ૨૮  
 પ્રાણું જન એન હેઠે, પરછી પૂર્ણ આસ  
 અપ્રાકૃત સર્મેશ પ્રમો, જન સર્વત્ર નિમાસ ૨૯  
 કર્તું અકર્તું અન્યથા,  
 સર્વ દરન સામર્થ્ય સદા, કર્તું સત્તા પરમેશ,  
 સર્વ નિત્ય સર્વત્ર નિત્ય સર્વત્ર ૩૦  
 બગાત સગી બક્તા હે,  
 બધ મુક્તા પ્રસગ તે, મો હે જીવન મુક્તા,  
 મુક્ત હોત નિત યુક્તા ૩૧  
 જથુ લગિ હૈન્ય ભયો નહિ,  
 અજીવ ઝીયો તથ જનિયો તમનગ ગિરિધર ડાસ,  
 હેઘડિ અપને હોય ૩૨  
 કર્તાખ્ય લૌહિક ઐદિક,  
 નિતિ વિષેક વેરાય જી, આમશ્ય નિમિત જુ હૈય,  
 નવધમાં મુસગજુ મોય ૩૩  
 આધીક પારમાધીક રાના,  
 વિવર્મ કામના મેટ હે, પુરુષાખ જી રધા,  
 મો મુસગ નિરધાર ૩૪  
 હુ સગતિ હુહ આતરી,  
 ઔરન ડો, ન, જિગાર હિ, જસ કદ રહ હિ આપ,  
 નહિ સદ્ગર કરી છાપ ૩૫  
 હુસરી જિગરી બરત જો,  
 ભિથ હોત હેં જહિ મે, ઔરન કરે જિગાર,  
 રસાદ મિમારી જિચાર. ૩૬  
 તા તે અસ હુસગ લહિ,  
 અંમો ભો પહીયાન કે, ત્યાસ હિ જાતી અસાર,  
 હુસગ તાજ્ય નિગધાર ૩૭

सत संगति छहा वहि, जस प्राप्ति आः;  
 ज्यों ज्यों मन्थन होत हे, त्यों त्यों नवनीत ६२. ३८  
 परि भित्रों जे आपमें, पाको करैं समउप;  
 तह वैत अनार हि, अस चुसंग अनुप. ३९  
 अ३ आप जब ठड़े नहि, निज सम उप करी धान;  
 औमें जनकी संगते, भित्तहि अमृत पान. ४०  
 समान शिखकी सम्पत्ता, हेत सदा संज्ञेग;  
 मन भिक्षाप ल्हे औड़यता, रोग नहि जब भोग. ४१  
 ताप तपे प्रढारों सहै, सभिं अंग घैंचाण;  
 अंग भरैठ ह मूँखता, आनुपन ल्हु कदाय. ४२  
 साव चुखन होहि जे, कुंदन सों भिक्षि जय;  
 हेघ रीछु ल्हों जहि दो, तथ निन्दैप सुधाय. ४३  
 परि ताप ल्हों आकरो, तज जुहो ल्हों जय;  
 सो हिर भूत भित्रों नहि, या ते समन्तु चुदाय. ४४  
 अभर दंश अप मन धै, कीट रहै नित ध्यान;  
 तो कीट अभर हि होत है, अस अती भग आन. ४५  
 परसमनी ज्वलोह डों, करत कलकों इप;  
 ताते अधीक सत्पुरुप हे, जे करहि तदूप. ४६  
 पैथाकी रीति अहै, ज्याति गगन अही खुँद;  
 भूमी पर्यो जब तां झुँदै, अस मन रहै मुकुद. ४७

મત ગતન તે દૈવિકન, પરટદિ અપનો મેળ  
 પ્રગત શુષ્ટ ક રોત હે, પર કાયા જયુ પ્રમેશ ૨૮  
 પ્રાકૃત જન મન દેસને, પરછી પૂર્ણ આસ  
 અપ્રાકૃત સર્વેશ પ્રમો, અન સર્વત્ર નિમાસ ૨૯  
 કંતું અકંતું અન્યથા, કંતું સા। પરમેશ  
 સર્વ કરન સામથ્ય સદ્ગ, સર્વત્ર નિત્ય સર્વેશ ૩૦  
 અગ્રન સર્ગી અમત હે, મો હૈ જરૂર સુધા,  
 અધ સુધા પ્રસગ તે, સુકૃત હોત નિત સુકૃત ૩૧  
 જળ લગિ હૈન્ય બથો નહિ, નમનગ ગિરિધર કોસ,  
 અભુય કુથો તન જાનિયે હૈખદિ અપને હો॥ ૩૨  
 કર્તાભ્ય લૌકિક ઐદિક, આમસ્ય નિમિત જુ દોય,  
 નિતિ બિમેક ઐરાભ્ય જુ, અધમ્ય સુસગજુ મોય ૩૩  
 આચિર્યક પારમાચિર્ય - જાનણ,  
 ત્રિવર્મ કામના મેટ હે, પુર્ણાંશ જુ વ્યાર  
 કુસ ગતિ કુદુ ભાતડી જસ કુદુ રહ હિ આય,  
 ઔરન ડો, ન, બિભાગ હિ, નહિ સદરસ કરી છાય ૩૪  
 કુસરી બિગારી અમત લે, ઔરન કરે મિગાર,  
 મિશ હોત હેં બાંદિ મે, વ્યાદ મિગારી બિચાર. ૩૫  
 તા તે અસ કુસગ લહિ, ત્યાગ હિ જની અસાર,  
 એસો કોદ પહિયાન કે, કુસગ વાજ્ય નિરાધાર ૩૬

सत संगति कहा वहि, जस पथामृत सान;  
 ज्यों ज्यों मंथन होत हैं, त्यों त्यों नवनीत दर. ३८  
 पारि भिक्षे ले आपमें, वाडी करैं समझ;  
 तक श्वेत बनाव हि, अस सुसंग अनुप. ३९  
 अह आप जख नहे नहि, निज सम उप करी धान;  
 औसे जलझी संगते, भिलत हि अमृत पान. ४०  
 समान रिखझी सञ्चयता, होत चढ़ा संबोध;  
 मन भिलाप नहे औडयता, रेग नहि भज बोग. ४१  
 ताप तपे प्रहरीं सहै, सञ्चिद अंग जीचाथ;  
 अंग भरोड इ भूदुखता, आनुपन नु कदाय. ४२  
 साव सुखन होहि ले, कुंठन सों भिलि जाय;  
 देह रीषु घों नहि ओ, तथ निजरूप सुधाय. ४३  
 परि ताप छों आकरो, तथ जुहो घों जाय;  
 सो द्विर मूल भिक्षे नहि, या ले समानु मुदाय. ४४  
 अमर हंश अध मन धरै, कीट रहे निन ध्यान;  
 तो कीट अमर हि होत है, अस अती लग भान. ४५  
 परसमनी नु लोह तै, करत कनकों उप;  
 ताते अधीक सत्पुरूप हे, ले करहि तदूप. ४६  
 खैयाली रीति अहै, स्वाति गगन अही छुंद;  
 भूमी पर्यो जख नां छुहै, अस मन रहे मुकुद. ४७

सीप सागर भैं रहे, स्वाति झुँड भेड़ केर्ह;  
 सागर नक भवि नहि, २३ दि रवाति भेम. ४८  
 और्से फूध जमाव दि, तैसो साधु संग;  
 भवाह मालो होत हैं, रस पुष्टीत सर्वंग. ४९  
 जमावन चारो अद्धतो, हाट थी ५५ निरधार;  
 प्रथम परिष्ठा हुअझड़ी, पात्र अपात्र यिचार. ५०  
 उत्तर मुलठ रह के अमर,  
तभ पथामृत सारजे, सदन करदि लदि ढेत;  
 तें छो चेरे न बह इटे,  
नवनीत वडे ज्यु निरेत. ५१  
 अंग अंग रसज्जन खड़े,  
इटे तहु इटे नहि, सज्जन त्रै गंभीर;  
 श्रेष्ठ मुसंग जाडों भिज्जे,  
संगद्धिए सम होय धी, और्सो पङ्की २८;  
 अंग उद्धक्षें आन जख,  
अस साधनकी संगतें, और्सो भद्रत प्रसंग. ५३  
 आयुर्भेड़ खड़े नहि,  
अनुओं यिन औपद इरै, इडाअत ऐध अग्नन;  
 यिक्तिसा ऐपद पथको,  
और्सो ऐध मुसहायड़, वहि लेत है जन. ५५  
 आयुर्भेड़ खड़े नहि,  
अनुओं यिन औपद इरै, जन हि यिबिध ग्रयोग;  
 और्सो ऐध मुसहायड़, और्सो ते टरहि रोग. ५७

ऐ शाख पागत,	अहं धि निश्चय मन्;
उडेनी रेहेनी ओइसी,	औरे विवेद सत ५८
म त्राय बद्धय चितन सता,	अहविन् प्रभार्य;
सदा सर्व शुक्ष सम,	नदि ब्रह्म कुरु स्वार्थ ५९
औरे अडे उदार निधि,	उठानामंत रसान,
मुसग सेवन वालिको,	दृतधी तु जल ६०
रात्मा ग्रेमडे भूतते,	रवत त दरि भरा झान,
और भूत सम तोरी ग्रनो,	देवत दि गेहावीन ६१
मनि दुँन नग रहत है,	सता और दि अग,
म्बुस बुट दरि है रहै,	जिवसत प्रभु नित संग ६२
नित्या नित्य मियार जहाँ,	सारासार मिथेक,
आमुदेव सर्वत्र भति,	पूति सदा मुनेक ६३
श्रव दया प्रधन वृण्डा,	सत्य पथा उच्ची दान,
चक्रित अह नभ्रता,	पद भारग कपान ६४
मोह तिभिर अज्ञानको,	ज्यादां गहि ना लेख,
उम्म ज्ञान उपासना,	पथाधिकार उपदेश ६५
क्षीर नीर मिथन जहाँ,	प्रथक करत है दंस,
औरे मिशानी सदा,	निष्कल जन घंस ६६
नवधर्म ज्ञान विराग्य धुत,	साध्य योग तप भवित,
परमह देश्वर प्रति,	उत्तमी प्रेमासक्ति ६७

- शुद्धाचार विचार मुनि, श्रेष्ठ हु लुटिमान;  
पूर्वमारण जिधा अलगी, करत हैरीहो दान ६६
- सरक रववध थी हृष्णु को, चरण मंत्र उपदेश;  
सर्व अत्रेय भिक्षान दि, आत्मांतिक अथ प्रभेश ६७
- निरपृद निर्देशी सदा, पंच विषय नहि देत;  
सदा एक रथक नां रहि, सदगुन सिंहु निडेत. ७०
- पंचकाल परायन सदा हृष्णु शु वृत्ति;  
सेवा रमन अरु ध्यानमें, अनहो सदा अनुरक्षित. ७१
- धैर्यांत जिमेक सुत, सदा अिमत्र अन गान;  
नियुनातित परात्पर, वृत्ति अनुसंधान. ७२
- जस धातु भित्रित है, तस अब ग्रहु संबंध;  
छांडोऽय उपनिषद् इथे, दूरत अवहो वंध. ७३
- पात्रा पान जियारि हैं, करत हि दरि संधान;  
छनडों जस अधिकार हैं, तस औषध अनुपान. ७४
- हृष्णु कीर्ति उच्चरि हि सदा, पर अह शु ग्रेम;  
तिर्यक्ति सदा संतोष्युत, निराकरण हृति क्षेम. ७५
- सर्व समर्पित अलगों, नहि को आथय आन;  
जिहानी निमोन सदा, अभिति अन अलिमान. ७६
- अलार्पित प्रसादी भीतु, नहि को खान के पान;  
सर्वदा सब बावसु, हृष्णु कीर्ति गुन गान. ७७

निगम गति पांडित्यता, तदेवन हृति आचार;  
 × × × × (अहीं एक चरण घूटे छे )  
 परियथ अभुक्त मागभी, सदा श्री हृष्णा सक्ति;  
 श्री गोपी अवतार श्री पति, विनये पर्म ज्ञु भक्ति. ૭૮  
 असना सक्ति अग्नेसमें, अभावृत शुशुर्गंत;  
 मानभी सेवन मुख्य रति, दशम रहस्य अनंत. ૭૯  
 भक्ति रसात्मक भावदो, उद्दीपन संधंध;  
 श्रीमद् भागवतामृत, सार सुपेष्ठ अधंध. ૮૦  
 अतक्यै तक्यै जे सार हें, विनये अनुसंधान;  
 अह जिनु चर्ची न डो, एहि रस गुलतान. ૮૧  
 विद्वत् रत्न कारभीरी प्रति, निहिं चाखी, ૫૪૮;  
 पोथी अशुद्ध न होहि उभु, अस आनी चुरुपृष्ठ. ૮૨  
 अव्यंपाडी शुद्धानडो, विदित ग्रसाठी बोग;  
 अह्नार्पणु जिनु सर्व डो, त्यान्य सदा लही रोग. ૮૩  
 अद्वान्युभमधि कडे, दश अकार डे अन;  
 विहित बोग भये अह डो, अरान डे दरिजन. ૮૪  
 अप्टाक्षर, पंचाक्षर आदि, हृष्णु डों जप;  
 सदा लक्ष ईक अहमें, दास्य भाव लही आप ૮૫

॥ नाम वैष्णव हेतुत्व सुख्यमित्येतदुच्यते ॥  
 ॥१॥ योजयेत् नाम दासत्वंभगवन्मंद्र पूर्वकं ॥

॥ तु ध पाराशर रम्योऽक्त उत्तर भागे दीतियाध्याये  
 पाराशर प्रति व्यास नवनम् ॥

॥२॥ दासोऽस्मि भगवन् विष्णो तथ कल्याण भाजन ॥

॥ ५६५३॥ उत्तर अ०३-अ०४-५० थी विष्णु  
भुति प्रसंगे श्री भहावेशनु वयन ॥

॥३॥ दासोऽहं कोमलेद्वस्य रामस्याक्षिष्ठ कर्मणे ॥

( वालिभी रामाखणे शुद्ध छाँडे हुमंत वयन )

॥४॥ हरिदासस्य राजपै ॥ ( श्रीमद भागवत )

॥५॥ हरिदासी वजौकसाम् ( श्रीमद्भागवते उद्धव प्रसंगे )

निंदा सुति डों सभ लहू, कडि इष्टु शुनगान;  
निर्भय-स्वतंत्र-निर्पेक्षता, आभ्य कथा नडि कान ॥६

नडि डी थो याथना, छडि इष्टु अभमान;  
सर्वात्म भाव विक्षसे सदा, करी इष्टु इपा ते दान ॥७

इष्टु अहित ज्यासों उटे, अह उपने वैराग;  
रनेह अहित शिखाई ढे, इष्टुर्पार्षु भति, त्याग ॥८

रान अधिक तात्त्वम् सें, नीति धर्म समेत;  
इस अंग कहा नहि ज्याहिगें, ओसो अयन समैत ॥९

अज गानहे ओधमें, बहुत हैर दृष्टांत;  
संशय छेही रहस्य कथे, तत्त्वसार सिद्धांत ॥१०

शुभी भूत भहात्मा अह, तद्वत ले विद्वान;  
भिजायांत, अनिय युत, तामें कर समान ॥११

સત્યોચયાર	ધર્માચરણ,	નિત કરી અલાક્ષ્યાસ;
આદરસ્ય પ્રમાણ હુર્ગું તજે,	ગુરુદુદ્ધ કર દિ નિવાસ.	૬૨
માત પિના ગુરુ હેવડોં,	પ્રિય હૈં જે જે રીત;	
નિર્દોષ કૃતિ નિત આચૈરે,	સમ દ્રષ્ટિ પરદિન.	૬૩
ઉર અમલ તો અંતરે,	અચલ અજ્ઞા સિદ્ધાંત;	
પ્રેમ ભક્તિ કે છંદ તો,	સત્તા હુદ્ધ નહે શાંત.	૬૪
હૃદય કથા રસ વિષસમે,	દ્રગાંધે બાહ્ય મુનીદ;	
રોમાચિત પુલકિત તન,	ગાજત હૃદ્ધ અન શીર.	૬૫
નિર્મલ બાની રસમથી,	ભક્તિમય સુરપદ;	
સત્ત્વપ્રાક્ષર નયુ સૂત સમ,	નહિં કો આતિ અર્પણ.	૬૬
અવણુ કન્ત અધિકાધિક,	ઉપજ દિ પ્રેમ પ્રમાણ;	
મધુર મિષ્ટ ક્ષણુ ક્ષણુ પ્રતિ,	નથીન ઇચ્છ અભિવાપ	૬૭
કૃષી કર હિતકર પાત્ર સમ,	ઘરીત કરવી ઉપદેશ;	
સિદ્ધણુ-પદ, તિન વત્તસ સહે,	આન પદે નહિં લેશ	૬૮
શુદ્ધ સુપાત્ર ખાલણ કરે,	સોમવર્દી રસ પાન;	
આન વંશકો વમન કરે,	પાત્રપાત્ર નિરાન.	૬૯
મૃહુ મંણુલ કોમલ ભવ્યતા,	અતિ અદ્ભુત મુખરાયા;	
પ્રમાન યુક્તિ અર્થ સિધ,	દષ્ટાંત મું સ્પષ્ટ પ્રકાશ.	૧૦૦
કાય્ય કોં કારન કહે,	કર દિ સમાધાન;	
કાય્ય કારન સાતે પરે,	દેત જાન કોં દાન.	૧૦૧

शुद्धादृत परात्पर, परम्परा अमस्य करी सिद्धात,  
श्रेष्ठाधिकारी पातडा, अमस्य करी निर्भीत ११२

समुद्र भीपरे होत है, मुक्ता विश्वध अकर,  
मुक्ता अभीलिक सर्वनहि, अस साहु निरधार ११३

सत्यमात खड़े नहि, असत्य कही न सहाय,  
निर्भयने गाज कहै, भर्सिद्ध सम समुआय. ११४

११५ लेके रगमे, अतर्ने उमग,  
हरि इस यश आवेश ते, छिनु छिनु चुहि अग ११५

अधिगाधिक हरि ग्रेममे, झनडा हे सर्वंग,  
दिनहिनछिनछिनहोतहे, कृष्ण कीर्तने रग ११६

बोक लाज, हुत स्पागी है, अद्वरत सरडा ग्रेम,  
ओसे भिरसे साधडा, हूठत ही सम नेम ११७

॥ पुस्त्रे खीत्रे विशेषोगा जातिनामा थमा दया ॥  
॥ न कारण यद्भजने भवितरेव हि कारण ॥

(पालिमगी रामायण-रामरीतार्थ भगवद्भक्ता प्रति श्री राम वगन ॥)

हरिभक्ति सम डो कहा ? आन नहि कृष्ण हैय,  
अहान द विदेषता, तासु गीत वे टेय ११८

भवयागिरि यहन सम, कृष्ण भक्ति को रग,  
तामे अग्निधा भिन्न कर, भिन्धन घोर लुकाग ११९

- भूमि गत ले दृश्य है, तापे प्रेत अनन्त  
सद्गत दृत पावे नहि, और मिलिधि जल. १२०
- जस नुपाधीश के मिनान डो, कंगतही दीन प्रथान,  
हुर्मूल अकिञ्चन नहि थी, अर्थाती, अनन्ती, न प्रथान १२१
- परि कथा जाहा दोत है, जहा त्यागी गृह राम,  
वगन आर्थ धरी मुख्यता, अर्थात तत अन राम १२२
- आपस निदा त्याज है, अकाली करी २६५,  
निरभिमान वीन ऐरहि, अमन भक्ति ०३ २६६. १२३
- क्षुद्र अही सम टड़ेन हो, करत दिन, तज भेन,  
नित्य नवीन यश मुनत हि, पार उभग रसरेल. १२४
- बुध खास शित उष्णता, अह ले अरसत गेल,  
सअडो सही अम्या गृत, मुन हि अनो नेल १२५
- ज्यो यों भान चितमे गहै, ज्यो ज्यो गहत मिकार,  
हूँड, कमट, हूपन तजै, इथा वगन ईकतार. १२६
- लागी लागी सम कहै, लागी नहि लगार;  
लागी तो तम जनिये, निकसे हिरहे पार. १२७
- प्रेमहित आत्सर्य युत, अनडो सद्गत मुभार,  
ध्यान अभरन सेवन करै, तिनडो प्रयु दरशार १२८
- चित चितन निरादिन करै, प्रेमागत युत गाय,  
प्रगट अह दरसै तडा, जो सत् सग नयु धाय. १२९

सत्यगुन गिरु प्रभो, ज्ञन सजी भूगुणी वात,  
 भूगु वाचन धरी उपेहे, ताते प्रभु मिष्पात ૧૩૨  
 अस सदनता धानि કે, કર દિ સત પ્રસગ,  
 જાન મિગાગ એમેક ર, ભક્તિ પ્રગટત અગ ૧૩૩  
 નિગુન ખલ, નિગુન ભય, યા તે સવોતમ,  
 નિગુન અક્ષરાતિત રે, વે ધરુ પુરોતમ ૧૩૪  
 વે સગમે સગતે પરે, પર ખલ જન નામ,  
 શ્રી અજ રિન જન મેવ રિ, પરમાત્મન ધનસામ ૧૩૫  
 ધ્યાન નિષ્ઠ હુદુ ભાત રે, અતર બાદિ નિાટ,  
 અતર ધ્યાન મો શૈષ્ઠ દે, જરસ શૂક અલા-રિષ્ઠ ૧૩૬  
 અખડ અલકી મૂર્તમે, કર દિ જનમ મુખતિ,  
 પરોક્ષ પ્રગટ વહે ન્યાદિતે, ધ્યાન જુ અલ પ્રતિ ૧૩૭  
 રૂચય પ્રીતય અતુસાર મો, સગુણ અલનો ધ્યાન,  
 પ્રથમાન અમસ્ય દિ, દિર નિગુનાતિત જીન ૧૩૮  
 દેદાતમા સયોગ તે, ધ્યાન ભજત મેવન,  
 નરીર હુ ઉપયુક્ત રે, માતો રહે સાધત ૧૩૯  
 પચ મહાભૂત અગ હે, સગ જન મૂન અતરાતમ,  
 વદુ આતમા મો અસ હે, સખત મૂન પરમાતમ ૧૪૦  
 પતિ સદગુર જનકી, તસ આહન બિન એવ,  
 એકાતિક દનિલકન ગિરુ, એવત અગર-મેર ૧૪૧

अस सप्त पीढ़ी लगी, शुरु वर्तु भगवद् भट्ट,  
 मुसग अितु हरि रत नहि, नहि ऐम आसन्त १४०

सरय छेद समूल ते २५८ यु जान अनत,  
 सत्य नित्य निवित अउ, सो भाष्ट वह सत १४१

निरानी सत्पुश्यको  
 रमामानुभवते कहि, प्रगट अह साक्षात्,  
 सम समाये जाहिमे, अस एड भूमि प्रदेश,  
 या ते बड़ा समूद है, अलयाते लिपटत देश १४३

ताते एड अगस्तज्ज, समूद जल कीये पान,  
 माते अधिक अलाड है, नहि दग्धत सुनि जन १४४

अनत कोटी अलाड के, अधिपति छड़ि भग्नेश,  
 भासनते छड़ि पाते, त्रिभिर्भु करी षेश १४५

भु-जल, अउ अलाडको, धरी धरा अन शेश,  
 नागायन उग्पे धरे, अउ लीतर उधीकेश १४६

औमे शेश अरोप डो, पशोहा अही उर्जग,  
 अिधर चेपि सहा, ति। चेपि निः अग. १४७

गहत अडत अउ भाष्ट है, अन वह अशु भिनाय,  
 रीस दीध दग भातशी, सहत सहा अजग्र १४८

॥ अहोभाग्यं अहोभाग्यं नंद गोप वज्रोऽसाम् ॥  
 ॥ यन्मित्रं परमानंदं पूर्णद्वलसनातनम् ॥  
 (श्रीभद्रभाष्ट)

चासुदेवस्य ये भक्ताः शांतास्तद् गतमानसा  
तेषां दासस्य दासेऽहं भवे जन्मनि जन्मनि.  
(पांडव गीता)

॥ अहमस्मि नारायण दासदास ॥

॥ दासस्यदास च दासदास ॥

(भीष्म पिता महानुं वयन्)

सत्पुरुषनके भिक्षनकी, अनकों भनमें आंच;  
उत्तम लक्षा भिक्षावधी, प्रशु कर्ही द६ सांच. १४६

करहि संग खड़जनको, आरतो नितधाय;  
द६ अधिकास सदा धरै, कर हि प्रशु तिन रदाय. १५०

द६ अधिकास ३ दिनता, श्रद्धणु भनन अन कीन;  
नितिधास वहे अपनकों, जस वारी करी भीन. १५१

अलानंद अप्स तिन, इचै न भाँड़ि भोद;  
अदंत! भमता छाँडी सथ, ग्रेम भक्ति करी लेह. १५२

अनन्य नेघा हृष्णपे, नित्य चुसारे भियार;  
असार अनितों त्यागी है, सेवही हृष्ण चुसार. १५३

बगवह अर्थ लगाव हि, धर्दिय भन अह चित;  
सग हि अपीं हृष्ण डों, भन हम बच सुं प्रीत. १५४

ध्यान रमन अह भेव हि, धड़ यह त्रिगुनातिन;  
क्षर अक्षर हुहु ते अतित, हे यह सर्वातीत. १५५

૫૨ અતિ ૫-માત્રમ અરુ  
 એદ ગીતા પુરાત્મે, તૃતીય અદળ ભગવાન  
 પ્રગટ સૂર્ય ચેખત નહિ, ને દે નોંધુ અધ,  
 આશુરી રાગે નહિ, અધુ ભાઈ અધ ૧૫૫  
 હદ્ય દિલ્લિ અનકી અહી, અનડો નાન ચુચાન,  
 દિલ્ય દર્સ એ અભિતે, દર દિ કૃષ્ણ તિન રમ ૧૫૬  
 જગત કે આવેલ તે, કરિવર કિય અદ્દામ  
 વરાય હાય અનમે વર્ષ, પ્રગટ અતિ ધનરામ ૧૫૭  
 દ્વાર વારિ અગ્રિ ભરો, અસારે યદ સસાર,  
 પારાન વદ જનર્મ બસે, ન બીજાંદી લદિ અસાર ૧૫૮  
 પાપાનથી લીનર ને, અનિ કરી અચાન,  
 યા તેં વાન બેદત નહિ, અસભસિ કર દી નિમાર ૧૫૯  
 દ્વારાય ન મુન પુતરી, ડર દી દિશા દર્દાર,  
 અસ ભાતિ દર્દિ દગ રહે, તથ નિશન દરિ ભાર ૧૬૦  
 લ સાર સમુદ્ર થાંદે નહિ, આશ્રય મહુવા નાર,  
 દાણુ નૌકામે બરે, તથ લદિ દર્દિ કો દર્દાર ૧૬૧  
 સહગુર ખર નિધાનિયે, કણુંધાર વસ રીન,  
 સસાર સમુદ્ર નિકાસી કે, કણુત પ્રસુતે પ્રોત ૧૬૨  
 સાંધુ સુસગ તયે નહિ, અસત ન તરફિ દુસગ,  
 સંજૂન કસુ દુસગીતે, નહિ છાપત નિઃ રગ ૧૬૩

હુસંગીકો પાશ કણુ, નહિ જ્યાપત કણુ લેથ;  
આપઠાં પ્રસંગ તણુ, નહિ છાંડત નિજ વેશ. ૧૬૬

॥ સતસંગાત્ ભવતિ સાધુતા ખલાનાં,  
સાધુનાં નહિ ખલુ સંગમાત્ ખલન્દ્વ;  
આમોદે કુસુમભવ્ય મૃદેવઘતે,  
મૃદુ ગંધ નહિ કુસુમાવધારયંતે ॥

સંગ નામ સંદર્ભન હોં, આસક્તિ ઝુત ડેત;  
મન મિલાપ વહેં ઓક્તો, પ્રગટન ઇલ, જસ ઐત. ૧૬૭

શુદ્ધ રેત કે યોગ તેં, જસ પ્રગટન હેં વત્સ;  
મન મિલાપદી પ્રીતિ અસ, જસ વારીયે ચાલસ. ૧૬૮

સુણુન પાત્ર બિધતેં ભર્યાં, નહિ તથ વે સુપાત્ર;  
નહિ પાન તેં મૃત્યુ વહેં, પદ પાત્ર નહિ જ્યુ અપાત્ર. ૧૬૯

મૃદ્દા પાત્ર કણુ હોય તણુ, જમે અમૃત સારે;  
અસ ભાતિ હરિ ભક્તાડોં, સેવન કરી ધરી પ્રાર. ૧૭૦

હરિ યશ તેં અંકીત જયુ, આતી હોય રસાલ;  
અગવત મુણુ કીર્તિ અહેત, તાતેં મૃત્ય જાલ. ૧૭૧

હરિ યશ અંકિત અંક હૈં, આન સણેં લહી શન્ય;  
અંક મુદ્રા સખ શન્ય જનુ, હેત જયુ દશ દશ શન્ય. ૧૭૨

યા તેં આદ્ય યશ અંક ધરિ,  
ચેદુ જિનતિ હોત હેં, દિભુતસાદિ જે નૃન્ય;  
અંગ અંગી સખ પૂન્ય. ૧૭૩

- અટ ગિનાડી શન્ય લે, ટાક તીનથ સમ મોાર  
વાયસ વહ જલ મળિતમે, અપનો બગ દિ વોય. ૧૭૪
- કાગનિ રૂગ કલકલ કરે, નલિ સર્જન રસુ ખર,  
ઓકિન મધુર રાણ કરે, અમ હુદુ આતિ પિચાર ૧૭૫
- ઝુંગડ ડાગ માં ભલી હે, દસ રચ નલિ એરી,  
કૃપણ કીર્તનામૃત પીયે, રિનડો ભાસત કોરી. ૧૭૬
- ઝુંગાદલી મિઠુ રચમે, છસુ ન ઢરી હે આન,  
ક્ષીર અદૈ નીર લાગી હે, નલિ જન મર દિ પાન ૧૭૭
- અસત રત ઓકિલ ડો, માધુર રસ ઉચ્ચાર;  
ગંગાન બૂરુજ રસ નોગલી, ઉક્ષ ન ગ્રસદી લગાર ૧૭૮
- ચઠોર શીતળ રચપે, ગાયત પ્રરન ર્થાર,  
તાકે બન લુંતે રહી, અચ્છિકે ચાગાર ૧૭૯
- પણી ઓકિલ બાનડો, મેરલિ કાગ નિજ જાન,  
પર આવે સંગ છિંડિ, નડિ કનન કષુ સાન ૧૮૦
- વહ કાક ચોપન કરે, રાખન હેં નિજ ર્થાન,  
કોકિલ નામ પર ભૂત્ય રહે, જ્યો લ્યો નનિકમે આન. ૧૮૧
- ગિગ પ્રગટ હે નલિ, ઓકિન આન હર ભારી,  
માની સુનકે રિનકો, હુદુ ડાગ નેંડિ મારી ૧૮૨
- અસભાતિ સત્પુર્યકી, ઓકિન મંડનમે જય,  
ના નાય મિલિકે હે, સુદુર સ્વર દરસાન ૧૮૩

જાત ભાવ નહિ એકસી, વાંદાં રહે તો જસ મૂલ્ય;  
 × × (ધીણું ચરેણું અગ્નાનું નથી) × ×

પણું ધર્મ સમ જાહિ હોં, તસ સમ જાદિ સુભાવ;  
 સમાન શાંત રૂપું જતાં, સાગ્રહ્યત્વ કરદિ દરસાવ. ૧૮૪

નથોં લ્યોં નદિ સામર્થ્યતા, ઉડવનાથી ગતિ નહિ;  
 રથોં લ્યોં આતી નાં ઉચ્ચરે, વિજાતિ લેણી જ્યાંહિ. ૧૮૫

સાધુ જન નિજ મર્મ હોં, દ્વારાત હેં સમર્થીઓ;  
 કૃમ્બ રૂપીય જાતિમો, દાખેં આંગ દિલમિત. ૧૮૬

નિજરૂપ વિજાતિ હોં, દાંધત હેં નિશાલિન;  
 વ્યસ ભાતિ નિજ આશાય, નહિ દરસાવત બિજ. ૧૮૭

સાધુ જન ઘલયોગ કષુ, ભાવિ તો મિલિ જાય;  
 તદ્દું ન પરસે તાહિ હો, તૈલ વારી નહિ કાય. ૧૮૮

જાતિ પર કુલ ધર્મ વ્યક્ત, સુભાવ આહિ સમાન;  
 રૂપ રસ દૂલ વહી પ્રગટ હિ, નિશ્ચય દડ પદિયાન ૧૮૯.

સુષ્પ્ય આધિદેનિક સ્વામિની, જહિત ભાદારાની સેષાય;  
 જાતોદરકી વેપરા, ધૂન સમ નાદિ ન હોય. ૧૯૦

દાઢચામિસેં સથ જનનહોં, દોત, મનોરથ પૂર્ણ;  
 રહ ધીકો મનોરથ ભી પ્રભુ, નહિ કષુ જ્યાતેં અપૂર્ણ. ૧૯૧

શુત સનકાદિ નારદ, અગ, અગ શી અર મહારેવા;  
 સખરાં સથ કુનિ નડપિ, પરિક્ષાત અર રૂક્ષદેવ. ૧૯૨

આધ્યાત્મિ સદાચલ મુને હે, અર્થ નગરન ભક્તાચાર  
ઔપનો સેવક દાસ કરિ મિહુગમ પથ સુકાર્મ ૧૬૩

॥ દાસ સૃતા સ્વરત સર્વે જ્યાત્માન પરમાત્મન ॥

(મહા ભારતે નાભ્યષ્ણા પાખ્યાને અલોન વચ્ચનમ्)

॥ યો યર્દશ સત્ત ભજેત ॥ (ધતિ શુને)

ભળન ધ્યાન ચિંતન રમણ, આર્દ્ર પ્રભુ એક,  
ન્રિયનાતિત પગાત્પર, જર્નાતીતકી ૨૫ ૧૬૪

સત્ય અનત જ્ઞાન ધન, સત્ત્યામૃત રસ ૩૫  
ઐદ ઇ કાન અતિત હે, સો જો અજકે ભૂપ ૧૬૫

પર અલ પરમાત્મ જો, મુર્દ્યોત્તમ પરમાના,  
રસનિધિ ગુણ નિધિ પ્રભો, શ્રી હાણ જોવિંદ ૧૬૬

કરું અકરું અન્યથા, કરું સદા સમર્થ,  
સ્વતનત્ર રવેનિંહત નિર્ભય, પર્યોધિ પ્રેમ ઇન અર્થ ૧૬૭

એસે શ્રી સર્મેશ્વર, સો પ્રભુ ભક્તાધિન  
અપની મદતા ત્યાગીકે, ભક્તત પ્રતિ ગઢે દિન ૧૬૮

તાતે નિઝો એષ્ટ લદી, પરમૈકાતિક સેવ,  
અતર ગી વારા મિનાય હે, એસે સદગુર દેસ ૧૬૯

પારસ્પરનિ તે સગતે, લોહા, દેમ દ્વિ લોધ,  
સાધુ જન નિજ મમ હૈ, અસ પ્રભાર ચિત પ્રોધ ૨૦૦

- કામધેનુ મુંડમ અરુ, વિતામનિ સર્વ નોષાં;  
પ્રચળાધિક અતિ દાન હે, યા તે સાહુ શૈષ. ૨૦૧
- અલ્લાને અત્સ દરન કિયે, બાળરા આલક સંગ;  
તર્ય બાળરા આલક છીકે, બેનુ લેત્રાદિ શૃંગ. ૨૦૨
- સંગદિ ૩૫ શ્રી કૃષ્ણ જવુ, ભર્યે તહેવત આપ; .  
॥ એકોડહં બહુ ઇયામ ॥ કુલિ, દાખી પ્રગટ પ્રતાપ. ૨૦૩
- બાસુહેવ ભય સર્વ હૈ, અસ દાખત ઉપહેરા;  
ઓસે મહાત્મા દુર્લભ સહા, સાર દિ યડ આહેરા. ૨૦૪
- કૃષ્ણ કૃતિં મુખ ગાંધિ રે, સત્યામૃત ઘડ ઓદા;  
આન કથન અમૃત લદોં, કાલાંતર કાય સર્વ તેઢ. ૨૦૫
- સરવર તરવર સંત જન, પરમુખ શૈય દિ ચાદિ;  
સ્વારથ રંધ ન ચાપડોં, પર અનદિત કરિ નાંડિ. ૨૦૬
- આનંદ કંદ જો રસ નિધિ, પૂર્ણ પરમાનંદ;  
વે રસભર પ્રેમામૃત, ડારત વાહિ ઇંદ રૂષ. ૨૦૭
- રસ રૂપ વે સત્યામૃત, તિનકોં કર દિ દસન;  
આન અમૃત સો કથન હૈં સત્યામૃત કરવત પાન. ૨૦૮
- જુન ચાખ્યો, જિન અનુભવ્યો, અસ્તીકિક રસ માધુર્ય;  
વિનકોં અર્નન કડા કથે, મુખ ઢોંક ચાતુર્ય. ૨૦૯
- જતનોં દાન જ્યાહિ ગિયો, તિતનોં રસ અધિકાર;  
x x (શીજું ચરણ મળતું નથી) x x

- ता प्रभान दर सुकृत छि, दान वे दानी निशेह  
दान हिये धरा थहु दिशा, देव छि गेश अशेश २१०
- आगे जस जस दान हे, तस तस मे अपार  
अधिकाधि-८१को भवन, प्रभु पुणि सिंहार २११
- सर दर ब्रेष्ट लेन्दे को, सो अड अधिक अथार,  
सो ज्यादिमे नित खसे, वे पुणोताम निधार २१२
- अस अनुग्रह निश्चिना रसिडेत निधान,  
य, प्रीतमके रमामे, रग्लि सत सु रन २१३
- सदा खबो यथो नात हे, अक्षय धार अपार  
पुण्यार्थ यतु दैनदर्शन, पठ सारनडो सार २१४
- उर्ध्व धर अधिकारी वे, यह मारगमे धार  
गुणमारी सो कलानडी श्री इष्टव्य यद गीती नव २१५
- शनडो मन दद यादिमो, सतत रति भनि भात,  
अनन्य अकितपथ अनुसरै, ऐव छि सदा थी कात २१६
- सदा चित्त लघ्यो रहै, नेकु छृटत नाडि,  
मन भिनापडी अंडयना, वादिको अनु याही २१७
- ज्ञान तुनसीट, काठ शुनडी अमग,  
वामे भगवद् भगवनी, कोरी सुनिके उमग २१८
- लेस श्री गीता भनि, सहजनमे कोड ए,  
सिंह कही के तत्त्वचित् भाषे भिरन भिरेक २१९

- અનાનિકોં સથ અદિત, અહ પથારથ ગ્રાન;  
 સદજ સિદ્ધ અનુભોં સદા, મદાતમા વદિ પરિચાન. ૨૨૦
- ચાર ચિન્દ દરિ ભક્તકે, પ્રગટી કૃતી હેત;  
 ભાવ અદિત અદ દીનતા, પર હુઃખોં હરી જેત. ૨૨૧
- સુગંધો મન આક્રોદિ, જસ સુગંધો શાગ;  
 નસ દરિ ભક્ત જ્યુ દાખદિ, અપનોં પરમ અનુરોગ. ૨૨૨
- રંગાદે ડે રંગાદે, અનકો સદા ઉમંગ;  
 રંગ રંગ અયાપત તાદિકોં, હેત ન રસ કશુ બંગ. ૨૨૩
- એમેં લરિજન સંગતિ, અનકો મિલદી અદ્ય;  
 વેદુ અડભાગી કદી, કૃપા માર્ગ નદિ શ્વદ્ય. ૨૨૪
- કૃષ્ણ કૃપાકો ચિન્દ પદી, અન મિલિદરિ સંગીસંગ;  
 સત્યંમતિ તેં ક્ષિય હેં, પરમાનંદ રંગ અભગ. ૨૨૫
- અન્યે આગે દરિ કૃપા, તિનકો મિલે સુસંત;  
 કરદિ સેવન સંતકો, પહુંચત ભવ દધિ અંત. ૨૨૬
- ૨૬ આશ્રય દરિ ગુરુન ડોં, જો કોડ કરદિ જંત;  
 સ્વી શુગાદિ નીચ હું, યા તેં પાવે થી કંત. ૨૨૭
- ૨૭ નિશ્ચય દેં જાદિ ડોં, તાદિકોં ક્ષણ સઘ;  
 અનન્ય રાગથુ અહ અત્ય ડેં, તાત્પર્યનુ ગોતા ગઘ. ૨૨૮
- અનકો પ્રેમાનન્દ, અરદ, જયોં જયોં અધીક નુંડોં;  
 પાયક પ્રાયસ નંદાં દેલ દેં, વાંડાં રીધ રૂમોદ્દ. ૨૨૯

उत्तम शुद्धरे हेस भधि, श्री नर्मदा पुस्तीन;  
 श्री शेषपाठि प्रभु वांडा, कवि निवास वांडा शीन. २४०

श्री गुरु बलबल लाल, श्री गिरिधर प्रभव प्रताप;  
 प्रन गंथ करवाय, निज हास धर्यो कुत्रिनाम. २४१

ग्राम नाम चंद्रीधुरी, हरि जनको मूल धाम;  
 आस भरये अज देशमें, ह्याराम अस नाम. २४२

गोपों बलबली साहेदरों, सच्च लरिजन को दास;  
 साखी हुडा अस नाम धर्यो, श्री कृष्ण मिलनशी आश. २४३

निर्दोष अस्ति शियार हें, करिजन युनि शिनियेन;  
 हृष्णु सजंधी अकाप सच, हृष्णु हेत अनेन. २४४

श्रीमद् बलबलकी कृपा, पाप हुडा यह शीन;  
 नूनाधिक छहु होय सो, शुद्ध हि करी भणीन. २४५

॥ संपूर्ण ॥

॥ श्री जागीरजन बलबलार्पणमरह ॥



સહજ સિદ્ધ સામયી લ્યાલા,	વારા નહિ કરું હુ પ્રેરાસ
જનકો સાધ્ય ભયે નહિ,	વાલા સાધતથી આરા ૨૩૦
જનમે બસે કમેદિની,	ચદા બસે આકાશ
બે જ્યાહિડે મન બસે,	સો તાહિડે પાસ ૨૩૧
સરયી નાગિતક પરધર્મ રંધી,	સધરો જુનકો અભાન,
ચાર્નોકાદિં ત્યાગી હે,	સ્વર્ધર્મ ધરી ભર ભાવ ૨૩૨
અનાહિ શુદ્ધ છુદ્ધ અલ હે,	તાપે ઉર્દુ ખાર,
તત્ત્વ સમ ભક્તિ ભક્ત ગુરુ,	યદ સેનન હે સાર ૨૩૩
નિત્ય નૈમિત્તિક કામ્ય અસ,	સેનન નિનિધ પ્રકાર,
નિત્ય આનસ્યક દિન પ્રતિ,	નૈમિત પ્રસગ અતુસાર ૨૩૪
કામ્ય નિધિદ્ય એદ ન કલ્યો,	તદપિ સકામિત જન,
સકામ તે મિનિધ કરે,	અનેક ઉપાસન ૨૩૫
દિન અધિકારી વે લહો,	તિનકો યદ નુ મિહિત,
દિનકો વે ન ઝુઝાહિ	જ્યાલા નગી જુનકી પ્રીત ૨૩૬
શ્રેષ્ઠ મિધણુ ચો સપ્રદા,	કુતાદૈત અદૈત
નિરિષ્ટા દૈત અસ કહે,	સય પર શુધ્ધાદૈત ૨૩૭
શ્રીબિષણુ રૂમી પથ જુનઅહે,	અસ શ્રી વદવમ હેવ,
શાગોપીજન વદવમ પ્રલો,	તિનકી કરી નિત સેર ૨૩૮
સવત શત અણા દશ,	પચય ચારીત સાન,
આમન કૃષ્ણ જુ અણ્ણમી,	ગ્રથ સમાપ્ત રસાન ૨૩૯

ઉત્તમ શુદ્ધિર દેશ ભધિ, શ્રી નર્મદા મુખીન;  
શ્રી શૈપથાઇ પ્રભુ વાંદાં, કવિ નિવાસ વાંદાં કીન. ૨૪૦

શ્રી ગુરુ બહલભ લાલ, શ્રી ગિરિધર પ્રથમ પ્રતાપ;  
પૂરુ અંથ કર્વાપ, નિજ દાસ દર્શો કૃત્તિનાપ. ૨૪૧

આમ નામ ચંદીપુરી, હરિ જનદો મૂર્ત ધામ;  
આસ બન્ધો અજ હેરાપે, દ્વારામ અસ નામ. ૨૪૨

ઝેણો બહલભા સાડોદરોં, સાથ દર્શિયન કો દાસ;  
સાખી હુદા અસ નામ ધર્યો, શ્રી કૃષ્ણ મિત્રનદી આશ. ૨૪૩

નિર્દાંપ ખલ મિચાર હે, કમિજન યુનિ ગિનિયેં;  
કૃષ્ણ સાગરી અવાપ રૂળ, દુર્ગ હેત અતેન. ૨૪૪

શ્રીમહ વહલમહી કૃપા, પાય હુદા પદ કીન;  
ન્યૂનાધિક કષ્ટ હોય સો, શુદ્ધ છિ કરી પ્રથીન. ૨૪૫

॥ સંપૂર્ણ ॥

॥ શ્રી જાપીજન વહલભાર્યામરતુ ॥



श्री गोपीजनवल्लभाय नम

श्री राधिकाप्राणुनाथाय नम

श्री नंदनंदनाय नमः

श्री जगपीशाय नम

॥ श्री गुरुगोपीजनवल्लभाय नम ॥

अथ श्रीमद भागवत अनुष्ठमणिका भाषा भाष्य चोपाधि मध्य श्रीमत  
इष्टेश्वर द्वारा भौतिकता विष्यते

होड़।

श्री गुरु श्री महाभ प्रक्ष, श्री रिद्धन सह छीत,  
सुग ५८ ५५०८ २४ करो, अभिनवन अगतीत १

कमन चरन कमलद अरन, पद्म कमनाक त,  
मगव भोद निधान सम, कलुस केस छतात २

राधा अर अनभ सद, अष्ट सभा कवि भूप,  
नमन चरन तिनके कर, भेरे ज्ञन इप ३

श्रुति रमृति सहाइ सम, अपरे इप भगवत,  
दादशाग श्री भागवत, ग्रीष्म सत्तम सम सत ४

नित्य अवन यहु अंथो, सक्ष अवस्थु आही;  
अति व्यवसाई लुवले, नाहि अनत हे ताहि ५  
ओक ऐर पूर्ण अवन कीनो पायो दार;  
स अति निति सभ्यरित रही, तो भक्त यहु मन भाव ६  
तिन छित हेतु वरनिहो, अथ न गुड विस्तार;  
पहत सुनत ही कहे दयो, सुन्यत होए सार सार ७  
२५४ जु प्रकरण मे कषी, ज्ञे अध्याय जु आत,  
सो सभ जांनी ज्ञायगी, अनायास भक्त आत. ८  
इप कल्पो श्री झूळुहो, श्री भागवत अमेद,  
श्री भद्राप्रभु निरन्धरे, सो विधि इहु दुरभेद ९

## ૭૬ રોલા.

प्रथम १ દ્વિતિય ૨૫૪ રોલા લીલા હેં ભાઈ,  
જી મુર્ખોત્તમ પાપ, ઉભય ચિત્તન કડી રાખી १  
દ્વિતિય પક્ષ અધિકાર, પ્રથમ લીલા હેં ગાઈ,  
દ્વિતિય સુ લીલા રોલ ખાન એંસે હુ અતાઈ ૨  
દ્વિતિય સુ લીલા સર્વ, ઓક બાહુ અનવારી;  
ચતુરથ લીલા કિસર્ગભાઈ, દ્વિતિય ગિરિધારી. ૩  
પ્રથમ લીલા સ્થાન, સુ કટિ પથાતુ ભાગ ઉદિ.  
ચેપણ પણ ૨૫, ઉદર અવિનાસિ ખત કરિ. ૪

ਉਤਿ ਲੀਨਾ ਸਾਹਮ ਦਰਿ, ੮੩ ਦਰਤ ਪਾਸ ਰੇ  
 ਮਨਜਤੁ ਆਖੁਮ, ਅੱਖ ਅਨ ਮਨਯਾਮ ਦੇ ੫  
 ਤਰਮ ੨੫ਥ ਚੜਾਨ ਅਤਲ ਹੁਸਦੇ। ਗਿਨਿਪ੍ਰਤੋ,  
 ਦਰਮ ੨੧ਥ ਨਿਰੈਖ ਛੁਕ ਅੀ ਗੁਧਾ ਪਰਤੋ ੯  
 ਅੰਮਰਤ ਸੁਕਿਤ ਲੀਨਾ ਮਨੁਝ ਮਨ ਮੋਇਨ,  
 ਆਥਰ ਲੀਨਾ ਫਾਨ ਫਾਮੇ ੨ ੩੨ ਦੁਖਨ ੭

## ਟੋਲਾ।

ਖਦ ਮਿਥਿ ਚਿੰਤਨ ਖੀਤੇ, ਅੀ ਭਾਗਜਤ ਜਗੀਨ  
 ਅੰਮ ਪ੍ਰਕਾਸ਼ੁ ਕੇ ਨਾਮ ੬, ਸਗ ਮਿਥਿ ਤਿਥਾਵੀਸ ੧

## ਚੋਪਾਨ

॥ ਅੰਮ੍ਰਦੂ ਭਾਗਜਤਕੇ ਰਹੇਤਾਲੀਸ ਪ੍ਰਕਰਣ ॥  
 ॥ ਤਥਾ ੧੨ ਸ਼ਕਧਰੰ ਪ੍ਰਥਾਰ ਤਥਾ ਅੰਧਾਧ ਸੰਖਧਾ ਨਾਮ ॥

ਪ੍ਰਥਮ ੨੫ਥ ਉਨ੍ਹਿਸ ਅੰਧਾਧ, ਤਾਂਕੇ ਪ੍ਰਦਾਨੁ ਤੀਨ ਕਲਾਪ ੧  
 ਦੀਨ ੩ ਮਾਖਮ ਇਤਮ ੩੨, ਤਿਨਤਿਨ ਅੰਧਾਧ(ਮਾਪੁਨਿਤੇ) ੨  
 ਸੁ ਅੰਧਾ (੫) ਕੋ ਦਿਤੀਥ ੨੫ਥ, ਤਾਮੇ ਪ੍ਰਦਾਨੁ ਤੀਨ ਸਮਧ ੩  
 ਦੂ ਅੰਧਾਓ ਤਲ ਭਾਨ, ਉਥੁ ਪ੍ਰਸਾਦਾਨੁ ਕੋ ਕੋ ਨਾਨ ੪  
 ਚਿਤਿਥ ਮਨਜ ਪਟ ਅੰਧਾਧ ਵਡੇ, ਤਾਮੇ ਦੇ ਪ੍ਰਦਾਨ ਦਿਓ ਕਡੇ, ੫  
 ਉਤਪਤਿ ਅ੩ ਉਥਪਤਿ ਦੇ ਨਾਮ, ਸੁਸ ਭੀਨੀ ਪਥ ਨਾਮੇ ਅਭਿਗਾਮ, ੬  
 ਤੇਤਿਮ ਅੰਧਾਧ ਚਿਤਿਥ ੨੫ਥ, ਪ੍ਰਕਾਨ ਤਾਮੇ ਪਥਨੁ ਸਥ ੭

અતુંધા પ્રકરન અધિકારી, ગુનાતીત અથ ચ્યાર બિચ્યારી ૮  
 ત્રિતિય સગુનકે તિન અધ્યાય, ચતુર્થ કાન ધ્યાનો ગાય ૯  
 પચાસ તત્ત્વદિપ પ્રકરન કલ્લોં, એ તેરે અધ્યાડો લલ્લો, ૧૦  
 ખૂદીતિસ અધ્યા ચતુર્થ માનો, તાકે ચો પ્રકરન પરમાનો ૧૧  
 પ્રથમ ધરમ પ્રકરન સત બાય, દુસરો અથ સુઅધ્યા ખાચ ૧૨  
 ચ્યારદિપો તિસરો જો કામ, બ્રહ્મ આડો મોશ્ટાગુનામ ૧૩  
 અછ તત્ત્વ પટ વીસ હ્યો પુનઃ, મુનિધૂકનિસ લગ દર્શિસાપૂજાય ૧૪  
 પટ નિસ આધ્યા પચાસ ઝીન, તાકે પ્રકરન સમજો તીન ૧૫  
 તિન અધ્યાડો પ્રકરન હેમે, ધૂક ધૂસ પ્રકરન કાન અગોર ૧૬  
 તિસરો અપન સુ અધ્યા હોય, ચોમિસ ળાજ્યગતમા મોય ૧૭  
 પરમાત્મા હિર લગ ધર્મીસ, અથ પણ્ઠમ અધ્યા ઉન્નીસ ૧૮  
 પ્રકરન તાકે તિન શુભ ધામ, તિન અધ્યાડો પ્રકરન નામ ૧૯  
 પ્રકરન ધ્યાન ચૌદ ઢો ઓાર, ઢો ડો અગ્નન પ્રકરન મહોર ૨૦  
 સભ્યમ ડે પદે અધ્યાય, પ્રકરન તીન સુ સુતીતં ગાય ૨૧  
 અસદ્વાસના અધ્યા પાય, સદ્વાસના પાય હિર ચાય ૨૨  
 ત્રિતિય સદા સદ્વાસન આહી, સોડુ પાય નુનાધિક નાહી ૨૩  
 અષ્ટમ અધ્યા ચોધિસ સાર, તાકે પ્રકરન ભાઘે ચાર ૨૪  
 તામસ ચો અધ્યા પરિમાન, સાતિંક પ્રકરન નોડો આન ૨૫  
 તિસરો ગાન્ધસ હિરનો જુકિન, ધૂક અધ્યા ડો પ્રકરન સુકિત ૨૬  
 નનમ સુ અધ્યા ચોધિસ જોસ, તાકે પ્રકરન પૂરે હોય ૨૭  
 મૂર્દ નર મરીદ પ્રકરન, ચર નર પુછ્ય પ્રકરન અન ૨૮

વાર વાર હુદુ કે અધ્યાત્મ, દસ્તામ પ્રકરન પંચ કહાય ૨૬  
 સત્યાપી હ અધ્યા હે ભાગે, તીન મતાતાર કે હુદે રાગે ૩૦  
 સેઓભિન્ન નિષ્પત્તે અધ્યાત્મિનો, પ્રકરન જ્વલ આર ખર મન્યો ૩૧  
 તામસ પ્રકરન અહિવિસ લયે, ક્ષેપક તિનસહુ પેતીસ ભયે. ૩૨  
 તિસરો રાજકુલ પ્રકરન ભાગ્યો, સુહુ અહિવિસ અધ્યાત્મો સાગ્યો. ૩૩  
 છક વીસડો અતુર્થ સાતીંદ, શુન પ્રકરન પચમ ઘટ નીંડ ૩૪  
 એકાદશાહે છક તિસગાએ, તાંક પ્રકરન હોય બનાયે ૩૫  
 પ્રકરન શ્રીધન મુહિતધર સાર, ઉન તિસ અધ્યાત્મો નિસ્તાર. ૩૬  
 તામે હોય ભેદ હેં સાચ, ખલ ભાવ છક અધ્યા પાચ ૩૭  
 દિર ચોછસ અધ્યા સાયુજ, ખલ મુહિક હેં અધ્યાયુજ. ૩૮  
 તામે ભેદ હોય દિર લાગ, મમતા એક અદતા ત્યાગ. ૩૯  
 દ્વાદશ નિર્દશ અધ્યા જાગે, તાકે પ્રકરન પાચ બનાયે. ૪૦  
 લોકાશ્રમ પ્રકરન છકે જોયો, બેદાશ્રય પ્રકરન દિર જોયો ૪૧  
 દૈહ દૈ દૈ અધ્યાપ કે, અમૃવદ્ધસુત આશ્રમ હું ત્રય સુખદાય ૪૨  
 શાખદાશ્રય દિર તિન અધ્યાપ, અરથાશ્રય હું ત્રય સુખદાય ૪૩  
 દૈ દૈ ચાલીસ પ્રકરન અદભૂત, તામે દશ લધુ અતદ ભૂત ૪૪  
 નિશિત પત્તીસ સખ અધ્યાપ, એર સતીશ તીન કહાય. ૪૫  
 શ્રોઙ સંજે દશ આડ ઉજાર, રૂધ ભાગ તામે નિસ્તાર. ૪૬  
 છતુંતર કલાય અર લખ પંચ, બરન સહદ મીલી પરીયન રચ ૪૭  
 શ્રીભાગવત સખ દષ્ટુ અરૂપ, દ્વાનાય શ્રી કૃષ્ણ સ્વરૂપ ૪૮

## ਫਾਲ੍ਗ।

ਕਿਉ ਮ ਕਿਉ ਨਾਮ ਸ਼ਬਦ, ਅਸੇ ਧਨ ਤੋਂ ਹੈਨਾਵ  
ਆਹੀ ਜਾਣਿਓ ਤੇਰ ਹੈ, ਵਾਲਾ ਨਾਹਿਓ ਆਵ ੧

## ਛੰਦ ਰਿਲਾਈ

ਅਸੇ ੨੩ ਪ੍ਰਥਮ ਸ਼ਕਖ,	ਅਨੁਕੂਲ ਸੁਨ੍ਹ ਰਸ ਰਾਵੀ	
ਹੈ ਉਨਿਸ ਅਧਿਆਤ,	ਛੀਨ ਪ੍ਰਕਲਪ ਹੈ ਆਵਿ ੨	
ਪ੍ਰਥਮ ਪ੍ਰਥਮ ਅਧਿਆਤ,	ਪ੍ਰਕ ਸ਼ੌਨਕ ਸਲਿਆਨੀ	
ਪ੍ਰਥਮ ਅਪਰਮੇ ਚੁਤ ਪੁਰਾਨਿ,	ਚੁਭ ਉਤਰ ਦੀਨਾ ੩	
ਭਕਿਤ ਯੋਗ ਉਤਖੰਚ ਕਲੀ,	ਸਥਤੇ ਹਰਿ ਰੀਤੀ	
ਪ੍ਰਥਮ ਤ੃ਤੀਥ ਔਤਾਰ ਕਲੇ,	ਯੋਧਿਸ ਜੇ ਸ਼੍ਰੀ ੪	
ਅਥੋ ਤੀਨ ਤੋਂ ਛੀਨ,	ਤੀਨ ਤੋਂ ਮਧ੍ਯਮ ਆਨੀ	
ਪ੍ਰਥਮ ਚਤੁਰ ਅਧਿਆਤ,	ਵਾਸ ਚਿੰਤਾਤੁਰ ਜਨੀ ੫	
ਗੇਰੇ ਪਰਮਾਨਦ ਵਦਾ,	ਨਾਰਦ ਸੁਨਿ ਆਧੇ	
ਪ੍ਰਥਮ ਪਥ ਸੁਨਿ ਵਾਸ,	ਵਿਮਨ ਉਪਹੇਥ ਘਤਾਧੇ ੬	
ਅੀਆਗਵਾਨ ਕਦੇ ਤੁਮ ਪ੍ਰਗਟ,	ਤਾਪ ਘੁੜੀ ਜਾਇ	
ਵਾਸੇ ਹਾਨ ਪ੍ਰਤੀਤੀ,	ਅਪਨੀ ਗਾਥਾ ਗਾਈ ੭	
ਪ੍ਰਥਮ ਪਾਥਮੇ ਨਾਰਦ	ਨਿਜ ਨਤਾਤ ਸੁਨਾਧੇ	
ਪੂਰ੍ਵ ਵਾਗੀ ਤਨੁ ਅਪਰ	ਜਨਮ ਹੋ ਹਰਿ ਪਥ ਪਾਧੇ ੮	
ਅਸੇ ਉਤਸਮਾਧਿਕਾਰ,	ਤੇਰ ਅਖਾਡੀ ਪ੍ਰਕਲਪ	
ਪ੍ਰਥਮ ਸਾਪਤਮੇ ਅਖਗਥਾਮਾ,	ਪੀਤੇ ਹਰਿ ਜਨ ੯	

કૃપા સિંહુ શ્રી ગિર્દિવધર, નિજ જન ગત ગાખ્યો  
 પ્રથમ અષ્ટમે ગર્ભ ઉત્તર, નક્ષત્ર ભાગ્યો ૧૦  
 કૃતાજૂ શુભ અત્યન્ત નિત્યાયે શૈન ધર્મનદ્વ  
 પ્રથમ સુ નવમે, ગાય યુદ્ધિષ્ઠિર એદ હરનદ્વ ૧૧  
 બિષ્ણુ પિતામહ સુખ દ્વારા ઉપરોક્ત કરાયે,  
 ધર્મ અનેક પ્રકાર, કૃષ્ણ જન તાપ ન સાયે ૧૨  
 પ્રથમ સુ દસમે રાય યુદ્ધિષ્ઠિર રોજ ખાડારે,  
 આપ દાનિકાધીશ દાનિક પુરી પધારે ૧૩  
 પ્રથમ વ્યાઘ્રે સરો સુહૃદ, મિલિક સુખ દીને,  
 જર્થા જોગ જગતાથ, સમન મન રજન કીને ૧૪  
 પ્રથમ બાળો અગ્રહ ભક્તા પરિદ્ધત ભૂપા  
 જર્થમ સુ વરનન કુયો, પવિત્ર ચરિત અનુપા ૧૫  
 પ્રથમ તેરમે સંકન તીરય કરી વિહુર પધારે,  
 આયે હરિતનાધુર, મિલિ, સાય જન તાપ નિનારે ૧૬  
 ધૂતગઢ ગાધારી નિંદે, ગયે ઉત્તર પથ સદ,  
 કિયે યોગ અભ્યાસ દ્વારા પાયે મોખ્યપદ ૧૭  
 પ્રથમ ચૌદમે રાય યુદ્ધિષ્ઠિર, પાય એ અતિ,  
 બયે બુત ઉત્તપાત દેખીક, અમીત ભધ ભતિ ૧૮  
 એસેમે અર્દીન દાનિક પુરિ રો આયે  
 દેખ્યો સુખ દુઃખ દયો, કષ્ટ યોગન નહિ પાયે ૧૯

પુનઃ સતક પ્રભ,	મરી હિતલિક ચારાંથા,
પ્રથમ પદ્માશ પાંચ	ગવન એકે હુઅ અન ૧૦
બયો સકુણ યાનહુનકો ક્ષય	સુની પ્રતારા પ્ર.
પરીક્ષાત કો ગાં ગાસનયો,	ઓછાય લખ્યો શુ ૨૧
ગયે ઉત્તા-પ્રથ	મિનિ પાદવ પાચ તુ સય
પ્રથમ સેનમે રથા ભાઈ,	કાયો ગરુનુ અમ ૧૧
લાય વિલુ કરન,	હિંસિકાય નિમરો જરૂ હી
ધર્મ ધર સુગ મરી નાયો,	તીનો ત । તાંડી ૧૩
પ્રથમ સપ્તા રમે,	નૃપ કનિકા રિ ॥ ગીતી
મરો દૂર હે એન	ધરનની ન્કા ગીતી ૨૪
પ્રથમ અષ્ટા રમે,	ભગવત ભર્તા સમ દેખો
કસ પૂરી તે રાપ બયો,	ભૂપતિ ન હેઠો ૨૫
પ્રથમ ઉદ્દીમરો	રાજ સમગ્રતાગ કરીઓ અ,
એકે પગિતા ગત	નથ શ્રી ગગાજી તટ ૨૬
વદા આયે સય કૃપી,	૩ શ્રી શુક્રદેવ પધારે
પુરો નિષ મધ્યાન	રાજ કરિ પદ ચિર ધાર ૨૭

દાઢા.

પગન બદું અનુદ્ભવનિકા, પ્રથમ નું ધ્રુવ પ્રકાર  
“એ દ્વાપર દ્વાનિવિ, ધ્રુણી નંદી નિરૂપામ ૧

દૃતિ શ્રીમદ્ભગવતે મહાપુરાળે દ્વારા કૃત ભાષા  
નિર્દેશે પ્રથમ સર્વધાનુદ્ધરમણિકા મસાન

दाढ़ी.

- झुनो अ द्वितिया २४६ दे, दश अध्या विगताः;  
उद्दिष्ट लीका जान यद, प्रकर्ता तीन प्रकार १
- प्रकर्ता तत्त्व ध्यान प्रथम अध्या दे<sup>१</sup> उद्दिष्टेः;  
द्वे मुनि हृष्य प्रसाद, भनन पट्टों के लड्डीये. २
- द्वितीय प्रथममें सांख्य योग जान चुड़े आयें;  
रथुल ३५ भगवत् विश्वमय धार्मन घटायें. ३
- द्वितीय द्वितीयमें सूक्ष्म ध्यान, उद्धो भगवंता;  
प्रकर्ता हृष्य प्रसाद दोपटों, चुनु अम संता. ४
- द्वितीय तृतीयमें, उत्तपत सम हेनभाई आभी;  
सकल सकारीक आभी, वात सर्व सुहु कहे गाभी. ५
- यह निमें द्विर उद्धों, छोड़ी सर्व कुण्डु उपासेः;  
सकल रामना पर्न लेय, सर्व संकृत नामें. ६
- द्वितीय च्यारमें कियों भंगजायरन अनुपाः;  
आ शुक मुनि किय रत्नन, शु श्री पुरुषोत्तम ३५। ७
- पट्टों तिसरो भनन, विभाग, होय दे तामेः;  
उत्पत्ति उपपत्ति, वरनन एती दे नमें. ८
- द्वितीय पांचमें नारद, विधिसां प्रश्न जु ज्ञानेः;  
मे सर्वके प्रति उत्तर, विधनाःविधिषत दीने. ९

\* विधिषत=रीते कुम प्रभाष्ये.

अध्यात्मक पंची करन जान, रथ भूदेव दीः;  
 अहमेव सर्व कलो, न असा रहे जुती अमडो. १०  
 द्वितीय पटमे अष्टु उप गंगाज अताये,  
 सर्व उत्पत्ती श्रील ते भर्ति से सर्व गाये. ११  
 द्वितीय सप्तमे अतुविंश, अवतार सदेतुः;  
 सहम वर्णन श्रीये, हाथुके भवधि सेतु १२  
 द्वितीय आहते अम उपपत्ती प्रकरन इकाये;  
 भूर भुनि न्योने प्रश्न श्रीये, सर्व ऐधा गाये. १३  
 द्वितीय तुनवमे श्री प्रश्न, नाभि नविनते धातो,  
 अपती उपत्ति कली, ओर इथा सुख दाता १४  
 अतुर श्रीमान् श्री भागात, श्री न उपदेशा;  
 \*हिरण्यगर्भ वद नारद, भूतकोऽ कलो अगेया १५  
 नारद व्यासे कलो, व्यास ते गुड्ड जन्यो,  
 श्रीशुक्ले मेरा गिर्भुरात, लकी पात वर्षान्यो १६  
 द्वितीय सुधामे, अधि औतिक भूत्य अताये;  
 अध्यात्मक आधिदैविक, आर छे समुमाये. १७

दा. हा.

पून द्वितीय २५ धकी, अनुहमनिका अभानी;  
 श्रीगुड गिरिधर त्री हृषा. हर्ति हृषाऽ\* गानि १८  
 हति श्रीमद्भागवते महापुराणे दयारामकृत भाषा निवधे  
 द्वितीय संधानुकमणिका समाप्त

તृतीय) તો મે અલાને શાળકી ગુણિ કીની,  
દર્સ દીધે પરમેણિ, સુપિં કુરી આપ ચુ નીતી ૧૦  
ચોથે પ્રકરન કાન દોષ તો તૃતી દમને વહી,  
કાનાત્મકી મનુ પ્રકાણું, પશુ ચંપિ મહી ૧૧  
તૃતીય જ્યાંમે કાન પરમાળુંની ગતિ ભાખી,  
પચમ પ્રકરન ત૧ અધ્ય નો કો સુનિ અભિનાખી ૧૨  
તૃતીય બાજુમે ખલ અગ મૃંગ ચુ ભાખાની,  
સનકાદિક મદાદેવ, મનિચ્યાણિ દર જાની ૧૩  
સરસ્વતી કન્યા, રત્નાંશુ મનુ ગત અપા  
તૃતીય તે બાનાદ જુ કો પ્રાકટય અત્રૂપા ૧૪  
તૃતીય અતુર્દશ અનિય, ચુ ગનિ રસ દીતી ભીની,  
નિજ પનિયે નિ સમનાલ રતિ પ્રાર્થના ક્રીની ૧૫  
તૃતીય પચ દશ મૈદુ હમે અતુર્સન<sup>૧</sup> આયે,  
દરિ દાના રત્ય પિજય, શાપ પિનહિતે પાયે ૧૬  
તૃતીય પોડય સનકાદિક પાયે ભી દરિ દર્મન  
તૃતીય અસ્તદળ દિરેણ્યાક નાગાદશુ સુદ ધન ૧૭  
તૃતીય આટા દરામે, અરીત વેહી દું ગાયે  
તૃતીય ઉન્નીસદરિ દિરેણ્યાક દતિ<sup>૨</sup> કિતિ<sup>૩</sup> વે આયે ૧૮

(૧) અતુ સન=સનમાણિ અ ન ભાઈ (૨) દરિ=દું

(૩) કિતિ=દૂંઘી

तृतीय वीसमे श्रीमार्ग, जु निय सुउपा,  
 शुद्ध घन मध्य छलो, अनन उनि घणो अनूपा १६  
 अम घटयो ग्रहन, तत्त्व अध्याय तेंडो  
 तामे हु द्वे नेह, प्रगट क्षी हु न एव तो १७  
 तृतीय ओक्टोसमे, मनु स्वाप नुसने अपनी,  
 देवदृष्टि इन्याय, शुउप इता मनु तपनी १८  
 हे वे डो नसि, कर्मभी आर्थना इनी,  
 तृतीय वाईसमे दिरे, प्रगति हुदिता दीनी १९  
 तृतीय तेझस नसि कर्म, अपने चोगाभ्यास वन,  
 ग्रह इधें जीभन निभान, रिथत अति सुख निर्भन २०  
 हेन इति दरसाय, प्रगति हुपछ धन्या  
 ग्रन्तुर मनहो भूत, प्रथम प्रगति नो इन्या २१  
 तृतीय चोएस श्री कपिन, हेन जू जन्म सुगायो,  
 नो उन्या उद्ध्वाङ, पथा लिधि सोहु सुनायो २२  
 ता खाडे सुनि कर्म, सन तछ बनमे आये,  
 श्रीर साधन इय शुद्ध, चित्तसु धन्मगति पाये २३  
 तृतीय प्रथमस श्रीकपिनहेन, जननी सुख दीनो,  
 साध्य योग अध्यात्म, ज्ञान हिपदेश सुझीतो २४  
 तृतीय पठ धस, सत्ताधस लग, तत्त्व साध्य वर्णन  
 कपिन सुनिने आयो सु अपनी अवाके सन २५

તृतीय અધ્યાત્મ સુનિ યોગ ધ્યાન લે સ્વરૂપ કલ્યો દે  
મો અરૂપ કરે દિયો નાથ માતા સુ લલો દે ૨૬

તતીય ઉત્તરતિક્ષસમે ભક્તિ યોગ ભન ભરતન કીનો,  
તૃતીય ત્રિનમે ડર્મ વિપાઢુ, મળની લીનો ૨૦

તૃતીય એકૃતિક્ષસમે, શ્વર અવ દાગન્નમે આયો,  
તમતે સર્વ રૂતાત જુ, જન્મ ભરત દ્વો ગાયો ૨૧

તૃતીય મચ્છીક્ષસમે જ્ઞાન, બન્ધિ ભન પદ્ધતિ ગ્રાહ્ય,  
તૃતીય તેતીક્ષ તામો, દેવ હતિ સિદ્ધ પા પાઈ ૩૨

કુપિન દેતા પા છે, ઉત્તર પથ પથારે,  
પુરુણ તત્ત્વ પ્રકરણ, નોંધકો નન્યો પારે ૩૩

પા મે રે દે બેદ, ચ્યાર અધ્યાત્મ જુ આદિ  
પુરુષ મુક્તિ ડો પ્રકાર, ચુનીને રસ ગ્રાદી ૩૪

તહુપગત અધ્યાત્મ જુનો, મો રિધિ જી મુક્તિ  
કરી ગાયા સદ્ગૈપ કૃપણજન સમુજ્ઝો ખુક્તિ ૩૫

### દોષી

અતિ સુ દર અતુક્ષમનિકા, પ્રદીપ તૃતીય ૨૫૬  
પાત મુનત જન કરે ર્યો, રહી ન આધિ અપગધ ૧

इતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે દ્વારામ  
કૃત ભાષા નિગર્ધે તૃતીય સ્વર્ધાનુદ્રમણિકા  
॥ સપૂર્ણ ॥

## देवाला

गतो यतुर्थं २५४ के धर्मिसंकाश अप्रथम  
गिरसग्नीना १ नीये, प्र-०८ २३२ क०१८ १

## ॥ ७६ देवाला ॥

धर्म अर्थ अउ काम नाल प्रकरण ना नामा  
गेना प्रकरण धर्म, सभनडो अति अभिरामा १

दक्ष प्रज्ञपति १०१, ते याउ अधिग्राही  
यतुर्ग प्रथम भनु कन्या वा वलो निरसारी २

तामे सोम इ हतान्तर, हुर्वासा नारू,  
नागधणु छत्यान्ति जन्म, कहे शुभ सान्द ३

यतुर्ग अपग्मे निष्ठसुमनडो, थन दहो अलाला  
दक्ष प्रज्ञपति गती हनी, गर्व भरे आये त्यादा ४

सकन समा निधनने, वदा उग्नि के आदर गतो  
दे नदि श्री मादादेव वणी रिस रस लीनो ५

ताते भयो परम्पर, विद्युत ११५ ह दीने  
यतुर्थ तृप्तीयमे ददा, यन नते सम दीने ६

दध्नी जनकडे नैये, भई सति ह था भ-७  
नाच निमेहन करी, नात रामर तथ भर-७ ७

यतु च्यार आहेता, उनधि पितु के हीरी  
पाठी ऐह ताते नत, दि सतिने देद ओरी ८

ચતુ પદમે નાર્થ કુનિ, ગલુ દિગ આયે  
 સમાધાન સમ સતિ, સમવિ સમૃક કરી ગાયે ૮  
 શુનત ડેણી જિવ ગન, સમદ પ'તાઈ ત્થિયો હે,  
 હત દાર દુ દક્ષ, પજ વિદ્વસ કિયો હે ૧૦  
 ચતુન્થ પદમે અકાદિક, સમ મુર મિનિ આયે,  
 સ્તરન નમન ત્રિય, સમાધાન મરાહેર મનાયે ૧૧  
 ચતુન્થ સતમે, દલ પજ પૂન કન્વાયો  
 પા, સમ મિનિ સ્તરન, કૃપ્ય એ ગુન ગત ગાયો ૧૨  
 અગ હુસગ પ્રેરન, અર્થ અદ્યાય પાય ડે,  
 હુન ચરિત્ર નમે સુની, અશ ન રે આચ્છે ૧૩  
 ચતુન્થ અહ ઉત્તાન, પાદો વદ જુગાયો,  
 અપ્ય-માત હુમ્યાચન શુનત, હુન નિય હુઅ પાયો ૧૪  
 શ્રી પસુના લદ નાય, અરણ્ય મદ્દા તપ કીનો,  
 ચતુન્થ નો કીનો, વીકૃપ્ય હુપા કરી દરશન દીનો ૧૫  
 ધર્ઘાતે બગ અધીક દીયો, હુન કુન પદ પાયે,  
 નાથ નિર્દેશ (આદેરા) ચદાય રીચ, નૂરાદ ધર આયે ૧૬  
 ચતુન્થ દસગે નુન મહુ, ધર્ડ ઉત્તમ નામા,  
 નન મૃગયા ડો ગયો, દન્યો ડોધ વદ જુ નામા ૧૭  
 બાના ગૈર નિમિત્ય, આપ કર્દાન અનિનમા,  
 અધિપતિ વદ કુમેન, કાયો તાસુ સાગામા ૧૮

અધાર અધારમેં આપ મત.	નૃપ	ધૂમગે	આપે;
કિયો યુદ્ધલે સમાપ્તાન,	ચુન	સહન	પદાર્થે ૧૯
અતુર જાગે, હૂન	પનિ	પૂર્ણ ગજાદુ	ઝીનો,
સા સમ સૂત કોં બોપી,	આપ	અચનીત	પદ લીનો. ૨૦
તથા જુ ધૂમકો જનતી	મોહુ	પરમ	પદ પાઈ;
તુનીય કામ પ્રકરન,	અમ	ગ્રારે	કો જુતી બાઇ. ૨૧
પૃથુ ગળ તામે અધિકારી,	ચરીન		સુદાવન;
અતુરથ નિશ હુનકો જાય,	જુ	મર યો	પાવન ૨૨
અતુ અતુર્દસ મદાહુદ્દ,	નૃપ	એન જુ	ગાયો;
સો શીર ફુર્તર અલ રાપતે	નારા	હુ	પાયો. ૨૩
અતુરથ પડે પૃથુ	જનમ	ચરીન	અખાને;
અગ્રનદ ભક્ત મદા હરિ અ શ	સામે	ડોડ	જાનો. ૨૪
અતુર ભોદ તે ઈક ધસ	લગ યુંન ઓર ન	આગે;	
પૃથુ રાજકે પરમ પરિત્ર	અરિન	દિ	ગાયો. ૨૫
અતુરથ દાવિશમે	સહન	સનકાદિક	આપે;
સનત કુમારસું આતમ યોગ	પૃથુ	રાજ	પાયો ૨૬
અતુર્ય તે ધસ યોગાભ્યાસ,	ગળ	જુ	કીનોં;
દેહ ત્યાગ મોં કર્યુ	પૃથુજુ	પરમપદ	લીનો. ૨૭
અમ ચોથોં પ્રકરન	મોક્ષ	અધ્યાપ	આડકોં;
યામે હે દે જેદ,	પુન્ય	હે	પરમ પાડકોં ૨૮

एक अह तत्व दथा तिन अध्याय साँचे होः;  
 एमार दृष्टि सायुज्य के मु अध्याय पांच होः. २६  
 चतुर चतुर जिशमें खंश पृथुको जिस्तायेही;<  
 भाले प्रयेताको शिव, दृढ गीत हृच्यायेही. ३०  
 चतुर पचीस लृप प्राचीन अद्विष्ट डां भिलि नारह;  
 कथन कीयो आभ्यान पुरंजनको भवपारह. ३१  
 आष्टभिंश क्षें अली कथा बनन लृप पांची;  
 सुनी निसंशय भयो, चतुर उत्तीस के भाँडी. ३२  
 भूर ऋषिको उपदेश, सार अंतरमें लायेही;  
 कपिका अभमें गये लूप, वडां सिद्धि पायेही. ३३  
 चतुर तीस जर दीयों, प्रसन्न प्रयेता श्रीअही;  
 करो राज असुतामह, घडोर यासन दीन रीझी. ३४  
 चतुरथ छक्तीस नाथ प्रयेता नारह भिलायेही;  
 भगवत वात सुनाध द्वें अमृत पद पायेही. ३५  
 धृतनी कथा मुनि भैत्रेय तें शिरुर अवणु करी;  
 आये हरितना पूँमें, भगवद रस छृद्या भरी. ३६

### टोहा.

चतुरथ रक्ष्यां भद्र, अनुकमनिक परिष्ठुः;  
 धृत सुनत ली कहे द्यो, पाप ताप सर युरी. ३७  
 इति श्रीमद्भागवते महापुराणे द्व्याराम मृत भाषा  
 निर्वये चतुर्थ स्कंधानुकमणिका  
 संपूर्ण ॥४॥

## દોષ્ટ।

પચમ સંધ સુની અમે, જોકે લીના નાન,  
તે એ વિરા અધ્યાત્મ ડો, પ્રકરણ તીન ગુખાન ૧

## છંદ રોલા.

દેરા કાન અડ ગ્રેન, નામ નમ પ્રકરણ નાચે,  
ખૂન દેસ પ્રકરણ અધ્યાત્મ, તીન મો દાહીએ ૨

પચમ પ્રથમ બસ પ્રિયભાઈ ડો શુદ્ધ સુનિ ભાઘે,  
સ્વપ્ત સમદ્ર અન સ્વપ્ત દીપ, નિર્ણય કઢી દાખે ૩

પચ અસ્ત અસ્તિન, પુત્ર નો ભાઘે અનુપા  
નિઃખગત સુની નોઅડકે, ભાઘે મો ભૂપા ૪

પચ તીન તૃપ નાનીપર પ્રશુ પ્રમીળ ભાઘે ૫,  
પરમ કૃપા તરીકુન હીડો વરાન દ્વારે હે ૬

અમ દૂસરો પ્રકરણ, ધર્દ ધર્દ અધ્યાત્મ ડાન ડો,  
જામે જાન ઉપમ, ભુજ આગ શ્રી ગુપ્તાનડો. ૭

પચ તુદ્ધ શ્રી દ્વાપન દેન, પ્રાકટ્ય કરે ૮,  
મોપી તૃપાન ધન કુ, નાભિ તૃપ મોદ વડે ૯

ઉપમહેન ગન પુત્ર ભાઘે, તીન કે કઢુ કાળ,  
ઓડારી ક્ષાળન, યોગેશ્વર નો નાળ ૧૦

પચમ પંચ અરુ પડ કે, ડાન ચંદ્ર કરે ૧૧,  
પચ અમ તૃપ નર્થ, પુત્ર ભાઘે જુ ભાઘે ૧૨

- પચમ અમે ભરત ભૂપ, શુભ અગ્નિ સુગાયે,  
ભૂગ કે સગ, ભયે, સુગજનમ, મોહ વય પાયે ૬
- પચમ નો જડ ભરત, ચન્દ્ર અભૂતન બાં,  
પચમ તરા ગંગાધ્ર પિગાર, જહલતો રાડાર્ન ૧૦
- પચ જ્વાર જહલતે, ભૂપત પૃષ્ઠો જાના,  
ખાર તેર દુલ્લ ભરાટા હિં મરન પિધાના. ૧૧
- પચ ઘૌંદ રૂપ આતમ પિદા સુનિ તે પાયે,  
રૂગન જડ ભરતકે પ્રતાપ પં મેલ સધાયે. ૧૨
- પચ પચ દળ સુમતિકો અર્થન્યો શુભ ગસા,  
તાકે ગસ મિથે રૂપ ગન ભયે પત પ્રતાસા ૧૩
- પચ મોનમે લુગોન અગ્નન ભવ્ય ભયો ડે,  
જખુ દીપ નરખડ સુ મેડ પ્રભાર રાંદો ડે. ૧૪
- પચ સખ દસ મેવ્ય અરુ મેરક કડે ખડ અથ  
આગ્રાદમ ઉનિસ નગ, અગ્નન એદિ ચન્દ્ર અગ ૧૫
- પચમ મિનમે સખત પ્રમાન સુભાખ્યો,  
પચમ દ્વાર છસ લેનિયાં સુગ્રનાર દાખ્યો ૧૬
- માઈસ અર તેદસ નગ એહિ અગ્નિ ડે ગાયે,  
પચમ ચોધસ ગૃહકો પ્રમાન ભતાયો ૧૭
- અગ નિસરો પ્રકણ ગૃહન કે અધ્યાય સુસુનિ  
નામે ડે કે મેદ એનાત્મા પન્માત્મા પુનિ ૧૮

पय पय विशगे सप्त खातान  
पय छ धसमे अद्राद्यस नगडेका

किं कथन,  
मरनन १६

दाहा।

पयमडी अनुहभविका, पूर्णधृष्टि चु अनुप,  
द्वया पर्वन इच्छि अपनते, प्रसन्न हेय भव भूप

इति श्रीमद्भागवते महापुराणे दयारामवृत्त भाषा  
निवधे पंचम स्कंधानुक्रमणिका  
समाप्त ॥ ५ ॥



## દોષા.

અમ સુનિ પૃથ્વી, એકદે કે ઉત્તિસ અધ્યાય,  
પોપન લીના અનિયે, પ્રકાન તીન કલાય ૧

## છંડ રેલા

નામ ધાન અગ્રયન યદ, ત્રિપ્રકાન ત્રિનામા,  
પદ્ધતો પ્રકાન નામ, તીન ડો અતિ અભિગમ ૨

પૃથ્વી પૃથ્વીમે અગ્રમેન આખ્યાન બખાન્યો,  
પૃથ્વી હૃદે જમદૂત લો, દર્શિ અગ્રને જાન્યો ૩

અગ્રવત નામ પ્રતાય વખો, સદગરી સુખ આયો,  
મદા હુણ આયેન મીયો, તં પ્રભુ પા પાયો ૪

પૃથ્વી તીસરે ગડ નામ માલાતમ ઇલતા ગન વાગે,  
ધર્મગાય મરનન કીનો, નિજ ફુન આગે ૫

અમ ગૈધ્યુન હરિ નામ અગ્રન ડિતનાદિ ડોધ,  
મરેજત દુ આજતે, રદા મન જૈયો કોઈ ૬

અમ દૂપરો પ્રકાન, ચૌદ અધ્યાય ઘાનદો,  
પર ચોયેમે મરન્યો નર એ પુ પ્રચેતાનડો ૭

કલ્યો રક્ષ દો જર્મ, રલ્યો મદા તપ ને કીનો  
શ્રી હરિ પ્રસન અરુ સતતિનો સર દીનો ૮

રડ પચમે રક્ષ જૂ કે જિતનેક પુત્ર ભયે,  
નાનદ કો ઉપહેશ પાય, જરૂ મોક્ષ પાય ગયે ૯

१० तम गेहा फैल, राप नार को गीता  
 ११ एवं कन्या साव अरु शुल प्रकट न गीता ११  
 १२ दिं जे ल्याको ठ, नास लिन के भाषे  
 जे ए सतान भये, आहु ठी दाख १२  
 १३ सतमे छ द्यो आप शुउ गुदगुपति तङ,  
 चिक्षेप शुउ भाने, निष्प भयो अगि बङ १३  
 १४ अ अः रिते भरना वर्म नामन आयो,  
 १५ घटनो भूपति चिक्षेप को भायो गायो १४  
 अनासुर हो जन्म भयो, लभते आये,  
 १६ स दस शुर अगि, द्यायि लयि के नये १५  
 देद तज भनि दीये, अर ताड़ा अनवायो  
 सो शुरेद ले, उवासुर-ते शुद्धु आयो १६  
 १७ एकारमे जु पग्सप र सभ्य ली युध के  
 व्यत प्रगसा भये अन अउ नायड युधके १७  
 १८ दासमे सविपति अनासुर को भायो,  
 चिक्षेप दीयो अनगाय, दान लही वास निवायो १८  
 १९ त्रिरमे रत्या अह धरें लागी,  
 सो दिं नभ करी भरा भुउप भूने जम लागी १९  
 २० औरें अनासुर फु- जन्म सो भायो,  
 चित्र डेतु उन्दास उतो, सोउ के दायो २०

પર પડે સૂત મળન શોધ બોસો કઢી તીનો,  
નાર્ગ આયે સનાધાન નાપતિ કો કુનો ૧૬

પર પોડા સૂત વચન સુનત જીગાય ભયો હે,  
સાધન કુનો શુદ્ધ ચિત્ત, હરિ દરશ ન્યો હે ૨૦

પર સરણ વિજાતે<sup>૧</sup> બેદી વિમાન સધાયે,  
જ પહોંચે કેનાસ શાપ ઉમખા તે પાયે ૨૧

તિસરો અગ્રચન પ્રકાણ, દે અધ્યાય નહ્વો હે  
પર અષ્ટાદશ પુગ, અદીતિ વર કલ્યો હે. ૨૨

અરુ દીતિ સૂત ડોણ, ખાશ ઝીંગ ભયે મરત ગન,  
ઉન પચાસ હુ દિયે છદ્રકો<sup>૨</sup> ભયો સુ મળતન. ૨૩

પર ઉન્નીસમે કથ્યો, પુસનત હો વિવાન સમ,  
હરિ પ્રસન્ન તથ સહજ, લાભ રતિકા તથ । અમ ૨૪

હોદુ

થદ પણ સ અનહમનિકા, ભર્તી પુન ગુરુ ઓજ,  
પણ દ્વા ડો<sup>૩</sup> પ્રિય ભયે, નજીપતિ અગત સગોજ ૨૫

ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે દ્વારામ  
કૃત ભાપા નિવંધે પાઈ સ્ક્રિંધાનુક્રમણિકા  
॥ સંપૂર્ણ. ૬ ॥



## होला

ज्ञानम् लीना उति ४३, दरा अरु प्रय आपाय  
 प्रदर्शन मुरे नीन छ, हेत हु नाम गनाय १  
 असहनासना ऐक, दिनीप सहनासना आही  
 सदसदनासना तृतीय, प्रथम प्रयक्तो कुणाही २  
 सप्त प्रथम व्रय तिष्ठप, साप डान उच्चार्यो  
 सप्त हुसर भे भुन्यो, दिरुद्याक्षड उरि भार्यो ३  
 सो सूरी के ५३ शोळ, भयो भाता जे दीती,  
 सभाधान शोळ, भूर्वाख्यान हु यज्ञ प्रतीति ४  
 सप्त तिनमे वधु, दैर के वे के दारेण्यु,  
 दिग्दृष्टकरुपु तपक्तीनो, अकर्त्ता भद्रा दाढेण्यु ५  
 विधना<sup>२</sup> अये प्रसन्न, भागी कंडी दम यर हाता,  
 ज्यो ज्यो विधि वर भागे, सो सम हये विधाना<sup>३</sup> ६  
 सप्त तुर्पमे छिरुद्याक्षयपु राज्य कीरो ७,  
 सम हुदारक तृष्ण, हुरत भग्नप दीयो ८, ७  
 पुत्र अये शीर व्यार, तीन डा डाम केला ले,  
 तुर्प प्रकट प्रदाद, भुवरगत्वद भक्त भद्रा ले ९  
 सप्त प्रय नदादाद, गुडें पद्मन भद्रये,  
 शुक्र सूत पद्मवे, आर आप भन ऐक न काये १०

- ૫૧ પ્રકટ પ્રદાદ, કૃપણુ હરિ બાન રચ દે,  
સહ વાસના દ્વિતીય, અકરણુ અધ્યાય ૫૨ ડે. ૧૦
- સોતમ એમે ગુડ ધર, જતને માનક આવે,  
તીનડો હ્લી પ્રદાદ, તત્ત્વ દમ તુમે રિખાવે ૧૧
- સમદી અળ ૫ પાણ, પડો કા યદ દેહ ડારી,  
રામ- કૃષ્ણ- જોનિદ, જોપાલ, પડો મુખ્યકારી ૧૨
- સાનુ સાખમે સમ વગિન પૂજ્યો પ્રા'નાદ  
શુભ કલા તેજ પાયે કું, શ્રી કૃપણુમલ ન્યાદા ૧૩
- તમ એતે પ્રદાદ, મુનો દમ એમે પાયે,  
જે નાતાકે જહર દતો, જથ નારદ આયે ૧૪
- નિન મો અખાડો ઉપોશત તત્ત્વ અખાન્યો,  
દો સમીપ અતિ ગર્ભ મિઠો, તાતેજ મેજ નન્યો ૧૫
- નિપ્કામ ર્મ, વૈગણ્ય જ્ઞાન સદ ભક્તિ જતાઈ,  
સુસગ તે હોઈ વિવેક, સમર્પન દરિ શુહ રાધ ૧૬
- સમ ધર્મન તે બેઘ, ભક્તિ પ્રીતિ દરિ સેવન,  
આધાપનતે કરી હરિ પ્રીતિ સ પાદન ૧૭
- સોત અહે પનમ ભક્ત પ્રદૂનાદે દેખી,  
કુદુ જનક અતિ હીધ કાયો, ભય દીયો બિસેખી ૧૮
- શ્રી નૃસિંહ પ્રકટે અભિનેત્ર તત્ત્વેના,  
કનક કર્યપુ નખતે ગિરારીલે રહુતિ સમ દેના ૧૯

सभन्म नव प्रदुर्भाव की गुनि ऐमसु भी ३,  
लीयो भक्त उत्सव, प्रसन्न लये अति ५।३ ०

सभन्म द्वा अग्रान भजित धु गतोन नियावन,  
राजपासन वेगयो, आप प्रसाद दृपा २ १

अह भय नामा अमुर, त्रिपुर लायो चु जगये;  
तृतीय सदसद्वासना पंच अध्यार चु आये २ २

सप्त व्याघ्रे बदारा भरन, ते ले ले कर्मा;  
सप्त वारमे धर्माद्यारी, वानप्रस्थ धर्मा. २ ३

सप्त तेजे पति धर्म, जन भाति अतायो,  
अह अजमर प्रदुर्भाव, भयो संवाद मुग्धयो. २ ४

सप्त अतुर्गत गृह्यथाक्रमडो धर्म अभान्यो,  
मे पाए धर्माद्य, अदीने द्वे करी भान्यो. २ ५

सप्त पंच द्वा उगम-, अध्यम ओर डनिष्ठा;  
सप्त प्रकारे धर्म उडे, भानत नदि अष्टा. २ ६

### दाह।

सप्तमडी संपूर्ण भध, अतुर्भाणिष्ठा अनुप,  
द्याराम उडे ले उने, मे न परे भव दृप २ ७

इति श्रीग्रद्व भागवते महापुराणे द्याराम कृत भाषा  
निर्यथे भस्त्रम संधानवृक्षमणिका  
समाप्त ॥ ७ ॥

## हाँडा.

अष्टम रुद्धके चुनो, चोर्द्धस अध्याय सार;  
भनवंतरे लीला लडो, प्रकरण जामे व्यारे

## छंद रोला.

तामस सातिक गमस भक्ति दें यद च्छारें;  
चेहेलो प्रकरन तामस चें अध्याय जिव्यारें. १

अष्टम पूरवमें रवायंकुव, रवारे चीरा कळीयें;  
उत्तम तामस यद सग्नाम, भनु ते लळीयें. २

अष्ट अपरमें गजेंद्र तो, आदो अलो दें;  
अह वीजें लरि रतुति करी, ज्वन दीन भयो दें. ३

सो शुनिके, असु दीन अंधुदो र हीआये;  
तुरत आदो मारी, कृपाल गजेंद्र धुडाये. ४

अह च्यो आद गजेंद्र, पूरव ते जनम कडे दें;  
श्री लरि परस प्रताप, हेषु जन मोक्ष लडे दें. ५

अथ दुसरे सातिक, प्रकरन अध्याय इक लडे;  
अह पञ्चममें रैथन, भनु चाकुप भनु कडे. ६

जामे अमृन भथन निभित्य, अमर सगडी जुरि;  
क्षीर भागर तट ज्व, रतुति शीनी दें श्री लरि. ७

अह पट श्री ग्रमु ग्रसन भये, अग्नान दयो दें;  
भीमे सुरासुर भंद्रायत, उड्यो न गयो दें. ८

हु भी लभी आर्तनाथ, तुरत २३५१३६ आये,  
 महर पग्न सुपग्न धरी, सागर ९८ लाये ८

अह भनमे कुरमावतार, धरी भथन कर्यो,  
 अथम भद्रा दिव निक्यो, सो शिवनुकोऽपायो. १०

अष्ट अष्टमे रत्न चौ, निक्ये न जो देह,  
 कुधा पान हे समय, कुरासुर लग्न लगे देह. ११

तथ प्रशु भाया अधीप, भोदनी ३५ ही लीने;  
 असुर अह सथ आप, अनिश्च भोदित छाने. १२

अह नो अमृत अमर अभिन उत्तर्यो पाना;  
 दैत्य परोसन समय भये हरि अंतर घाना १३

आटम हसमे देवासुर सथाम इलो हे;  
 अष्ट ग्यारमे भद्रा दाउन हि लुह भये हे. १४

अष्ट खार भोदनी स्वरूप लभी शिव भोदित भये,  
 अष्ट तेर अध्याय चिये, वैवरूप भनु हडे १५

छनडे राज्यमे शी वामनश प्रकटे भाये;  
 अविष्य भनवतर आगे होने कही दाये १६

डैन डैनसे ताडे नाम कहतहो वरही;  
 सामरही अह दक्ष सावर्णी अहसानर्णी. १७


धर्म सावर्णी इद सावर्णी हे अभिरामा;  
 हे सावर्णी धर्म सावर्णी सातो नामा १८

- આ અચતુર દશ મનવાદિક મનુ પુર તુ આડી  
બાળે ભગવન અશ સમે કષુ સરથ નાહી ૧૬
- અ૧ તિસરો ગાંધે અકલણુ અધ્યાત્મ સુનનકો,  
અમે ચુનનકી માન, તોત નિગતાગ ભવમે ૧૭
- અ૨ પચ દશ ડલો, રાત મનિ નૃપતે કીનો  
અ૩ અચ્છુમેઘ વજ કીયો મોહ હેડે દીનો ૧૯
- અ૪મ જોન અણી, પુર મામના કાગળુ  
વિજયિ નિજનાથ કરી, કર તાપ નિરાગળુ ૨૦
- કરો એસેનત પુર દેખગો પતિયો ભાખી  
જો એછુ તામી વિધિ મધ્યારથ ચુઢુ હેડે દીખી ૨૧
- અ૫ સમેન દશ માયો, સુનત હરિ પ્રમત બધે હેઠ  
આયે આપ ગર્ભ વિદો, મામન અલાદિ હેડે હે ૨૨
- અ૬ એક રૂપ થી નામનથ પ્રાકૃતથ કુ ગાયે,  
મલિ નૃપ યજ પધારે વદ્ધ નનમાન તુ પાયે ૨૩
- અ૭ ઉત્ત્રિસ વિરોદ પૂણી સન્ધ્ય ગાયો કે,  
એક ચરન ભુ, દ્વિતીપરંગ સન્ધ્ય માસ નિયો ૨૪
- અ૮ ખીસમે તૂલીય પાંડો કોર ન પાયે,  
તાને મયન મિસાં, પરગ્ય બધે સુગાયે ૨૫
- અ૯ ધક હસ ગ્રગભે શ્રી પ્રભુ પદાગુપ્ત લખી  
અથ હેઠ અભિરોદ મિદો, મન નૃત બધે સુપરી ૨૬

तो प्रवाल पृथ्वी आगे, २१२०७ लय दे,  
 ५४७ दिन तुम मृत पाठ १५३० कुंडे १२०६  
 अठ गांधस विग्रह, इयन तर एव न लाभ्या  
 आत्म निवेदन करी, दरि आगे ५ भग्नक राख्यो ३०  
 तर प्रसन्न प्रश्न भये, मृतनको रात्रि नियो ३  
 भये भक्त आधीन, खसि निर शस नियो दे ३१  
 अथ तेष्वस गति उत्ती रागधानी सूर गीनी,  
 तर देवनरे हेव देवन भुनि अति गीनी ३२  
 अग चोयो प्रकरण भक्ति अपाप सङ्कटको,  
 अप्स चतुर्विंश गे सङ्क भायग सत्य न तको ३३  
 देवस्तते भवुराज विष, ओ अरिति मूलान्यो,  
 ओ दरिको अनतार भास्य आकृति भासान्यो ३४

दोषा.

अनु-मणिका पूर्ण ६४ दरि कीन,  
 पहत मूलत सङ्क छी गने, दरि नक्षत्र सन भीन  
 इति श्रीमद्भागवते भद्रापुराणे दयारामकृत भाषा निर्धने  
 अष्टम स्कंधानुब्रमणिका  
 समाप्त ॥ ८ ॥



## દાદા.

અમ નવમ સ્કુલમાં સુનો અતુક્ષમની સામ ડોય  
ઇશાનુલીલા એળી હે, પ્રકર ન ગમે હોય.

## ॥ ૭૬ રેલા ॥

- |             |          |               |            |       |                |           |
|-------------|----------|---------------|------------|-------|----------------|-----------|
| સુધીએ       | બંસ      | પ્રકરન        | મન્યાદો    | હુર   | લહીએ;          |           |
| ચંદ્ર       | બંસ      | પુણિ          | પ્રકરણ     | સો    | કુસરા          | કહીએ. ૧   |
| બાર         | બાર      | અધ્યાય,       | દોડુકે     | ભાંની | લીને;          |           |
| પ્રથમ       | બારદો    | ભાનુ          | બંસ,       | અમ    | સુનો           | અનીજો. ૨  |
| નવ          | પૂર્વ    | વૈવર્યત,      | મનુ        | દસ    | પુત્ર          | સુધન્યા,  |
| દાદિવાઙુ    |          | આદિક અહ,      | એક         | ભષ    | હે             | કન્યા. ૩  |
| નવમ         | અવર      | કહે ચ્યાર,    | પુત્ર      | બધે   | નલિ            | સંતાના,   |
| તીન ગુત્રડો | બંસ      | ભધે,          | વૃત્તાતિ   |       |                | બ્યાના. ૪ |
| નૃગ         | નાભાગ    | ચંસ નદિષ્યાંત | તીનો       | કે    | નામા;          |           |
| અમ          | આગેં     | નૃપ સુનો.     | કંડત ધી    | શુક   | શુભ ધામા. ૫    |           |
| નવ          | તિસરે    | શર્યાતિ       | બંસ        | કલો   | બિસ્તારા;      |           |
| ભી          | રેચતી    | જ બંસ         | પ્રકર      | થી    | દલધર હારા. ૬   |           |
| નવમ         | તુર્ય ગે | નૃગ નૃપ       | બંસ સુખરની | બધે   | હેં            |           |
| દનકે        |          |               | અંગરીશ     | હરિ   | ભક્ત બધે હેં ૭ |           |
| અદ્યન       | અકિત     | કરી           | કારિકાધીદા |       | રિઝાએ;         |           |
| નહે         | શાપ      | હે            | મુનિસે     | હુઃખ  | પાએ. ૮         |           |

નર પચમ દૂરમાના શરણ સતતને ધારે  
 પ્રભુ પન્યત ન રહે, હારી અમરીગડો આરે ૬  
 તાપ સુદર્શન તરફિ શર્મો ભવ પાયે શિખા  
 ધર્મ કરે રહિ ભક્ત મીન કરે વીની નિખા ૧૦  
 નર એ અગ્રણ અસ રાય અમરીગ ભરો દે,  
 તા પાછે ઘદરાદ ગયાં અસ કલો દે ૧૧  
 જાકે અસ વિં માધાતા ભૂપ ભયે દે,  
 તાકે ભયે મુદ્રાદ, જાડ પ્રશુ મર્યાદયે દે ૧૨  
 નર સતમે માધાતા સૂત પૃઢ કુરસ કહે દે,  
 રન્યો તાકો અર જામે દાનિશદ ભયે દે ૧૩  
 નો અહ દાનિશદ્રકો અસ પ્રશાસ નખાને,  
 જાહિ અસમે ગાળ સગર ભયે સાથ જાને ૧૪  
 નર નરમે વરન્યો, નૃપ સગર અર મણ સમર્થ,  
 જાણ અસમે દ્વાત ભયે ગુણી ભૂપ ભગીરથ ૧૫  
 જાને શ્રી ગગાણકો ભૂતન પદરયે  
 તીનકે અસ પરનતમે, નૃપ અહસાગ એ ગાયે ૧૬  
 નો દસમે અદ્વાગ અસ, વરન્યો મણ ઉત્તમ  
 જાકે અસમે પ્રકટે, શ્રી રધુષર પુરોત્તમ ૧૭  
 તિનકે પરમ પવિત્ર ચરીત કરે અથ છતિ  
 નો એકાદશ ગમ રાજય વરન્યો શુભ નીતિ ૧૮

- નો દાદશ શ્રીરામપુત્ર કૃશ વંશ સુગાયો,  
અમ પુણિ પ્રકાશ અધ્યય સુઆયો ૧૬
- નો ત્રિ દશ ધર્દિવાઙ્મ પુત્ર જે નિમી કહે રે,  
તિનથે મસ વળનોા, જામે નૃપ જનક ભયે હે ૨૦
- નો ચૌમે ચદ્રમા તે સૂત ખુધ ભયે હે,  
તિન તે ચૈન પુરુષા પુત્ર ભયે જુ કહે હે- ૨૧
- નો પદ્રેમે મસ પુરુષા નથ શુભધામા  
જાડે મસ કિં પ્રકટે શ્રી પરશુરામા ૨૨
- નો પોડશ શ્રી પરશુરામ ડો ચરીત સુગાયો,  
અદૃ અિશ્વામિત્ર ડો જનસુ જુડ યામે કલાયા ૨૩
- નો સતત પુરુષા નેણ સૂત નહ્ય મસા  
રાય વ્યાતી હેઠ મસકી કરી પ્રદાશા ૨૪
- નો છન્નિસમે રાય વ્યાતી પરમ ગતિ પાયે,  
નો ખીસમે છેણ હુ મસ પુરુષા ગાયે ૨૫
- જાડે મસ નિ રાજ હુષ્ટત ભયે રે,  
તાડે ભરત ભયે, તાડો દિર મસ કહે કે ૨૬
- જાડે બસમે રતિદેવ ગાજ મડ ભાયે  
પુની ગર્ગાચારજો મસ સોં કણી દાયે, ૨૭
- નૃપ પાંચાન હૃપા ચારજ કરે દોષુચારજ,  
ચુદ કના પૂરન જામે, નિધાસમ ચુરજ. ૨૮

નો આઈસમે ગજ દૂપઃ કરે મુજાને,  
 તા પાટે અગ્રમીઠ ભૂપડો ખસ વખાને ૨૩  
 જાકે ખસમેં જન સધ ભૂપાલ ભયો હે,  
 તા પાછે ગજ સતતુ ડો અંસ કલ્યો હે ૨૫  
 પાડવ અહ કૌશન ડો અંસ મુ આજયે ગાયે;  
 જરાસધ ડો વશ મિધિઅત આચ શુનારો ૨૧  
 નો તેદ્દસ ધ્યાતિ પુત્ર રહે જો વ્યાગ;  
 તાડો ખસ કલ્યો જમે થદુ અંસ પૃકાગ ૨૨  
 જમે તે મેધાતિથિ કાયિ ભયે બગનન ધીનો;  
 નહિ અગ્ન્યો મિશ્તા, મૂનમાત્ર હી કુદે તીનો, ૨૩  
 નો ચોઈસમેં જમદાભિ ડો વંસ કલ્યો હે;  
 તા પાછે અદ્દુ ખસ અરણ રહ્યો . હે. ૨૪  
 ઉદ્ઘેન દૈવકો અંસ અખાંયો પાઠયે;  
 કંસ જન્ય જુરમેન ખસ દિર અગ્ન્યો આજયે. ૨૫  
 જાકે પુત્ર ભયે વસુદેવજુ અતિ અભિગમા,  
 જિનકે પ્રકટ જાયે શ્રી મૃપણ ચંદ શુખધામા. ૨૬  
     દાઢો

અનુષ્ઠમ નિકઃ અતિ ભક્તી પૂરન નરમ ૨૬૪;  
 પાપ તાપ પ્રદ્યે દ્વા રંચક હોત સંખ્ય. ૧  
 ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે દ્વારામ કૃત ભાષા  
 નિવેદે નવમ સ્ક્રિધાનુક્રમણિકા  
 સંપૂર્ણ.

## દોડો.

સની અમ દશમ રૂપે, સત્યારી અધ્યાય,  
તીન ભંતાતં કે મીલી, નિર્મણે પૂર્ણ કઢાય ૧

નિરાધ કીના નિરૂપન, પ્રકરણ જામે પાચ,  
જનમ રૂપ તામસ ગજસ રૂપ સાત્ત્વિક શુનાભ્યસાચ ૨

## છંદ વૈલા.

પ્રથમ સુપ્રકરણ જનમ અમે અધ્યાય ચ્યાર્ટો  
અનાધાસ ઉપયાર મુનો સ સાર પાર્ગડો ૧

દૂસર પ્રથમમે પૂર્ણો પ્રથમ પરીક્ષણ ભૂપા,  
આરમ્ભો શ્રી શુક મુનિ ઉત્તર દીયો અનૂપા ૨

નેનુક દુર્લિતા નેની, અસુહેવ જી કો દીની,  
બૃત નાયન સહીત કસ સારથી ઇતિ ધીની ૩

નસ દ્વિતીય દેવાળી પદ મૃત ભીય કસતે પાયે  
નાકભૂષણ દેવકીને રોહિની ઉત્તર પદગાયે ૪

તનનાંતર શ્રી કૃપણ દેવકી ગર્ભ પધારે,  
અલાદિક સુર રહુતિ ધીની, તન તાપ નિરારે ૫

નસ નિમે શ્રી કૃપણ જનમ મધુ પુરી ભયો હે,  
કીની રહુતિ વસુહેન દેવાળી તાપ ગયો હે ૬

શ્રી જોડુનમે યગોદા જોદ પુરી પદગાયે,  
ઘા તે આપા પુરી ને, અપને ઘર આયે ૭

દસમ ચાંમે માયા ઉડીકે ગઈ અધ્યાત્મ  
 જણો કસ પદ્માન નાય ખન રાન પ્રકાશ ૮  
  
 લમાધાન ભગવાનીડા ખન, દિન ત્ય શુતાર  
 હે આપસ સતત પીડા, સમ તુત પદાયે ૯  
  
 અથાર્તસ અધ્યાય દુઃખિ, તામુસ પ્રદેશ હે,  
 તામે હે શીર બેદ ચાર, મદા પ્રશુ મયન હે ૧૦  
  
 પ્રથમ પ્રમાણુ, પ્રમેય, દૃ સાધન દૂત ચો નામા,  
 પૂર્વ સ્વાત્મ અધ્યાય કઢે, સો અનિ અભિરામા ૧૧  
  
 દસમ પચમે શ્રીજ ખર, પ્રકટે મો બાખ,  
 નદ મહેસુન સમ વિજાળન સુખ ખન કણી દાખે. ૧૨  
  
 ના ગરો મહુરા કસે કર દેન સુ ગાય,  
 માતે મીત વન્દુદેવ ઘોર કુત જોકુત આયે ૧૩  
  
 દસમ ખર પૂતના પ્રશુન પરપાન કરાયો,  
 દસ્ત માનણી ગતિ દ્વાનિધિ અનિ સુગાયો ૧૪  
  
 દશમ સ્વલ્પમે રામટ બળ, તરણુાદત માર્ગી,  
 મિશ્ચ ઇપ દર્સાય માર મુદ, દિન સુક ડાર્ગી ૧૫  
  
 દશમ અષ્ટમે ગર્ભ સુનિ, નામ કરન કીનો,  
 પાછે શીર અરિત કરી, જોપીજન સુખ દીનો ૧૬  
  
 તદનતર અતિકા ભક્ષણ મિસ નદન દિખાયો  
 નિશ્ચ ઇપ કો દરરાન અએ દિરિ કરનાયો ૧૭

दृश्योमे दधिभाजन भाव्यो। निरोध कारन,  
 उत्तुभ्यन अथे गये मृष्ण, जनतापु निराग्न १८  
 द्वा द्वामे यम वाञ्छुन दूम उद्धार कियो हे,  
 क्षयो। स्तवन सुनी, ग्रेमभक्ति त्रा दान दियो हे १९  
 द्वा अपारे दिभि विवन, नमे ज्ञु मिचार्यो,  
 श्री गृद्धवन नदगाम बसवेऽग्र धार्यो २०  
 २०। पर्यारे प्रभु प्रथम अत्सामुर भार्यो,  
 २१ यथ पक्षी, दरि अकु दुष्ट मित्रार्यो २१  
 अनन लीवा व्यूह दारे प्रभुने आप क्षगाध,  
 न विषम हुगादिक होपु, अन प्रखुजन अत्सवाध २२  
 आगे अदे न होपु, तालि अन सुक्ति जानी,  
 अक्षिनके शापानु अल, पर्म द्या प्रभु आनी २३  
 अन पक्षात्तर कप्ते, अध्याय तीन २,  
 क्षेपु गाक्य मित्रु, भद्रप्रभु याते श्रीन हे २४  
 ॥ भयात् क्लपमिक्लपेषु न चिमुद्यति कर्दिच्चित् ॥  
 (श्रीभद्र भागवते कृतीय रक्षे सप्त उत्तोण भागवत प्रसंगे )  
 दस द्वादश अदा अनी अधामुर दिनमे भार्यो,  
 अत्स गोपगलु जप्त अनगत नाथ निर्मार्यो २५  
 द्वाम नगोनशमे शुभ भोजन शिना मिगाने,  
 ज्ञान भड्वी एवी अध्य भन भोहन आने २६

જાડ અરોગત હે, ભમન સહુ રૂપા હરે હે  
 તાદિ ભમય વિધિ ૨૩ ગ્રાસ સય દન કરે હે ૨૭  
 દશમ ચૌથ કિંદ રત્નન મિરાતા નાન તાતડો  
 અગ ફુલરા પ્રકૃત પ્રમેય અધ્યાય સાતડો ૨૮  
 દસમ પચ દન ગાય ચરાનન દરિ બન આયે  
 ગન કીડા સદ સખ્ય રત્યો ઘેનુક સો ગાયે ૨૯  
 મિથ બન ખાન કિંદો જો ચોપન મૃત્યુ હિ પાયે  
 કરી કરણું અમી દ્રાદિ, જૂણ્ઠિ હરિ સંકલ ગુવાયે ૩૦  
 દાયક દામે કાનિદમન કરી, દૂર કિંદો મિથ;  
 નાગ પતીડો અવન કૃષ્ણ પુનિ પદગ હે મિથ ૩૧  
 દામ સાથ દય કાનિ આગમન દેતુ કલો બન,  
 નિરિ દાવાનથ ખાન, કિંદો દારનાગત વત્સથ ૩૨  
 દશ અધ્યાદ્યા બાન ચરીત, ચરાનત જૈસા  
 ચિથમ નાતુ અગનન, પ્રનાય મારો બન નૈયા ૩૩  
 દશ ઉનિસમે દાવામિ શ્રીન ખાન કિંદો હરિ,  
 ગનતે ધર આયે શુપાન સો મિધિ અગનન કરી ૩૪  
 દશમ ખીસમે વરદા ગિતુ, રહેં ગિતુ બનન,  
 દશમ એક ખીસ એનુ ગીત અગનન મન મોતન ૩૫  
 અમ તીસરો સાવન પ્રકૃત અધ્યાય સાતડો,  
 જો રસ ખાવે મન હે, રતન સુ ન પિવે માતડો ૩૬

દસ બાઈઓમેં દિમાંત તિતુંા અનનત કીનોઃ;  
અત કા ત્યારનિ અજ અક્તા ન રજુપતિ અગ દીનો. ૩૭

દસ તેછસ પ્રશ્ન કાલિ પત્તીનકે બોલતન કીને;  
થાયે દ્વિજન ડાં હૃદાણ એ કિયા ગ.-ગમોહીને. ૩૮

દસ ચોધસ મેં દ્વાર બોગ પ્રશ્ન સક્તસ ગિટાયો;  
મો સમ શ્રી જોવર્ધન જ્ઞુ ॥૧॥ બોગ ધનાયો. ૩૯

અજાસારીએ અન્યાયય કાર્યો ન સુદાયો,  
અનન્ય ધર્મ ઉચ્ચત લમડો, દરિ સમ સમુજ્ઞાયો. ૪૦

દશ પચીસ મુગુપતિ ડી, ગેધકાળુ અધ દાખ્યો;  
શ્રી તિનિધિ ગિરિધરી, નિજજન ગન નિષેં નાખ્યો. ૪૧

દશ પટ મિસ સમ અચ્યન્ન, હૃદાણ અતુલ અર દાખ્યો;  
નાગાય તમ સમડો, ગર્ભ મુનિ અચ બાખ્યો. ૪૨

દસ સોપ્ત વીસ મધ્યા જુરી કર પાય પરો દે,  
સુતિ કરી ડરી, જોખિદ નામ અભિગેક કર્યો દે. ૪૩

દશ અધસ પ્રશ્ન ન્ય અચન પારા તેચ સુદાયે,  
મામ અત્સ હુદ અજજન, કિય નિજ ધામ દિખાયે. ૪૪

અન ચોથો દસ પ્રક્રન, સુની અધ્યાય સાતગે;  
જને ગસ રમન અનિન્ન, આનંદ ગાત ડાં અપ,  
દસ ઉંતીસ ઐનુ અનાય, અજ અક્તા હુનામે,  
રાસારબ કાયો દરિ અંતર અાન હ પાયે ૪૫

-નમ રોમ કર ભરન હણ વીના અગનદો ૪  
 મિન અમ્યો ગુરન, રીરે નાથ ગોજનદો ૫  
 ત્સ ધર તીમ કર ભરન ગોપિન ગીત અગારો  
 -સ મતીમ શીર રોય દીરો, પ્રણ એવ ચિકારા ૬  
 -મ તેતીમદે ગાસ મદન એવ ગર જૂણ ગને,  
 વર થત કીડા દૃપણ ભક્ત મત વળત શને ૭  
 ત્સ નોલીસમે એ એ નિગતે સર્વ કુદામે  
 એકોર રાસ અનગમ સહીત, એવ ચાન્ત બુગાયે ૮  
 ચુખ ચુડ કંદ હુંદ અન કુખ ડેન દિ આયો,  
 અનિ, રીર તે કાઢી વીયો, નિર ભારી શુરાયો ૯  
 -સ પેંટિસ કર ભરન, સિયોગ દિનમ રાપન મન  
 પનમ પ્રેમમર ગને શુગન ગીતદો મનન ૧૦  
 અમ તિઝુરો રાગસ પ્રદેન અડાન્સ જેમે  
 ધામે હિંગાર લેદ હે, નામ શુનૈયે ૧૧  
 એ પ્રમાન અર પ્રમેય સાધન એવ રોંતાના,  
 ધૂર પ્રમાન અદ્યાય સાતદો એ અમિગમા ૧૨  
 એ દતીમદે અધમાસુનદો અધ પ્રણ કીનો,  
 નાર કસ ઉપરેશ ગયો મો સર કહી દીનો ૧૩  
 દરમ સર્વ રિશમે, ડેવિ ડેસને માયો,  
 નારદ નદ ધર આય, અનિ પ્રશુરો કહી દાયો ૧૪

તાપા છે યોમાયું તો ગવ ગિનિબન ધીનો,  
 મના કષ્ટ તે કાઢી ગોપગન તો સુખ દીનો ૫૭  
 તરા અદ્વાતિસમે કષ્ટમે અદ્વાત કાને પાણે,  
 કૃતાન પ્રલ ૫૮ પ્રલ નીચ્ચી મદા સુખ પાણે ૫૮  
 દસ ઉચ્ચાનિસ અદ્વાત સગ દૃષ્ટય જનગમા,  
 અથ એદિક પદ્ધારે, મધુગા પુરી સુખધામા ૫૯  
 મધ્ય ૫૯ જલમે અદ્વાત તો દૃતાન દીને,  
 જોપરાદ્ધ તે. ૬૦ હિખાય એદ વન ધીને. ૬૦  
 દસ ઉચ્ચાનિસમે સાડનડસુત<sup>1</sup> રુતિ ન. નિવિકીની,  
 પણિપણ પન્મેળ વિ, મતિ વની ન્તિ નાતી ૬૧  
 દસ દાહુતાદીસ શ્રી પ્રલુ મહુપુરી પ્રવેન ધીનો,  
 અનદાઉ અડ ગોપ સખા ગન ઈ સગ લીનો ૬૨  
 એદ્ધ માયો રજક મુક્તિ નિ તાડ દીની,  
 માણી સિદ્ધમાડ અક્તિ દધ કરણા ધીની ૬૩  
 દસ હુદુ ઉચ્ચાનિસ હુસન્યા ઉપ મનોદુ ધીનો,  
 વા દર્શિ હુદુકો ૬૫ તોરી ઈ હુદુ કર દીનો ૬૪  
 દસ લયે હુદુલુ ૦૧ મડમ પ્રલુ આયે,  
 અન અધ્યાય સાતકો પ્રમેય પ્રકલ્ન ગાયે ૬૫

<sup>1</sup> સા દાડસુત=અદ્વાત

इस श्रियालीस छुनवया भीड़ को अब छानो,  
 भाव तुम्हें हरि दर्शा मिथिल समनको दीनो ६६  
 जिना कस श्री कृष्ण गम गुग समझो भाषे  
 अडभागी जे जन, प्रगपर मादाम् भग दे ६७  
 दरा चो यानीस महन कुद इति कसु भार्यो,  
 जननी जनक अधन छुडाय, दरि ताप निरायो ६८  
 इस ऐतानिस समाधान पितु भात दिये दे,  
 हिम्मेन उ गज्यासन ऐहाय दिये दे ६९  
 ननहिको अज पदप निन शरणार्थ;  
 जन्म समय गौ सद्भी, वसुनेव निराध. ७०  
 अल्पर्थ अत धारी, अनतिका गुड गृह आये,  
 अिधा परी सादीपन गुड, करी टदव निकाये ७१  
 काना फिको भीती पुत्र गुड वाई दिये दे,  
 अिदा भागी भद्धुपुरी पाओ धारे स्वजन निये दे. ७२  
 इस छेंआलीस उद्धवो अज प्रकु पदाये,  
 साजि समय रथ भेडी, न८ जू ते वर आये ७३  
 अगवत भात उरत भीती निशि देक्षण्डु लेपे,  
 ग्रानसमे उद्धनडु प्रज भक्तनने देपे ७४  
 इस सत-यालिस, उद्धो गान उपहेशन आये  
 ग्रेमासक्त अचन गोपिन ते, झुतत लगाये ७५

गुरु सत्व उपज्ञो लियमे,	मद	जान	गमाये।
अनि रघुत उपावभन	सभ	उडी	मुनाये ७६
दस अहतालिस डुखन के	धर	कुण्ठ	राधारे,
सङ्कल मनोरथ सिद्ध काये	अहुर	के	आये ७७
भगवा ग्रिये भगवत्,	प्रशंसा	भक्त	मुनाये,
अहुर के हिर पाठ्यकी	मुन	लेन	पड़ाये ७८
दसम उन पचास अहुर दरितनपूर आये,			
पाठ्य से दिनभिने, कुरान वय मुने मुनाये ७९			
धूतराष्ट्रकु एव रिखा, कुता हु अ			बीज,
मधुपुरी आय कही सम पी,			श्रीज ८०
हति पूर्णाधृ समाप्त,	अम उत्तराधृ	कही,	
तृतीय प्रकरन साधन,	अधार्य सातडो	लहीये ८१	
दश पचास जये युध मार्ग उत्तर ऐरी			
गुरी अन्या आये अहो अहान्ही में ही ८२			
ताडी सनय हिर कान परन ह आये धाठ,			
तर समूद्र पे प्रभु दारिका पुरी रथनार्त ८३			
निशि अप्ती धन्वन्ता सम त्रै वा पद्यो			
निक्षी आप हिरि भने, परन पाठे उषी धाये ८४			
मोवत दो भुजुक्क गुहामे वहा तरि आये,			
पाडी उदाय पितामह आप अर्चिना पाये ८५			

૧૫ એકાત્મ યત્ન લખ રહે જરૂર જાણા  
 ૧૬ ૧૮ મુચ્યુદા તિથો રહે રહુનિ ગત ગાયા ૮૫  
 ૧૭ જાત મચ્યુ રહે જરૂર જરૂર કરી ધારા  
 ૧૮ નમ વર રેસતિ રહિમણી નરેલા આરા ૮૭  
 ૧૯ રેપન રહિમણીન્ડો પ્રશુ દરેન ટિથો હે,  
 ૨૦ રોપન જાનભાડ, કૃપગણ ઉત વિયા હે ૮૮  
 ૨૧ જાન અર્વણી રૂક્મેયાડ તજ દીનો  
 ૨૨ દાગનતી પ્રશુ નિધિ પૂર્વક જિખાડ કીના ૮૯  
 ૨૩ પચનત જાયે પુર પ્રશુનત રહે ગયો નગર,  
 ૨૪ મારી સદનારી, કૃષુ સુત આયે નિજ ધર ૯૦  
 ૨૫ રહેપન મણિ પ્રશુન, નશુનતી પ્રશુ જ્યાડે  
 સનાઉત લીત ધરી હરી, સત્યમામ રહે ગાડ હો  
 ૨૬ ચોણો ૨૭ પ્રકનત સુનિ અધ્યાય સાતકો,  
 ૨૮ પણ ૨૯ જરી, વિનિધિતાપાયધારનતકો ૯૧  
 ૨૯ સત્તનત શીજ પાડણ સુધિ ૨૧ પધાર  
 છતનગે સનાઉતકુ સત્તધન્યા મારે ૯૨  
 ૩૦ મણિ લ યો રહુન હુણ સત્યમામા પાયે,  
 પકુગણી આયદેતે પ્રશુ દાગનતી આયે ૯૩

सत्प्रेना तर अन्यो, भ्रात सद पाडे धाये,  
 श्री दग्नि श्री दग्न्यो, मनी व्याते नही पाये ६५  
 आयो श्रभु अपराह गमहू डैतर वायो  
 भणि अहुर्गु वाये, सर्व भन सहेल भायो ६६  
 इसआन मे श्रील किर धदग्रन्थ आये,  
 कार्विण्य -यो, आदर गनु लगये ६७  
 अडे भिन विनाडोऽ पुनि अद्राटु प्राये,  
 एयादि नक्षमण्डा श्री दग्नि ल्लन सर्व आनंद पाये ६८  
 इन इन सामे हुए भौमासुर भारी,  
 व्याडे भेव दग्नर दन्यो, हुए मुगरी ६९  
 इसम साध उठिभनिमो, दाय लुक्त अच ओते,  
 पहरगनी प्रति उत्तर हे, अन तार ओते ७००  
 इस भक्षह सर जी तो, इन हन पुन भये हे,  
 तिनमे सुख्य अप्य जी, अतके नाम कहे हे. ७०१  
 प्रद्युमनश्चु के सूत अनित्यर्गु वये हे,  
 ऐ भातुन दन्या लाये नदा युद्ध कहे हे ७०२  
 "या मासह अनित्यर्गु, या भाष्टुसुरश्चो दन्या  
 उपा लडो नाम दग्न्यु, क्षीती हे धन्या ७०३  
 अनुव धनाक्षम क्षीयो असुर सर भारी भन्य  
 नाग पाग गुधनमे, जनी जुछ के आय ७०४

- इम शीसा आयुराम् पात्र युद्ध गुगाये  
अनिवार्य उपा व्याही, कुञ्जु गत धडो नारे १०५
- अग चोया प्रकरण सातिर एड मस भेदे  
तामि पटेया प्रमेय सत अध्याय लाए दे १०६
- हरा चोसा दृष्टे पयो कु कुमास उदायो,  
पूर्व जन्म वरात सले, नृग नृप कुदी डारो १०७
- तनक देव भयो, कोश देतु, खड भडिन सुहीन दे,  
ऐराग अभिव लिला, एसो अवन्व कीन दे. १०८
- हस पेंसा शी अवहेन्नु अज एड़ेर पधारे,  
भाले सेनन कीय रमन जन्मन कृ ए दुनधारे १०९
- हस छासड धीड़ दित्यो अह आरी राग,  
आशी अम करी हरि सद सम हुए समाग ११०
- हरा सतसा दुर्योधनकी लक्ष्मणा जु कन्या,  
शी जबूती पुन लरी, हनि के अकु सिन्या १११
- अहे गये कुनी समें अन्त दुनधर वका आये,  
कौतन कलो न भन्यो, अचन कुकु कुनाये ११२
- कोपे पुर-ओधा मानत हिं नये अचाये,  
अर अद्व सपरिणार, राम दारिका आये. ११३
- हस धकोनसप्ति ते नारद दारिका पधारे,  
शाम्भो गृहस्थानम हेषत हेषत लारे. ११४

नर्द नर्द वीना हेप्ती थकित भये सान सदनप्रति  
 पुती प्रभुके पग परे, नम दो नाथ अन्त गति ११५  
 हस गीत अदनीक दृष्टि कर्ते भो आये  
 गध परे ते भूप, पराये हृत चु आया ११६  
 नान आप कडे पाडनदो, गधसु को मन  
 अम अध्याय सातको तिसरो साधन प्रकर्तन ११७  
 हराम एक सप्तितमे,  
 हर एव नान होको उधरउच्च समत करी,  
 पाते श्री ग्रन्थ आप छ प्रग्रथमे भधा  
 पाडनादि सपडो दिनिर्विनिके भो वधारे ११८  
 हस हुत गधसु निमिता, हिमा सम उती  
 लगासध इति राज वधाया तद सुब नीति ११९  
 यि छुडाय भूप सम श्री लरि अति सुख पाये  
 ई तुत गोभा सद सगडो सदन पधाये १२०  
 अभय दान हे आप छ प्रग्रथमे सधारे,  
 हुपा सिंहु श्री हृष्टि यद निर लन अति घारे १२१  
 हनम सुअमार राय सुरज युधिष्ठिर कीनो  
 आदि, पुल्य ग्रन्थ ग्राण्ड, दृ रिशुपानडी दीनो १२२  
 हरा पर्वात जनयन अम कानन सो गोरो,  
 हुप गरी हुयाधन मान भग भन धारो १२३

- દ્વામ કુદુરે રાન્ધિય દાનગરી આણો,  
તામ દાણુ પુષ્પ પ્રદૂષન આણો. ૮ ગ્રામ ૧૨૫
- દ્વામ ગીતોનર ગાં ધાર કરી હજિ નિદ ભાણો,  
ચાણો ઇંડ પ્રેરન અસ્થાય સાં ઉચ્ચાણો. ૧૨૬
- દ્વામ અદૃતર નાલકડો અધ કરી શાણો;  
તથ નિદૂરથો એ. કુદુરથંડને ભાણો. ૧૨૭
- પણી ભદ્રાનારે કુદ પદ્ધારે, જીંદર વ્યામ જી;  
તીર્થ યાત્રા કરન પદ્ધારે, ભા અત ગમ જી ૧૨૮
- દ્વા અગન્યારી સક્ષમ તીર્થ કરી આયે દાખળ;  
ઘનિ ભારનો કુદ પૂર્ણ કરવાયેઃ નદીર. ૧૨૯
- દ્વામ એંગા લિય છેણો, જિધ સુદામા સાધુ;  
દ્વારાવતી આણો, પ્રશુ ભિલિ, ટિપમાન, અગાધુ ૧૩૦
- દ્વસમ છઠારી પ્રસન દોય જનાયન કુપાકર;  
ઐમન અતુલ પહાય રિયા, જિન કરે, જિપ્રધ. ૧૩૧
- દ્વા વ્યામી મે સૂર્ય અદશુ મિન, અદુ દિલુ ધારે;  
કુર્દેન સહૃદુએ દ્વારિકાધીન પદ્ધારે. ૧૩૨
- વદાં આયે અજ ખંતા, મિદે સંઘડો સુખ દીને;  
ગોપીન રે ગોપીય, મનોન્ય પૂર્ણુ ઝાને. ૧૩૩
- દ્વા નાસીને, પાંડાનો પ્રશુ દરરાન રીને;  
કુરાન વારતા કરી, પરરથર આનદ લીને. ૧૩૪

थीज छा पटराण्ही, द्रौपदी भित्त भये हें,  
 पचारी खुचे वतात, सो सकन कडे हे १३५  
 दश चेगमीमे प्रभु, कपि मुनि पूर्व दीनी,  
 नान्द मुख अमुदेन, जान संपत्ति दीनी १३६  
 पुनि यज हु करवायेह, समझे निशा करायेह,  
 सम परिकर सद हाण्डु, दानिकापृगीमे आये १३७  
 शुण्ठ प्रकरण अस ४८ अध्यात्म सुनो नडबागी,  
 सुनत भाव शुचि हेम, चित उनिष्ठ अनुगागी १३८  
 दश पचारी हेसडी पुत्र कस पर भावे  
 सो वेवे हु लगि अनिहे, पातान पधारे १३९  
 लाय द्विये देवकीभात, अन पान दग्धयेह,  
 श्री राम रथग गये, प्रसाद पर प्रभुहो पायेह १४०  
 कस छयागी गत अर्द्धन, दूषु गुमदाहे करी  
 मुती पधारे चूतटेव, गलाट दृप हे धर श्री लगि १४१  
 दश सत्यारी मुनि परमेह, रिष्टु निहेन-५१,  
 मेव नुति नारयण, मरती सुनतः प॒ १४२  
 दश अहंपाती गिर्वानु भक्ता तो मेक्ष भित्त देह,  
 हेव अक्षत अंशुर्प भावमेव लतु शीनत देह १४३  
 दश न व्यासी नग भवन वेह झोन्हो निहेवा,  
 निहेवे कुम्हा प्रसाग, अक्षासुर ग० भावेवा १४४

ता पाछे लोडा लोडायत ५२ अय ३  
 भरे पुन आहानके श्री प्रभु राये वायके १४२  
 इन नेउमे गदलानि शृदर्थात्रम् गाये,  
 यात्र दुख वित्तान् अमिन, तेह पार न पाये १४६

## दाढा.

पुरन अर्द्ध अनुष्टुप्मनिका निरेष न्याम गुप्त;  
 भुने झुनाये कडे हयो, छटे भाया अघ.

इति श्रीमद्भागवते मद्दापुराणे द्यासाम धृत भाषा  
 निवंधे दशम स्कंधानुष्टुप्मनिका  
 समाप्त. ॥१०॥



## होड़ो।

अग्र ऐकान्श गुरुधडे के हृषि तिस अध्याय,  
मुठिन लीना जनिये, प्रकरण होय कठाय

## छांड रेला।

उत्तम मुठित अउ खल मुठित द्वे नाम हुके हैं, ~  
प्रथम १। अठित उन्नितम अध्याय रहे हैं ~ १

दोय मेर तामिथ खल सायुज्य साय हे,  
खलभान मुठिन मुप्रथम अध्याय पाय हे २

ऐकान्श हुर खलशाह, जान त्रु पायेहा,  
ज्यार अवर ममुदेन, नान जान अनायेहा ३

तामे नर योगी सनाँ जनके भाये  
उनि हरि होय जने हु, अचन भये हरी हाये ~ ४

ऐकान्श नि अतगीक्ष प्रखुध पिप्पनानन,  
आविर रोत्र थद अवार अचन, भन झाये कुमबनन ५

ऐनाना चो अमस ३ उभानन कुद नायक,  
अथ सायुज्य मुठित प्रदनन चो नित को नायक ६

ऐकान्श ५३ हेव ग्रुति श्रीलक्ष्मी दीनी,  
पाठ अम यादवकु, नाय अस आनु दीनी, ७

जनय अभान डो नग यज्ञ याग ग्रन सानन  
अस मिया गुनी हरि उद्धन प्रन भाये उन्निकेसन ८

અકાદમી સત્ત અવધૂતહો,	અનિદાસ	મુભાષ્યો,
યદુગાળસો <sup>१</sup> કયો સવાઃ	સફય	કહી શાખ્યો ૮
ચોધસ ગુરુ કીને જ્ઞાનય,	મેં	કદી રીને,
કાદુકી કાતી તરજ ભર,	સઅને <sup>૨</sup>	ગુન લીને. ૧૦
અકાદમી અનો દુરુ	ચોધસ	ગુરુકો હૈનુ,
અકાદમી એસ ઉક્કન	ગાન દરિ	દિવ ભરમેનુ ૧૧
અકાદમી અકાદમી કરે	ભક્તિ	સત્ત મેવા;
માયા આધ કરે નહિ,	વારુ	કહી દરિ દેવા. ૧૨
અકાદમી કાંગે કદ	સારુ	સંગ્રહો મદિમા,
દૃષ્પુચ્છ	પૈનેકો	સાધન માતે <sup>૩</sup> સીમા. ૧૩
અકાદમી વિદ્ધામે	તરબળાન	કહી રીતી;
સઅમે <sup>૪</sup> સમદ્ધી રાખે,	અદાત્મા	નીતી. ૧૪
ન્યાર ચૌદ ભક્તિ યોગ	નિ	ઉત્કપો અનાયો,
પાઠે ધ્યાન અરૂપ	પ્રલુબ્ધનકો	સમુભાયો. ૧૫
અકાદમી	પડેમે	અદ્યાદ્ય ને સિદ્ધિ;
જ અધિ પ્રાપ્ત હેણ,	કૃષુ	આખી સો ણિધી. ૧૬
ન્યાર સોજમે	૩૫	નિખુતિ કૃષુ દિખાયો;
ઘકેશ	સત્તર	ભરતાશમકો ધર્મ સુ ગાયો. ૧૭
અદ્યાદરમે	નેહી	અકાદમી ઉંનિસમે સુતી,
ભક્તિયોગ	યમનિયમ	કૃષુ અનન પુખસો સુનિ. ૧૮

अेकादश शीसमे ज्ञान करम योग करये;  
 अहिनयोग विधि वक्षये श्री गिरिवरधर गाये. १६  
 अेकादश धृक्षास, अधिधि निषेध करतम भावे;  
 अेकादश बाहुस तत्त्व निष्ठें से गाये. १७  
 अेकादश त्रेषुसमे, भिक्षुगीत सुनाये;  
 अेकादश चो पर्यास वांच्य योग लक्षण गाये. १८  
 अेकादश छम्पास औदेपाख्यान वभान्ये;  
 छुक नश सत विस, पुरुष आराधन विधि कही जन्ये. १९  
 अेकादश अद्वीसमे पौगाचार्य कहे हैं;  
 वीमुख अवन मूने संशय भु लवह न २० देह. २०  
 अक्षश उन्नतिसमे योगभार्ग उपहेना करी;  
 विदा झाँये उद्देहो वदिकायम श्री हरि. २१  
 अम अल भुक्ति प्रकरन अरनन भोध हैय देह;  
 ताभिय भरता अद त्याग, अस गो देव देव. २२  
 अेकादश त्रीसमे त्याग भमताडा हेहो;  
 नीकसी दागिने, अभास लीला करी देहो. २३  
 शोकादश उक्तिसमे त्याग अदता भाषी,  
 अलादिक गुनि भीनी. कृष्ण असनना हाषी. २४  
 आशुःका व्यामोद करन, असलीला भीनी प्रक्षु,  
 अदा दागिकधीश दारिका गजत भदाविशु. २५  
 हाँडे।—हृद अेकादश २६ खण्डी अनुकमनिका अनूप,  
 शुनत पहत ओ दृष्ट रति वावे तो तदूप  
 इनि श्रीमद्भागवते महापुराणे पकादश स्कधानुष्मणिशा  
 ममत. ॥२६॥

## होड़ा.

अथ सुनी दादश गुरु के निवार अध्यात  
आश्रम लीवा कहत है। प्रदुष्य पात्र - १४

## छंद शाला।

- |              |                              |                       |   |              |
|--------------|------------------------------|-----------------------|---|--------------|
| लोकाश्रय     | अऽग्निश्रय                   | भगवद्ग्रन्थ           | ८ | मुत्ती,      |
| नारदाश्रय    | अर्थाश्रय                    | नाम पात्र             | ९ | हृ के सुनी । |
| लोकाश्रय     | अकृति गुरु                   | सो हे हे अध्याय डो;   |   |              |
| आर प्रथममें  | गुरुन                        | त्वे लंबे ग्रन्थ डो ॥ |   |              |
| पात्र अपगमे  | हेनदार                       | गन गन गायो;           |   |              |
| वेदाश्रय     | अकृति                        | अध्याय दोयडो आयो।     | ३ |              |
| पाठ तिसरमें  | सर्व सुग सुग के धर्म कहे है; |                       |   |              |
| आर अथानमें   | प्रभान                       | सुग सुग के शुद्धि है. | ४ |              |
| प्रथम डायडो  | वनन                          | ओं याहीमे नीडो;       |   |              |
| भगवद् आश्रय  | प्रकृति                      | तिसरो सोहे नीडो।      | ५ |              |
| पाठ पाचमें   | प्रभान                       | लक्ष्म कथन छहो है;    |   |              |
| परीक्षण गुडो | तलक                          | एन आयो सु कहो है।     | ६ |              |
| दादश पट-सतमे | परीक्षत मोक्ष भयो कही दायो;  |                       |   |              |
| सर्पघरा      | पुनि लाखा                    | वनन वेद सु भायो।      | ७ |              |
| चोथो अकृति   | शश्वाश्रय                    | तीन भडी;              |   |              |
| त्री भागवत   | श्रमद्भर्म                   | आश्रय झुग्य अ॒ लडी।   | ८ |              |

માર્ક આધ્યાત થાન, અહીં નો દસ્તે ગિન,  
અર્થીથી પ્રદાન પચન અધ્યાત મું કે તિન. ૬

શ્રી ભાગવત લું અથ્ માત્રી શ્રી હૃદ્ય વર્ણા,  
કોણ હાકની દુદ્દા મુર્ખ્ પ્રમાન અનુષ્ટ. ૭

દુદ્દા દુદ્દામે પૂર્વેની કથા સર્વ ગાઈ,  
આદી અત ર્યોં એક હી અધ્યાત મે સુનાઈ. ૮

આજ તેને પુનાન સંખ્યા ઇન્દ્રયુતિ લાગી,  
શ્રી ભાગવત હૃદ્ય મય દિનિન એક ઉ. ગાયી. ૯

### છંદ ઉદ્ઘાગીત

એક અનુકૂળ શ્રી ભાગવતો, જુને એઠો જુનારહી,  
શ્રી હૃદ્યાંશી એ પ્રેમ અહિત લડે દન ભત લારહી,  
સમ પાપ ભદ્ર સંતાપ ભાને, જનની જાગ્ર ન આપહી,  
હૃત લડે અભિમન કામ માયાકાન ત્રાસ મિટારહી ૧

સમ ધર્મ સાધનને નહીંત, એક એંદો કા નું જારી,  
થા લોક જરા પર લોક સુખ, કોણ, કદા, ન સત્તારહી,  
ચાનદ અગ્ન હજો નિર સુખ અનુભ કષુ ન નિષારહી,  
દિય અમે પરમાત્મા છખી, શ્રી હૃદ્ય મોદ અદારહી. ૨

શ્રી નર્મદા તથ ચરી પૂરી, શ્રી નેપાયી અલુ જરા,  
સાયોદરો નાગન સુરાતી, વિષ કનિ અસિયત વરા,  
જન દ્વાનામ જ્ઞા નાસ ગૈંગ્રો જનની ન્યના ન્યી,  
શ્રી ગુરુ શ્રી ગિરિન ધરન ન ચાંડ લરી ન્યના ન્યી. ૩

દોહું.

પ્રાણ ભર અનુક્રમનિકા, વો ભાગનત પુનાય  
સ્વાગત કેંદ્રિય અમ્રો, એંગ રે જે ગાન

શક અદ્ય અગન્યાસી, ગુભ ઇયુન દ્વિતીયા ઈંગ,  
અથ સમાન તાલી દીન, પુનઃ કરી પ્રાણ તુંયુ

ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે દ્વયારામહૃત ભાગા નિર્વચિ  
દ્વારદ્શ સ્કંધાનુનુમણિકા સમાપ્ત.

॥ શ્રી રસ્તનુ, શુર્મ ભવનુ, શ્રી હરિ શ્રી હૃત્યાંપિગમસ્તુ ॥



५६-(१)

गांग झोन्ह

सर्वोपरि धाम दमाग हे, जदा ऐनत नटवर घाना हे  
सर्वोपरि० २

जिन कला या नारि गति जया दा,  
ओँ ते ओन भीगाना हे -सर्वोपरि० १

निनाका अद्वेत निन०४८,  
निनमो लो वे न्याग हे,-सर्वोपरि० २

मुक्तभागी भर्त न ज्ञाने,  
शुद्ध पुर सच्चाना हे -सर्वोपरि० ३

साखी

प्राकृत आकृति भान नितहे, अद्वेत अर्मेश्वर सा०  
जे सगडा अज्ञन हे, विनमो क्षेत्रो घा- -सर्वोपरि० ४

भाविक भलराई ना परमे, शुद्ध महाने सा०  
प-धर्म परमात्म अभिन वे, अद्वेत दित अभतार -सर्वोपरि० ५

निन०४८ इच्छाते निगम पुण्याना, तो६ प्रनिपादित गोंदोडे  
गोकृन था० सिनाना, अक्ष-तीत निगुनपर घानारे -नवो० ६

પુત્રીનો પુત્ર વસ્તિએ મનુભન રીતો, ને નેમ માટેઓ ગળી,  
ખાલજુના તપનુ તેજ આળીને બગ્ગે ક્રીદુ, અ ગરીબ અટોલો રગ્ગો તે  
તે ધન્ય ૮

રિશાને બહિત ગદાધનમે લીરી, ને, ના જો, લેતી રાસના ગળી,  
ભરી સારે સુદિત પ્રભુદામે આપી, ને ભારે મથે ભના રજગીને.  
તે ધન્ય ૫

દનિના નાડીબા અસ ભવ કૃતિ હરે, કર્મા શુણી જથું ચિત્ત ચળી,  
ન્યાનો પ્રીતમ સનમુખ તેના, કે દેની ને ચોતાતી ગેરો નય રગ્ગો તે  
તે વન્ય ૬

### ૫૮ (૩)

ગાગ ધરન ધન્યાશી

ત્રિશુશુતિત પરથન પરાત્પર, પર્યાતમ પ્રાણ્યાધ રજ,  
કર્મ ચિત્ત શુણુ રૂપ રૂપ નામે, હિં ય નેટોના ન પામે ડો પા-જ  
એલેવો ડોણુ રિચિદાણુ જ હરે, ને અગલિતનો વિગતાજ,  
“ યાય નામ મહુ યથ ” કૃતિ એવે, નેતિ નેતિ ઉચ્ચા-જ  
ડો નથન ગણે, ડો ઇન્ને ગણે, ચેર રિહુની ગણુના ધારજ,  
પળુ એ પ્રભના નામ ચિન્તની,  
અગલિગત ગણુના ન શાન્તી જાયજ ૩

હિં ભદ્રાણ નિધાન તિમિચ રૂપ, તે હિં કરે હોત પ્રદાનજ;  
નામે સદૃગતિ રોષે તતકાણુ, પતિત પાવન અધના-જ  
નામ વીનાતમદ રૂપાતમરપાતમા, દિવ્ય ચિન્તિ અન્યપદ,  
એમાદી ડોધ પ્રફાળનો અશર, નદી પદ્મા-ય તરુ-જ ૫

—गि दगि सक्षीनन वायो पाप हे, नाच पुण्य शोडागे—  
निर्भय थद गेडे दगि अजगा, तु वी दगि गे न उच्चार  
त्यानिधि पुण्य परमानह, सत् वी हाण्य निर्धार  
था ओङ्कनधर—सनिधि कुभमुर, पर्म तत्र अनिसार

सुख (५)

१२—प्रश्नध

सुख ऐतु एक सतोप, भर वैभव सम हुडेस टेक  
वाये डो धनाहय, सुलडो गवे, सततिवान ताम हुभी लोवे,  
युक पनिचार अल्लौडे। गोवे, भीन बत्त सान मदातन गोदावे  
यो इषु गोह अपुहर्य, अति हे सोप

सुख ऐतु एक सतोप, (१)

अथु तृप चट्ठनिं पह पावे, तो भन धृद होन लेन लनयावे,  
मो भयो तग अलासन भावे, तोड नाण्या अपूर्व हु अनावे  
भनसा भरी नडी भीन तोप, टरी नलि गिनतोप

सुख ऐतु एक सतोप (२)

कशु कामना न लेय निम्तार, अनप्ततावे ताप अपा—  
तासो सञ्चित वारनार, ताडो हाण्य लगे क्षौ पार,  
वाहावे होर सुख हु अ होप, पाप ताप हु अ होप  
सुख ऐतु एक सतोप (३)

तासो हे त्राण्या सम आरी, पर्म एक आश अचल गिनिवारी,  
निर्भय परमानह लेय भारी, निरानित सेय समर्थ जननारी  
तिक्षा द्यागम निर्दीप, सत्य सत्य निर्दीप

सुख ऐतु एक सतोप (४)

## દક્ષણી ભાષાનો અલગંગ-(૫)

ગાગ ખીનાવણ

(મનનકર, ભન લયદુર, શ્રી ગમતનન, એ તરેદથી ગારાર ઢે)

શ્રી ગોપાન, નદ્યાન, પ્રાણુતપાન નીતિયાન,  
 ડાન વ્યાન માન માદા મતે-મધ્યે હૃપા કુરુ, ગોપીકા પને—૧-  
 મધ્યે હૃપા કુરુ ગોપિકા પને, મધ્યે હૃપા કુરુ ગાધિકા પને—૨-  
 પતિતપાનતા દે નિશ્ચ ભગ, આત્મ ત્રાણ અભિન જાણ, લક્ત પ્રાણ,  
 પદ્મ લાણ, પ્રાણ પ્રાણ ધરણીધર ધરા, અભિન ધર્મગ તે દ્વાનયા,  
 નિશ્ચતાત માત આત, જ્ઞાત વાત, હૃત્ય જ્યાત, ધી અરદાત,  
 શય બન દ્વા, નીન રદ્દજના, પ્રેપન સુર્કુમા,  
 જદ્ધપિ હુષ્પ, પાપ સુષ્પ, પરચુણે અતુષ્પ,  
 અષ્પ તરપિ તુષ્પ તાર અહી ક્ષમા,  
 સંણા કરા અચળ સદનતે શ્રી ગોપાન ૧

દે પગતપગ, ભક્ત ભૂરણા, વિરિધિ પાપ તાપ,  
 આપ, રીપુ, પ્રતાપ ગરિત, માપ પારી આપ નીડત,  
 એત હુપણા, અધમ ઉધ્ધ ૧, અભ્યાય ઝુખકરા,  
 આદિમાર, અરી અપાર, રનેશ ભાર, નાશભાર, દારમાર ભાર, શ્રીરન  
 પ્રેમ લક્ષ્ણા ભન્તિ દાયકા, નિત્ય એવ,  
 કથન હૃષ્ણ મિત, કાંઈ પિષ્ટ, અતિ સહીંગ, હાયી નાષ્કા  
 અનુપમાદભૂતા, તે અદ્દનગતે શ્રી ગોપાન •  
 અદ્ધરોતમા, તે દરે પ્રણો, થી નેશ, રેષ નો  
 પિતુ મદેશ પતિ ભૂરેશ અનિર્દેશ, વેન શુન પિણો

अथमें हृत्य हृत्य भयो, संश्रिति क्षेत्र गयो;  
 उपर्यो शाश्व इन्म समूक्षते, अही जांही अनवारी—मेरे नाथ. २  
 अडों मे चिंताभनी पुर्ये, भये भनोरथ भाये.  
 नहिं आशहर मुरशक्तिधी, आहि अद्वा त्रिपुरारी.—मेरे नाथ. ३  
 ज्याहुं ना त्रिगुन परेस करे, जे द्ये प्रधान पूज्य परे;  
 नहीं गम्य भन गीरा नीगमधी गति रोपडी दारी—मेरे नाथ. ४  
 गुरु ओमद अद्विभक्ते गये शहत दम जरुके  
 हयानाथके जयुगल किंशोर शीर पद्धतये सुभद्रारी मेरे नाथ गिरो ५

## ५८ (C)

राग काशी.

नहीं दह दरि विश्वास, ताङुं दरिद्रास न कहीये;  
 दरि न हृदयमें आवे कम्हु, आस्कुर द्योय निवास  
 ताङुं दरिद्रास न कहीये. १

क्षृत व्यर्थ सभ दोमत भरमें, ज्यों दृष्टि गिना दुताश;  
 संशयात्मा वित्तश्रिति, श्री मुणे लाभयुं अविनाश.  
 ताङुं दरिद्रास न कहीये. २

गिन विश्वास जन्म सुचकांडुं, प्रगट भावे सुभ राथ;  
 व्यर्थ भयो अद्वाल धांडुत, भृषि प्रतीति नाथ.  
 ताङुं दरिद्रास न कहीये ३

ઔપંધ સત અણ ને સરથ, આવે ડા. અધ્યાત્મ  
જ્ઞાન વિદ્યાસ રિચર્ડર ગાહી, સયદી પુરત ને આગ  
તાક રિદ્ધાસ ન કહીએ ૫

અનુગ્રહ ઉદાર ભિન્ન મન નિબે, કેખું ભિન અધ્યાત્મ,  
એ ભડકે ચાતક જગ્યા મ્યાત્રી, કશું ન દેખ નિનાગ  
તાક રિદ્ધાસ ન કહીએ. ૫

સક્ષું બાધક નીનકે હીસ વડીએ, નહી દ્વાતાને બાસ;  
દ્વા ભૂતી કશુ જનહી જાપ તું, અનિશ્ચાત કે પાસ  
તાક રિદ્ધાસ ન કહીએ. ૬

#### ૫૬ (૬)

એક વર્ણો જોપીલન વાનન, નહી જ્વાભી આને,  
નહી જ્વાભી બીજો રે, ભારે નહી જ્વાભી બીજો. ૭.  
અથર હોધનુ કામ ન ભારે, રીલે કે બીજો;  
કુશુ કરે તે પ્રમાણુ, કારજ વધુમો કે બીજો,  
પ્રાણુ જાપ પણ અન્ય દૃતિમા, મન ગણે બીજો.—એક વર્ણો. ૧

શુખી દુઃખી નેમ ગમે તેમ રાખે, એના શુશુ ગાડિ,  
વિના ભુલનો ઘર શુક્ષામ, વેવે ત્યા વેચાડિ;  
એજ ગમ્યો એથી મન માન્યું, બીજો નન સાઢુ;  
એના અતિ અસતાર હું હોધનો, દ્વાસ ન તુઢેચાડિ.  
એક વર્ણો. ૨

કૃષ્ણ વિના દિર અરર નમે, તો છેદનો દંડ;  
નંદકુંદર પણ નામ કરે તો, કૃષ્ણ કરું શતખંડ,

અનર દેસની આગ કરે, અન બાંને અલ્પાડ,  
અન્ય અમૃત દર્શન દોડે પગ, તો પાડુ પિડ  
એડ નથો. ૩

હુ ચાતક જળ ગાતી શ્રીજી, હુ જખ લન્નિ નારી  
હુ લારીન કારી લન્નિ દફાત, ધારી તે ધારી,  
અન્ય પતિનત કરેને નહીં, તે કદીયે વખનિયારી  
શ્રી કુરુક્ષેષ નભનજો કહે નથો, સદા ટેક મારી  
ઝેણ વથો. ૪

## ૫૮ ૧૦

નાગ સારણ

સત્તા શ્રી કૃપણને બેવોડે, સમજ લો મુઘા સિદ્ધાત,  
વાત કડુ તે વિચારમા વાવો, ભાગો મનની ભાત—સદા ૨૬

સહુ મરાગન કૃપણ ડે, નથી હ'પુ અનાનુ ડોન  
સાગન ગ્રાન્યોને દ્વારાતે, શાખા સમજ જોય—સદા ૨

વિશ્વ હું લન્નિ રૂપ એ રહેતે, સાચું ભરવે કાગ,  
ન્યાડ ન તે ગોપાળની પણ, ન્યાગ ખરા ગોપાગ—સદા ૨

કાયાથી થઈ ન્હીં ધરા કાણ સ નઘે, ભાયા માહે સમાણ,  
કાયાથી ધાયા છાયાથી નકાયા, કાયા કદ્દ લહે ધાયા—સદા

શુખ ધરિયો, થડ ને ડરા, એમ લન્નિ સંસાર,  
કૃપણ ભરે હ્યા કાર્હિન પાકા, વેદ પુનાલુ નિયાર—સદા ૪

૫ (૧)

ગાગ નનિત

તેવા રિ સંસુખના દોષ, સાધન વિમુખ તથા  
જેમ નિર્ણય મુગાજરી તરફની યોગ્ય અથવા ભાગ  
સાધન વિમુખ તથા ૧

જેવા એવા નનારી, જેવા તેજ નિનાના લોચન રે  
જેવા અગ્નના રો જીવ જેચુ પક્ષપાત્રિક અર્થતીન  
સાધન વિમુખ તથા ૨

જેવી ઘરી અગુતી કર્યાય, જેરી તિથિ અગ્રામ રે,  
જેવો હોષ મુહુર્નો, જેચુ ધ્રમ રેત ન નમ  
સાધન વિમુખ તથા ૩

જેચુ પગધીના સુખ જેવા નસળી કેવા સમરે  
જેવી પાખ પિપાનિશ્ચ કેરી, જેવો અનનો ધરમ  
સાધન વિમુખ તથા ૩

નુરજી પગારાન પન્નગામનો, કયા બાગ્યુ ને પાપરે  
સુશીલ વિભીષણ અનથ, આત પત્ની લોગે અદ્યાપિ  
સાધન વિમુખ તથા ૪

ગાગાદિક તરફ નદી તેઢનો, દારાઅદ ન કુરન રે  
મો, મેડી ત્યા લગી તેઢનો, જ્યાદ વગી નદી રખિનો જન  
સાધન વિમુખ તથા ૫

हुगचारी विपथी अन्निनेदिय, भवसुख लोगी न आधे;  
रत्निथी विमुखने कगडे श्रुति कडे, हरि भक्त, न अपगाध  
साधन विमुख तथा. ६

नृप प्राचीन अदीप कण्ठोदि, गुरुभैं कलश भणियुं रे,  
अमक्ताना गुण है.प ३५ छे, राज्ञ वयनथी कणीयुं.  
साधन विमुख तथा. ७

लायी लेघ झूते हृष्टा पुष्टजन, कुमेन रिमजन दायी रे,  
पाप न भोग्युं, सदेद सर्वोपरि झूत लोड सिधायी  
साधन विमुखतथा. ८

सचित, क्षियमाणु आरब्ध न, पांडने श्रुति गायरे,  
तद्धि हुःपी, शिव क्षिप पड्युं पीडुं, होप न हरि धर्माय  
साधन विमुख तथा. ९

जे उपाय अपगाध टणे, दरि-क्षमा, नरड वा रोगे,  
क्षमा विमुख सबवे न, अधरित भक्त नरड हुःभ भोग  
साधन विमुख तथा. १०

इया प्रीतमनी लीला अटपटी, कडें छशुं न इवे रे,  
पण ऐटलु निष्ठे अमने, दरिनकातु अदित जनवे  
साधन विमुख तथा. ११

#### पं (१२)

अटवा श्री दरिने शे नर गाय, शाने अथडाय,  
कारे शाने अथडाय,  
भगता वी इष्टु सर्व सुख थाय, अवसर वडी लाय.  
अटवा श्री दरिने शे नरगाय १२

નથી રે નથી દુઃખું લમો પ્રનુ તોઈ, નિંબે એવું જો  
જારે નિરો કયું જોઈ

ભૂલ્યા તે અતથાગ ગયા રોઈ, એ શૂણિ નખન હોડોઈ  
એવા થી દર્શિને રે નરગાર ૮

નથી રે નથી એમા એકુ પહાની ઘામી, અર્વે ગુણું ઘામી  
જારે અર્વે ગુણું ઘામી,

બજરે એવા દાસ ન્યાના ઘામી, પ્રભુ અતર જામી  
એવા થી દર્શિને રે નરગાય ૯

૫૮ (૧૩)

ગાગ કે જો।

તે ભગવતીના દર્શાન દુર્દીંબ, જેણું ભાષ જોય તેને તે જોરે  
અસ્તાકન માને અર નામે, તાપ વિનિધના મેરે તે ૧

શ્રેમ ભક્તિમા પણેના પૂર્ગ, નિંદા કરે નહી ડોની રે,  
અતભૂતા અપિનારી પણેના, નિર્ણણ ભનિ સદ જોની રે તે ૨

અર્દેચ જેણું ર્યામ સુદર તેણું નિગાનિ ધ્યાન ન સુકે રે,  
દ્રાસ ઉચામે થા દૃષ્ટિને સમરે, નિમિદેક નામ ન ચુકે રે તે ૩

દ્રામા ર્યા સમદાટિ જેમા, સત્ય પ્રથા એ ચાને રે,  
સનોપી સાતિના ને રિવેળ, અજનાનદ્રા રહાલે રે તે ૪

જેણું સર્વ અમર્યા દર્શિને, મેના કરે જોહે જાણી રે,  
દર્શિયાસ ધરે નિજ ધર્યુનો, શુદ્ધ ન રાખે કાણી રે તે ૫

અન્ય પ્રસારી અનુભાવ્ય વરને, ધક્ક શુદ્ધ રોગુર પણ કેલારે  
પ્રાણી ભાન તથું હિત ધર્યે, પરગણુ જેણ સમેત તે તે  
છાલીત અભિમાન-દિત શુચી, મોદ માયાથી અગગારે,  
નાની લાગી સુખ હુખ સમ લડે, ભત્સગને રડે વળગારે તે  
તે દન્જિનતા દાસના દાસનો, દાસ પ્રશુ સુને કાનેરે,  
ન્યો ભણે તેના અન્યાની ગજ, ભાન ગજ પણ સહા હૃળોરે તે

## ગાગ- ધોળ ૧૪

સદગુણુ ચિદ્ધુ શ્રીનાથજ ર, શેડેને સુદુડેને મોદ નાગે ગાજ;  
નિરોક સુદૃઢ મોદન સુખમા રે, નીંગે પરમાનદ ઉર નાગે નાજ  
સદગુણુ ચિદ્ધુ શ્રીનાથજ રે

૩૫ શુ નરણુ રસીયા ગયતુ રે, અતિ અન્યનેરો નટનર નાગર ગાજ,  
ભૂપણુ રસિક જનના કોચનતુ રે, છમિનો સુદૃગતાનો સાગરરાજ.

સદગુણુ સિદ્ધુ શ્રીનાથજ રે ૨

દીન દ્યાળ રિસાદિ સાભાપારે, પણ ન્યા દુષ્ટ ઉપર નન વાપેગાજ,  
દુષ્ટ દ્યાકર શુણુ એક ગોપિનામારે, મોદી સુક્રિત અરીને આપેગાજ  
સદગુણુ ચિદ્ધુ શ્રીનાથજ રે ૩

ઓનડી ક્ષમા ના કોઈભા સ લકે રે, જોઈલી રભા રમણુભા દીરી રાજ,  
પાણુ પ્રદાન સલ્લો રભનુ આલણુનોર, તે ઉપર વાણી કલી મીરી નાજ.  
સદગુણુ સિદ્ધુ શ્રીનાથજ રે ૪

ઇશ્વર યદી રાગણુભા વત્સનતારે, ઓનડી કોઈ થી ના અનીઓવે ગાજ,  
સેના સેવકની શ્રી ચામથી રે, અનુચિત કરતા લાજ ન નાવે રાજ.  
સદગુણુ સિદ્ધુ શ્રીનાથજ રે ૫

આંત ખાંડુ પતિતના પાવન છારે, ચિંતામણિ પૃથ્વીકામ હો ગજ,  
સર્વ ધર્મ સહ સાધન નિરોમણિ હે, એવું નંદિંગનું નામ હો ગજ.  
સદગુણ સિદ્ધુ શ્રીનાથજ રે. ૬

પાછિક રિષ્ટ વિંચ વ્યાપી રહારે, વધુઅમે નમ્મવે સૌ કમણાણું નાજ;  
નિઃનાક નાધા સંગે નિત્ય રહો હે, એવા તોલુ ચતુર વખાણું નાજ.  
સદગુણ મિંદુ શ્રીનાથજ રે. ૭

સંન્યતી રમા સંખ્યા રાણીયારે, વહે વિધિ રિવ રેણ અનધી નાજ,  
ઘણું અનંત હોડી અસ્તાદનારે, નેતા પાં ના મોધને લાઘ્યોલીધો ગજ.  
સદગુણ સિદ્ધુ શ્રીનાથજ રે. ૮

અત રતનમણિ મોંધા કર્યાં હે, નેવિના હોળી કષ્ટ લગી ચાલે નાજ;  
અન્નતૃણ સભિવાહિક સોધા કર્યા ર, રક્ષણ રક્તનું વિચાર્ય વદાયે ગજ  
સદગુણ સિદ્ધુ શ્રીનાથજ રે. ૯

એવા દાસ દ્વારા કિલમજ હે, સઉદુણ પણ ધર્મ દૃપાના નાજ,  
કે ડાદ એ પ્રલુદી અણગા ભગે હે, તેના અંક કંભતા કાળા ગજ.  
સદગુણ સિદ્ધુ શ્રીનાથજ રે. ૧૦

## ૫૮ (૧૫)

રાગ-ડારી

પ્રેમ રસ તે પિયે રે, નેતેમા રે અનિ અનજરપણ,  
મોટાઈ ધારી ભારીરે, સમજ ન ગાયે ક્ષાળુ ૨૫

ઝુદ્ધ આદ રાક્ષણમધ્યે, દીરી વેનુમા વેગરી,  
દરતી હૃતા તે દારીખમ્યા પાછા, તેને ગાધ પિપીલિંગા ખાઈ,  
મોટમ ગાયે ગાયે રે, ને હું રહેણ અનુ. પ્રેમરસ ૧

મરોયા વૃક્ષને ધણું વિઠલણ, પીડાય બદ પેર કરી,  
રસને હું ખ હેણે નહી રે, હ્યાં સદા રે હજીની દરી,  
સમજુ વિચારો રે, શુખ છે શામાં ધણુ પ્રેમ રસ ૨

કમનતણો મર્યાદ તે મધ્યે, તે ભુક્ણે જે સમાપે દોય,  
ગુરુદન દૂર નિકટ નિ નાના, તેદ વિચારો સદુ ડોય,  
પ્રકટ જથ પેણોરે, ને હું જુદુ ભણું. પ્રેમ રસ ૩

એક સિદ્ધાત સમજવા મારે, કદ્યાં સર્વ દાટાત,  
શ્રી દરિ ખણ મિન બહુ કદાવે, નથી નથી મિત્ર માટાત,  
મારે દ્વાય થાની રે, તુંતો નકાનો અનુથી અણુ. પ્રેમ રસ. ૪

## ૫૯ (૧૬)

રાગ-ગરણો.

નથી નિશે ડોધને નાથ, ક્ષાળુ પતી શુ કરણો,  
અતિ અમિત અત્કર્ષ ગાથ, શું કરણો દરણો.-૨૬.

નેદુ સમય ગાજયાભિષેક રણુપતિ, તે વેળાએ વન રે,  
અંડાસનો મૃત્યુકાળ, તે વેળા રાજનાસન.-ક્ષાળુ પતી. ૧

हेरणी वभुरेनो क्षस रथ दाके, ग्नेद भर्या आ ना रे १  
 गर्जात पनटाइ पनडमा, कागगृद पधरान्या—क्षणु परी २  
  
 नतो इतो व्राण्डी मोदोसे, नदूप रुद्र मुनि चढीयो रे,  
 तत्क्षण श्राप थ्यो आत्मणनो सप्त थछ भूमि पडियो—क्षणु परी ३  
  
 पर्मितरान गग मारे सदने, मुनि आश्रम घेयो रे,  
 उमति पद्मना श्राप निप्रगृद, तज गगातट भेयो—क्षणु परी ४  
  
 अनभविक लहि रथान नाता, असिध ल्यनिरूप नडियो रे,  
 नातथी श्राप थ्यो दग्धिपार्द, असुर थर्क्षिति पडिया—क्षणु परी ५  
  
 अनड भ्रू मुनि नहि नने, जानी रिरोभणि—दावे रे,  
 संग वातमा श्राप पर्गपू, दाव हुने न आवे—क्षणु परी ६  
  
 द्वेष अचित यो नेसभामा, दक्ष सा खिम सुखियो रे,  
 आग लज्जा रुति तमे निरुम्भे, भीन्ते नथी डोर्मनियो—क्षणु परी ७  
  
 अति हुभिया सुभिया तोप पगमा,  
 अति सुभिया देख हुभिया रे,  
 निरु गति अडन कल्यामा नावे,  
 छर्गहु करो प्रभु सुभिया—क्षणु परी ८  
  
 द्या प्रीतमछनी अटपी लीवा,  
 रु मने नही कहेता रे,  
 राखो तेम रही पाओ ते सही,  
 उपणु मुन्यज असेता—क्षणु परी ९

नो-अद्वायाम गिरे (१७)

तन्निचतन तत्कथन मन्योऽन्यं तत्प्रोधनम्  
एतदेव परत्वं वद्याभ्यास गिरु शुधा

अभातभी ५० वर्षत चित्वन कर्तु, ५०० बुसुप्ति भो ना लेनी  
पाय उथन कर्तु समान अभावीओ भो तो देओ आये ५००५  
प्रमोध कर्ता आ प्रभाषे अभु एवमानदमान इति तदाकान नाभनी  
लेने सभर्थं पडिनो अलाज्ञास करे ०

आशीर्वाद (१८)

नवभारा

गिरुयो, शुभी नहो, तुम सकू एविवर  
आनद मगव अभु, दरि भे रडो तुम मन-१

अजित ग्रेम आसप्ति, व्यसन श्री नरेश  
शुभ अग्रवीष आव सदा, हु अ को न सक-२

कर्म कान माना भय, जन्म मन्यु जाओ  
शुभ भति रहो सतत भन डप्य करु न धाओ-३

सहयुयु सत्सग, सदा रडो गुन काम  
येही आरिष देत, सदा दास द्याराम-४

॥ इति शुभम श्री कृष्णार्पण मरतु ॥

॥ सं पूर्ण म ॥